

કંપની ધારા કલમ ૩૯૫ અન્વયે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરનાં તારીખ ૩૧/૩/૨૦૨૨ ના રોજ પુરા થતાં વાર્ષિક અહેવાલની કામગીરી અંગેનો સરકારનો અહેવાલ

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ નો વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષનો ૩૨મો વાર્ષિક અહેવાલ રાજ્ય સરકારને તા. ૧/૩/૨૦૨૩ ના રોજ મળેલ છે. અહેવાલનાં વર્ષ દરમ્યાન નિગમે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરેલ છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વર્ષ ૨૦૨૧ -૨૦૨૨ દરમ્યાન ઉર્જા પરિયોજના-આયોજન અને તેના અમલીકરણના તબક્કાઓની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ રહ્યું હતું. નિગમે ગત વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં ₹ ૩૨૨.૩૧ કરોડ ની આવક સામે, વર્ષ ૨૦૨૧ -૨૦૨૨ દરમ્યાન ₹ ૫૧૨.૯૬ કરોડ ની આવક મેળવી છે તથા નિગમે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં થયેલ ₹ ૫૭.૬૯ કરોડના નફોની સામે વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ દરમ્યાન ₹ ૧૨૫.૩૩ કરોડ નો નફો કરેલ છે.

આગામી પ્રોજેક્ટ્સની ફંડની જરૂરિયાતોનો વિચાર કરીને, ચાલુ વર્ષે નફો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેથી અહેવાલનાં વર્ષ દરમ્યાન કોઈ ડિવિડન્ડ ભલામણ કરતા નથી. રાજ્ય સરકારનું આ નિગમમાં ૫૧ ટકાથી વધુ રોકાણ હોવાથી, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ સરકારી કંપની છે. તા. ૩૧/૩/૨૦૨૨ ના રોજ કંપનીની અધિકૃત શેરમૂડી ₹ ૬૦૦ કરોડની સામે, ભરપાઈ થયેલ શેરમૂડી ₹ ૫૧૩.૨૨ કરોડની છે.

કંપની રાજ્યમાં ઉર્જાક્ષેત્રે વિકાસકારી ઉદીપક તરીકેની ભૂમિકા બજાવી રહેલ છે. વિવિધ બળતણ પર આધારિત ઉર્જા પરિયોજનાઓ નિયત કરે છે. આવી ઉર્જા પરિયોજનાઓ માટે તાંત્રિક-આર્થિક શક્યતા અહેવાલ તૈયાર કરે છે. યોગ્ય ખાનગી/સંયુક્ત ક્ષેત્રના પક્ષકારો નિયત કરે છે અને પસંદ કરેલા પક્ષકારો સાથે પરિયોજનાઓનો સંયુક્ત રીતે અમલ કરે છે. ઉર્જા પરિયોજનાઓ નિયત કર્યા પછી તેના અમલ માટે જળ અને હવા પ્રદુષણ મંજૂરી, પર્યાવરણીય અને વન મંજૂરી, નાગરિક ઉદ્વચન મંજૂરી જેવી વૈદ્યાનિક અને વહીવટી મંજૂરીઓ મેળવવાની કામગીરી આ નિગમ દ્વારા હાથ ધરવામાં આવે છે. જમીન સંપાદન અધિનિયમ હેઠળ જમીન સંપાદન સંબંધી ઔપચારિકતાઓ આગળ ઘપાવે છે અને ઉર્જા પરિયોજનાઓ માટે બળતણ સંયોજન જોડે છે. કેટલાક કિસ્સાઓમાં જાહેર સાહસો સાથે સમજૂતી કરારથી પરિયોજનાઓ અમલી બનાવવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન નીચેના પ્રોજેક્ટ્સ કાર્યરત અથવા અમલીકરણ હેઠળ હતા.

(૧) જીપીસીએલની વીજળી પરિયોજના (વિન્ડ મિલ/ સૌર કાર્યરત છે)

- (ક) ૬ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના, મનાબા અને પેથાપુર ગામો, તાલુકા રાપર, જી. કચ્છ
- (ખ) ૧૦.૫ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના, જમનવાડા, જી. કચ્છ
- (ગ) ૪.૨ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના, હાઈબ્રીડાઈઝેશનની સંકલ્પના હેઠળ ચારણકા સોલર પાર્ક, જી. પાટણ
- (ઘ) ૫ મે.વો. સોલર વીજ પરિયોજના, પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગુજરાત સોલરપાર્ક ગામ ચારણકા ખાતે
- (ચ) ૧૦ મે.વો. સોલર વીજ પરિયોજના, પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગુજરાત સોલરપાર્ક ગામ ચારણકા ખાતે
- (છ) ૧ મે.વો.નો છત આધારિત સોલર વીજ પ્રોજેક્ટ

(૨) ૬ મે.વો. સોલર વીજ પરિયોજના બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે:

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલારાઈઝેશન પ્રોજેક્ટ વિકસિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી મોઢેરા નગરને સતત ચોવીસ કલાક (૨૪ x ૭) સોલાર એનર્જી પૂરી પાડવા માટે પ્રખ્યાત સૂર્ય મંદિર, મોઢેરાથી ૬ કી.મી. દૂર મહેસાણા જીલ્લાના સુજાણપુરા ગામ ખાતે ૧૨ હેક્ટર સરકારી જમીનમાં સોલાર પાવર પ્રોજેક્ટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સ્થાપવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ કુલ ₹.૮૦.૬૬ કરોડ છે.

(૩) વિવિધ સોલાર પાર્ક:

૧) ગુજરાત સોલાર પાર્ક:

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એ ચારણકા, તાલુકા સાંતલપુર, જિલ્લો પાટણ ખાતે ચારણકા સોલાર પાર્ક વિકસાવવા માટેની નોડલ એજન્સી છે, આજ સુધીમાં ૩૬ ડેવલપર્સે આ પાર્કમાં કુલ ૭૩૦ મેગાવોટ સોલાર ક્ષમતા સ્થાપિત કરી છે.

૨) ૧૦૦૦ મે.વો. ઘોલેરા સોલાર પાવર પાર્ક:

ગુજરાત સરકારે ઘોલેરા ખાતે ૧૦૦૦ મે.વો. સોલાર પાવર પ્રોજેક્ટ નાખવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે જીપીસીએલને અમલકર્તા એજન્સી જાહેર કરેલ છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ કરવામાં આવેલ છે. હાલમાં કુલ ૩૦૦ મે.વો. નો સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત કરી દેવામાં આવેલ છે.

૩) ૭૦૦ + મેગાવોટ રાધાનેસડા અલ્ટ્રામેગા સોલાર પાવર પાર્ક:

આ પાર્ક ગામ રાધાનેસડા તા.:વાવ, જિલ્લો: બનાસકાંઠા ખાતે આવેલ છે. આ પાર્ક ૪૮૫ મે.વો. સોલાર પાવર જનરેશન સાથે કાર્યરત છે, તથા ૨૧૫ મે.વો. સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. આ પાર્કમાં અંતરીય રોડ, બંધ, સંદેશા વ્યવહાર, પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠો, વીજપરિવહન, સ્ટ્રોમવોટર ડ્રેઈન જેવા માળખાકીય કામો પૂર્ણ થયેલ છે. આ પાર્કનું સંચાલન જીપીસીએલ દ્વારા સંભાળવામાં આવે છે.

૪) ૩૦ ગી.વો. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક (૩૦,૦૦૦ મે.વો.):

ગુજરાત સરકારે રાજ્યની વેસ્ટ લેન્ડ પોલિસી હેઠળ ગુજરાતના જિલ્લા-કચ્છને અડીને આવેલા વિઠાકોટ પોસ્ટ પાસે, ૩૦ ગી.વો. રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ૭૨૪૦૦ હેક્ટર વેસ્ટ લેન્ડ ફાળવી છે. આ સંદર્ભમાં, આર.ઈ. પાર્કની સ્થાપના માટે એમ.એન.આર.ઈ. અને સંરક્ષણ મંત્રાલય તરફથી "સૈદ્ધાંતિક મંજૂરી" મળેલ છે. જીપીસીએલ ગુજરાતમાં ૩૦ ગી.વો. રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે સુવિધા આપતી એજન્સી તરીકે કામ કરે છે. આજ સુધીમાં ગુજરાત સરકારે અદાણી ગ્રીન એનર્જી લિ., ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ., સર્જન રિયાલિટી લિ., એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિ., ગુજરાત ગુજરાત સ્ટેટે ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિ. અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ., વગેરે જેવા વિવિધ સોલાર/વિન્ડ/હાઈબ્રિડ પાર્ક ડેવલપર્સને ૨૫૮૦૦ મેગાવોટ ના વિન્ડ/સોલાર/હાઈબ્રિડ પાર્ક માટે જમીન ફાળવી છે.

(૪) ખાણકામ પરિયોજનાઓ:

- ભાવનગર લિગ્નાઈટ ખાણકામ પરિયોજનાઓ.

ભાવનગર ખાતે ૫૦૦ મેગાવોટના ભાવનગર લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન (બી.એલ.ટી.પી.એસ.) પાવર પ્રોજેક્ટની જરૂરિયાતને પહોંચી વળવા માટે, જી.પી.સી.એલ. એ ત્રણ (૦૩) લિગ્નાઈટ માઈનિંગ લીઝ મંજૂર થયેલ છે,

- (૧) ઘોઘા-સુરકા માઈનિંગ પ્રોજેક્ટ (૧૩૫૫ હેક્ટર),
- (૨) ખડસાલિયા -I માઈનિંગ પ્રોજેક્ટ (૭૧૨ હેક્ટર),
- (૩) ખડસાલીયા-II માઈનિંગ પ્રોજેક્ટ (૯૧૪ હેક્ટર).

હાલમાં, ઘોઘા-સુરકા લિગ્નાઈટ માઈનિંગ લીઝ ચાલુ છે અને અન્ય બે (૦૨) માઈનિંગ લીઝ નોન-ઓપરેટીંગ છે જે બી.એલ.ટી.પી.એસ.ની વાસ્તવિક લિગ્નાઈટ જરૂરિયાતને જોતા પછીના તબક્કામાં ચલાવવામાં આવશે.

ઘોઘા સુરકા લિગ્નાઈટ માઈનિંગ પ્રોજેક્ટ ૧૩૫૫ હેક્ટરના ખાણકામ લીઝ વિસ્તાર માં છે અને ૫૪.૬૮ મિલિયન ટનના માઈનેબેલ રિઝર્વ છે. ખાણની રેટેડ ઉત્પાદન ક્ષમતા ૨.૨૫ મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને સ્ટ્રીપિંગ રેશિયો ૧:૯:૩૨ છે. ખાણનું સમય સીમા ૨૫ વર્ષ છે. જી.પી.સી.એલ. એ ખાણ વિસ્તારમાં એપ્રિલ, ૨૦૧૮ થી ખાણકામની પ્રવૃત્તિઓ ખાણ ડેવલપર ક્રમ ઓપરેટરની (એટલે કે મેસર્સ પી.સી. પટેલ-મહાલક્ષ્મી-સિમ્પલેક્સ કન્સોર્ટિયમ પ્રાઇવેટ લિમિટેડ) નિમણૂક કરીને શરૂ કરી છે અને ઓગસ્ટ, ૨૦૧૮ થી બી.એલ.ટી.પી.એસ. ને સતત લિગ્નાઈટ સપ્લાય કરે છે. જી.પી.સી.એલ. તેમની જરૂરિયાત મુજબ બી.એલ.ટી.પી.એસ.ને લિગ્નાઈટ સપ્લાય કરે છે. તારીખ ૩૧.૦૩.૨૦૨૨ સુધી જી.પી.સી.એલ. એ બી.એલ.ટી.પી.એસ. ને લગભગ ૪.૪૫ મિલિયન ટન લિગ્નાઈટ સપ્લાય કરેલ છે.

મમતા વર્મા
અગ્રસચિવ


ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ



Address : Block No. 8, Sixth Floor,
Udhyog Bhavan, Sector 11,
Gandhinagar - 382 011
Phone : 079 - 23251255-60
Fax : 91-79-23251254
www.gpcl.gujarat.gov.in
CIN:U40100GJ1990SGC013961



ગુજરાત
પાવર
કોર્પોરેશન
લિમિટેડ



ગુજરાત
પાવર
કોર્પોરેશન
લિમિટેડ

વાર્ષિક અહેવાલ
૨૦૨૧-૨૦૨૨

મૂળ અંગ્રેજી અહેવાલનું આ ગુજરાતી ભાષાંતર છે.
કોઈ સંદિગ્ધતા જણાય તો મૂળ અંગ્રેજી અહેવાલ આખરી ગણાશે.

૩૨મો વાર્ષિક અહેવાલ- ૨૦૨૧-૨૨

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ – ગાંધીનગર
 (સી.આઇ.એન: યુ૪૦૧૦૦જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧;
 રજિસ્ટર્ડ ઓફિસ: ૬ઠ્ઠો માળ, બ્લોક નં. ૬ અને ૮, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર -૩૮૨૦૧૧
 વેબસાઇટ - www.gpcl.gujarat.gov.in
 (ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૫૧૨૫૫-૬૦; ફેક્સ-૦૭૯-૨૩૨૫૧૨૫૪)

નિયામક મંડળ

શ્રીમતી સુનયના તોમર, આઇએએસ	: ચેરમેન (૧૦/૦૧/૨૦૨૦થી ૧૫/૦૬/૨૦૨૧)
શ્રીમતી મમતા વર્મા, આઇએએસ	: ચેરમેન (૦૯/૦૭/૨૦૨૧થી)
શ્રી એસ.બી.ખયાલિયા	: મેનેજિંગ ડિરેક્ટર (૦૧/૧૦/૨૦૨૧ સુધી)
શ્રી વિકલ્પ ભારદ્વાજ	: મેનેજિંગ ડિરેક્ટર (૧૧/૧૧/૨૦૨૧થી)
શ્રીમતી અંજુ શર્મા, આઇ.એ.એસ	: મહિલા નિયામક (૨૮/૦૭/૨૦૨૧ સુધી)
શ્રી પ્રફુલ એચ.રાણા	: નિયામક
સુશ્રી દિપલ હડિયલ	: નિયામક (નાણાં વિભાગ, ગુજરાત સરકારના નામનિયુક્ત)

સ્વતંત્ર નિયામકો

શ્રી પી.કે.તનેજા, આઇ.એ.એસ. (નિવૃત્ત)	: સ્વતંત્ર નિયામક (૨૬/૧૧/૨૦૨૦થી)
મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ	
શ્રી મેહુલ જે. ડનાયક	: ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર
સુશ્રી કૃપા એન. જોશી	: કંપની સેક્રેટરી
ઓડિટરો	
વૈધાનિક ઓડિટરો	મે. અનિલ એન.શાહ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદ
સેક્રેટરિયલ ઓડિટર્સ	મે. ધારા પટેલ, કંપની સેક્રેટરીઝ, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી, અમદાવાદ
કોસ્ટ ઓડિટર્સ	મે. પી. એચ. દેસાઇ એન્ડ કું. કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદ
બેંકર્સ	એક્સીસ બેંક લિમિટેડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

અનુક્રમણિકા

અ.નં.	વિગત	પાના નંબર
૧.	નિયામકનો અહેવાલ	૦૧
૨.	કંપની ધારો ૨૦૧૩ની કલમ-૧૪૩(ક)(ખ) મુજબ કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ, ભારત સરકાર તરફથી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરના તા. ૩૧મી માર્ચ, ૨૦૨૨ ના હિસાબો ઉપર કરવામાં આવેલાં ટીકા ટિપ્પણી	૨૨
૩.	ઓડિટરનો અહેવાલ	૨૩
૪.	પાકું સરવૈયું	૩૫
૫.	નફા-નુકસાન ખાતું	૩૬
૬.	કેશફ્લો સ્ટેટમેન્ટ	૩૭
૭.	ઇકિવટીમાં ફેરફાર અંગેનું પત્રક	૩૯
૮.	નાણાકીય પત્રકો અંગેની નોંધો ૧ થી ૩૧	૪૦

નિયામકોનો અહેવાલ

પ્રતિ,
સભાસદો
ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જી.પી.સી.એલ.)
ગાંધીનગર

તા.૩૧-૩-૨૦૨૨ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીનો ૩૨મો વાર્ષિક અહેવાલ અને હિસાબોનું ઓડિટ કરેલું પત્રક રજૂ કરતાં આપના નિયામકો આનંદ અનુભવે છે.

૧. નાણાકીય પરિણામો

(રૂ. કરોડમાં)

ક્રમ નં.	વિગત	૨૦૨૧-૨૨	૨૦૨૦-૨૧
૧.	કુલ આવક	૫૧૨.૮૬	૩૨૨.૩૧
૨.	કુલ ખર્ચ	૩૮૫.૧૩	૨૬૪.૬૨
૩.	અપવાદરૂપ બાબતો	(૨.૫૦)	-
૪.	કરવેરા પહેલાંનો નફો	૧૨૫.૩૩	૫૭.૬૯
૫.	વિલંબિત કર સહિત કરવેરા	(૩૪.૦૯)	(૧૬.૪૪)
૬.	કરવેરા પછીનો નફો/(ખોટ)	૮૧.૨૪	૪૧.૨૫
૭.	અન્ય સર્વગ્રાહી આવક (ઓસીઆઈ)	(૧૧.૧૩)	૫૬.૨૬
૮.	આ સમયગાળાની કુલ સર્વગ્રાહી આવક	૮૦.૧૧	૮૭.૫૧

૨. ડિવિડન્ડ

ચાલુ વર્ષ દરમિયાન કંપનીએ નફો કર્યો છે. આમ છતાં, આગામી પ્રોજેક્ટ્સને કારણે આપના નિયામકો વર્ષ ૨૦૨૧-૨૨ માટે કોઈ ડિવિડન્ડની ભલામણ કરતા નથી.

૩. અનામત ખાતે તબદીલી

નફાને અનામત ખાતે લઈ જવામાં આવે છે. .

૪. હકદાવો કરવામાં ન આવ્યો હોય એવા ડિવિડન્ડની ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈ.ઈ.પી.એફ.)માં તબદીલી

આઈ.ઈ.પી.એફ.માં તબદીલ કરવું પડે તેવું હકદાવો કર્યા વિનાનું / વણચુકવાયેલું કોઈ ડિવિડન્ડ ન હોવાથી કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૨૫(૨)ની જોગવાઈઓ કંપનીને લાગુ પડતી નથી.

૫. થાપણો

૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરાં થતાં વર્ષ દરમિયાન, કંપનીએ, “ઘ કંપનીઝ (એક્સેપ્ટન્સ ઓફ ડિપોઝીટ્સ) રુલ્સ ૨૦૧૪ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ “થાપણો”ના અર્થની મર્યાદામાં આવતી હોય એવી કોઈ થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી નથી. આમ, “ઘ કંપનીઝ (એક્સેપ્ટન્સ ઓફ ડિપોઝીટ્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ ૩(૨)ને “કંપનીઝ (એક્સેપ્ટન્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમો ૮(૫)(૫) અને (૬) સાથે અને કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૭૩ સાથે વાંચતાં, તે આ કંપનીને લાગુ પડતા નથી.

૬. હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓની સ્થિતિ

(ક) વીજ પરિયોજનાઓ

૧) જી.પી.સી.એલ.ની પોતાની વીજ પરિયોજનાઓ (સૌર/પવન)

ક. શિકારપુર ખાતે ૬ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના

જી.પી.સી.એલ. એ નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મનાબા અને પેથાપુર ગામો ખાતે ૬ મે.વો. વિન્ડ મિલની પરિયોજના સ્થાપી છે. આ પરિયોજના પૂર્ણરીતે કાર્યરત છે. વર્ષ ૨૦૨૧-૨૨માં, આ પરિયોજનાએ ૭.૬૯ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે રૂ. ૨.૭૩ કરોડની આવક કરી છે.

ખ. જમનવાડા ખાતે ૧૦.૫ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના

જી.પી.સી.એલ. એ કચ્છ જિલ્લાના જમનવાડા ખાતે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૬.૩ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના અને ૨૦૧૨-૧૩ દરમિયાન ૪.૨ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના સ્થાપી છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત છે. તેણે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩.૪૧ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે તથા આશરે રૂ. ૫.૦૮ કરોડની આવક કરી છે.

ગ. હાઇબ્રીડાઇઝેશનની સંકલ્પના હેઠળ ચારણકા ખાતે ૪.૨ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના

ચારણકા સોલાર પાર્ક ખાતે હાઇબ્રીડાઇઝેશનની સંકલ્પનાનો પ્રયોગ કરવા માટે વર્ષ ૨૦૧૨-૧૩માં જી.પી.સી.એલ. એ ૪.૨ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના સ્થાપી છે. આ પરિયોજના સંપૂર્ણ કાર્યરત છે. વર્ષ ૨૦૨૧-૨૨માં તેણે ૪.૭૮ મે.વો. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે રૂ. ૧.૭ કરોડની આવક કરી છે.

ઘ. ચારણકા ખાતે ૫ મે.વો.નો સોલાર પ્રોજેક્ટ

જી.પી.સી.એલ.એ ચારણકા ખાતે વર્ષ ૨૦૧૧-૧૨માં ૫ મે.વો.નો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટ કાર્યરત છે. વર્ષ ૨૦૨૧-૨૨માં તેણે ૬.૪૨ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે રૂ. ૮.૪૮ કરોડની આવક કરી છે.

ચ. મોઢેરા સૂર્ય મંદિર અને શહેરનું સૌર વીજળીકરણ

ગુજરાત સરકાર અને ભારત સરકાર સંયુક્ત રીતે મોઢેરા સૂર્ય મંદિર અને શહેરનું સૌર વીજળીકરણ કરવાનો એક અનન્ય નિદર્શન પ્રોજેક્ટ ઊભો કર્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મોઢેરા સૂર્ય મંદિર અને શહેરને નિરંતર સૌર વીજળી પૂરી પાડવાનો છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે જીપીસીએલને અમલકર્તા એજન્સી જાહેર કરી છે. આ પ્રોજેક્ટનું અંદાજિત ખર્ચ રૂ. ૮૦.૬૬ કરોડ છે અને તે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના મધ્યમાં પૂરી થવાની અપેક્ષા છે.

૨) ગુજરાત સોલાર પાર્ક

ગુજરાત સોલાર પાર્ક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલો છે. આ સંકલિત “સોલાર પાર્ક” વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અને ઘરઆંગણે વીજળી મેળવવાની જોગવાઈ સાથે અતિ આધુનિક આધારમાળખું ધરાવે છે. ૩૬ ડેવલપર્સ સાથે ૭૩૦ મે.વો.ના સોલાર પ્રોજેક્ટની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

૩) જે.એન.એન.એસ.એમ. તબક્કા-૨ યોજના હેઠળ ૧૦ મે.વો.નો સોલાર પાવર પ્રોજેક્ટ

જી.પી.સી.એલ. એ જે.એન.એન.એસ.એમ. તબક્કા-૨ હેઠળ રૂ. ૬૨ કરોડના ઇ.પી.સી. ખર્ચે પ્રથમ બેચની ૧૦ મે.વો.ની સૌર વીજ પરિયોજના શરૂ કરી છે. તારીખ ૨૦-૦૩-૨૦૧૫ના રોજ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં તેણે ૨૨.૫૫ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે ૧૦.૦૪ કરોડની આવક કરી છે.

૪) જી.પી.સી.એલ.નો પોતાનો ૧ મે.વો.નો સોલાર રુફટોપ પ્રોજેક્ટ

જી.પી.સી.એલ.એ તેના ગાંધીનગર અને અમદાવાદનાં જુદાં જુદાં સરકારી મકાનો પરના ૧ મે.વો.ના સોલાર રુફટોપ પ્રોજેક્ટ માટે ટેરેન્ટ પાવર લિ. સાથે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) કર્યા છે. જી.પી.સી.એલ.એ. ૮૮૩.૮૯ કિ.વો. વીજળીનું ઉત્પાદન વર્ષ ૨૦૧૩-૧૪માં સફળતાપૂર્વક શરૂ કર્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં આ પ્રોજેક્ટે રૂ. ૬૧.૩૫ લાખની આવક કરી છે.

૫) ૭૦૦ + રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક

આ પરિયોજના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધાનેસડા ગામ ખાતે આવેલી છે. પાર્કમાં ૪૮૫ મે.વો. સોલાર વીજળીના ઉત્પાદન સાથે કાર્યરત છે અને ૨૧૫ મે.વો.ની ક્ષમતા માટેનું કામ ચાલુ છે. ઉક્ત પાર્ક ખાતે માર્ગનું બાંધકામ, પાળાં, પાણી પુરવઠો, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો, જેવી આધારમાળખાકીય સુવિધાઓનાં કામો પૂરાં થયાં છે.

૬) ૧૦૦૦ મે. વો.નો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક (તબક્કો-૧)

ગુજરાત સરકારે ૧૦૦૦ મે.વો.નો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક ઊભો કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન લાંબી મુદતના પટેથી જમીન પૂરી પાડવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે. આ પ્રોજેક્ટમાં જીપીસીએલ સોલાર પાવર પાર્ક ડેવલપર છે. જીયુવીએનએલએ આ પાર્કમાંથી સૌર વીજળી ખરીદવા અંગેનું ટેન્ડરો મંગાવ્યાં હતાં. તે પૈકી ૩૦૦ મે.વો.ની ક્ષમતા ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા માર્ચ, ૨૦૨૨માં કરવામાં આવ્યું છે. બાકીના ૭૦૦ મે.વો. માટેનો નિર્ણય APTEL દ્વારા લેવામાં આવશે.

૭) ૩૦ ગીગા વોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક

ગુજરાત સરકારે રાજ્ય પડતર જમીન નીતિ (સ્ટેટ વેસ્ટ લેંડ પોલિસી) હેઠળ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેની વિઘાકોટ પોસ્ટ નજીક ખાવડા ખાતે ૩૦ ગીગા વોટના રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ૭૨૪૦૦ હેક્ટર પડતર જમીન ફળવી છે. આ સંદર્ભમાં, રિન્યુએબલ

એનર્જી પાર્ક સ્થાપવા માટે MNRE અને રક્ષા મંત્રાલયે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાતમાં આ ૩૦ ગીગા વોટના રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ માટે જીપીસીએલ સહાયકર્તા એજન્સી તરીકે કામ કરે છે. વેસ્ટ લેન્ડ પોલીસી ૨૦૧૯ હેઠળ તેને નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી હોવાથી જીપીસીએલ સરકારી સત્તાતંત્રો, ડેવલપર્સ અને અન્ય સક્ષમ સત્તામંડળો સાથે સતત સંકલન કરી રહ્યું છે જેથી, ૩૦ ગીગા વોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્ધારિત સમયમાં શરૂ કરી શકાય.

૮) સમુદ્રના મોજાં આધારિત વિજળી પરિયોજના

સમુદ્રનાં મોજાં આધારિત ભરતી પરિયોજનાના અમલ માટે નોડલ એજન્સી તરીકે જી.પી.સી.એલ.ની નિમણૂક કરવામાં આવી છે.

(ખ) ખાણકામ પરિયોજનાઓ

૧) ૫૦૦ મે.વો.ભાવનગર લિગ્નાઇટ આધારિત વીજ પરિયોજના

લિગ્નાઇટ ખાણકામ માટે જી.પી.સી.એલ. એ ભાવનગર જિલ્લામાં ત્રણ લિગ્નાઇટ બ્લોક/ ખાણકામ પટા નિયત કર્યા છે.

૧. ઘોઘા- સુરકા લિગ્નાઇટ ભંડાર (૧૩૫૫ હેક્ટર)

૨. ખડસાલિયા- ૧ લિગ્નાઇટ ભંડાર (૭૧૨ હેક્ટર) (આ પરિયોજના હજુ શરૂ થવાની બાકી છે.)

૩. ખડસાલિયા- ૨ લિગ્નાઇટ ભંડાર (૯૧૪ હેક્ટર) (આ પરિયોજના હજુ શરૂ થવાની બાકી છે.)

(૧) ઘોઘા-સુરકા લિગ્નાઇટ ભંડાર

વાર્ષિક ૨.૨૫ એમએમટીની નિર્ધારિત ક્ષમતા સાથેના ૧૩૫૫ હેક્ટરના વિસ્તારના ઉત્પાનન પટા પૈકી "કન્સેન્ટ અવોર્ડ" થકી લગભગ ૧૦૬૯ હેક્ટર ખનગી જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. ઉત્પાનન પ્રવૃત્તિઓ માટે જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ/સંમતિઓ મેળવી લેવામાં/અમલમાં મૂકવામાં આવી છે. ઘોઘા-સુરકા લિગ્નાઇટ ખાણ ખાતે ઉત્પાનન પ્રવૃત્તિ ૦૧/૦૪/૨૦૧૮ થી શરૂ કરવામાં આવી છે અને ભાવનગર થર્મલ પાવર સ્ટેશન (બીએલટીપીએસ)ને લિગ્નાઇટનો પુરવઠો તા. ૦૮/૦૮/૨૦૧૮થી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં બીએલટીપીએસને લગભગ ૪૪,૪૮,૯૪૩.૬૫ ટન લિગ્નાઇટનો પુરવઠો આપવામાં આવ્યો છે.

(૨) બૈતરણી પશ્ચિમ કોલસા બ્લોક

કોલ બ્લોકની ફાળવણી રદ કરવાની બાબત ઓરિસ્સા હાઇકોર્ટમાં પડતર છે. કોલસા મંત્રાલયે બૈતરણી પશ્ચિમ કોલસા બ્લોકની ફાળવણી મે. ઓરિસ્સા માઈનીંગ કોર્પોરેશન લિમિટેડને કરી છે અને કોલસા મંત્રાલયે બી.ડબલ્યુ.સી.સી.એલ.ને જિઓલોજીકલ રીપોર્ટ અને સંમતિના ખર્ચ પેટે વળતર ચુકવ્યું છે, જે ત્રણેય પ્રમોટર કંપનીઓને સરખા ભાગે વહેંચવામાં આવ્યું છે. બી.ડબલ્યુ.સી.સી.એલ.ના નિયામક મંડળ અને શેરધારકોએ શેર મૂડી રૂ. ૩૦ કરોડથી ઘટાડીને રૂ. ૬ કરોડ કરવાની મંજૂરી આપી છે અને આ ઘટાડા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં અરજી દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

૭. ગૌણ / સહયોગી/ સંયુક્ત સાહસની કંપનીઓ

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ આ કંપની કોઈ ગૌણ કંપનીઓ ધરાવતી નથી.

કંપની એક સહયોગી કંપની એટલે કે બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (બી.ડબલ્યુ.સી.સી.એલ.) ધરાવે છે અને તે ઉપરાંત ૧૦ ટકા કરતા ઓછા રોકાણ સાથેની અન્ય ૩ સંયુક્તરીતે નિયંત્રિત કંપનીઓ ધરાવે છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૨૯ની પેટા કલમ-૩ના પ્રથમ પરંતુક હેઠળ જરૂરી છે તે મુજબ, " ધ કંપનીઝ (એકાઉન્ટ્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૫માં સમાવિષ્ટ નિર્દિષ્ટ ફોર્મ એ.ઓ.સી. ૧માં સહયોગી સંયુક્ત સાહસોને લગતું નાણાકીય પત્રક આ અહેવાલ સાથે "જોડાણ-૧" તરીકે આપવામાં આવ્યું છે. બી.ડબલ્યુ.સી.સી.એલ.ને ફાળવવામાં આવેલો કોલ બ્લોક ભારત સરકારના કોલસા મંત્રાલયે રદ કર્યો હોવાથી અને આ બાબત ઓરિસ્સા હાઇકોર્ટમાં ન્યાયાધીન હોવાથી બી.ડબલ્યુ.સી.સી.એલ.નાં નાણાકીય પત્રકોને આ કંપની સાથે એકત્રિત કરવામાં આવ્યાં નથી. બી.ડબલ્યુ.સી.સી.એલ. દ્વારા શેર મૂડીમાં ઘટાડો કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) માં અરજી દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

૮. નિયામકો અને મહત્વનો વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ

(ક) ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર

વર્ષ દરમિયાન શ્રીમતી સુનયના તોમર, આઇ.એ.એસ. તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી કંપનીના આધ્યક્ષ હતા અને શ્રી એસ.બી.ખાવલિયા તા. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. ત્યારબાદ, તા. ૦૮/૦૭/૨૦૨૧થી શ્રીમતી મમતા વર્મા, આઇ.એ.એસ.ને કંપનીનાં આધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં અને તા. ૧૧/૧૧/૨૦૨૧થી વિકલ્પ ભારદ્વાજ, આઇ.એ.એસ.ને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા .

(ખ) સ્વતંત્ર નિયામકો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૯(૬) અન્વયે નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ નિયામકોની “સ્વતંત્રતા”ની વ્યાખ્યાના સંદર્ભમાં, શ્રી પી.કે.તનેજા, આઇ.એ.એસ. (નિવૃત્ત) નિયામક મંડળમાં “નોન-એક્ઝીક્યુટીવ” સ્વતંત્ર નિયામક છે અને બીજા “નોન-એક્ઝીક્યુટીવ” સ્વતંત્ર નિયામકની નિમણૂક પ્રક્રિયા હેઠળ છે. સ્વતંત્ર નિયામકે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૯ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ જરૂરી એકરાર રજૂ કર્યો છે. તમામ નિયામકોએ નિર્દિષ્ટ કરવામાં આવેલી સંહિતાનું પાલન કરવા અંગેનો એકરાર રજૂ કર્યો છે.

(ગ) મહિલા નિયામક

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૯ની જોગવાઈઓના સંદર્ભમાં, કંપનીના નિયામકમંડળમાં શ્રીમતી મમતા વર્મા, આઇ.એ.એસ. અને સુશ્રી. દિપલ હડિયલ મહિલા નિયામકો છે.

(ઘ) મહત્વનો વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ

૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ દરમિયાન સુશ્રી કૃપા જોશી કંપનીના કંપની સેક્રેટરી તથા કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૨૦૩ હેઠળ કે.એમ.પી. પણ છે. શ્રી મેહુલ જે. ડનાયક કંપનીના ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર તેમજ કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૨૦૩ હેઠળ કે.એમ.પી. પણ છે.

૯. નિયામક મંડળની બેઠકોની સંખ્યા.

સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષ દરમિયાન નિયામક મંડળની ચાર બેઠકો તા. ૩૧/૦૭/૨૦૨૧, ૨૮/૧૧/૨૦૨૧, ૨૮/૧૨/૨૦૨૧, અને ૨૮/૦૩/૨૦૨૨ના રોજ મળી હતી. બે સળંગ બેઠકો વચ્ચેનો સમયગાળો કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ નિયત કરવામાં આવેલી સમય મર્યાદા મુજબનો હતો.

૧૦. નિયામક મંડળની સમિતિઓ

સમીક્ષા હેઠળનાં વર્ષ દરમિયાન કંપની અધિનિયમ, ૨૦૧૩ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોની સંબંધિત જોગવાઈઓની જરૂરિયાતોને અનુસાર કંપની “નિગમિત સામાજિક જવાબદારી સમિતિ” અને વખતોવખત ઇકિવટી શેર્સની ફાળવણી કરવા માટે “શેર ઓફર એન્ડ એલોટમેન્ટ કમિટિ” ધરાવે છે.

(ક) નિગમિત સામાજિક જવાબદારી સમિતિ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૫ની જોગવાઈઓ અનુસાર, કંપનીએ નિગમિત સામાજિક જવાબદારી સમિતિની રચના કરી છે. તા. ૩૧/૦૩/૨૦૨૨ના રોજ નિગમિત સામાજિક જવાબદારી સમિતિ નીચે મુજબ છે.

- (૧) શ્રી પી.કે. તનેજા, આઇ.એ.એસ. – સમિતિનાં ચેર પર્સન
- (૨) શ્રી વિકલ્પ ભારદ્વાજ, આઇ.એ.એસ. – સભ્ય
- (૩) શ્રી પી.એચ.રાણા – સભ્ય
- (૪) સુશ્રી દિપલ હડિયલ – સભ્ય

સમિતિની પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ “જોડણ-૨”માં આપવામાં આવ્યો છે.

૧૧. તકેદારી તંત્ર/ વ્હીસલ બ્લોઅર પોલિસી

કંપનીએ એક તકેદારી તંત્ર અમલમાં મૂક્યું છે, જેને અનુસરીને વ્હીસલ બ્લોઅર્સ ગેરવાજબી કાર્ય-વર્તણૂક, વ્યવસ્થાપન પ્રયાસો, વ્યાપાર પ્રથાઓ, મનોવૈજ્ઞાનિક રીતે વિપરિત કાર્ય-પરિસ્થિતિઓ, ખરેખર અથવા શંકાસ્પદ છેતરપીંડીઓ અથવા આચારસંહિતાના ભંગ કે કાનૂની અથવા નિયંત્રક આવશ્યકતાઓના ભંગ, કોઇપણ ખોટાં નાણાકીય પત્રકો અથવા અહેવાલો અથવા નાણાકીય પત્રકો કે અહેવાલોની ખોટી રજૂઆત અને આવી અન્ય નકારાત્મક પ્રકારની પ્રવૃત્તિઓ જે કંપનીની છાપ બગાડતી હોવાનું કે સામાજિક પ્રતિષ્ઠા ઝાંખી પાડતી હોવાનું કે કામના સ્થળે કર્મચારીઓનો જુસ્સો અને સલામતી ઘટાડતી હોવાનું જણાય તેની સામે ચિંતા વ્યક્ત કરી શકશે. વ્હીસલ બ્લોઅર અપવાદરૂપ સંજોગોમાં સીધા જ ઓડિટ સમિતિના ચેરમેનનો સંપર્ક કરી શકે છે અને તેમની ચિંતા કે ફરિયાદ જણાવી શકે છે.

૧૨. કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૮૬ હેઠળ આપવામાં આવેલી લોન, ગેરંટી કે કરવામાં આવેલાં રોકાણોની વિગતો.

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ કરેલું રોકાણ અને આપેલી લોન વર્ષ ૨૦૨૧-૨૨નાં નાણાકીય પત્રકની અનુક્રમે નોંધ-૩ અને ૪ તથા નોંધ-૫માં દર્શાવ્યાં છે.

૧૩. સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલા કરારો અથવા ગોઠવણીની વિગતો

સંબંધિત પક્ષકારો સાથે આ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ કરેલી તમામ લેવડદેવડો સામાન્ય કામકાજરૂપે જ અને યોગ્ય અંતર જાળવીને કરવામાં આવી હતી અને કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૮૮ લાગુ પડે એવી કોઈ લેવડદેવડ કરવામાં આવી નથી. વધુમાં, સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કંપનીના પ્રમોટર્સ, નિયામકો અથવા મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગ સાથે, કંપનીના હિત સાથે ઘર્ષણમાં આવે એવી કોઈ લેવડદેવડ સંબંધિત પક્ષકારો થકી કરવામાં આવી નથી. આપના નિયામકો વર્ષ ૨૦૨૧-૨૨નાં નાણાકીય પત્રકની નોંધ-૨૭ તરફ આપનું ધ્યાન દોરે છે જેમાં સંબંધિત પક્ષકારો સાથેની લેવડદેવડો દર્શાવવામાં આવી છે. વધુમાં જયારે હોલ્ડિંગ કંપની/ સહયોગી કંપની રાજ્ય નિયંત્રિત કંપની હોય ત્યારે આવી જાહેરાત કરવી જરૂરી નથી.

૧૪. વાર્ષિક રિટર્નની તારીખ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૩૪(૩)(ક), કલમ -૮૨ (૩)ને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૧૨ સાથે વાંચતાં, તેમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ મુજબનું નિર્દિષ્ટ ફોર્મ એમ.જી.ટી.-૯ આ અહેવાલના ભાગરૂપે “જોડાણ-૩” તરીકે આપવામાં આવ્યું છે.

૧૫. ઓડિટરો અને ઓડિટરનાં અવલોકનો :

(ક) વૈધાનિક ઓડિટરો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૩૮ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈ મુજબ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની કચેરી, નવી દિલ્હીએ મે. અનિલ એન. શાહ એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની નિમણૂક ૨૦૨૧-૨૨ના વર્ષ માટે વૈધાનિક ઓડિટર તરીકે કરી છે. તેઓ આ હોદ્દો આગામી વર્ષની સામાન્ય સભાની તારીખ સુધી ધારણ કરી રાખશે.

(ખ) કોસ્ટ ઓડિટરો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૮(૧) હેઠળ કેંદ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યા મુજબ, આ કંપનીએ કોસ્ટ એકાઉન્ટીંગ રેકર્ડ્ઝ રાખવું જરૂરી છે. તદનુસાર કંપની જરૂરી કોસ્ટ હિસાબો અને રેકર્ડ રાખે છે. કંપનીઝ (કોસ્ટ રેકર્ડ્ઝ એન્ડ ઓડિટ) રુલ્સ, ૨૦૧૪ મુજબ, મે. પી. એચ. દેસાઈ એન્ડ કું., કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની નિમણૂક વર્ષ ૨૦૨૧-૨૨ માટે કંપનીના કોસ્ટ ઓડિટર તરીકે કરી છે.

(ગ) આંતરિક ઓડિટરો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૩૮ને, તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો સાથે વાંચતાં, તેમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, નિયામક મંડળે મે. સંદીપ દેસાઈ એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની નિમણૂક વર્ષ ૨૦૨૧-૨૨ માટે કંપનીનું આંતરિક ઓડિટ કરવા માટે કંપનીના આંતરિક ઓડિટર તરીકે કરી છે. આંતરિક ઓડિટરોનાં અવલોકનો અને ભલામણો ઓડિટ સમિતિને જણાવવામાં આવે છે અને ઓડિટ સમિતિ તે અંગે યોગ્ય કાર્યવાહી કરે છે.

(ઘ) સેક્રેટરિયલ ઓડિટર્સ

કલમ-૨૦૪ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈ મુજબ કંપનીએ મે. ધારા પટેલ, કંપની સેક્રેટરીઝ, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી, અમદાવાદની નિમણૂક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સેક્રેટરિયલ ઓડિટર તરીકે કરી છે. સેક્રેટરીયલ ઓડિટરનો અહેવાલ આ સાથેના “જોડાણ-૪”માં આપવામાં આવ્યો છે.

(ચ) વૈધાનિક ઓડિટરે તેમના ઓડિટ અહેવાલમાં અને સેક્રેટરિયલ ઓડિટરે તેમના સેક્રેટરિયલ ઓડિટર અહેવાલમાં દર્શાવેલા દરેક ક્વોલિફિકેશન/ રિઝર્વેશન/ વિપરિત રિમાર્ક અથવા અસ્વિકરણ (ડિસ્ક્લેઇમર) અંગે નિયામક મંડળનો ખુલાસો અથવા ટિકા-ટિપ્પણ.

વૈધાનિક ઓડિટરે તેમના ઓડિટ અહેવાલમાં કોઈ ક્વાલિફિકેશન, રિઝર્વેશન દર્શાવ્યાં નથી અને કોઈ વિપરિત નોંધ પણ કરી નથી. તેમણે કોઈ અસ્વિકરણ (ડિસ્ક્લેઇમર) પણ આપ્યું નથી. સેક્રેટરિયલ ઓડિટરનાં અવલોકનો સ્વયંસ્પષ્ટ છે.

૧૬. કંપનીની નાણાકીય સ્થિતિને અસર કરતા પ્રત્યક્ષ ફેરફારો અને પ્રતિબદ્ધતાઓ :

નાણાકીય વર્ષના અંત એટલે કે ૩૧મી માર્ચ, ૨૦૨૨ અને નિયામકોના અહેવાલની તારીખ વચ્ચેના સમયગાળામાં રાબેતા મુજબના ધંધાકીય સોદા સિવાય એવા કોઈ પ્રત્યક્ષ ફેરફારો કે પ્રતિબદ્ધતાઓ કરવામાં આવી નથી જેનાથી કંપનીની નાણાકીય સ્થિતિ પર વિપરિત અસર પડે. કંપનીના કામકાજના પ્રકારમાં કોઈ ફેરફાર થયો નથી. કંપનીના ચાલુ કામકાજ પર કે ભાવિ કામગીરી પર અસર કરે એવા કોઈ મહત્વના કે પ્રત્યક્ષ હુકમો નિયંત્રકો અથવા કોર્ટ અથવા ટ્રિબ્યુનલે ઇસ્યુ કર્યાં નથી.

૧૭. કર્મચારીઓની વિગતો

આ એક સરકારી કંપની હોવાથી, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના તા. ૦૫/૦૬/૨૦૧૫ના જાહેરનામા મુજબ, કલમ ૧૯૭ આ કંપનીને લાગુ પડતી નથી.

૧૮. શેર મૂડી

આ કંપની માત્ર એક જ વર્ગના શેર્સ એટલે કે ઇક્વિટી શેર્સ ધરાવે છે. તા. ૩૧/૦૩/૨૦૨૨ના રોજ કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. ૬૦૦ કરોડ હતી, જે રૂ. ૧૦૦/-નો એક એવા ૬ કરોડ શેર્સમાં વિભાજિત થયેલી છે. તા. ૩૧/૦૩/૨૦૨૨ના રોજ કંપનીની ઇસ્યુ, સબસ્ક્રાઇબ અને ભરપાઈ થયેલ શેર મૂડી રૂ. ૫,૧૩,૨૩,૨૭,૦૫૦ હતી. મૂડી સંબંધી અન્ય વિગતો નીચે મુજબ છે.

(ક) જામીનગીરીઓ પાછી ખરીદવી

કંપનીએ સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન તેની કોઈ જામીનગીરી પાછી ખરીદી નથી.

(ખ) સ્વીટ ઇક્વિટી

કંપનીએ સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કોઈ સ્વીટ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કર્યા નથી.

(ગ) બોનસ શેર્સ

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કોઈ બોનસ શેર ઇસ્યુ કરવામાં આવ્યા નથી.

(ઘ) કર્મચારીઓનો સ્ટોક ઓપ્શન પ્લાન

કંપનીએ કર્મચારીઓને કોઈ સ્ટોક ઓપ્શન પ્લાન પૂરો પાડ્યો નથી.

૧૯. ઊર્જા, પ્રૌદ્યોગિકીનું ગ્રહણ અને વિદેશી હુંડિયામણની આવક જાવક :

(ક) ઊર્જાનું ગ્રહણ : સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, જેની જાહેરાત કરવી પડે એવી ઊર્જાની કોઈ વપરાશ થઈ ન હતી.

(ખ) ટેકનોલોજીનું ગ્રહણ : સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન આપની કંપનીએ કોઈ ટેકનોલોજીની આયાત કરી નથી.

(ગ) વિદેશી હુંડિયામણની આવક અને જાવક : શૂન્ય

૨૦. જોખમ વ્યવસ્થાપન

કંપનીની સંપત્તિ અને મીલકતોનો પૂરતો વીમો ઉતારવમાં આવ્યો છે.

૨૧. આંતરિક ઓડિટ અને નિયંત્રણ પદ્ધતિ

કંપની તેના કદ અને કામગીરીના પ્રમાણને સુસંગત એવી યોગ્ય આંતરિક નિયંત્રણ પદ્ધતિ અને પ્રક્રિયાઓ ધરાવે છે. જે થકી કંપની નિર્ધારિત નીતિઓ અને પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરે છે, જેથી ઓડિટ હેઠળ આવતા પ્રત્યેક વિષય અંગેના જોખમો ઘટાડી શકાય. આ માટે કંપનીના સ્ટેન્ડ અલોન આઈએનડી એએસ નાણાકીય પત્રકો અંગેના સ્વતંત્ર ઓડિટરના સમાન તારીખના અહેવાલ સાથેનું જોડાણ-૩ જુઓ.

૨૨. કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ઉકેલ) અધિનિયમ, ૨૦૧૩ હેઠળ જાહેરાત

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કંપનીને મહિલા કર્મચારીઓની જાતીય સતામણી અંગે શૂન્ય ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ઉકેલ) અધિનિયમ, ૨૦૧૩ની જોગવાઈઓ હેઠળ આંતરિક ફરિયાદ સમિતિની રચના હજુ કરવાની છે.

૨૩. નિયામક મંડળનું મૂલ્યાંકન

આ એક સરકારી કંપની હોવાથી, ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તા પમી જુન, ૨૦૧૫ના જાહેરનામા ક્રમાંક જીએસઆર-૧૬૩(ચ)ને ધ્યાનમાં લેતાં, અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૪(૩)(ધ)ની જોગવાઈઓ લાગુ પડતી નથી.

૨૪. નિયામકોની જવાબદારી અંગેનું નિવેદન

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૪(પ)ની જોગવાઈઓ મુજબ નિયામક મંડળ તેની જવાબદારી અંગે નિવેદન કરે છે કે -

(ક) આ વાર્ષિક અહેવાલો તૈયાર કરવામાં મહત્વનાં વિચલન સંબંધી યોગ્ય ખુલાસાઓ સાથે લાગુ પાડવાપાત્ર હિસાબી ધોરણો અનુસરવામાં આવ્યાં છે.

(ખ) નિયામકોએ નાણાકીય વર્ષના અંતે કંપનીની સ્થિતિનું અને કંપનીના નફા-નુકસાનનું સાચું અને યોગ્ય ચિત્ર આપે એવી હિસાબી નીતિઓ પસંદ કરી છે અને એમને એકધારી લાગુ પાડવામાં આવી છે અને ઉચિત અને વિવેકી નિર્ણયો અને અંદાજો કર્યા છે.

- (ગ) નિયામકોએ કંપનીની મિલકતની સલામતી માટે અને છળકપટ તથા અન્ય અનિયમિતતાઓ રોકવા અને શોધી કાઢવા, આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર પૂરતું હિસાબી રેકર્ડ રાખવા માટે યોગ્ય અને પૂરતી કાળજી લીધી છે.
- (ઘ) નિયામકોએ આ વાર્ષિક હિસબો ચાલુ ઘંઠાના આધારે તૈયાર કર્યા છે.
- (ચ) (કંપની લિસ્ટેડ કંપની ન હોવાથી લાગુ પડતું નથી)
- (છ) નિયામકોએ એવી યોગ્ય પદ્ધતિઓ ઘડી છે કે જેથી લાગુ પાડવાપાત્ર તમામ કાયદાઓનું અનુપાલન થાય અને આવી પદ્ધતિઓ પર્યાપ્ત અને અસરકારક રીતે કામ કરે તે સુનિશ્ચિત કરી શકાય.

૨૫. અન્ય જહેરાતો

- ક) વર્ષ દરમિયાન કંપનીના કામકાજના પ્રકારમાં કોઈ ફેરફાર થયો નથી.
- ખ) કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૧૨)ના સંદર્ભમાં, વૈધાનિક ઓડિટરોના ઓડિટ દરમિયાન કોઈ છેતરપીંડી જોવા કે જાણવા મળી નથી.
- ગ) આ અહેવાલમાં અન્યત્ર જણાવવામાં આવ્યું છે એ સિવાય, રેગ્યુલેટર્સ અથવા કોર્ટ્સ અથવા ટ્રિબ્યુનલ્સ દ્વારા એવા કોઈ મહત્ત્વના કે પ્રત્યક્ષ હુકમો કરવામાં આવ્યા નથી જેની ચાલુ ઘંઠા પર કે કંપનીના ભવિષ્યના કામકાજ પર કોઈ અસર પડે.
- ઘ) કંપનીએ લાગુ પડતા સેક્ટરિયલ ધોરણોનું પાલન કર્યું છે.

૨૬. ઋણસ્વીકાર :

આપના નિયામકો તમામ કર્મચારીઓએ કંપની પ્રત્યે દાખવેલી નિષ્ઠા, વફાદારી અને સહકાર બદલ તેમનો આભાર માને છે. આપના નિયામકો ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો, ખાસ કરીને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગ્રાહકો, બેંકર્સ અને અન્ય નિયમકારી સત્તામંડળો તરફથી મળેલ બહુમૂલ્ય યોગદાન, સહકાર અને સહાયની સાભાર નોંધ લે છે.

સ્થળ : ગાંધીનગર

તા. ૧૯-૧૨-૨૦૨૨

નિયામક મંડળના નામે અને
તેમના વતી
સહી/-
(શ્રીમતી મમતા વર્મા, આઈ.એ.એસ.)
અધ્યક્ષ
ડીઆઈએન: ૦૧૮૫૪૩૧૫

જોડાણ-૧

ફોર્મ - એઓસી-૧

(કલમ-૧૨૯ની પેટા કલમ (૩)ના પહેલા પરંતુકને કંપનીઝ (એકાઉન્ટ્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૫ સાથે વાંચતાં, તેમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર)

કંપનીની શાખાઓ/ સહયોગી કંપનીઓ/ સંયુક્ત સહાસોનાં નાણાકીય પત્રકોની લાક્ષણિકતાઓનો સમાવેશ કરતું પત્રક

ભાગ- 'ક' - શાખાઓ- લાગુ પડતું નથી (કંપની તેની કોઈ શાખા ધરાવતી નથી.)

ભાગ- 'ખ' - સહયોગી કંપનીઓ અને સંયુક્ત સાહસો

સહયોગી કંપનીઓ સાથે સંબંધિત, કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ- ૧૨૯(૩)ને અનુસરીને પત્રક

સહયોગી કંપનીનું નામ	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (BWCCCL)
૧. ઓડિટ કરવામાં આવેલાં છેલ્લાં પાકાં સરવૈયાની તારીખ.	૩૧-૦૩-૨૦૨૨
૨. વર્ષના અંતે કંપનીએ ધારણ કરેલા સહયોગી કંપનીના શેર્સ હોલ્ડિંગનું પ્રમાણ	રૂ. ૧૦૦૦/-નો એક એવા ૧૦૦૦૦૦
સહયોગી કંપની/ સંયુક્ત સાહસમાં રોકાણ કરવામાં આવેલી રકમ	રૂ. ૧૦,૦૦,૦૦,૦૦૦/-
હોલ્ડિંગનું પ્રમાણ %	૩૩.૩૩ ટકા
૩. નોંધપાત્ર પ્રભાવ કેવી રીતે પડે છે તેનું વર્ણન	ગુજરાત સરકારની કંપની છે. (જેનું પ્રતિનિધિત્વ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ કરે છે), ઓરિસ્સા સરકાર અને કેરાલા સરકારની આ સંયુક્ત સાહસની કંપની છે, જેમાં દરેક સરકારનો ૩૩.૩૩ ટકા હિસ્સો છે.
૪. સહયોગી કંપની/ સંયુક્ત સાહસને એકત્રિત ન કરવાનાં કારણો.	BWCCCLને ભારત સરકારના કોલસા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવેલો કોલ બ્લોક ૨૬ કરવામાં આવ્યો છે. આ બાબત ઓરિસ્સાની હાઇકોર્ટમાં સબજ્યુડિસ (ન્યાયાધીન) છે. તેથી નાણાકીય પત્રકોને કંપની સાથે એકત્રિત કરવામાં આવ્યાં નથી.
૫. ઓડિટ કરવામાં આવેલાં છેલ્લાં પાકાં સરવૈયા મુજબ શેરહોલ્ડિંગ મુજબ ચોખ્ખી કિંમત.	BWCCCLની કુલ કિંમત: રૂ. ૩૩,૭૭,૩૯,૮૭૩/- જીપીસીએલનો હિસ્સો (૩૩.૩૩ ટકા): રૂ. ૧૧,૨૫,૬૮,૭૦૦/-
૬. વર્ષનો નફો/ ખોટ	ચોખ્ખો નફો રૂ. ૮૧,૪૮,૨૬૪/- જીપીસીએલનો હિસ્સો: રૂ. ૨૭,૧૫,૮૧૬/-
૧. એકત્રિકરણમાં ધ્યાને લેવામાં આવેલી	શૂન્ય
૨. એકત્રિકરણમાં ધ્યાને લેવામાં ન આવેલી	રૂ. ૨૭,૧૫,૮૧૬/- એનએ તરીકે

૧. કામગીરી હજુ ચાલુ કરવાની હોય એવી સહયોગી કંપનીઓ અથવા સંયુક્ત સાહસોનાં નામ.

૨. વર્ષ દરમિયાન ફરિયાદોમાં ગયેલી અથવા વેચી નાખવામાં આવેલી સહયોગી કંપનીઓ અથવા સંયુક્ત સાહસોનાં નામ.

નોંધ : આ ફોર્મને, પાકા સરવૈયાને કરવામાં આવે છે તે જ રીતે પ્રમાણિત કરવાનું છે.

તા. ૧૯-૧૨- ૨૦૨૨

સ્થળ : ગાંધીનગર

સહી
અધ્યક્ષ
ડીઆઇએન-૦૧૮૫૪૩૧૫

સહી
ચીફ ફાઇનાન્સીઅલ
ઓફીસર

નિયામક મંડળના નામે
અને તેમના વતી

સહી
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઇએન-૦૮૩૯૬૨૨૨

સહી
કંપની સેક્રેટરી

જોડાણ- ૨

કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી (સીએસઆર) પ્રવૃત્તિઓ અંગે વાર્ષિક અહેવાલ

૧. કંપનીની સીએસઆર નીતિની ટૂંકી રૂપરેખા

કંપની સમજે છે કે કંપની સમાજનો એક ભાગ હોવાથી સમાજની શક્ય એટલી વધુ સેવા કરવી અને સમાજને મદદરૂપ બનવું તે કંપનીની નૈતિક જવાબદારી છે. આ સીએસઆર નીતિનો, સીએસઆર હેઠળનાં પહેલરૂપ પ્રયાસો થકી ઉદ્દેશ સમાજનો સર્વગ્રાહી વિકાસ કરવાનો અને સમાજ માટે સામાજિક, પર્યાવરણલક્ષી અને આર્થિક મૂલ્ય ઊભું કરવાનો છે.

૨. સીએસઆર સમિતિની રચના (૩૧/૦૩/૨૦૨૨ના રોજ)

ક્રમાંક	નિયામકનું નામ અને નિયામકનો પ્રકાર	હોદ્દો	વર્ષ દરમિયાન સીએસઆર સમિતિની મળેલી બેઠકો	વર્ષ દરમિયાન સીએસઆર સમિતિની મળેલી બેઠકોમાં આપેલી હાજરી
૧	શ્રી પી.કે. તનેજા, આઈ.એ.એસ. (નિવૃત્ત) સ્વતંત્ર નિયામક	ચેરમેન	૦૧	૦૧
૨	શ્રી વિકલ્પ ભારદ્વાજ, આઈ.એ.એસ., મેનેજિંગ ડિરેક્ટર	સભ્ય	૦૧	૦૧
૩	સુશ્રી દિપલ હડિયલ, નિયામક	સભ્ય	૦૧	૦૧
૪	શ્રી પી.એચ.રાણા, નિયામક	સભ્ય	૦૧	૦૧

(નાણાકીય વર્ષ દરમિયાન ફેરફાર)

શ્રીમતિ અંજુ શર્મા, આઈ.એ.એસ. - સીએસઆર સમિતિનાં ચેર પર્સન (૨૮/૦૭/૨૦૨૧ સુધી)

શ્રી એસ.બી. ખયાલિયા - સીએસઆર સમિતિના સભ્ય (૦૧/૧૦/૨૦૨૧ સુધી)

૩. કંપનીના નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી કોમીટી, કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી નીતિ, કોર્પોરેટ સોશ્યલ પ્રોજેક્ટ્સ જ્યાં પ્રદર્શિત કરવામાં આવતાં હોય તે વેબ લિન્ક જણાવો-

www.gpcl.gujarat.gov.in

૪. નિયમ ૮ ના પેટા નિયમ (૩) મુજબ અમલમાં મૂકવામાં આવેલ સીએસઆર પ્રોજેક્ટ્સની અસરનું મૂલ્યાંકન અંગે કારોબારી સમીક્ષા વેબ લિન્ક સાથે જણાવો, લાગુ પડતું હોય તો: લાગુ પડતું નથી.

૫. કંપનીઝ (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી પોલિસી) રુલ્સ ૨૦૧૪ના નિયમ ૭ ના પેટા નિયમ (૩) મુજબ ક્ષતિપૂર્તિ માટે ઉપલબ્ધ રકમની વિગત: શૂન્ય

ક્રમાંક	નાણાકીય વર્ષ	અગાઉના નાણાકીય વર્ષમાંથી ક્ષતિપૂર્તિ માટે ઉપલબ્ધ રકમ રૂપિયામાં	નાણાકીય વર્ષ માટે ક્ષતિપૂર્તિ માટેની કોઈ રકમ જરૂરી હોય તો તે રકમ
શૂન્ય			

૬. કલમ ૧૩૫ (૫) મુજબ છેલ્લાં ત્રણ વર્ષનો કંપનીનો સરેરાશ ચોખ્ખો નફો : રૂ. ૬૪,૫૬,૫૦,૯૬૯/-

૭. (ક) કલમ ૧૩૫ (૫) મુજબ કંપનીના સરેરાશ ચોખ્ખા નફાના ૨ ટકા: રૂ. ૧,૨૯,૧૩,૦૧૯/-

(ખ) અગાઉનાં નાણાકીય વર્ષનાં સીએસઆર પ્રોજેક્ટ્સ અથવા કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓમાંથી ફાજલ રહેલી રકમ: શૂન્ય

(ગ) નાણાકીય વર્ષ માટે ક્ષતિપૂર્તિ માટે જરૂરી રકમ: શૂન્ય

(ઘ) નાણાકીય વર્ષ માટે સીએસઆર હેઠળ કુલ જવાબદારી (૭ક + ૭ખ + ૭ગ): રૂ. ૧,૨૯,૧૩,૦૧૯

૮. (ક) નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન સંસ્થાગત સામાજિક જવાબદારીની ખર્ચાયેલી અથવા વણખર્ચાયેલી રકમ

નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલી કુલ રકમ	વણખર્ચાયેલી રકમ (રૂપિયામાં)				
	કલમ ૧૩૫ (૬) મુજબ વણખર્ચાયેલી રકમ ખાતે તબદીલ કરવામાં આવેલ કુલ રકમ		કલમ ૧૩૫ (૬)ના બીજા પરંતુક મુજબ અનુસૂચિ ૭ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા કોઈપણ ભંડોળ ખાતે તબદીલ કરવામાં આવેલ રકમ		
	રકમ	તબદીલ કર્યાની તારીખ	ભંડોળનું નામ	રકમ	તબદીલ કર્યાની તારીખ
૩૮,૭૩,૮૦૬	૮૦,૩૯,૧૧૩	૨૮/૦૪/૨૦૨૨	લાગુ પડતું નથી	--	--

(ખ) સંસ્થાગત સામાજિક જવાબદારીના ચાલુ પ્રોજેક્ટ્સ સામે આ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખર્ચવામાં આવેલ રકમની વિગત

ક્રમ	પ્રોજેક્ટનું નામ	અધિનિયમ ની અનુસૂચિ ૭ની પ્રવૃત્તિઓ ની યાદી માંથી બાબત	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થળ	પ્રોજેક્ટ નો સમયગાળો	પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી રકમ	ચાલુ નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ	કલમ ૧૩૫ (૬) મુજબ વણખર્ચાયેલી તબદીલ કરવામાં આવેલ કુલ રકમ	પ્રત્યક્ષ (હા/ના)	મારફત	
										નામ	સી.એસ.આર રજીસ્ટ્રેશન નંબર
૧	હેપીનેસ કીટનું વિતરણ	ભૂખ, ગરીબી અને કુપોષણ નાબૂદ કરવાં અને આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવું	ના	ભાવનગર, ગુજરાત	૭ માસ	૫૫,૦૦,૦૦૦	૧૬,૫૦,૦૦૦		અમલકર્તા એજંસી મારફત		સી.એસ.આર.૨૦૦૦૦૨૮૬
૨	સ્માર્ટ આંગણવાડી - પરકોલેશન ટેકમાં સુધારો કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરતી ટાંકીનું બાંધકામ અને પીવપીવાનાં સુરક્ષિત પાણીની જોગવાઈ	શિક્ષણને પ્રોત્સાહન, પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ બનાવવું, પ્રાકૃતિક સંસાસધનોની જાળવણી અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ	ના	પાટણ, ગુજરાત	૭ માસ	૭૪,૧૩,૦૧૯	૨૨,૨૩,૮૦૬	૩૮,૫૦,૦૦૦	અમલકર્તા એજંસી મારફત		સી.એસ.આર.૨૦૦૦૦૨૮૭૯
	સરવાળો				૧,૨૯,૧૩,૦૧૯	૩૮,૭૩,૮૦૬	૮૦,૩૯,૧૧૩	૫૧,૮૯,૧૧૩			

(ગ) નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ચાલુ સિવાયના અન્ય પ્રોજેક્ટ્સ સામે ખર્ચવામાં આવેલ સી.એસ.આર રકમ

ક્રમાંક	પ્રોજેક્ટનું નામ	અધિનિયમની અનુસૂચિ-૭ની પ્રવૃત્તિઓની યાદીમાંથી બાબત	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થળ	પ્રોજેક્ટ માટે ખર્ચવામાં આવેલી રકમ (રૂપિયા.માં)	અમલીકરણની રીત - પ્રત્યક્ષ (હા/ના)	અમલીકરણની રીત -અમલીકરણ એજંસી મારફત	
							નામ	સી.એસ.આર રજીસ્ટ્રેશન નંબર
શૂન્ય								

(ઘ) વહીવટી સામાન્ય વ્યવસ્થાઓમાં ખર્ચવામાં આવેલી રકમ - શૂન્ય

(ચ) અસર અંગેના મૂલ્યાંકન પાછળ ખર્ચવામાં આવેલી રકમ, જો લાગુ પડતું હોય તો - શૂન્ય.

(છ) નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલી કુલ રકમ (૮ક + ૮ખ + ૮ગ + ૮ઘ): રૂ. ૩૮,૭૩,૮૦૬/-

(ઝ) નાણાકીય વર્ષ માટે વણખર્ચાયેલી રહેલી રકમ: ૮૦,૩૯,૧૧૩

(જ) ક્ષતિપૂર્તિ માટેની કોઈ અધિક રકમ હોય તો: લાગુ પડતું નથી.

ક્રમાંક	વિગત	રકમ (રૂપિયામાં)
૧	કલમ ૧૩૫ (૫) મુજબ કંપનીના સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા	૧,૨૮,૧૩,૦૧૮/-
૨	નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી કુલ રકમ	૩૮,૭૩,૮૦૬/-
૩	નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલી અધિક રકમ (૨)-(૧)	શૂન્ય
૪	અગાઉનાં નાણાકીય વર્ષના સંસ્થાગત સામાજિક જવાબદારીના પ્રોજેક્ટ અથવા કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓમાંથી ઊભી થયેલી ફાજલ રકમ	શૂન્ય
૫	ત્યાર પછીનાં નાણાકીય વર્ષમાં ક્ષતિપૂર્તિ માટે ઉપલબ્ધ રકમ (૩)-(૪)	શૂન્ય

૯. (ક) અગાઉનાં ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન સંસ્થાગત સામાજિક જવાબદારીની વણખર્ચાયેલી રકમ

ક્રમાંક	અગાઉનાં ત્રણ નાણાકીય વર્ષો	કલમ ૧૩૫ (૬) મુજબ વણખર્ચાયેલી રકમ ખાતે તબદીલ કરવામાં આવેલ કુલ રકમ (રૂ. માં)	અહેવાલનાં વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ	કલમ ૧૩૫ (૬) હેઠળ સીએસઆર ખાતામાં સિલક	(૬) મુજબ અનુસૂચિ ૭ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા કોઈપણ ભંડોળ ખાતે તબદીલ કરવામાં આવેલ રકમ (રૂ.માં)			ત્યાર પછીનાં નાણાકીય વર્ષોમાં ખર્ચવાની બાકી રહેતી રકમ (રૂ. માં)
				(રૂ.માં)	ભંડોળનું નામ	રકમ	તબદીલ કર્યાની તારીખ	
૧.	૨૦૨૦-૨૧	૩૫,૧૫,૦૦૦	૩૨,૬૧,૧૬૪	૨,૫૩,૮૩૬	પી.એમ.કેસ ફંડ	૧,૦૭,૦૫,૮૭૦	૦૨/૦૮/૨૦૨૧	૨,૫૩,૮૩૬
૨.	૨૦૧૯-૨૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩	૨૦૧૮-૧૯	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	સરવાળો	૩૫,૧૫,૦૦૦	૩૨,૬૧,૧૬૪	૨,૫૩,૮૩૬	-	૧,૦૭,૦૫,૮૭૦	-	૨,૫૩,૮૩૬

(ખ) અગાઉનાં નાણાકીય વર્ષ(ો)ના ચાલુ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખર્ચવામાં આવેલી સીએસઆર રકમની વિગતો:

ક્રમ	પ્રોજેક્ટનું નામ	અધિનિયમની અનુસૂચિ ૭ની પ્રવૃત્તિઓની યાદી માંથી બાબત	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થળ	પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી રકમ	ચાલુ નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ	અમલીકરણની રીત - પ્રત્યક્ષ (હા/ના)	અમલીકરણની રીત -અમલીકરણ એજન્સી મારફત
૧.	શિક્ષણને પ્રોત્સાહન	ખાસ કરીને બાળકો માટેનાં ખાસ શિક્ષણ સહિત શિક્ષણને પ્રોત્સાહન	ના	ઘોઘા, ભાવનગર, ગુજરાત	૮,૫૦,૦૦૦/-	૫,૧૧,૧૬૪/-	પ્રત્યક્ષ	લાગુ પડતું નથી
૨.	હેપીનેસ કીટનું વિતરણ	ભૂખ, ગરીબી અને કુપોષણ નાબૂદ કરવાં અને આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવું	ના	ભાવનગર, ગુજરાત	૨૭,૫૦,૦૦૦/-	૨૭,૫૦,૦૦૦/-	અમલકર્તા એજન્સી	અક્ષયપાત્ર ફાઉન્ડેશન
	સરવાળો				૩૫,૫૦,૦૦૦/-	૩૨,૬૧,૧૬૪/-		

૧૦. ચાલુ નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી સંસ્થાગત સામાજિક જવાબદારી માટેની રકમમાંથી કોઈ મૂડીરૂપ મિલકત ઊભી કરવા કે સંપાદિત કરવામાં આવી છે? ના

જો હા, તો ઊભી કરવા કે સંપાદિત કરવામાં આવેલી મૂડીરૂપ મિલકતોની સંખ્યા જણાવો - લાગુ પડતું નથી.

ચાલુ નાણાકીય વર્ષમાં ખર્ચ કરવામાં આવેલ સંસ્થાગત સામાજિક જવાબદારી માટેની રકમમાંથી આ રીતે ઊભી કરવા કે સંપાદિત કરવામાં આવેલી આવી મિલકતોસંબંધી વિગતો રજૂ કરો:

ક્રમાંક	સંપત્તિ અથવા મિલકતની ટૂંકી વિગત	સંપત્તિ અથવા મિલકતનો પીનકોડ	નિર્માણની તારીખ	ખર્ચવામાં આવેલી સી.એસ.આર રકમ	નોંધાયેલા માલિકની સંસ્થા/ સત્તા મંડળ/ લાભાર્થીની વિગત
લાગુ પડતું નથી					

(તમામ ખાનાં રેવન્યુ રેકોર્ડમાં હોય તે મુજબ ભરવાં; ફ્લેટ નંબર, ઘર નંબર, મ્યુનિસિપલ કચેરી/મ્યુનિસિપલ કોર્પોરેશન/ગ્રામ પંચાયતનું નામ સ્પષ્ટ રીતે જણાવવું અને સ્થાવર મિલકતનું ક્ષેત્રફળ તેમજ તેની સીમાઓ પણ જણાવવી)

૧૧. કંપની અધિનિયમની કલમ ૧૩૫ની પેટા કલમ ૫ મુજબ સરેરાશ, ચોખ્ખા નફાના બે ટકા જેટલી રકમ વાપરવામાં કંપની નિષ્ફળ રહી હોય તો, તે માટેનાં કારણો જણાવો:

લાગુ પડતું નથી કારણ કે કંપનીએ વણવપરાયેલી રકમ, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૩૫(૬) હેઠળ કંપની દ્વારા જાળવવામાં આવેલ, વણખર્ચાયેલ સંસ્થાગત સામાજિક જવાબદારી ખાતામાં ચાલુ પ્રોજેક્ટમાં તબદીલ કરી છે

સહી/-

પી. કે. તનેજા, આઈ.એ.એસ.(નિવૃત્ત)

અધ્યક્ષ- સીએસઆર સમિતિ

ડી.આઈ.એન-૦૦૦૧૦૫૮૮

સહી/-

વિકલ્પ ભારદ્વાજ, આઈ.એ.એસ.

મેનેજિંગ ડિરેક્ટર

(ડી.આઈ.એન: ૦૮૩૮૬૨૨૨)

ફોર્મ નં. એમ.જી.ટી.- ૯

વાર્ષિક રિટર્નની તારીખ

૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા વર્ષ મુજબ

(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપનીઝ મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના નિયમ ૧૨(૧)ને અનુસરીને)

૧. નોંધણી અને અન્ય વિગતો :

- (૧) સી.આઇ.એન. - યુ ૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧
- (૨) નોંધણીની તારીખ : ૨૮ જૂન, ૧૯૯૦
- (૩) કંપનીનું નામ : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
- (૪) કંપનીની કક્ષા/ પેટા કક્ષા : શેર મૂડી ધરાવતી/ રાજ્ય સરકારની કંપની
- (૫) રજિસ્ટર્ડ ઓફિસ અને સંપર્કની વિગત : બ્લોક નં. ૬ અને ૮, ૬જી માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૨૫૫-૬૦, ફેક્સ-૦૭૯-૨૩૨૫૧૨૫૪

ઈમેઇલ : cosecgpcl@yahoo.co.in- વેબસાઇટ - www.gpcl.gujarat.gov.in

૬. કંપની લીસ્ટેડ છે? : ના
૭. રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનું નામ, સરનામું અને સંપર્ક વિગતો- લાગુ પડતું નથી.

૨. કંપનીની મુખ્ય ધંધાકીય પ્રવૃત્તિઓ

જેનો કંપનીના કુલ ટર્ન ઓવરમાં ૧૦ ટકા કે તેથી વધુ ફાળો હોય તેવી તમામ ધંધાકીય પ્રવૃત્તિઓ જણાવવી.

ક્રમ નં.	મુખ્ય બનાવટ/ સેવાઓનાં નામ અને વર્ણન	બનાવટ/ સેવાનો એન.આઇ.સી. કોડ નં.	કંપનીના કુલ ટર્નઓવરમાં ટકાવારી
૧.	સૌર ઊર્જાનું ઉત્પાદન ઊર્જાના અન્ય બિન પરંપરાગત સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન ખાણકામ સાથે સંકળાયેલ હોય એ સિવાયનું “સાઇટ-પ્રિપરેશન” (સોલાર પાર્કનો વિકાસ)	૪૦૧૦૬ ૪૦૧૦૮ ૪૫૧૦૨	૧૦ ટકાથી વધુ

૩. હોલ્ડીંગ, સબસીડીઅરી અને સહયોગી (એસોસીએટ) કંપનીઓની વિગતો

ક્રમ નં.	કંપનીનું નામ અને સરનામું	સી.આઇ.એન./ જી.એલ.એન.	હોલ્ડીંગ/ સબ સીડીઅરી/ એસોસીએટ	ધારણ કરેલા શેર્સની ટકાવારી	લાગુ પડતી કલમ
૧.	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ, ૩જી માળ, સેતુ ભવન, (ઓરિસ્સા બ્રિજ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન બિલ્ડિંગ) પ્લોટ નં. ૩ (ડી), નયા પલ્લી, બીબીએસઆર-૭૫૧૦૧૨	યુ૪૦૧૦૨૦ આર૨૦૦૮એસ	એસોસીએટ કંપની	૩૩.૩૩ ટકા	૨ (૬)

૪. શેર હોલ્ડિંગ પેટર્ન (કુલ ઇક્વિટીની ટકાવારી તરીકે ઇક્વિટી શેર મૂડીનું વિભાજન (બ્રેકઅપ))

(૧) કક્ષાવાર શેર હોલ્ડિંગ

શેરધારકોની કક્ષા	વર્ષની શરૂઆતમાં ધારણ કરેલા શેર્સ				વર્ષના અંતે ધારણ કરેલા શેર્સ				વર્ષ દરમિયાન ટકાવારીમાં ફેરફાર
	ડીમેટ	વાસ્તવિક	સરવાળો	કુલ શેર્સની ટકાવારી	ડીમેટ	વાસ્તવિક	સરવાળો	કુલ શેર્સની ટકાવારી	
ક. પ્રમોટર્સ (૧) ભારતીય									
(ક) વ્યક્તિગત / (એચ.યુ. એફ)	-	૮૫.૫	૮૫.૫	૦.૦૦	-	૮૫.૫	૮૫.૫	૦.૦૦	-
(ખ) કેન્દ્ર સરકાર	-	-	-	-	-	-	-	-	-
(ગ) રાજ્ય સરકાર(રો)	-	૪૯૩૯૨૪૬૨	૪૯૩૯૨૪૬૨	૯૬.૨૩૯૨	-	૪૯૩૯૩૧૭૨.૦	૪૯૩૯૩૧૭૨	૯૬.૨૩૯૩	(+)૦.૦૦૦૧%
(ઘ) બોડીઝ કોર્પોરેટ		૧૯૩૦૦૧૩	૧૯૩૦૦૧૩	૦૩.૭૬૦૬		૧૯૩૦૦૧૩.૦	૧૯૩૦૦૧૩	૦૩.૭૬૦૬	-
(ચ) બેંકો/ નાણાકીય સંસ્થાઓ	-	-	-	-	-	-	-	-	-
(છ) અન્ય કોઈ	-	-	-	-	-	-	-	-	-
પેટા સરવાળો.(ક)(૧)		૫૧૩૨૨૫૬૦.૫	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦		૫૧૩૨૩૨૭૦.૫	૫૧૩૨૩૨૭૦.૫	૧૦૦	
(૨) વિદેશી પેટા સરવાળો ક(૨)	-	-	-	-	-	-	-	-	-
પ્રમોટર (ક)નું કુલ શેરહોલ્ડિંગ= ક(૧)+ ક(૨)	-	૫૧૩૨૨૫૬૦.૫	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦	-	૫૧૩૨૩૨૭૦.૫	૫૧૩૨૩૨૭૦.૫	૧૦૦	
(ખ) જાહેર શેર હોલ્ડિંગ	-	-	-	-	-	-	-	-	-
કુલ જાહેર શેર હોલ્ડિંગ (ખ)= ખ(૧) + ખ(૨)	-	-	-	-	-	-	-	-	-
ગ. જી.ડી.આર.એસ. અને એ.ડી.આર.એસ. વતી કર્ટોડિયન દ્વારા ધારણ કરવામાં આવેલા શેર્સ	-	-	-	-	-	-	-	-	-
કુલ સરવાળો (ક + ખ + ગ)		૫૧૩૨૨૫૬૦.૫	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦		૫૧૩૨૩૨૭૦.૫	૫૧૩૨૩૨૭૦.૫	૧૦૦	

(૨) પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ

ક્રમ નં.	શેર ધારકનું નામ	વર્ષના આરંભમાં શેર હોલ્ડિંગ			વર્ષના અંતે શેર હોલ્ડિંગ			વર્ષ દરમિયાન શેર હોલ્ડિંગમાં બદલાયેલી ટકાવારી
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	કુલ શેર્સ સામે તારણમાં મૂકેલા શેર્સ	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	કુલ શેર્સ સામે તારણમાં મૂકેલા શેર્સ	
૧.	ગુજરાતના રાજ્યપાલ	૪૯૩૯૨૪૬૨	૯૬.૨૪	-	૪૯૩૯૩૧૭૨.૦	૯૬.૨૪	-	(+)૦.૦૦૦૧ %
૨.	ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ	૧૯૩૦૦૧૩	૦૩.૭૬	-	૧૯૩૦૦૧૩	૩.૭૬	-	-
૩.	*અન્ય	૮૫.૫	૦.૦૦	-	૮૫.૫	૦.૦૦	-	-
	સરવાળો	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦	-	૫૧૩૨૩૨૭૦.૫	૧૦૦	-	-

* અન્યમાં ગુજરાતના રાજ્યપાલ તેમ જ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના નામનિયુક્તોનો સમાવેશ થાય છે.

૩. પ્રમોટરના શેરહોલ્ડીંગમાં ફેરફાર (કોઈ ફેરફાર ન હોય તો પણ જણાવવું)**

	વર્ષના આરંભમાં શેર હોલ્ડીંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેર હોલ્ડીંગ	
	શેરોની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
વર્ષના આરંભમાં	૪૯૩૯૨૪૬૨	૯૬.૨૩૯૨	૪૯૩૯૨૪૬૨	૯૬.૨૩૯૨
ગુજરાતના રાજ્યપાલ				
(ક) ૧૪-૦૭-૨૦૨૧ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને ફાળવવામાં આવેલા, રૂ. ૧૦૦નો એક એવા ૨૬૦ શેર્સ અધિકારના આધારે	૨૬૦	-	૪૯૩૯૨૭૨૨	-
(ખ) ૦૫/૦૩/૨૦૨૨ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને ફાળવવામાં આવેલા, રૂ. ૧૦૦નો એક એવા ૪૫૦ શેર્સ અધિકારના આધારે	૪૫૦		૪૯૩૯૩૧૭૨	
વર્ષના અંતે			૪૯૩૯૩૧૭૨	૯૬.૨૩૯૩

** પ્રમોટરની કક્ષામાં આવતા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને અન્યમાં કોઈ ફેરફાર નથી.

(૪) સર્વોચ્ચ ૧૦ શેરધારકો, (નિયામકો, પ્રમોટરો અને GDRs તથા ADRs સિવાય)ની શેરહોલ્ડીંગ પેટર્ન

ક્રમ નં.	વર્ષના આરંભમાં શેરહોલ્ડીંગ	વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડીંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	સર્વોચ્ચ-૧૦ પૈકીના પ્રત્યેક શેરધારકો માટે	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષના આરંભમાં	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષ દરમિયાન શેર હોલ્ડીંગમાં તારીખવાર થયેલો વધારો/ ઘટાડો; વધારો/ ઘટાડો થવાનાં કારણો જણાવવાં (જેમ કે ફાળવણી/ તબદિલી/ બોનસ/ સ્વીટ ઇક્વિટી વગેરે)	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષના અંતે (અથવા વર્ષ દરમિયાન અલગ પાડવામાં આવ્યા હોય તો અલગ પડ્યાની તારીખ)	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	સરવાળો..		

(૫) નિયામકો અને મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગનું શેર હોલ્ડીંગ

ક્રમ નં.	નિયામકશ્રીનું નામ/મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગના નામ	વર્ષના આરંભમાં શેરહોલ્ડીંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડીંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષના આરંભમાં	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષ દરમિયાન શેર હોલ્ડીંગમાં તારીખવાર થયેલો વધારો/	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષના અંતે	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.

નોંધ : કોઈપણ નિયામક/ મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી કંપનીના શેર ધરાવતા નથી.

પ. કંપનીનું દેવું

બાકી/ઉપાર્જિત પરંતુ ચૂકવવાનો સમય પાક્યો ન હોય તેવા વ્યાજ સહિત કંપનીનું દેવું

(૩. લાખમાં)

	થાપણો સિવાય તારણવાળી લોન	તારણ વિનાની લોન	થાપણો	કુલ દેવું
નાણાકીય વર્ષના આરંભમાં દેવું				
(૧) મુદ્દલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૨) પાકેલું પણ ન ચુકવાયેલું વ્યાજ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૩) ઉપાર્જિત પરંતુ ચુકવવાનો સમય પાક્યો ન હોય તેવું વ્યાજ (૧લી એપ્રિલ)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ સરવાળો... (૧ + ૨ + ૩)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
નાણાકીય વર્ષ દરમિયાન દેવામાં વધ/ઘટ				
વધારો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ઘટાડો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ચોખ્ખો ફેરફાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
નાણાકીય વર્ષના અંતે દેવું				
(૧) મુદ્દલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૨) પાકેલું પણ ન ચુકવાયેલું વ્યાજ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૩) ઉપાર્જિત પરંતુ ચુકવવાનો સમય પાક્યો ન હોય તેવું વ્યાજ (૧લી એપ્રિલ)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ સરવાળો... (૧ + ૨ + ૩)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

૬. નિયામકો અને મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગનું મહેનતાણું

(ક) મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું

ક્રમ નં.	મહેનતાણાની વિગત	મેનેજિંગ ડિરેક્ટરનું નામ		કુલ રકમ
		શ્રી એસ.બી.ખયાલિયા (૦૧/૦૪/૨૦૨૧ થી ૦૧/૦૮/૨૦૨૧)	શ્રી વિકલ્પ ભારદ્વાજ (૧૧/૧૧/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૨)	
૧.	કુલ પગાર (ક) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પગાર (ખ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૨) હેઠળના લાભોની રકમ (ગ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૩) હેઠળ પગારના બદલે મળતા લાભો.	૨૦,૧૩,૦૬૨/-	-	૨૦,૧૩,૦૬૨/-
		૨,૦૦,૪૦૫/-	-	૨,૦૦,૪૦૫/-
૨.	સ્ટોક વિકલ્પ	----		----
૩.	સ્વીટ ઇક્વિટી	----		----
૪.	કમિશન - નફાની ટકાવારી પેટે - અન્ય જણાવો	----		----
૫.	અન્ય જણાવો*	૪,૦૦૦/-	૧૨,૦૦૦/-	૧૬,૦૦૦/-
	સરવાળો... (ક)	૨૨,૧૭,૪૬૭/-	૧૨,૦૦૦/-	૨૨,૨૯,૪૬૭/-
	અધિનિયમ મુજબ ટોચ મર્યાદા	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.

*શ્રી વિકલ્પ ભારદ્વાજ, આઈ.એ.એસ.ને, તેઓ નોકરીમાં ચાલુ આઈ.એ.એસ. અધિકારી હોવાથી જીપીસીએલના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો ધરાવવા માટે કોઈ મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. તેમની બેઠક દીઠ રૂ. ૨૦૦૦/-ની સીટીંગ ફી સીધી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે. બોર્ડ અને બેઠક(કો)માં હાજરી આપવા બદલ, બેઠક દીઠ રૂ. ૨૦૦૦/-ના દરે પ્રાસંગિક ખર્ચ તરીકે ટોકન રકમ શ્રી એસ.બી. ખયાલિયા અને શ્રી વિકલ્પ ભારદ્વાજ, આઈ.એ.એસ.ને ચુકવવામાં આવી હતી.

(ખ) અન્ય નિયામકોને મહેનતાણું

કક્ષા	મહેનતાણાની વિગતો			સરવાળો
	બોર્ડ અને સમિતિઓની બેઠકો માટે સીટીંગ ફી	કમિશન	અન્ય (બોર્ડ અને સમિતિઓની બેઠકો માટેની પ્રાસંગિક ફી)	
અધ્યક્ષા-શ્રીમતી સુનયના તોમર		---	---	---
અધ્યક્ષા - સુશ્રી મમતા વર્મા, આઈએ.એસ.	***	---	₹,૦૦૦/-	₹,૦૦૦/-
સરવાળો- ક	---	---	₹,૦૦૦/-	₹,૦૦૦/-
સ્વતંત્ર નિયામકો				
શ્રી પી.કે.તનેજા, આઈએ.એસ. (નિવૃત્ત)	૧૩,૫૦૦/-	---	૧૦,૦૦૦/-	૨૩,૫૦૦/-
અન્ય નોન-એક્ઝીક્યુટિવ નિયામકો				
શ્રીમતી અંજુ શર્મા, આઈ.એ.એસ.	***	---	---	---
શ્રી પી.એચ. રાણા	૨૭,૦૦૦/-	---	૧૮,૦૦૦/-	૪૫,૦૦૦/-
સુશ્રી દિપલ હડિયલ (ગુજરાત સરકારના નાણા વિભાગનાં નામનિયુક્ત)	***	---	૧૪,૦૦૦/-	૧૪,૦૦૦/-
સરવાળો.. ખ	૪૦,૫૦૦/-	---	૪૨,૦૦૦/-	૮૨,૫૦૦/-
સરવાળો- વ્યવસાયકીય મહેનતાણું (ક + ખ)	૪૦,૫૦૦/-	---	૪૮,૦૦૦/-	૮૮,૫૦૦/-
અધિનિયમ મુજબ ટોચ મર્યાદા	-----	-----	-----	-----

*** સેવા બજાવતા આઈ.એ.એસ. અધિકારીઓ અથવા ગુજરાત સરકારના નામ નિયુક્તોના સંદર્ભમાં બેઠક દીઠ રૂ. ૩૦૦૦/-ની સીટીંગ ફી સીધી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે (૧૦ % ટીડીએસ બાદ કરીને) અને બેઠક દીઠ રૂ. ૨૦૦૦/-ના દરે પ્રાસંગિક ખર્ચ સીધું સંબંધિત નિયામક/કોને ચુકવવામાં આવ્યું છે.

ગ. મેનેજિંગ ડિરેક્ટર/ મેનેજર/ ડબલ્યુટીડી સિવાયના મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગને મહેનતાણું

ક્રમ નં.	મહેનતાણાની વિગતો	મહત્ત્વનો વ્યવસાયકીય કર્મચારી વર્ગ		
		સીઈઓ	સીએસ	સીએફઓ
૧.	કુલ ૫ગાર (ક) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૭(૧)માં સમાવિષ્ટ જોગવાઈ મુજબ ૫ગાર (ખ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૨) હેઠળના લાભોની રકમ (ગ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૩) હેઠળ ૫ગારના બદલે મળતા લાભો.	-----	૧૦,૧૫,૫૬૩/-	૨૦,૩૮,૦૮૭/-
૨.	સ્ટોક વિકલ્પ	-----	-----	-----
૩.	સ્વીટ ઇક્વિટી	-----	-----	-----
૪.	કમિશન - નફાની ટકાવારી મુજબ - અન્ય, જણાવો	-----	-----	-----
૫.	અન્ય, જણાવો	-----	-----	-----

ક્રમ નં.	મહેનતાણાની વિગતો	મહત્ત્વનો વ્યવસાયકીય કર્મચારી વર્ગ		
		સીઈઓ	સીએસ	સીએફઓ
	સરવાળો..	-----	રૂ. ૧૦,૧૫,૫૬૩/-	રૂ. ૨૦,૩૮,૦૯૭/-

૭. ગુનાઓની સજા/ દંડ/ માફી

પ્રકાર	ટૂંકું વર્ણન	વિગત			સત્તામંડળ આર.ડી./ [એન. સી.એલ.ટી./ કોર્ટ]	અપીલ કરવામાં આવી છે. (વિગતો આપો)
		દંડની	સજાની	માફીની		
ક. કંપની			લાગુ પડતું નથી.		લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
ખ. નિયામકો			લાગુ પડતું નથી.		લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
ગ. ચૂક કરનાર અન્ય અધિકારીઓ			લાગુ પડતું નથી.		લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.

સહી/-
ચેરમેન
ડી.આઈ.એન: ૦૧૮૫૪૩૧૫

નિયામક મંડળના નામે અને તેના વતી
સહી/-
નિયામક
ડી.આઈ.એન: ૦૯૩૯૬૨૨૨

સેક્ટરીઅલ ઓડિટ અહેવાલ

૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે

(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૨૦૪(૧) અને કંપનીઝ અપોઇન્ટમેન્ટ એન્ડ રેમ્યુનેરેશન પર્સોનલ), રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૯ નં. અનુસરીને)

પ્રતિ

સભાસદો
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ,
૬હો માળ, બ્લોક નં. ૬ અને ૮
ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧,
ગાંધીનગર - ૩૮૨૦૧૧

અમે, લાગુ પડતી વૈધાનિક જોગવાઈઓ મુજબ, સારી કોર્પોરેટ પદ્ધતિઓનું પાલન કરતા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડનું સેક્ટરીઅલ ઓડિટ કર્યું છે. આ સેક્ટરીઅલ ઓડિટ અમે એ પ્રકારે કર્યું છે જે અમને કોર્પોરેટ રીતભાત/વૈધાનિક અનુપાલનનું મૂલ્યાંકન કરવા અને તે અંગે અમારો અભિપ્રાય આપવા માટે યોગ્ય આધાર પૂરો પાડે છે. કંપનીના ચોપડા, કાગળો, મિનિટ બુક્સ, ફોર્મ્સ અને કંપનીએ ફાઇલ કરેલાં રિટર્ન્સ અને જાળવેલા અન્ય રેકર્ડ તથા પૂરી પાડેલી માહિતીના આધારે કંપની, તેના અધિકારીઓ, એજન્ટો, અધિકૃત પ્રતિનિધિઓએ સેક્ટરીઅલ ઓડિટની કામગીરી દરમિયાન પૂરી પાડેલી માહિતીના આધારે અમે આથી જણાવીએ છીએ કે અમારા મતે, કંપનીએ, ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરાં થતાં નાણાકીય વર્ષને આવરી લેતા સમયગાળા દરમિયાન અહીં નીચે જણાવેલી વૈધાનિક જોગવાઈઓનું પાલન કર્યું છે અને અમે અહીં નીચે જણાવ્યાં છે એ વિષયો અને પદ્ધતિ પૂરતું કંપની બોર્ડ સંબંધી પ્રક્રિયાઓ અને અનુપાલન વ્યવસ્થા ધરાવે છે.

અમે, કંપનીએ નીચે જણાવેલા કાયદાઓની જોગવાઈઓ મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતિત નાણાકીય વર્ષ માટે હિસાબના ચોપડા, પેપર્સ, મિનિટ બુક્સ, ફોર્મ્સ અને ફાઇલ કરેલાં રિટર્ન્સ અને જાળવેલા રેકર્ડ તપાસ્યા છે.

- (૧) કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ) અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો.
- (૨) ધ સીક્યુરીટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૬ (એસ.સી.આર.એ.) અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો.
- (૩) ઘ ડિપોઝીટરીઝ એક્ટ, ૧૯૯૬ અને તે હેઠળ ઘડવામાં આવેલા વિનિયમો અને પેટા-કાયદા કંપનીને લાગુ પડતા નથી કારણ કે સરકારી કંપનીઓને તા. ૨૨મી જાન્યુઆરી ૨૦૧૯ના એમસીએ જાહેરનામા ક્રમાંક ૪૩(ચ) હેઠળ શેર્સના ફરજિયાત ડીમટીરીઅલાઇઝેશનમાંથી મૂક્તિ આપવામાં આવી છે.
- (૪) ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૯ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને વિનિયમો, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સીધા વિદેશી રોકાણ, સીધા દરિયાપારના રોકાણ અને બહારથી મેળવવામાં આવેલા વાણિજ્યિક કરજ પૂરતા કંપનીને સમીક્ષાના સમયગાળા દરમિયાન લાગુ પડતા નથી.
- (૫) સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ૧૯૯૨ (એસ.ઇ.બી.આઇ. એક્ટ) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં નીચેનાં વિનિયમો અને માર્ગદર્શક સૂચનાઓ કંપનીને લાગુ પડતાં નથી કારણ કે કંપની, સમીક્ષાના સમયગાળા દરમિયાન અનલિસ્ટેડ કંપની હતી.
 - (ક) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સબસ્ટાન્શિયલ એકવીઝીશન ઓફ શેર્સ એન્ડ ટેક ઓવર્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૧;
 - (ખ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (પ્રોહીબીશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ, ૧૯૯૨;
 - (ગ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૦૯;
 - (ઘ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન સ્કીમ એન્ડ એમ્પ્લોઇ સ્ટોક પર્ચેઝ સ્કીમ) ગાઇડ લાઇન્સ, ૧૯૯૯;
 - (ચ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇસ્યુ એન્ડ લીસ્ટીંગ ઓફ ડેટ સીક્યુરીટીઝ) રેગ્યુલેશન્સ, ૨૦૦૮;
 - (છ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (રજિસ્ટ્રાર્સ ટુ એન ઇસ્યુ એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૧૯૯૩- કંપની અધિનિયમ અને કલાયન્ટ સાથેના વ્યવહાર અંગે.
 - (જ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ડીલિસ્ટીંગ ઓફ ઇકિવટી શેર્સ) રેગ્યુલેશન્સ, ૨૦૦૯; અને
 - (ઝ) ઘ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (બાયબેક ઓફ સીક્યુરીટીઝ) રેગ્યુલેશન્સ, ૧૯૯૯

હું વધુમાં જણાવું છું કે કંપનીમાં પ્રવર્તમાન અનુપાલન પદ્ધતિના સંદર્ભમાં અને તેને અનુસરીને સંબંધિત દસ્તાવેજો તથા રેકર્ડઝની ટેસ્ટ ચેકના આધારે તપાસ કરતાં, કંપનીએ ખાસ તેને લાગુ પડતા નીચેના કાયદાઓનું પાલન કર્યું છે.

- (૧) ઘ ઇલેક્ટ્રીસિટી એક્ટ, ૨૦૦૩
- (૨) માઇન્સ એક્ટ, ૧૯૫૨
- (૩) ઘ એન્વાયર્નમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬
મેં નીચેના લાગુ પડતા ખંડોના પાલન સંબંધી તપાસ પણ કરી છે.
- (૧) ઘ ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્ટરીઅલ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સેક્ટરીઅલ સ્ટાન્ડર્ડઝ.

(૨) કંપની અનલીસ્ટેડ હોવાથી તેણે લીસ્ટીંગ એગ્રીમેન્ટ ઓફ સ્ટોક એક્સ્ચેન્જનું પાલન કરવું જરૂરી નથી.

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ, અમારાં નીચેનાં અવલોકનોને અધીન રહીને ઉપર જણાવેલાં અધિનિયમો, નિયમો, વિનિયમો, માર્ગદર્શક સૂચનાઓ, ધોરણો વગેરેનું પાલન કર્યું છે.

૧. બે સ્વતંત્ર નિયામકો એટલે કે શ્રી પ્રકાશ શાહ, આઇ.એ.એસ. (નિવૃત્ત) અને શ્રી ભરતકુમાર મોદીની નિયુક્તિની મુદત તા.૩૧/૦૩/૨૦૨૦ના રોજ પૂરી થવાને કારણે કંપનીએ તે પૈકીની એક સ્વતંત્ર નિયામકની જગ્યા તા.૨૬/૧૧/૨૦૨૦ના રોજ ભરી છે અને બીજા એક સ્વતંત્ર નિયામકની નિમણૂક કરવાની હજુ બાકી છે અને તદ્દનુસાર, કંપની અધિનિયમની કલમો ૧૪૮, ૧૭૭ અને ૧૭૮ હેઠળની જરૂરિયાત મુજબ સમિતિઓની રચના કરવાની છે.
૨. કંપનીની વાર્ષિક સામાન્ય સભા તા.૨૮/૧૨/૨૦૨૧ના રોજ બોલાવવામાં આવી હતી. આમ છતાં આ વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી અને ઓડિટ થયેલા હિસાબો મુલતવી રાખવામાં આવેલી વાર્ષિક સામાન્ય સભાની તા. ૮મી માર્ચ, ૨૦૨૨ના રોજ બોલાવવામાં આવેલી બેઠકમાં એટલે કે, વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની નિયત તારીખ પછી (વાર્ષિક સામાન્ય સભા બોલાવવા માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ સમય સહિત) બોલાવવામાં આવેલી બેઠકમાં સ્વીકારવામાં આવ્યા હતા.

અમે વધુમાં જણાવીએ છીએ કે -

તા. ૩૧/૦૩/૨૦૨૨ના રોજ મુજબ, ઉપર જણાવવામાં આવેલા અમારા અવલોકનને અધીન, કંપનીના નિયામક મંડળની રચના યોગ્ય રીતે, એકઝીક્યુટીવ ડિરેક્ટર્સ અને નોન-એકઝીક્યુટીવ ડિરેક્ટર્સ સાથે કરવામાં આવી છે. સમીક્ષાના સમયગાળા દરમિયાન નિયામક મંડળની રચનામાં કરવામાં આવેલા ફેરફારો, અધિનિયમની જોગવાઈઓ મુજબ કરવામાં આવ્યા હતા.

તમામ નિયામકોને બોર્ડની બેઠકના સમયની પર્યાપ્ત નોટિસ આપવામાં આવી છે અને એજન્ડા તથા એજન્ડા અંગેની વિગતવાર નોંધો સાત દિવસ અગાઉ મોકલી દેવામાં આવી છે અને ટૂંકી મુદતની નોટિસ મોકલતી વખતે કંપની અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈનું પાલન કરવામાં આવે છે અને બેઠક યોજતા પહેલાં એજન્ડા અંગે વધુ માહિતી અને સ્પષ્ટતા મેળવવાની પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે જેથી બેઠકમાં પૂરતી જાણકારી સાથે ભાગ લઈ શકાય.

સામાન્ય રીતે નિયામક મંડળ અને સમિતિઓની બેઠકોમાં તમામ નિર્ણયો, નિયામક મંડળ અથવા યથાપ્રસંગ સમિતિની બેઠકોની કાર્યવાહી નોંધમાં નોંધાયા મુજબ જ લેવામાં આવે છે.

અમે વધુમાં જણાવીએ છીએ કે -

કંપની તેના કદ અને કામગીરીઓને અનુરૂપ, લાગુ પડતા કાયદા, નિયમો, વિનિયમો અને માર્ગદર્શક સૂચનાઓ પર દેખરેખ નિયંત્રણ રાખી શકાય અને તેમનું અનુપાલન કરી શકાય તેવી પર્યાપ્ત પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ ધરાવે છે.

અમે વધુમાં જણાવીએ છીએ કે -

૧. સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન નીચે મુજબની ફાળવણી કરવામાં આવી હતી.

(૧) કંપનીએ રૂ. ૧૦૦નો એક એવા કુલ રૂ. ૨૬,૦૦૦/-ના ૨૬૦ ઇકિવટિ શેર્સ તા. ૧૪/૦૭/૨૦૨૧ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને અધિકારના ધોરણે ફાળવ્યા છે.

(૩) કંપનીએ રૂ. ૧૦૦નો એક એવા કુલ રૂ. ૪૫,૦૦૦/-ના ૪૫૦ ઇકિવટિ શેર્સ તા. ૦૫/૦૩/૨૦૨૨ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને અધિકારના ધોરણે ફાળવ્યા છે.

કંપની સેક્રેટરી ધારા પટેલ વતી

સહી/-

પ્રોપ્રાઇટર

(ધારા પટેલ)

એસીએસ નં. ૨૮૧૯૮, સીપી નં. ૧૦૯૭૯
યુડીઆઇએન: એ૦૨૯૧૯૮ડી૦૦૨૭૪૧૬૫૫

તારીખ: ૧૮/૧૨/૨૦૨૨

સ્થળ: ગાંધીનગર

(આ અહેવાલ, જોડાણ-ક તરીકે જોડવામાં આવેલા સમાન તારીખના પત્ર સાથે વાંચવાનો છે, જે આ અહેવાલનો અભિન્ન ભાગ બને છે.)

જોડાણ - ક

પ્રતિ

સભાસદો

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ,

૬ હો માળ, બ્લોક નં. ૬ અને ૮

ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧

ગાંધીનગર- ૩૮૨૦૧૧

અમારો સમાન તારીખનો અહેવાલ આ પત્ર સાથે વાંચવાનો છે.

૧. સેક્રેટરિઅલ રેકર્ડની જાળવણી આ કંપનીના વ્યવસ્થાપક મંડળની જવાબદારી છે. અમારી જવાબદારી, અમારા ઓડિટના આધારે આ સેક્રેટરિઅલ રેકર્ડ્સ અંગે અભિપ્રાય આપવાની છે.
૨. અમે, સેક્રેટરિઅલ રેકર્ડ્સના વિષયવસ્તુની સચ્ચાઈ વિશે યોગ્ય ખાતરી મેળવવા માટે યોગ્ય એવી ઓડિટ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને અનુસર્યા છીએ. સેક્રેટરિઅલ રેકર્ડ્સમાં સાચી હકીકતો દર્શાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણના આધારે (ટેસ્ટ બેસીસ) ખરાઈ કરવામાં આવી છે. અમારું માનવું છે કે અમે અનુસરેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ અમારા અભિપ્રયને યોગ્ય આધાર પૂરો પાડે છે.
૩. અમે કંપનીના નાણાકીય પત્રકો, નાણાકીય રેકર્ડ્સ અને હિસાબોના ચોપડાની સચ્ચાઈ અને યોગ્યતાની ખરાઈ કરી નથી.
૪. કોર્પોરેટ તેમજ અન્ય લાગુ પડતા કાયદા, નિયમો, વિનિયમો, ધોરણોની જોગવાઈઓનું અનુપાલન કરાવવાની જવાબદારી વ્યવસ્થાપક મંડળની છે. અમારી તપાસ પરીક્ષણના આધારે કાર્યપદ્ધતિઓની ખરાઈ કરવા પૂરતી મર્યાદિત છે.
૫. સેક્રેટરીઅલ ઓડિટ અહેવાલ, કંપનીની ભાવિ નભાઉ ક્ષમતાની કે વ્યવસ્થાપક મંડળે કંપનીના કરવાં કામકાજની કાર્યક્ષમતા અને અસરકારકતાની ખાતરી આપતો નથી.

કંપની સેક્રેટરી ધારા પટેલ વતી

સહી/-

પ્રોપ્રાઇટર

(ધારા પટેલ)

એસીએસ નં. ૨૮૧૯૮, સીપી નં. ૧૦૯૭૯

યુડીઆઈએન: એ૦૨૯૧૯૮૩ી૦૦૨૭૪૧૬૫૫

તારીખ : ૧૯/૧૨/૨૦૨૨

સ્થળ : ગાંધીનગર

તા.૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા વર્ષ માટે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના હિસાબો પર કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૬)(બી) હેઠળ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનાં ટિકાન્ટિપ્પણ.

કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ નાણાકીય અહેવાલની રૂપરેખા મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા વર્ષ માટેના ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના વ્યવસ્થાપક મંડળની છે. ઉક્ત અધિનિયમની કલમ ૧૩૯(૫) હેઠળ ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નીમવામાં આવેલા વૈધાનિક ઓડિટરોની જવાબદારી, અધિનિયમની કલમ ૧૪૩(૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા 'ઓડીટીંગ એન્ડ એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ' ના આધારે, અધિનિયમની કલમ-૧૪૩ હેઠળ આ નાણાકીય પત્રકો અંગે અભિપ્રાય વ્યક્ત કરવાની છે. જે તેઓના તા. ૧૯મી ડીસેમ્બર, ૨૦૨૨ના ઓડિટ અહેવાલ અન્વયે વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે,

ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ વતી મેં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાકીય પત્રકોનું અધિનિયમની કલમ ૧૪૩(૬)(એ) હેઠળ પૂરક ઓડિટ (સપ્લીમેન્ટરી ઓડિટ) કર્યું છે. આ પૂરક ઓડિટ, વૈધાનિક ઓડિટરોના કામકાજ અંગેના કોઈ પણ કાગળો જોયા વિના, સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું છે અને તે મુખ્યત્વે વૈધાનિક ઓડિટરો અને કંપનીના કર્મચારીવર્ગને કરવામાં આવેલી પૂછપરછ તેમજ પસંદ કરવામાં આવેલા કેટલાક હિસાબી રેકર્ડ્સની તપાસ પૂરતું મર્યાદિત છે.

મારા પૂરક ઓડિટના આધારે મારા ધ્યાન પર એવી કોઈ મહત્ત્વની બાબત આવી નથી જે અંગે અધિનિયમની કલમ ૧૪૩(૬)(બી) હેઠળ, વૈધાનિક ઓડિટરના અથવા તેને પૂરક હોય એવા અહેવાલ સંબંધે કોઈ ટિકાન્ટિપ્પણ કરવા જરૂરી બને.

ભારતના કોમ્પ્ટ્રોલર ઓડિટરના નામે અને

તેમના વતી

સ્થળ : અમદાવાદ

તારીખ : ૧૦/૦૨/૨૦૨૩

સહી/-

(વિજય એન. કોઠારી)

એકાઉન્ટન્ટ જનરલ

(ઓડિટ-૨), ગુજરાત

સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

પ્રતિ,

સભાસદો

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ

ગાંધીનગર.

ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો અંગેનો અહેવાલ

અભિપ્રાય

અમે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, (કંપની)ના આ સાથેના નાણાકીય પત્રકો ઓડિટ કર્યા છે, જેમાં તા.૩૧મી માર્ચ, ૨૦૨૨ રોજ મુજબના પાકા સરવૈયા, નફા અને નુકસાન ખાતાના પત્રક (અન્ય સર્વગ્રાહી આવક સહિત), રોકડ - પ્રવાહ (કેશ - ફ્લો)નું પત્રક અને તે તારીખે પૂરાં થતાં વર્ષમાં ઇકિવટીમાં થયેલા ફેરફારનું પત્રક તેમજ મહત્ત્વની હિસાબી નીતિઓની સમીક્ષા અને અન્ય સ્પષ્ટીકરણાત્મક માહિતીનો સમાવેશ થાય છે. (હવે પછી અહીં જેનો ઉલ્લેખ ભારતીય હિસાબી ધોરણ મુજબનાં નાણાકીય પત્રકો તરીકે કરવામાં આવ્યો છે.)

અમારા મંતવ્ય અને અમારી શ્રેષ્ઠ જાણકારી તથા અમને આપવામાં આવેલા ખુલાસા મુજબ આ નાણાકીય પત્રકો કંપની અધિનિયમ ૨૦૧૩ (“અધિનિયમ”) અન્વયે જરૂરી બબાતોની માહિતી, અધિનિયમની કલમ ૧૩૩ને કંપનીઝ સુધારેલા (ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ) રુલ્સ, ૨૦૧૫ સાથે વાંચતાં, તે હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં, ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતોને સુસંગત રહીને ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ કંપનીના પાકા સરવૈયા અને કંપનીના કામકાજની સ્થિતિ અંગે અને તે તારીખે પૂરા થતા વર્ષ માટેના નફા, કુલ સર્વગ્રાહી આવક, ઇકિવટીમાં થયેલ ફેરફાર અને તેના રોકડ પ્રવાહ અંગે સાચું અને યોગ્ય ચિત્ર રજૂ કરે છે.

અભિપ્રાય માટેનો આધાર

અમે નાણાકીય પત્રકોનું અમારું ઓડિટ અધિનિયમ (એસએસએસ)ની કલમ ૧૪૩(૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ઓડિટિંગ અંગેનાં ધોરણો મુજબ કર્યું છે. એ ધોરણો હેઠળની અમારી જવાબદારીઓ વધુમાં અમારા અહેવાલના નાણાકીય પત્રકોના ભાગમાં, ઓડિટ માટેની ઓડિટરોની જવાબદારીઓમાં વર્ણવવામાં આવી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા “કોડ ઓફ એથીક્સ” તેમ જ અધિનિયમની જોગવાઈઓ તેમ જ તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ નાણાકીય પત્રકોના અમારા ઓડિટ સાથે સુસંગત એવી નૈતિક જરૂરિયાતો મુજબ અમે કંપનીથી સ્વતંત્ર છીએ અમે તે જરૂરિયાતો તથા “કોડ ઓફ એથીક્સ” મુજબ અમારી નૈતિક જવાબદારીઓ નિભાવી છે. અમે માનીએ છીએ કે અમે મેળવેલા ઓડિટ પુરાવા નાણાકીય પત્રકો અંગેના અમારા ઓડિટ અભિપ્રાયને આધાર પૂરો પાડવા માટે પર્યાપ્ત અને યોગ્ય છે.

ભાર મૂકવામાં આવેલી બાબતો

અમે, કંપની અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ (જીએસઈસીએલ) વચ્ચેના હાલમાં પ્રગતિ હેઠળના ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ અંગેની, નાણાકીય પત્રકોની નોંધ-૧૭ તરફ આપનું ધ્યાન દોરીએ છીએ. ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ પડતર છે તે દરમિયાન, કંપનીએ જીએસઈસીએલ સાથે વચગાળાની વ્યવસ્થાના આધારે રૂ. ૩૭૯૦૦.૭૬ લાખના લિગનાઈટ પ્રોજેક્ટમાંથી આવક પ્રાપ્ત કરી છે. નાણાકીય પત્રકો અંગેનો અમારો અભિપ્રાય અને નીચે આપેલો “અન્ય કાનૂની તથા વિનિયંત્રક જરૂરિયાતો” અંગેનો અમારો અહેવાલ આ બાબતમાં બદલાયો નથી.

નાણાકીય પત્રકો અને તે અંગેના ઓડિટરોના અહેવાલ સિવાયની મહત્ત્વની બાબતો

અન્ય બાબતોની માહિતી તૈયાર કરવાની જવાબદારી કંપનીના નિયામકમંડળની છે. અન્ય બાબતોની માહિતીમાં નિયામકમંડળના અહેવાલ સાથેનાં જોડાણો સહિત નિયામકમંડળના અહેવાલનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં નાણાકીય પત્રકો તથા તે અંગેના અમારા ઓડિટરોના અહેવાલનો સમાવેશ થતો નથી. આ ઓડિટરોના અહેવાલની તારીખ પછી અમને અન્ય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી અપેક્ષા છે.

નાણાકીય પત્રકો અંગેનો અમારો અભિપ્રાય અન્ય માહિતીને આવરી લેતો નથી અને અમે તે અંગે કોઈપણ પ્રકારની બાંધધરી અમારા તારણમાં વ્યક્ત કરતા નથી.

નાણાકીય પત્રકોના અમારા ઓડિટના સંબંધમાં અમારી જવાબદારી ઉપર જણાવેલી અન્ય માહિતી ઉપલબ્ધ બને ત્યારે તે વાંચવાની અને તેમ કરતી વખતે તે અન્ય માહિતી નાણાકીય પત્રકો સાથે પ્રત્યક્ષરીતે વિસંગત છે કે કેમ અથવા અમારા ઓડિટ દરમિયાન અથવા અન્યથા અમને પ્રાપ્ત થયેલી જાણકારીથી જુદી પડે છે કે કેમ અથવા તે અંગે પ્રત્યક્ષ રીતે કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું છે કે કેમ તે ધ્યાનમાં લેવાની છે.

અમે જ્યારે અન્ય માહિતી વાંચીએ ત્યારે અમે જો એવાં તારણ પર આવીએ કે આ અન્ય માહિતીમાં પ્રત્યક્ષરીતે કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું છે તો અમારે તે હકીકત એસએ ૭૨૦ “અન્ય માહિતી અંગે ઓડિટરની જવાબદારી” હેઠળની જરૂરિયાત મુજબ, સંચાલનનો હવાલો ધરાવતા હોય તેઓને

જણાવવી જરૂરી બને છે.

ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો માટે વ્યવસ્થાપક મંડળની જવાબદારી

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ-૧૩૪(પ)માં જણાવેલી બાબતોના સંદર્ભમાં, ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ કંપનીની નાણાકીય સ્થિતિ, અન્ય સર્વગ્રાહી આવક તથા કેશ-ફ્લો અને ઇકિવટીમાં થયેલા ફેરફાર સહિત નાણાકીય કામગીરીનું સાચું અને યોગ્ય ચિત્ર દર્શાવતાં આ નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી વ્યવસ્થાપક મંડળની છે. આ જવાબદારીમાં કંપનીની મિલકતોની સલામતી માટે અને બીજી છેતરપીંડીઓ અને અનિયમિતતાઓ રોકવા અને શોધવા માટે અધિનિયમની જોગવાઈઓ મુજબ પૂરતા હિસાબી રેકર્ડ જાળવવાનો; યોગ્ય હિસાબી પદ્ધતિઓ પસંદ કરી અપનાવવાનો; યોગ્ય અને વિવેકી નિર્ણયો કરવાનો; યોગ્ય રીતે અમલમાં મૂકી શકાય એવાં પૂરતાં આંતરિક નિયંત્રણો ઘડવાનો અને તેમને લાગુ પાડવાનો સમાવેશ થાય છે જેથી કોઈ છળકપટ અથવા ભૂલને કારણે વાસ્તવિક રીતે ખોટાં વિધાનોથી મુક્ત હોય એવાં નાણાકીય પત્રકો યોગ્ય રીતે તૈયાર કરવાના સંદર્ભમાં ચોકસાઈ અને પૂર્ણતા સુનિશ્ચિત કરી શકાય.

આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં વ્યવસ્થાપક મંડળ જો કંપનીને ફડચામાં લઈ જવા કે કંપનીનું કામકાજ બંધ કરી દેવાનો ઇરાદો ધરાવતું ન હોય તો, કંપનીની ચાલુ ધંધાના ધોરણે ચાલુ રહેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અને ચાલુ ધંધા સંબંધિત લાગુ પડતી બાબતો જાહેર કરવા માટે જવાબદાર છે. નિયામક મંડળ કંપનીના નાણાકીય અહેવાલ તૈયાર કરવા ઉપર દેખરેખ રાખવા માટે પણ જવાબદાર છે.

નાણાકીય પત્રકોના ઓડિટ અંગે ઓડિટરની જવાબદારી :

અમારો ઉદ્દેશ કોઈ છેતરપીંડી અથવા ભૂલને કારણે નાણાકીય પત્રકોમાં કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું ન હોવાની યોગ્ય ખાતરી મેળવવાનો છે અને ઓડિટરનો અહેવાલ બહાર પાડવાનો પણ છે, જેમાં અમારા અભિપ્રાયનો સમાવેશ થાય છે. યોગ્ય ખાતરી મેળવવી એ ઉચ્ચ પ્રકારની ખાતરી મેળવવા જેવું છે. પરંતુ તે કોઈ એવી ગેરંટી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડિટ કોઈ પ્રત્યક્ષ ખોટું નિવેદન કરવામાં આવ્યું હશે તો તેને શોધી જ કાઢશે. છેતરપીંડી અથવા ભૂલને કારણે ખોટું નિવેદન ઊભું થઈ શકે છે અને આ નાણાકીય પત્રકોના આધારે તેનો ઉપયોગ કરનારા દ્વારા લેવામાં આવેલા આર્થિક નિર્ણયોને તે નોંધપાત્ર પ્રમાણમાં વ્યક્તિગત કે એકંદરરિતે પ્રભાવિત કરે તેવી સંભાવના રહેલી હોય તો તેને પ્રત્યક્ષ ભૂલ કે છેતરપીંડી ગણવામાં આવે છે.

એસએ મુજબ કરવામાં આવેલા ઓડિટના ભાગરૂપે અમે વ્યાવસાયિક નિર્ણયો લઈએ છીએ અને સમગ્ર ઓડિટ દરમિયાન વ્યવસાયિક શંકા જાળવી રાખીએ છીએ. આ ઉપરાંત અમે-

- છેતરપીંડી અથવા ભૂલને કારણે નાણાકીય પત્રકોમાં કોઈ ખોટું નિવેદન થયું હોય તો તેને પારખીને તેનાથી ઊભા થનારા ખતરાનો ક્યાસ પણ કાઢીએ છીએ અને તે ખતરાના ઉકેલરૂપ ઓડિટ કાર્યપદ્ધતિઓ ઘડીને તેને લાગુ પણ પાડીએ છીએ તથા અમારા અભિપ્રાયના સમર્થનમાં યોગ્ય અને પૂરતા પુરાવા પણ મેળવીએ છીએ. કોઈ ભૂલની તુલનામાં છેતરપીંડીને પરિણામે થયેલા ખોટા નિવેદન ન શોધી શકવાનું જોખમ વધુ રહે છે કારણ કે છેતરપીંડીમાં મેળાપીપણું, બનાવટ, ઇરાદાપૂર્વકની ક્ષતિ, ઉચાપત અથવા આંતરિક નિયંત્રણની અવહેલના થાય છે.
- ઓડિટને સુસંગત આંતરિક નિયંત્રણની સમજ મેળવીએ છીએ, જેથી જે તે સંજોગોને અનુરૂપ ઓડિટ કાર્યપદ્ધતિઓ ઘડી શકાય. કંપની અધિનિયમની કલમ ૨૪૩(૩)(૧) હેઠળ અને કંપની પર્યાપ્ત આંતરિક નાણાકીય નિયંત્રણ પદ્ધતિ ધરાવે છે કે કેમ અને આવાં નિયંત્રણો વાસ્તવમાં અસરકારક રીતે લાગુ પડે છે કે નહીં તે અંગેનો અમારો અભિપ્રાય વ્યક્ત કરવાની પણ અમારી જવાબદારી છે.
- ઉપયોગમાં લેવામાં આવેલી હિસાબી નીતિઓની યોગ્યતા તથા વ્યવસ્થાપકમંડળ દ્વારા કાઢવામાં આવેલા હિસાબી અંદાજો અને કરવામાં આવેલી સંબંધિત જાહેરાતોની મૂલવણી પણ કરીએ છીએ.
- વ્યવસ્થાપકમંડળ દ્વારા હિસાબના ચાલુ ઉપક્રમના ઉપયોગના ઔચિત્ય તથા પ્રાપ્ત કરવામાં આવેલા ઓડિટ પુરાવાના આધારે કંપની ચાલુ ઉપક્રમ તરીકે ચાલુ રહેવાની ક્ષમતા પર નોંધપાત્ર શંકા ઊભી કરે તેવી ઘટનાઓ અથવા પરિસ્થિતિઓ સંબંધી કોઈ પ્રત્યક્ષ અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે પણ નક્કી કરીએ છીએ. કોઈ પ્રત્યક્ષ અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી હોવાનું અમને જણાય તો અમે અમારા ઓડિટરના અહેવાલમાં નાણાકીય પત્રકોમાં સંબંધિત જાહેરાતો તરફ ધ્યાન દોરીએ છીએ અને જો આવી જાહેરાતો અપર્યાપ્ત હોય તો અમે અમારા અભિપ્રાયમાં ફેરફાર કરીએ છીએ. અમારાં તારણો અમારા ઓડિટરના અહેવાલની તારીખ સુધી મેળવવામાં આવેલા ઓડિટના પુરાવા પર આધારિત હોય છે. આમ છતાં, ભાવિ ઘટનાઓ અથવા પરિસ્થિતિઓને કારણે કંપની તેની ચાલુ કામગીરી કરવાનું બંધ કરે એવું બની શકે છે.
- જાહેરાતો સહિત નાણાકીય પત્રકોની એકંદર રજૂઆત, માળખું અને વિષયવસ્તુનું મૂલ્યાંકન કરીએ છીએ અને નાણાકીય પત્રકોમાં લેવડ-દેવડો અને ઘટનાઓની યોગ્ય રજૂઆત થઈ છે કે નહીં તે પણ તપાસીએ છીએ.

અમે સંચાલનની કામગીરી કરતા લોકોને અન્ય બાબતોની સાથેસાથે ઓડિટના આયોજિત કાર્યક્ષેત્ર તથા સમય તેમ જ મહત્વનાં ઓડિટ તારણોની પણ જાણ કરીએ છીએ જેમાં અમારા ઓડિટ દરમિયાન અમને જોવા મળેલી આંતરિક નિયંત્રણ અંગેની ખામીઓનો સમાવેશ થાય છે.

સંચાલનની કામગીરી સંભાળતા લોકોને અમે લિખિત નિવેદન પણ આપીએ છીએ કે અમે સ્વતંત્રતા અંગેની સંબંધિત નૈતિક જરૂરિયાતોનું અનુપાલન કર્યું છે અને અમારી સ્વતંત્રતાને પ્રભાવિત કરે તેવા તમામ સંબંધો તથા અન્ય બાબતોની તેમજ લાગુ પડતું હોય ત્યાં સંબંધિત સુરક્ષાસંબંધી બાબતોની પણ

જાણ કરીએ છીએ.

સંચાલકોએ જણાવેલી બાબતો પૈકી ચાલુ સમયગાળાના નાણાકીય પત્રકોના ઓડિટમાં સૌથી મહત્વની હોય તેવી બાબતો અમે નક્કી કરીએ છીએ. કાયદો અથવા વિનિયમો હેઠળ આવી બાબતો જાહેર કરવા અંગે કોઈ બાધ ન હોય તો અથવા અત્યંત જૂજ કિસ્સાઓમાં જ્યારે અમને લાગે કે જાહેર હિતમાં કોઈ બાબત જણાવવી યોગ્ય નથી તે સિવાય અમે અમારા ઓડિટ અહેવાલમાં તે બાબતો જાહેર કરીએ છીએ કારણ કે તે બાબતો જાહેર કરવાથી જાહેર હિતમાં થનારા લાભોની તુલનામાં ઊભાં થનારાં વિપરિત પરિણામોની અસર વધુ ગંભીર હોવાની અપેક્ષા હોય છે.

અન્ય કાનૂની અને નિયંત્રક જરૂરિયાતો અંગેનો અહેવાલ

૧. કંપની અધિનિયમની કલમ-૧૪૩ની પેટા-કલમ (૧૧)ના સંદર્ભમાં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડવામાં આવેલા, કંપનીઝ (ઓડિટર્સ રિપોર્ટ) ઓર્ડર, ૨૦૧૬ (૬ ઓર્ડર)ની જરૂરિયાત મુજબ, અમે જોડાણ-૧માં, “ધ ઓર્ડર”ના ફકરા ૩ અને ૪માં નિર્દિષ્ટ કરવામાં આવેલી બાબતો અંગેનું એક પત્રક આપ્યું છે.
૨. અમે, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નિર્દેશો અને પેટાનિર્દેશોના આધારે જોડાણ-૨માં, અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને કંપનીના ચોપડા અને રેકર્ડની અમને યોગ્ય જણાઈ છે તેવી તપાસના આધારે, અધિનિયમની કલમ ૧૪૩(૫)ના સંદર્ભમાં અમારો અહેવાલ રજૂ કરીએ છીએ.
૩. કંપની અધિનિયમનીની કલમ ૧૪૩(૩)ની જરૂરિયાત મુજબ અમે જણાવીએ છીએ કે-
 - (ક) આ ઓડિટ માટે અમારી જાણકારી અને માન્યતા મુજબ જરૂરી હોય તેવી તમામ માહિતી અને ખુલાસા અમે મેળવ્યાં છે.
 - (ખ) અમારા મતે, કાયદા અન્વયે જાળવવાના થતા હિસાબના યોગ્ય ચોપડા કંપનીએ જાળવ્યા હોવાનું અમને હિસાબોના ચોપડાની અમે કરેલી તપાસ દરમિયાન જણાયું છે.
 - (ગ) આ અહેવાલમાં, રજૂ કરવામાં આવેલાં પાકા સરવૈયા, અન્ય સર્વગ્રાહી આવક તથા કેશ-ફ્લો અને ઇકિવટીમાં થયેલા ફેરફાર સહિત નફા અને નુકસાન પત્રક હિસાબના ચોપડા સાથે સુસંગત છે.
 - (ઘ) અમારા મતે, ઉક્ત નાણાકીય પત્રકો અધિનિયમની કલમ-૧૩૩ને કંપનીઝ (ઇન્ડિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ્ઝ) રુલ્સ, ૨૦૧૫ સાથે વાંચતાં, તેમાં નિર્દિષ્ટ કરવામાં આવેલાં હિસાબી ધોરણોનું પાલન કરે છે.
 - (ચ) નિયામકમંડળે જેને રેકર્ડ પર લીધી છે એ, ૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ મુજબ નિયામકો તરફથી મળેલી લિખિત રજૂઆત મુજબ, અધિનિયમની કલમ ૧૬૪(૨) અન્વયે કંપનીના કોઈ નિયામક તા. ૩૧-૩-૨૦૨૨ના રોજ નિયામક તરીકે નિમણૂક પામવા માટે ગેરલાયક નથી.
 - (છ) કંપનીનાં નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા પર આંતરિક નાણાકીય નિયંત્રણોની પર્યાપ્તતા અને આવાં નિયંત્રણોની કાર્યલક્ષી અસરકારકતા અંગે જુઓ આ અહેવાલ સાથે જોડાણ-૩ માં જોડેલ અલગ અહેવાલ. અમારો અહેવાલ નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર કંપનીનાં આંતરિક નિયંત્રણની પર્યાપ્તતા અને અસરકારકતા અંગેનો અમારો અમારો અભિપ્રાય વ્યક્ત કરે છે, જેમાં કોઈ ફેરફાર થયો નથી.
 - (જ) સુધારવામાં આવેલા અધિનિયમની કલમ ૧૮૭(૧૬)ની જરૂરિયાત મુજબ ઓડિટરના અહેવાલમાં સામેલ કરવાની અન્ય બાબતોના સંદર્ભમાં: અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ તેના નિયામકોને અધિનિયમની કલમ ૧૮૭ મુજબ મહેનતાણું ચુકવેલ છે.
 - (ઝ) કંપનીઝ (ઓડિટ એન્ડ ઓડિટર્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૧૧ મુજબ, ઓડિટરોના અહેવાલમાં સમાવવાની અન્ય બાબતોના સંદર્ભે, અમારા મતે અને અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ તથા અમને કરવામાં આવેલા ખુલાસા મુજબ-
 - (૧) કંપનીએ તેના નાણાકીય પત્રકોમાં, તેના પડતર કોર્ટ કેસોની નાણાકીય સ્થિતિ પર પડનારી અસર જાહેર કરી છે. (જુઓ નોંધ નં.૩૧ (ન))
 - (૨) નજીકના ભવિષ્યમાં નુકસાન થાય તેવા, ડેરીવેટીવ કોન્ટ્રાક્ટ સહિતના કોઈ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કંપની ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ ધરાવતી નથી.
 - (૩) કંપનીએ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં તબદીલ કરવી જરૂરી હોય તેવી કોઈ રકમ ન હતી.
- (૪). વ્યવસ્થાપક મંડળે જણાવ્યું છે કે, આ નાણાકીય પત્રકોની નોંધ-૩૧માં જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ, તેની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ કંપનીએ, લેખિતમાં અથવા અન્યથા નોંધાયેલી કોઈ ત્રાહિત સંસ્થાને એવી સમજ સાથે, તેનું કોઈ ભંડોળ (વ્યક્તિગત કે એકંદર એવું પ્રત્યક્ષ ભંડોળ), કોઈપણ વિદેશી સંસ્થા (મધ્યસ્થી સંસ્થા) સહિત, અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને, , પેશગી રૂપે અથવા લોન રૂપે આપ્યું નથી અથવા રોકાણ કર્યું નથી (ઉછીના લીધેલા ભંડોળમાંથી અથવા શેર પ્રીમિયમમાંથી અથવા ભંડોળના અન્ય કોઈ સ્ત્રોત અથવા પ્રકારમાંથી) કે તે મધ્યસ્થી સંસ્થા - પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, કંપની (આખરી લાભાર્થી) દ્વારા અથવા તેના વતી પારખવામાં આવેલ અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નાણા ધીરે અથવા

- તેમનામાં નાણાનું રોકાણ કરે અથવા આખરી લાભાર્થીઓ વતી કોઈ બાંધધરી, જામીનગીરી અથવા એવું કોઈ ખત કરી આપે
 - વ્યવસ્થાપક મંડળે જણાવ્યું છે કે, તેની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ, કંપનીએ, લેખિતમાં અથવા અન્યથા નોંધાયેલી કોઈ ત્રાહિત સંસ્થા (ભંડોળ આપનારી સંસ્થા) (આખરી લાભાર્થી) પાસેથી એવી સમજ સાથે કોઈ ભંડોળ (વ્યક્તિગત કે એકંદર એવું પ્રત્યક્ષ ભંડોળ), કોઈપણ ત્રાહિત સંસ્થા સહિત, અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી, પેશગી રૂપે અથવા લોન રૂપે મેળવ્યું નથી અથવા તેનું રોકાણ કર્યું નથી કે કંપની -
 - પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, ભંડોળ આપનારી સંસ્થા દ્વારા અથવા તેના વતી પારખવામાં આવેલ અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નાણા ધીરે અથવા
 - તેમનામાં નાણાનું રોકાણ કરે અથવા આખરી લાભાર્થીઓ વતી કોઈ બાંધધરી, જામીનગીરી અથવા એવું કોઈ ખત કરી આપે
૫. કંપનીએ, વર્ષ દરમિયાન, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૨૩ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કોઈ ડિવિડંડ જાહેર કર્યું કે ચુકવ્યું નથી.

અનિલ એન. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઢી નોંધણી નં. ૧૧૪૧૩૧w વતી

સહી/-

(જિજ્ઞા.એચ. શાહ)

ભાગીદાર

મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

સ્થળ: અમદાવાદ

તારીખ : ૧૯-૧૨-૨૦૨૨

યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

ઓડિટરના અહેવાલ સાથેનું “જોડાણ-૧”

(અમારા સમાન તારીખના અહેવાલના “અન્ય કાનૂની અને વિનિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ” હેઠળના ફકરા-૧માં જણાવેલ)

૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરાં થતાં વર્ષ માટેનાં, ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો અંગે કંપનીના સભ્યો સમક્ષના અમારા સ્વતંત્ર ઓડિટરના અહેવાલના જણાવેલ જોડાણ-૧માં અમે જણાવીએ છીએ કે-

(૧) કંપનીની મિલકત, પ્લાન્ટ અને સાધનસામગ્રીની બાબતમાં

- (ક) કંપનીએ પ્રમાણાત્મક વિગતો અને સ્થિતિ સહિત પૂરી વિગતો દર્શાવતું યોગ્ય રેકર્ડ જાળવ્યું છે.
 - (ખ) કંપની તેની સ્થાયી મિલકતો (સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રી)ની ખરાઈ તબક્કાવાર કાર્યક્રમ મુજબ કરે છે, જે અમારા મતે કંપનીના કદ અને તેની મિલકતોના સંદર્ભમાં યોગ્ય છે. આ કાર્યક્રમને અનુસરીને વર્ષ દરમિયાન વ્યવસ્થાપક મંડળે કેટલીક સ્થાયી મિલકતોની પ્રત્યક્ષ ખરાઈ કરી હતી. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ આ ખરાઈમાં કોઈ પ્રત્યક્ષ વિસંગતતા જણાઈ નથી.
 - (ગ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અમે જણાવીએ છીએ કે, કંપનીની જમીન અને મકાનોની તમામ સ્થાવર મિલકતો સરવૈયાની તારીખે કંપનીના નામે ધારણ થયેલી છે અને લીઝ હોલ્ડ સંપત્તિઓ માટે કંપની ચોખ્ખાં ટાઈટલ/લીઝ ડીડ ધરાવે છે. કંપનીની જમીન અને મકાનોની સ્થાવર મિલકતો પટેથી લેવામાં આવી છે અને નાણાકીય પત્રકોમાં સ્થાયી મિલકતો તરીકે જાહેર કરવામાં આવી છે તે કંપનીના નામે છે.
 - (ઘ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ વર્ષ દરમિયાન તેની સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રી અથવા અમૂર્ત મિલકતો અથવા બન્નેની પુનઃ કિંમત કઢાવી નથી.
 - (ચ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા તથા અમે તપાસેલા રેકર્ડ મુજબ, બેનામી લેવડદેવદ (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૮૮ (૧૯૮૮નો ૪૫મો) હેઠળ કોઈ બેનામી મિલકત ધરાવવા માટે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ કાર્યવાહી પડતર નથી.
૨. અમારા મતે, વર્ષ દરમિયાન માલસામગ્રીની ભૌતિક ચકાસણી વ્યવસ્થાપક મંડળ દ્વારા યોગ્ય સમયાંતરે કરવામાં આવી છે. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ હિસાબના ચોપડાની તુલનામાં ભૌતિક ખરાઈ દરમિયાન માલસામગ્રીના પ્રત્યેક વર્ગ માટે એકંદરે માલસામગ્રીના ૧૦ ટકા અથવા તેથી વધુ વિસંગતતા ધ્યાનમાં આવી ન હતી.
- અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ તથા કંપનીના રેકોર્ડની અમે કરેલી તપાસના આધારે, કંપનીએ બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી તેની હાલની મિલકતની જામીનગીરીના આધારે કુલ પાંચ કરોડ રૂપિયાથી વધુની મર્યાદામાં કાર્યકારી મૂડી મંજૂર કરાવી નથી. કંપનીને આવી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસે ત્રિમાસિક/માસિક રિટર્ન્સ અથવા પત્રકો રજૂ કરવાની જરૂર પડી નથી.
૩. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ -૧૮૯ હેઠળ જાળવવામાં આવેલા રજિસ્ટરમાં નોંધાયેલી કંપનીઓ, પેઢીઓ, મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીઓ અથવા અન્ય પાર્ટીઓને કોઈ તારણવાળી કે તારણ વિનાની લોન આપી નથી. તેથી, ધ સીએઆરઓના ફકરા (૩)(૩)(ક)(ખ) અને (ગ)ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.
 ૪. કંપની અધિનિયમની કલમ ૧૮૫ હેઠળ કંપનીએ કોઈ લોન, રોકાણો, ગેરંટી આપી નથી. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ તેણે કરેલા રોકાણોના સંદર્ભમાં અધિનિયમની કલમ ૧૮૬ની જોગવાઈઓનું પાલન કર્યું છે.
 ૫. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ વર્ષ દરમિયાન, અધિનિયમની કલમ ૭૩ થી ૭૬ અને તે હેઠળ ઘડવા માં આવેલા નિયમોની જોગવાઈઓ હેઠળ અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશો હેઠળ જાહેર જનતા પાસેથી કોઈ થાપણો સ્વીકારી નથી તેથી ધ ઓર્ડરના ખંડ (૩)(પ)ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.
 ૬. કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ ૧૪૮(૧) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ અમે કંપની દ્વારા જાળવવામાં આવેલા હિસાબના ચોપડા તપાસ્યા છે અને અમારા મતે કંપનીએ નિર્દિષ્ટ હિસાબો અને કોસ્ટ રેકર્ડ્સ પ્રથમ દ્રષ્ટિએ જાળવ્યાં છે. આમ છતાં અમે કોસ્ટ રેકર્ડ્સ સાચા અને સંપૂર્ણ છે કે નહીં તે નક્કી કરવાની દ્રષ્ટિએ તે વિગતવાર તપાસ્યા નથી.

૭. (ક) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ્સ મુજબ કંપની ભવિષ્યનિધિ, કર્મચારીઓનો રાજ્ય વીમો, આવકવેરો, જીએસટી, આબકારી શુલ્ક, જકાત, મૂલ્ય વર્ધિત કર અથવા ઉપકર તેમજ તેને લાગુ પડતી અન્ય વૈધાનિક રકમો સહિત ચૂકવવાપાત્ર તમામ નિર્વિવાદ વૈધાનિક રકમો યોગ્ય સત્તામંડળોને નિયમિતરીતે ચૂકવે છે. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ્સ મુજબ, કોઈ નિર્વિવાદ રકમ ૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ, તે ચૂકવવાપાત્ર બન્યા તે તારીખથી છ મહિના કરતા વધુ સમયથી સંબંધિત સત્તામંડળો પાસે કોઈ વિવાદના કારણે જમા કરાવવાના બાકી ન હતી.
- (ખ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ્સ મુજબ કંપનીએ જમા ન કરાવી હોય તેવી મૂલ્યવર્ધિત કર, જીએસટી, આબકારી શુલ્ક અને જકાતની કોઈ વિવાદિત રકમ નથી. આમ છતાં, અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, વિવાદના કારણે ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ મુજબ જમા કરાવી નથી શકાઈ તેવી આવક વેરા અને સર્વિસ ટેક્સની રકમોની વિગત નીચે મુજબ છે.

કાયદાનું નામ	લેણાંનો પ્રકાર	બાકી વિવાદી રકમ (રૂ. લાખમાં)	રકમને લગતું નાણાકીય વર્ષ	વિવાદ જ્યાં પડતર હોય તે ફોરમનું નામ
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૫.૦૬	૧૯૯૧-૯૨	હાઇકોર્ટ તા. ૨૬/૦૬/૨૦૧૨ના રોજ હુકમ કર્યો છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૧.૯	૧૯૯૨-૯૩	હાઇકોર્ટ તા. ૧૭/૧૦/૨૦૧૪ના રોજ હુકમ કર્યો છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૯૫૭૭.૦૩	૨૦૦૧-૦૨	હાઇકોર્ટ તા. ૩૦/૦૭/૧૨ના રોજ જીપીસીએલની તરફેણમાં હુકમ કર્યો છે. સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૧૦.૬૫	૨૦૦૨-૦૩	આઇટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૮.૦૫	૨૦૦૩-૦૪	આઇટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૬૦.૭૯	૨૦૦૪-૦૫	આઇટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૩૦.૭૨	૨૦૦૬-૦૭	આઇટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૫.૧૬	૨૦૦૭-૦૮	આઇટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૫.૮૧	૨૦૦૮-૦૯	આઇટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૯.૬	૨૦૦૨-૦૩	બાબત આઇટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૮૧.૧૩	૨૦૦૩-૦૪	બાબત આઇટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૩૭.૫૨	૨૦૦૪-૦૫	બાબત આઇટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૦૯.૭૯	૨૦૦૫-૦૬	બાબત આઇટીએટી પાસે પડતર છે.

આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૨૩.૦૫	૨૦૦૮-૧૦	સીઆઇટી (એ)એ તા. ૨૨/૦૮/૨૦૧૩ના રોજ હુકમ કર્યો છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૩૬.૪૬	૨૦૧૦-૧૧	આઇટીએટી એ તા. ૧૦/૦૭/૨૦૧૮ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૨૮.૫૩	૨૦૧૧-૧૨	આઇટીએટી એ તા. ૧૦/૦૭/૨૦૧૮ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૧.૨૮	૨૦૧૨-૧૩	આઇટીએટી એ તા. ૧૯/૦૮/૨૦૧૮ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૮.૬૩	૨૦૧૩-૧૪	આઇટીએટી એ તા. ૨૦/૦૮/૨૦૧૮ના રોજ હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૮૦૭.૯૦	૨૦૧૫-૧૬	એ.ઓ. એ કલમ ૧૪૭ હેઠળ તા. ૨૮/૦૩/૨૨ના રોજ હુકમ કર્યો છે. સીઆઇટી (એ)સમક્ષ અપીલ પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫.૭૦	૨૦૧૬-૧૭	એ.ઓ. એ કલમ ૧૪૩(૩) હેઠળ તા. ૨૬/૧૨/૧૮ના રોજ અને કલમ ૧૪૭ હેઠળ તા. ૨૮/૦૩/૨૨ના રોજ હુકમ કર્યો છે. સીઆઇટી (એ) સમક્ષ અપીલ પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૨૬.૭૨	૨૦૧૭-૧૮	એ.ઓ. એ કલમ ૧૪૩(૩) હેઠળ તા. ૨૪/૦૮/૨૧ના રોજ હુકમ કર્યો છે. સીઆઇટી (એ)સમક્ષ અપીલ પડતર છે.
સર્વિસ ટેક્સ એક્ટ	સર્વિસ ટેક્સ	૨૮૪૫	એપ્રિલ, ૨૦૦૮ થી ડિસેમ્બર, ૨૦૧૨	આ બાબત સીઇએસટીએટીસમક્ષ પડતર છે.

૮. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ મુજબ, વર્ષ દરમિયાન હિસાબોના ચોપડામાં નોંધવામાં ન આવ્યા હોય એવી કોઈ લેવડદેવડો કે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ (૧૯૬૧નો ૪૩મો) હેઠળ વર્ષ દરમિયાન જેની કરવેરા માટે આકારણી કરવામાં આવી ન હોય તેવી સરન્ડર કરેલી કે જાહેર કરેલી કોઈ રકમ ન હતી.
૯. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ વર્ષ દરમિયાન કોઈ લોન લીધી નથી. તેથી ધ ઓર્ડરના ખંડ (૩) (૯) (ખંડ ક થી છ)લાગુ પડતો નથી.
૧૦. અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી તથા કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ વર્ષ દરમિયાન પ્રારંભિક પબ્લિક ઓફર રૂપે અથવા વધુ પબ્લિક ઓફર રૂપે કોઈ નાણાં ઊભા કર્યા નથી (દેવા ખત સહિત). તેથી ધ ઓર્ડરનો ફકરો ૩(૧૦)(ક) લાગુ પડતો નથી. વર્ષ દરમિયાન, કંપનીએ કોઈ શેરોની પસંદગી મુજબની ફાળવણી (પ્રેફરેન્શ્યલ અલોટમેન્ટ) અથવા પબ્લિક પ્લેસમેન્ટ ફાળવણી અથવા સંપૂર્ણપણે કે આંશિક રીતે ચુકવાયેલા ડિબેન્ચરની ફાળવણી કરી નથી અને તેથી “ધ ઓર્ડર”ના ફકરા ૩(૧૦)(ખ) હેઠળ અહેવાલ રજૂ કરવાનું કંપની માટે લાગુ પડતી નથી.
૧૧. (ક)અમારી જાણકારી અને માન્યતા મુજબ તેમજ અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે, ઓડીટીંગ અંગેના ધોરણોમાં જણાવવામાં આવેલ “પ્રિન્સીપલ્સ ઓફ મટીરીયાલીટી”ને ધ્યાનમાં લેતાં, ઓડિટ દરમિયાન કંપની દ્વારા અથવા કંપનીના સાથે કોઈ છેતરપીંડી કરવામાં આવી હોય એવું અમારા ધ્યાનમાં કે જાણમાં આવ્યું નથી.
 - (ખ) કંપનીઝ (ઓડિટ એન્ડ ઓડિટર્સ) રુલ્સ ૨૦૧૪ના નિયમ ૧૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩ની પેટા કલમ ૧૨ હેઠળ કોસ્ટ ઓડિટર/સેક્ટરીયલ ઓડિટર અથવા કંપનીના વૈધાનિક ઓડિટર તરીકે અમારે ફોર્મ ઓડીટી-૪માં કોઈ અહેવાલ કેન્દ્ર સરકારને રજૂ કરવો જરૂરી બનતો નથી.
 - (ગ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, અમે જણાવીએ છીએ કે ઓડિટ દરમિયાન કંપનીની કોઈ વિહસલ બ્લોઅર ફરિયાદ પ્રાપ્ત થઈ નથી.
૧૨. આ કંપની કોઈ નિધિ કંપની નથી. તેથી ‘ધ ઓર્ડર’નો ખંડ(૧૨) કંપનીને લાગુ પડતો નથી.
૧૩. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, સંબંધિત પાર્ટીઓ સાથેની તમામ લેવડદેવડોમાં કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૭૭ અને ૧૮૮નું જ્યાં અનુપાલન કરવાનું લાગુ પડતું હોય ત્યાં કંપનીએ તેમનું પાલન કર્યું છે, અને ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકોમાં હિસાબી ધોરણ-૨૪ “સંબંધિત પાર્ટીઓ અંગેની જાહેરાત”ની વિગતો જાહેર કરવામાં આવી છે.

૧૪. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલ આ ખુલાસા મુજબ કંપની તેના કદ અને કામકાજના પ્રકારને અનુરૂપ આંતરિક ઓડિટ પદ્ધતિ ધરાવે છે.
ઓડિટ હેઠળના સમયગાળા માટેના આંતરિક ઓડિટરના અહેવાલો અમે ધ્યાનમાં લીધા છે.
૧૫. અમે તપાસેલા કંપનીના રેકોર્ડ અને હિસાબના ચોપડા તેમજ અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ નિયામકો અથવા તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે બિન રોકડ લેવડદેવડ કરી નથી. તેથી ખંડ ૩(૧૫) કંપની ને લાગુ પડતો નથી.
- ૧૬ (ક) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ની કલમ ૪૫-આઈએ હેઠળ નોંધણી કરાવવાની જરૂર નથી.
(ખ) વર્ષ દરમિયાન કંપનીએ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ/ હાઉસિંગ ફાઇનાન્સ પ્રવૃત્તિઓ કરી નથી. તદ્દનુસાર, “ધ ઓર્ડર”નો ખંડ ૩ (૧૬)(ખ) કંપનીને લાગુ પડતો નથી.
(ગ) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઘડવામાં આવેલા વિનિયમોમાં જણાવ્યા મુજબ આ કંપની કોઈ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની નથી. તેથી, ધ ઓર્ડર નો ખંડ (૧૬) (ગ) કંપનીને લાગુ પડતો નથી.
(ઘ) કંપનીના વ્યવસ્થાપક મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અને કરવા આવેલા ખુલાસાના આધારે, આ જૂથ કોઈ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની નથી. તદ્દનુસાર, ધ ઓર્ડર નો ખંડ (૧૬) (ઘ) કંપનીને લાગુ પડતો નથી. હા
૧૮. કંપનીએ આ નાણાકીય વર્ષ અને તેના તરત પહેલાંનાં નાણાકીય વર્ષ દરમિયાન કોઈ રોકડ ખોટ કરી નથી.
૧૯. વર્ષ દરમિયાન વૈધાનિક ઓડિટરે રાજીનામું આપ્યું નથી. તેથી, ધ ઓર્ડર નો ખંડ (૧૮) કંપનીને લાગુ પડતો નથી.
૨૦. અમારા મતે તેમ જ નાણાકીય ગુણોત્તર, ઉંમર અને તેમના વેચાણની અપેક્ષિત તારીખો અને નાણાકીય જવાબદારીઓની ચૂકવણી, નાણાકીય પત્રકો સાથે આપવામાં આવેલી અન્ય માહિતી, નિયામક મંડળ વિશેની અને વ્યવસ્થાપન સંબંધિત યોજનાઓ અંગેની અમારે જાણકારી, તેમજ અમે તપાસેલા, ધારણાઓનું સમર્થન કરતા પુરાવાઓના આધારે એવું કશું પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી જેનાથી અમારે એવું માનવાની જરૂર પડે કે, પાકા સરવૈયાની તારીખથી એક વર્ષની અંદર ચૂકવવાપાત્ર બનતી હોય એવી કોઈ હાલની જવાબદારીઓ પૂરી કરી ન શકે એવી પ્રત્યક્ષ અનિશ્ચિતતા આ ઓડિટની તારીખે આ કંપની માટે પ્રવર્તે છે. અમારો આ અહેવાલ ઓડિટ અહેવાલની તારીખે અસ્તિત્વ ધરાવતી હકીકતો પર આધારિત છે અને અમે એવી કોઈ બાંહેધરી અથવા ખાતરી આપતા નથી કે પાકા સરવૈયાની તારીખથી એક વર્ષના સમયગાળાની અંદર જે ચૂકવવાપાત્ર બનવાની હોય એવી તમામ જવાબદારીઓ કંપની, તે જ્યારે ચૂકવવાપાત્ર બને ત્યારે ચૂકવશે.
૨૧. ચાલુ પ્રોજેક્ટ અંગે પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાના આધારે, કંપનીએ તા. ૩૧/૦૩/૨૦૨૨ના રોજ મુજબ રૂ. ૯૨.૪૯ લાખની વણખર્ચાંયેલી સામાજિક જવાબદારીની રકમ અધિનિયમની કલમ ૧૩૫(૬)ની જોગવાઈઓને અનુસરીને, એક વિશિષ્ટ ખાતામાં તબદીલ કરી છે.
૨૨. સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોના ઓડિટના સંદર્ભમાં “ધ ઓર્ડર”ના ખંડ ૩(૨૧) હેઠળ અહેવાલ રજૂ કરવાની બાબત લાગુ પડતી નથી. તેથી આ અહેવાલમાં ઉપર જણાવેલ ખંડ અંગે કોઈ ટીકા-ટિપ્પણ કરવામાં આવી નથી.

અનિલ એન. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઢી નોંધણી નં. ૧૧૪૧૩૧w વતી

સહી/-

(જિજ્ઞા.એચ. શાહ)

ભાગીદાર

મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

સ્થળ: અમદાવાદ

તારીખ : ૧૯-૧૨-૨૦૨૨

યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

સ્વતંત્ર ઓડિટરના અહેવાલ સાથેનું જોડાણ-૨

(અમારા સમાન તારીખના અહેવાલના “અન્ય કાનૂની અને વિનિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ” હેઠળના ફકરા-૨માં જણાવેલ)
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૩(પ) હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માટેનો અહેવાલ

૧. મૂખ્ય નિર્દેશો

ક્રમ નં.	પ્રશ્નો	પ્રતિભાવ/ ઉપચારાત્મક પગલાં
૧.	કંપની તમામ હિસાબી લેવડદેવડો આઈટી પ્રણાલી મારફત પ્રોસેસ કરવાની સીસ્ટમ ધરાવે છે? જો હા, તો આઈટી સીસ્ટમની બહાર હિસાબી લેવડદેવડો કરવાની હિસાબોની ચોકસાઈ પર થનારી અસરો અને તેની સૂચિત નાણાકીય અસરો જણાવો.	હા, કંપની તમામ હિસાબી લેવડદેવડો આઈટી પ્રણાલી મારફત પ્રોસેસ કરવાની સીસ્ટમ ધરાવે છે. આઈટી સીસ્ટમની બહાર કોઈ હિસાબી લેવડદેવડો કરવામાં આવતી ન હોવાથી હિસાબોની ચોકસાઈ પર કોઈ અસર પડશે નહીં અને તેની કોઈ નાણાકીય અસરો પડશે નહીં.
૨.	કંપની લોન પરત ચુકવી શકી ન હોવાના કારણે કોઈ વર્તમાન લોનનું પુનર્ગઠન (રીસ્ટ્રક્ચરીંગ) કરવાનો અથવા લોન આપનારે કંપનીના દેવાં/ લોન/ વ્યાજ વગેરે માંડવાળ/ રાઈટ ઓફ કરવાનો કોઈ કિસ્સો છે? જો હા, તેની નાણાકીય અસરો જણાવો.	લાગુ પડતું નથી.
૩.	કોઈ ચોક્કસ યોજના માટે કેંદ્ર/રાજ્યની એજન્સીઓ પાસેથી મેળવેલ/મળવાપાત્ર ભંડોળ તેની શરતો મુજબ હિસાબે લેવામાં/ વાપરવામાં આવ્યું છે?. તેમાં કોઈ માર્ગાંતર હોય તો જણાવો.	લાગુ પડતું નથી

૨. વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૩(પ) હેઠળ બહાર પાડવામાં આવેલા પેટા-નિર્દેશો (ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર)

ક્રમ નં.	વિગતો	વિશેષ નોંધ
૧.	કંપનીએ તેની માલિકીકીની ફાજલ પડેલી જમીન પર દબાણ થતું અટકાવવા માટે પૂરતાં પગલાં લીધાં છે? કંપનીની કોઈ જમીન પર દબાણ થયું છે? તે અંગે કેસ ચાલે છે? તે ઉપયોગમાં લેવામાં આવી નથી અથવા ફાજલ જાહેર કરવામાં આવી છે? વિગતો આપવી.	હા ના
૨.	જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રકલ્પોની પરખ કરવા માટે સરકારની માર્ગદર્શક સૂચનાઓ/ નીતિઓ સાથે સુસંગત હોય એવી કોઈ વ્યવસ્થા છે? તેમાં કોઈ માર્ગાંતર થયું હોય તો જણાવો.	લાગુ પડતું નથી
૩.	શું કરારમાં નિર્દેષ્ટ કરવામાં આવેલાં સીમાચિત્તોની તુલનામાં થયેલાં કામો અંગે દેખરેખ નિયંત્રણ રાખવા માટેની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે અને કોઈ ભાવ વધારો હોય અથવા કરારમાંથી કોઈ આવક/ ખોટ થઈ હોય તો તેની અસર હિસાબના ચોપડામાં યોગ્ય રીતે આપવામાં આવે છે?	હા
૪.	કેન્દ્ર/ રાજ્યની એજન્સીઓમાંથી ચોક્કસ યોજનાઓ માટે મળેલા/ મળવાપાત્ર ભંડોળ યોગ્ય રીતે ઉપયોગમાં/ હિસાબે લેવામાં આવે છે? આમાં કોઈ માર્ગાંતર થયું હોવાના કિસ્સા બન્યા હોય તો જણાવો.	હા
૫.	બેંક ગેરંટી સમયસર રીવેલીડેટ કરવામાં આવી છે?	હા
૬.	નીચેનાની સિલકો અંગે ટિકા-ટિપ્પણ કરો ક. ધંધા સંબંધી મળવાપાત્ર, ધંધા સંબંધી ચુકવવાપાત્ર ખ. મુદતી થાપણો, બેંક ખાતાં અને મેળવેલી રોકડ	ના હા
૭.	પડતા મૂકવામાં આવેલા પ્રકલ્પો અંગે કરવામાં આવેલા ખર્ચનું પ્રમાણ નક્કી કરવું અને ખરેખર રાઈટ ઓફ કરવામાં આવેલી રકમ જણાવવી.	લાગુ પડતું નથી.

૩. વીજ ક્ષેત્ર

ક્રમ નં.	વિગતો	વિશેષ નોંધ
૧.	કંપનીની માલિકીની ફાજલ પડેલી જમીન પર દબાણ થતું રોકવા માટે લેવામાં આવેલાં પગલાં પૂરતાં છે કે નહીં તે તપાસવું.	હા
	કંપનીની જમીન પર દબાણ થયું હોય, તે સંબંધે કેસ ચાલતો હોય, તેનો ઉપયોગ થતો ન હોય અથવા તેને ફાજલ જાહેર કરવામાં આવી હોય તો તેની વિગતો જણાવવી.	લાગુ પડતું નથી.
૨.	નવી પરિયોજનાઓ શરૂ કરવા માટે જ્યાં જમીન સંપાદનનો મુદ્દો સંકળાયેલો હોય ત્યાં બાકી લેણાંની પતાવટ તમામ કેસોમાં ઝડપથી અને પારદર્શી રીતે કરવામાં આવી છે કે નહીં તે જણાવો. કોઈ માર્ગાન્તર (deviation)નો કેસ હોય તો તેની વિગતો આપો.	હા
૩.	કંપની કરારની શરતો મુજબ મહેસૂલની વસૂલાત કરવા માટેની અસરકારક પ્રણાલી ધરાવે છે કે કેમ અને તે મહેસૂલ, લાગુ પડતાં હિસાબી ધોરણોનું પાલન કરીને હિસાબના ચોપડે યોગ્ય રીતે હિસાબે લેવામાં આવે છે કે નહીં.	હા
૪.	પડતી મૂકવામાં આવેલી પરિયોજનાઓ અંગે કેટલું ખર્ચ કરવામાં આવ્યું છે અને તેમાંથી કેટલું ખર્ચ રાઈટ ઓફ કરવામાં આવ્યું છે.	લાગુ પડતું નથી.

૪. નિર્માણ

ક્રમ નં.	વિગતો	વિશેષ નોંધ
૧.	થર્મલ પાવર પ્રોજેક્ટના કિસ્સામાં, જુદા જુદા પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમોનું અનુપાલન તથા રાખ (એશ)ના ઉપયોગ અને નિકાલ સહિત, તેની અસર અને આ સંદર્ભે કંપનીની નીતિ અંગે તપાસ કરવી અને તે અંગે ટીકા-ટિપ્પણ આપવાં.	લાગુ પડતું નથી.
૨.	ખાણના તળિયે (પીટ એન્ડ) કોલસાનું ઉત્ખનન કરવા માટેની ખાનગી પક્ષકારો સાથે હિસ્સેદારીથી આવક વહેંચવા માટેના કરાર કંપનીએ કર્યાં છે અને કંપનીનાં નાણાકીય હિતોની પૂરતી રક્ષા કરવામાં આવે છે?	લાગુ પડતું નથી.
૩.	ઓર્ડર કરવામાં આવેલા અને પ્રાપ્ત થયેલા કોલસાની ગુણવત્તા / પ્રમાણનો હિસાબમેળ કરવાની યોગ્ય પ્રણાલી કંપની ધરાવે છે? અને કોલસાના ભેજનો ગ્રેડ તથા નુકસાની વગેરેની નોંધ હિસાબના ચોપડે યોગ્ય રીતે કરવામાં આવે છે?	લાગુ પડતું નથી.
૪.	રાજ્ય સરકારને વિનામૂલ્ય વીજળીનો કેટલો હિસ્સો મળવાપાત્ર છે? અને તેની ગણતરી પરસ્પર સંમતિ સંધાયા મુજબની શરતો પ્રમાણે કરીને, હિસાબનાં સ્વીકૃત ધોરણો મુજબ હિસાબોમાં તે દર્શાવવામાં આવે છે?	લાગુ પડતું નથી.
૫.	જળ વિદ્યુત પરિયોજનાઓના કેસમાં પાણીનો નિકાલ જૈવવૈવિધ્યની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નીતિ/ માર્ગદર્શક સૂચનાઓ મુજબ કરવામાં આવે છે? જૈવવૈવિધ્યની જાળવણી ન કરવા બદલ ચુકવાયેલ/ ચુકવવાપાત્ર દંડ વિશે જણાવવું.	લાગુ પડતું નથી.

અનિલ એન. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઢી નોંધણી નં. ૧૧૪૧૩૧w વતી

સહી/-

(જિજ્ઞા.એચ. શાહ)

ભાગીદાર

મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

સ્થળ: અમદાવાદ

તારીખ : ૧૯-૧૨-૨૦૨૨

યુ.ડી.આઈ.એન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

સ્વતંત્ર ઓડિટરોના અહેવાલ સાથેનું જોડાણ-૩

(અમારા સમાન તારીખના અહેવાલના “અન્ય કાનૂની અને વિનિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ” હેઠળના ફકરા-૩ના ખંડ (છ)માં જણાવેલ)

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ-૧૪૩ની પેટા કલમ-૩ના ખંડ (આઈ) હેઠળ નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશો અંગેનો અહેવાલ

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત વર્ષ માટેનાં ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો અંગે કંપનીના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવેલા અમારા અહેવાલમાં ઉલ્લેખેલ જોડાણ-૩માં, અમે જણાવીએ છીએ કે ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ મુજબ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (કંપની)નાં નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશોનું ઓડિટ, તે તારીખે પૂરા થતા વર્ષ માટેના આ કંપનીના નાણાકીય પત્રકોના ઓડિટ સાથે કર્યું છે.

આંતરિક નાણાકીય અંકુશો માટેની વ્યવસ્થાપક મંડળની જવાબદારી :

કંપનીનું વ્યવસ્થાપક મંડળ, ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશોના ઓડિટ અંગેની માર્ગદર્શક નોંધ (ગાયડન્સ નોટ)માં જણાવવામાં આવેલા આંતરિક અંકુશના આવશ્યક ઘટકોને ધ્યાનમાં રાખીને, કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના આંતરિક અંકુશો પર આધારિત આંતરિક નાણાકીય અંકુશો સ્થાપિત કરવાની અને તેમને જાળવવાની છે. આ જવાબદારીમાં, અધિનિયમ હેઠળ જરૂરી છે તે મુજબ કંપનીની નીતિઓના અનુપાલન, તેની મિલકતોની રક્ષા, છેતરપિંડી અને ભૂલોના કિસ્સા નિવારવા અને તેમને શોધવા, હિસાબી રેકર્ડ સંપૂર્ણ અને સાચું હોય તે સુનિશ્ચિત કરવું અને વિશ્વાસપાત્ર નાણાકીય માહિતી સમયસર તૈયાર કરવા સહિત, કામકાજ વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે અસરકારક રીતે કામ કરતા પર્યાપ્ત આંતરિક નાણાકીય અંકુશો તૈયાર કરવાની, તેમનો અમલ કરવાની અને તેમને જાળવવાની છે.

ઓડિટરની જવાબદારી

અમારી જવાબદારી, અમારા ઓડિટના આધારે કંપનીના આંતરિક નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા વિશે અમારો અભિપ્રાય આપવાની છે. અમે અમારું ઓડિટ, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના આંતરિક નાણાકીય અંકુશો અંગેની માર્ગદર્શક નોંધ (ગાયડન્સ નોટ) ઓન ઓડિટ ઓફ ઈન્ટર્નલ કંટ્રોલ્સ ઓવર ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ) તેમ જ અધિનિયમની કલમ-૧૪૩ (૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા અને આઈ.સી.એ.આઈ. દ્વારા બહાર પાડવામાં આવેલાં ઓડિટ અંગેનાં ધોરણો મુજબ, તે બંને આંતરિક નાણાકીય અંકુશોને જેટલા પ્રમાણમાં લાગુ પડે છે તે મુજબ કર્યું છે. ઓડિટ અંગેનાં એ ધોરણો અને ગાયડન્સ નોટની જરૂરિયાત મુજબ અમે નૈતિક આવશ્યકતાઓનું પાલન કર્યું છે અને નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર પર્યાપ્ત આંતરિક નાણાકીય અંકુશો સ્થાપિત કરવામાં અને જાળવવામાં આવ્યા હતા કે નહીં અને તમામ ભૌતિક બાબતોમાં તે અંકુશો અસરકારક રીતે કામ કરતા હતા કે નહીં તે વિશે ખાતરી થઈ શકે એ રીતે અમારું ઓડિટ કર્યું છે.

અમારા ઓડિટમાં, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશો પર્યાપ્ત છે કે નહીં તે અંગેના તેમ જ તેની અસરકારકતા અંગેના પુરાવા મેળવવા માટેની કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશો અંગેના અમારા ઓડિટમાં નાણાકીય બાબતો ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની સમજ પ્રાપ્ત કરવાનો, કોઈ ભૌતિક ઊણપ અસ્તિત્વ ધરાવતી હોય તો તે અંગેનું જોખમ નક્કી કરવાનો તેમ જ આવા જોખમના આધારે આંતરિક અંકુશોની રૂપરેખા તથા અસરકારકતા તપાસવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે. પસંદ કરવામાં આવેલી કાર્યપદ્ધતિઓ ઓડિટરના નિર્ણય (જજમેન્ટ) પર આધાર રાખે છે. જેમાં છેતરપિંડી અથવા ભૂલને કારણે રજૂ કરવામાં આવેલાં પ્રત્યક્ષ ખોટાં નિવેદનો અને નાણાકીય પત્રકોનાં જોખમો નક્કી કરવાનો સમાવેશ થાય છે.

અમારું માનવું છે કે અમે મેળવેલા ઓડિટ પુરાવા, પૂરતા અને યોગ્ય છે તથા નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના કંપનીના આંતરિક નાણાકીય અંકુશો અંગેના અમારા ઓડિટ અભિપ્રાયને ઉચિત આધાર પૂરો પાડે છે.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોનો અર્થ

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પર કંપનીનો આંતરિક નાણાકીય અંકુશ એ, સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ, બાદ્ય હેતુઓ માટે નાણાકીય પત્રકો તૈયાર કરવાની અને તેને રજૂ કરવાની વિશ્વસનીયતા વિશે યોગ્ય ખાતરી આપવા માટે ઘડવામાં આવેલી પ્રક્રિયા છે. કોઈપણ કંપનીના નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશમાં એ નીતિઓ અને કાર્યપદ્ધતિઓનો સમાવેશ થાય છે જે -

- (૧) તે કંપનીની મિલકતોની લેવડદેવડોને યોગ્ય અને સાચી રીતે દર્શાવતા વિગતવાર રેકર્ડની જાળવણી સાથે સંબંધ ધરાવતી હોય.
- (૨) એ બાબતની યોગ્ય ખાતરી પૂરી પાડતી હોય કે લેવડદેવડો, સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો જે રીતે તૈયાર કરવા જરૂરી છે તે મુજબ નોંધવામાં આવી છે અને કંપનીની પ્રાપ્તિઓ અને ખર્ચાઓ, કંપનીના વ્યવસ્થાપક મંડળ તથા નિયામકોની અધિકૃતિ મુજબ જ થાય છે; અને
- (૩) કંપનીનાં ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો પર જેની અસર પડી શકે તેમ હોય તેવી, કંપનીની મિલકતોના અનધિકૃત સંપાદન, ઉપયોગ અથવા ‘ડિપોઝીશન’ નિવારવા અથવા તેને સમયસર શોધી કાઢવાની યોગ્ય ખાતરી પૂરી પાડતી હોય.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની આંતરિક મર્યાદાઓ.

નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની આંતરિક મર્યાદાઓને કારણે, ભૂલ અથવા છેતરપિંડીને પરિણામે ખોટાં નિવેદનો કરવામાં આવે અથવા તે શોધી ન શકાય એવું પણ બને. આ મર્યાદાઓમાં અયોગ્ય વ્યવસ્થાપન અથવા વ્યવસ્થાપન અંગેનાં નિયંત્રણોનું આંતરિક નાણાકીય અંકુશો સાથેના ઘર્ષણની સંભાવનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરિસ્થિતિઓ બદલાવાને કારણે અથવા નીતિઓ કે પદ્ધતિઓનું પાલન

નબળું હોવાના કારણે પણ નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશ અંગેના વિશ્લેષણનું પ્રક્ષેપણ ક્યારેક અપૂરતું સાબિત થાય છે.

અભિપ્રાય :

અમારા મતે કંપની, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર તમામ ભૌતિક બાબતોમાં પૂરતા આંતરિક નાણાકીય અંકુશો ઘરાવે છે અને આ અંકુશો, ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોના ઓડિટ અંગેની માર્ગદર્શક નોંધમાં જણાવવામાં આવેલા આંતરિક અંકુશના આવશ્યક ઘટકોને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક અંકુશો પર આધારિત ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ મુજબ અસરકારકરીતે ચાલતા હતા.

અનિલ એન. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઢી નોંધણી નં. ૧૧૪૧૩૧w વતી

સહી/-

(જિજ્ઞા.એચ. શાહ)

ભાગીદાર

મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

સ્થળ: અમદાવાદ

તારીખ : ૧૯-૧૨-૨૦૨૨

યુટીઆઇએન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

ગુજરાત પાવર કોર્પોરેશન લિ.
તા.૩૧મી માર્ચ,૨૦૨૨ના રોજ મુજબ પાકું સરવૈયું

(રકમ લાખ રૂ. માં)

વિગતો	નોંધો	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
મિલકતો			
બિન ચાલુ મિલકતો			
સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી	૨	૨૯,૭૪૬.૬૪	૩૧,૦૧૯.૩૨
ઉત્પાદન વિકાસ મિલકતો	૨	૩,૮૧૧.૮૬	૩,૮૫૧.૮૨
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસોમાં રોકાણ	૩	૩,૧૮૩.૭૬	૩,૪૩૩.૭૬
નાણાકીય મિલકતો			
રોકાણો	૪	૧૧,૭૮૩.૮૩	૧૨,૮૮૫.૦૬
અન્ય નાણાકીય મિલકતો	૫	૧૮૮.૨૮	૧૮૮.૨૮
અન્ય બિન ચાલુ મિલકતો	૭	૫,૫૫૬.૯૬	૪,૭૫૨.૦૧
સરવાળો - બિન ચાલુ મિલકતો		૫૪,૨૭૧.૪૪	૫૬,૨૪૦.૨૫
ચાલુ મિલકતો			
માલ સામગ્રી	૮	૬,૩૫૪.૫૦	૬,૧૩૫.૪૦
નાણાકીય મિલકતો			
ધંધા સંબંધી મળવાપત્ર	૯	૮,૫૭૨.૬૯	૭,૪૯૨.૬૮
રોકડ અને રોકડ સમાન	૧૦	૧૪૬.૪૮	૭,૩૩૪.૯૧
અન્ય બેંક સિલકો	૧૦	૭,૭૪૪.૮૩	૭,૭૧૧.૯૨
અન્ય નાણાકીય મિલકતો	૫	૧,૦૨,૮૮૬.૬૭	૮૪,૬૦૫.૨૪
ચાલુ કર મિલકતો	૬	૨૩.૨૩	૫૭૩.૬૮
અન્ય ચાલુ મલકતો	૭	૭,૨૦૦.૨૩	૫,૦૨૨.૦૦
સરવાળો - ચાલુ મિલકતો		૧,૩૩,૦૨૮.૭૩	૧,૧૮,૮૭૫.૮૩
કુલ મિલકતો		૧,૮૭,૩૦૦.૧૭	૧,૭૫,૧૧૬.૦૮
ઇકિવટી અને જવાબદારીઓ			
ઇકિવટી			
ઇકિવટી શેર મૂલ્ય	૧૧	૫૧,૩૨૩.૨૭	૫૧,૩૨૨.૫૬
અન્ય ઇકિવટી	૧૨	૭૮,૫૩૧.૭૨	૭૦,૫૨૦.૩૦
સરવાળો - ઇકિવટી		૧,૨૯,૮૫૪.૯૯	૧,૨૧,૮૪૨.૮૬
જવાબદારીઓ			
બિન ચાલુ જવાબદારીઓ			
નાણાકીય જવાબદારીઓ	૨	૩.૬૦	૪.૧૯
પટાની જવાબદારીઓ	૧૩	૧,૫૫૮.૧૧	૧,૪૨૯.૦૩
જોગવાઈઓ	૧૪	૪,૨૬૦.૧૫	૪,૧૭૮.૬૨
વિલંબિત કર જવાબદારીઓ (ચોખ્ખી)	૧૪	૫,૩૪૪.૧૪	૫,૨૭૮.૪૭
અન્ય બિનચાલુ જવાબદારીઓ	૧૫	૧૧,૧૬૬.૦૦	૧૦,૮૯૦.૩૧
સરવાળો - બિન ચાલુ જવાબદારીઓ		૧૧,૧૬૬.૦૦	૧૦,૮૯૦.૩૧
ચાલુ જવાબદારીઓ			
નાણાકીય જવાબદારીઓ			
પટાની જવાબદારીઓ	૨	૦.૬૦	૦.૬૫
ધંધા સંબંધી ચુકવવાપાત્ર	૧૬	૫૮૩.૮૪	૩,૨૮૫.૮૬
જોગવાઈઓ	૧૩	૧૨૪.૩૮	૬૨.૬૪
અન્ય ચાલુ જવાબદારીઓ	૧૫	૪૫,૫૭૦.૨૬	૩૯,૦૩૩.૭૬
સરવાળો - ચાલુ જવાબદારીઓ		૪૬,૨૭૯.૧૮	૪૨,૩૮૨.૯૧
સરવાળો - જવાબદારીઓ		૫૭,૪૪૫.૧૮	૫૩,૨૭૩.૨૧
સરવાળો - ઇકિવટી અને જવાબદારીઓ		૧,૮૭,૩૦૦.૧૭	૧,૭૫,૧૧૬.૦૮

મહત્વની હિસાબી નીતિઓ
આ સાથેની નોંધો નાણાકીય પત્રોનો અભિન્ન ભાગ બને છે.

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧૧૫

વતી
જીજ્ઞા એચ. શાહ
ભાગીદાર
સભ્ય નં. ૧૪૧૮૨૫

તારીખ: ૧૯/૧૨/૨૦૨૨
સ્થળ: અમદાવાદ
યુટીઆઈએન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

૧

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : ૫૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧)

વતી
મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર

વતી
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫

વતી
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી

વતી
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૯૨૨૨૨

તારીખ : ૧૯/૧૨/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર

**ગુજરાત પાવર કોર્પોરેશન લિ.
તા.૩૧મી માર્ચ,૨૦૨૨ના રોજ પૂરા થતાં વર્ષ માટેનું નફા અને નુકસાન ખાતું**

(રકમ લાખ રૂ. માં)

વિગતો	નોંધો	૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧મી માર્ચ
આવક			
કામગીરીમાંથી આવક	૧૭	૪૫,૩૨૪.૬૪	૨૬,૮૮૨.૬૮
અન્ય આવક	૧૮	૨૫૭.૬૪	૩૮૮.૮૩
નાણા વ્યવસ્થામાંથી આવક	૧૯	૫,૭૧૪.૦૮	૪,૮૩૮.૪૪
સરવાળો - આવક (ક)		૫૧,૨૯૬.૩૭	૩૨,૨૩૦.૯૫
ખર્ચ			
બાંધકામ અને પ્લોટ્સના વિકાસ અંગેનું ખર્ચ	૨૦	૧,૧૩૨.૮૩	-
ઉત્પાદન વિકાસ ખર્ચ	૨૧	૩૪,૦૬૫.૧૪	૧૮,૭૫૮.૬૫
કર્મચારીઓના લાભો અંગેનું ખર્ચ	૨૨	૨૮૩.૩૯	૩૨૧.૪૨
નાણા વ્યવસ્થા સંબંધી ખર્ચ	૨૩	૧૬૭.૬૬	૧,૩૩૧.૦૫
ધસારા અંગેનું ખર્ચ	૨	૧,૨૮૫.૦૩	૧,૩૧૬.૧૫
ઋણમુક્તિ અંગેનું ખર્ચ	૨	૧૪૦.૫૧	૧૦૧.૨૬
અન્ય ખર્ચ	૨૪	૧,૪૨૮.૭૫	૩,૬૩૨.૮૧
સરવાળો - ખર્ચ (ખ)		૩૮,૫૧૩.૩૦	૨૬,૪૬૨.૩૫
અપવાદરૂપ બાબતો અને કરવેરા પહેલાંનો નફો/(ખોટ) (ક - ખ)		૧૨,૭૮૩.૦૭	૫,૭૬૮.૬૧
અપવાદરૂપ બાબતો	૩ અને ૩૦(ડ)	(૨૫૦.૦૦)	-
કરવેરા પહેલાંનો નફો (ખોટ)		૧૨,૫૩૩.૦૭	૫,૭૬૮.૬૧
કરવેરા સંબંધી ખર્ચ			
ચાલુ કરવેરા		(૩,૩૨૨.૭૪)	(૧,૭૬૮.૧૮)
કરવેરા માટે ઓછી/વધુ જોગવાઈ		(૩.૭૪)	૧૬.૮૪
વિલંબિત કર	૨૬	(૮૨.૩૫)	૧૦૭.૭૪
એમએટી ક્રેડિટ એન્ટાઇટલમેન્ટ			-
આ સમયગાળા માટે કરવેરા પછીનો નફો/(ખોટ) (ગ)		૮,૧૨૪.૨૪	૪,૧૨૪.૧૧
અન્ય સર્વગ્રાહી આવક			
નફા અને ખોટ પરત્વે જેમનું પુનઃ વર્ગીકરણ કરવામાં નહીં આવે તેવી બાબતો			
એફવીટીઓસીઆઈ ઇકિવટી ખતોની વાજબી કિંમતમાં ફેરફાર		(૧,૧૧૧.૧૩)	૫,૬૨૭.૬૬
નોકરી પછીના લાભો અંગેની જવાબદારીઓની પુનઃ ગણતરી		(૨.૮૦)	(૧.૧૦)
આ બાબતો અંગેનો આવકવેરો		૦.૮૨	૦.૩૨
આ સમયગાળા માટેની સર્વગ્રાહી અન્ય આવક, કર બાદ કર્યા પછી (ઘ)		(૧,૧૧૩.૧૧)	૫,૬૨૬.૮૮
આ સમયગાળા માટેની કુલ સર્વગ્રાહી આવક (ગ+ઘ)		૮,૦૧૧.૧૩	૯,૭૫૦.૯૯
આ સમયગાળા માટેનાં નફા માટે ઇકિવટી શેર દીઠ આવક (રૂ. ૧૦૦ની મૂળ કિંમતનો)	૨૫		
મૂળભૂત (રૂ.)		૧૭.૭૮	૮.૧૫
(ઘટેલી) (રૂ.)		૧૭.૭૮	૮.૧૫

મહત્વની હિસાબી નીતિઓ
આ સાથેની નોંધો નાણાકીય પત્રોનો અભિન્ન ભાગ બને છે.

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧૫

વતી
જીઆ એચ. શાહ
ભાગીદાર
સભ્ય નં. ૧૪૧૮૨૫

તારીખ: ૧૮/૧૨/૨૦૨૨
સ્થળ: અમદાવાદ
યુ.ટી.આઈ.એન: ૨૨૧૪૧૮૨૫બીજીઈએક્સએલ૭૨૭૭

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : ૫૪૦૧૦૦ જીજે ૧૮૮૦ એસજીસી ૦૧૩૮૬૧)

વતી
મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
વતી
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન: ૦૧૮૫૪૩૧૫

વતી
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી
વતી
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૮૬૨૨૨

તારીખ : ૧૮/૧૨/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
તા. ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા વર્ષનું કેશફ્લો પત્રક

(રકમ લાખ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત
સંચાલન પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
નફા અને નુકસાન પત્રક મુજબ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો	૧૨,૫૩૩.૦૭	૫,૭૬૮.૬૧
નીચેના માટે સમાયોજન :		
અપવાદરૂપ બાબતો	૨૫૦.૦૦	-
ઘસારો, ઋણમુક્તિ, ધટાડો અને નુકસાન	૧,૪૩૫.૫૩	૧,૪૧૭.૪૨
કર્મચારી લાભોની પુનઃ ગણતરી	(૨.૮૦)	(૧.૧૦)
નાણાવ્યવસ્થા અંગેનું ખર્ચ	૧૬૭.૬૬	૧,૩૩૧.૦૫
મિલકતોનાં વેચાણ અંગેની ખોટ	૦.૨૨	૮૮૨.૭૫
ડિવિડન્ડની આવક	(૧૬૧.૦૪)	(૧૬૧.૦૦)
ઇન્ટર કોર્પોરેટ ડિપોઝીટમાંથી વ્યાજ	(૫,૭૧૪.૦૮)	(૪,૮૩૮.૪૪)
કરવેરાની ઓછી/વધુ જોગવાઈ	(૩.૭૪)	૧૬.૮૪
કાર્યકારી મૂડીમાં ફેરફાર પહેલાં ચાલુ નફો	૮,૫૦૪.૮૨	૪,૩૧૬.૨૨
કાર્યકારી મૂડીમાં ફેરફારો માટેનું સમાયોજન		
માલસામગ્રી	(૨૧૮.૧૦)	(૨,૫૬૩.૩૮)
ઘંઘાસંબંધી મળવાપાત્ર	(૧,૦૮૦.૦૧)	૧૦,૭૭૧.૪૬
અન્ય નાણાકીય મિલકતો	(૧૮,૩૮૧.૪૩)	(૨૪,૩૭૦.૬૧)
અન્ય ચાલુ મિલકતો	(૧,૩૮૪.૮૨)	૭૦૧.૮૮
જોગવાઈઓ	(૫૮૮.૨૪)	૧૬૭.૮૫
અન્ય ચાલુ જવાબદારીઓ	૬,૫૩૬.૫૦	૧૦,૨૮૨.૦૩
ઘંઘાસંબંધી ચુકવવાપાત્ર	(૨,૭૦૧.૮૧)	૨,૩૮૭.૬૦
અન્ય બેંક બેલેન્સ	(૬૦૮.૪૩)	૫.૦૨
કામગીરીમાંથી ઊભી થયેલી રોકડ	(૮,૮૨૪.૭૨)	૧,૭૦૮.૧૫
કરવેરા (ચૂકવેલા) / રિફંડ	(૨,૫૬૫.૮૨)	(૧,૫૭૭.૨૩)
સંચાલન પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ક)	(૧૨,૪૯૦.૬૫)	૧૩૦.૮૨
રોકાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
સ્થાયી મિલકતોની ખરીદી	(૨૩.૪૮)	(૨૧.૬૧)
લાંબા ગાળાનાં રોકાણો પર ડિવિડન્ડ	૧૬૧.૦૪	૧૬૧.૦૦
ઇન્ટરકોર્પોરેટ ડિપોઝીટમાંથી વ્યાજ	૫,૪૮૪.૪૫	૪,૮૧૮.૨૩
અન્ય બિન-ચાલુ મિલકતો	(૮૦૪.૮૫)	૫૪.૬૮
સ્થાયી મિલકતોનું વેચાણ	૦.૩૬	૦.૦૨
રોકાણનું વેચાણ	-	-
રોકાણ પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ખ)	૪,૮૨૭.૪૨	૫,૦૧૨.૩૨
નાણા આપવાની પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
ઇકિવટી શેર્સ ઇસ્યુ કરવાથી ઊપજ (આવક)	૦.૭૧	૮૨૦.૦૦

શેરની ફાળવણી બાકી હોય એવા શેર અરજી નાણાં	૦.૨૯	-
નાણા વ્યવસ્થા અંગેનું ખર્ચ	(૧૬૭.૬૬)	(૧૧૭.૧૪)
અનુદાન પર વ્યાજ	-	(૧,૨૧૩.૮૧)
બિન ચાલુ જવાબદારીની પ્રાપ્તિ/ (પરત ચુકવણી)	૬૫.૦૨	૩,૨૧૪.૯૨
નાણા વ્યવસ્થા અંગેની પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ગ)	(૧૦૧.૬૪)	૨,૭૦૩.૮૬
રોકડ અને રોકડ સમાનમાં ચોખ્ખો વધારો / (ઘટાડો) (ઘ) (ક + ખ + ગ)	(૭,૭૬૪.૮૬)	૭,૮૪૭.૧૦
વર્ષની શરૂઆતમાં રોકડ અને રોકડ સમાન		
હાથ પરની રોકડ	૦.૫૧	૦.૩૬
બેંક બેલેન્સ	૭,૩૩૪.૪૦	૬૩.૮૮
લિક્વિડ ડિપોઝીટ	૫૭૬.૪૨	-
	૭,૯૧૧.૩૪	૬૪.૨૪
વર્ષના અંતે રોકડ અને રોકડ સમાન		
હાથ પરની રોકડ	૦.૫૮	૦.૫૧
બેંક બેલેન્સ	૧૪૫.૮૧	૭,૩૩૪.૪૦
લિક્વિડ ડિપોઝીટ	-	૫૭૬.૪૨
	૧૪૬.૪૮	૭,૯૧૧.૩૪

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧૫

વતી
જીશા એચ. શાહ
ભાગીદાર
સભ્ય નં. ૧૪૧૮૨૫

તારીખ: ૧૯/૧૨/૨૦૨૨
સ્થળ: અમદાવાદ
પુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : ૫૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧)

વતી
મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
વતી
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫

વતી
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી
વતી
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૯૩૯૬૨૨૨

તારીખ : ૧૯/૧૨/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિ.
૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતિત સમયગાળા માટે ઇકિવટીમાં ફેરફાર અંગેનું પત્રક

ક. ઇકિવટી શેરમૂડી

વિગત	શેરની સંખ્યા	રકમ (રૂ. લાખમાં)
ઇસ્યુ થયેલ, સબસ્ક્રાઇબ થયેલ અને ભરપાઈ થયેલ શેરમૂડી રૂ.૧૦૦નો એક એવા પૂરેપૂરી ભરપાઈ થયેલા ઇકિવટી શેર્સ ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ	૫,૦૫,૦૨,૫૬૮	૫૦,૫૦૨.૫૬
ઇકિવટી શેર મૂડીમાં ફેરફારો ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ	૮,૨૦,૦૦૦ ૫,૧૩,૨૨,૫૬૮	૮૨૦.૦૦ ૫૧,૩૨૨.૫૬
અગાઉના સામયની ભૂલને કારણે ઇકિવટી શેર મૂડીમાં ફેરફારો ચાલુ અહેવાલના સમયગાળાની શરૂઆતમાં પુનઃ જણાવવામાં આવેલી સિલક ઇકિવટી શેર મૂડીમાં ફેરફારો ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ મુજબ	- - ૭૧૦ ૫,૧૩,૨૩,૨૭૮	- - ૦.૭૧ ૫૧,૩૨૩.૨૭

ખ. અન્ય ઇકિવટી

(રકમ લાખ રૂ. માં)

વિગત	અનામત અને પૂરાંત			શેરની ફાળવણી બાકી હોય એવાં નાણાં	અન્ય સર્વગ્રાહી આવક થકી ઇકિવટી આવક	કુલ ઇકિવટી
	મૂડી અનામત	સામાન્ય અનામત	જાળવી રાખેલ આવક			
૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ સિલક	-	૩૭.૭૬	૫૬,૪૫૪.૩૪	-	૪,૨૭૭.૨૨	૬૦,૭૬૮.૩૨
અહેવાલના સમયગાળાના આરંભે પુનઃ જણાવવામાં આવેલી સિલક	-	૩૭.૭૬	૫૬,૪૫૪.૩૪	-	૪,૨૭૭.૨૨	૬૦,૭૬૮.૩૨
વર્ષ માટેનો નફો	-	-	૪,૧૨૪.૧૧	-	-	૪,૧૨૪.૧૧
વર્ષ માટેની અન્ય સર્વગ્રાહી આવક	-	-	-	-	૫,૬૨૬.૮૮	૫,૬૨૬.૮૮
વર્ષ માટેની કુલ સર્વગ્રાહી આવક	-	૩૭.૭૬	૬૦,૫૭૮.૪૫	-	૮,૯૦૪.૧૦	૭૦,૫૨૦.૩૦
ઉમેરો : શેર મૂડી પેટે ફાળો	-	-	-	૮૨૦.૦૦	-	૮૨૦.૦૦
ઇકિવટી શેર્સ ઇસ્યુ કર્યાં	-	-	-	(૮૨૦.૦૦)	-	(૮૨૦.૦૦)
વર્ષ દરમિયાન વપરાશ	-	-	-	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ સિલક	-	૩૭.૭૬	૬૦,૫૭૮.૪૫	-	૮,૯૦૪.૧૦	૭૦,૫૨૦.૩૦
અહેવાલના સમયગાળાના આરંભે પુનઃ જણાવવામાં આવેલી સિલક	-	૩૭.૭૬	૬૦,૫૭૮.૪૫	-	૮,૯૦૪.૧૦	૭૦,૫૨૦.૩૦
વર્ષ માટેનો નફો	-	-	૮,૧૨૪.૨૪	-	-	૮,૧૨૪.૨૪
વર્ષ માટેની અન્ય સર્વગ્રાહી આવક	-	-	-	-	(૧,૧૧૩.૧૧)	(૧,૧૧૩.૧૧)
વર્ષ માટેની કુલ સર્વગ્રાહી આવક	-	૩૭.૭૬	૬૮,૭૦૨.૬૯	-	૮,૭૯૦.૯૯	૭૮,૫૩૧.૪૩
ઉમેરો : શેર મૂડી પેટે ફાળો	-	-	-	૧.૦૦	-	૧.૦૦
ઇકિવટી શેર્સ ઇસ્યુ કર્યાં	-	-	-	(૦.૭૧)	-	(૦.૭૧)
વર્ષ દરમિયાન વપરાશ	-	-	-	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ બેલેન્સ	-	૩૭.૭૬	૬૮,૭૦૨.૬૯	૦.૨૯	૮,૭૯૦.૯૯	૭૮,૫૩૧.૭૨

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧૧૧

વતી
જીણા એચ. શાહ
ભાગીદાર
સભ્ય નં. ૧૪૧૮૨૫

તારીખ: ૧૮/૧૨/૨૦૨૨
સ્થળ: અમદાવાદ
યુટીઆઇએન: ૨૨૧૪૧૮૨૫બીજીઈએકસએલ૭૨૭૭

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઇએન : ૫૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧)

વતી
મેહુલ જી. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
વતી
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઇએન : ૦૧૮૫૪૩૧૫

વતી
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી
વતી
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઇએન: ૦૮૩૯૬૨૨૨

તારીખ : ૧૮/૧૨/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ

૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતિત વર્ષ માટેના નાણાકીય પત્રકો અંગેની નોંધો

૧. મહત્ત્વની હિસાબી નીતિઓ અને પદ્ધતિઓ અંગે નિવેદન

ક. સામાન્ય માહિતી

આ નાણાકીય પત્રકોમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (કંપની) જે કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ રચાયેલી એક સરકારી કંપની છે, તેનાં નાણાકીય પત્રકોનો સમાવેશ થાય છે.

આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છોડે માળ, બ્લોક નં. ૬ અને ૮, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૧૧ ખાતે આવેલી છે. આ કંપની વીજ ઉત્પાદનની કામગીરી કરે છે અને તેને સોલાર પાર્કના વિકાસ માટે ગુજરાત સરકારે નોડલ એજન્સી તરીકે પદનામિત કરી છે.

ખ. મહત્ત્વની હિસાબી નીતિઓ

ખ.૧ ભારતીય હિસાબી ધોરણોના અનુપાલન અંગેનું પત્રક

આ સ્ટેન્ડઅલોન નાણાકીય પત્રકો કંપની અધિનિયમ-૨૦૧૩ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જાહેર કરવામાં આવેલા નિયમો સહિત, તે અધિનિયમની કલમ -૧૩૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ભારતીય હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યાં છે.

ખ. ૨ ઐતિહાસિક ખર્ચ- પરંપરા

નીચેની બાબતો કે જેમાં વાજબી કિંમતો સંબંધિત ભારતીય હિસાબી ધોરણોની આવશ્યકતા મુજબ તૈયાર કરવામાં આવી છે તે સિવાય આ નાણાકીય પત્રકો ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો તેમજ કંપની અધિનિયમ, ૨૦૧૩ની સંબંધિત જોગવાઈઓ અને તે હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ભારતીય હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવામાં આવે છે.

- વાજબી કિંમતે આપવામાં આવેલી કેટલીક નાણાકીય મિલકતો અને જવાબદારીઓ .

- નિર્ધારિત લાભ સંબંધી યોજનાઓ - વાજબી કિંમતે માપવામાં આવેલી યોજનાઓ

અગાઉના સમયગાળાની / અગાઉથી ચુકવેલ બાબતો :

વ્યવસ્થાપક મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલી અગાઉના સમયગાળાની બાબતો સંબંધિત હિસાબી સમયગાળાઓને પુનઃ જણાવીને પશ્ચાતવર્તી અસરથી હિસાબે લેવામાં આવે છે.

ખ. ૩ અંદાજો અને નિર્ણયો (જજમેન્ટ્સ)નો ઉપયોગ આ નાણાકીય પત્રકો ભારતીય હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવા અને રજૂ કરવામાં આવ્યાં છે. ભારતીય હિસાબી ધોરણો મુજબ વ્યવસ્થાપક મંડળે અંદાજો અને ધારણાઓ બાંધવા અને નિર્ણયો લેવા જરૂરી છે. જેની અસર અહેવાલમાં જણાવવામાં આવેલી મિલકતો અને જવાબદારીઓ, આવક અને ખર્ચ તેમજ આકસ્મિક જવાબદારીઓની જાહેર કરવામાં આવેલી રકમો પર પડે છે. આ અંદાજો અને ધારણાઓ, નાણાકીય પત્રકો તૈયાર કરવાની તારીખે સંબંધિત હકીકતો અને સંજોગોના વ્યવસ્થાપક મંડળે કરેલા વિશ્લેષણ પર આધારિત છે.

અંદાજો અને ધારણાઓની નિરંતર ધોરણે સમીક્ષા કરવામાં આવે છે. હિસાબી અંદાજોનું પુનર્વિલોકન ધારણાના આધારે હિસાબે લેવામાં આવે છે.

આ નીતિ એ બાબતોનું વિહંગાવલોકન પૂરું પાડે છે જેમાં નિર્ણયો કરવાના હોય છે અને જેમાં મૂળ આકારણી કરતાં અંદાજો અને ધારણાઓ જુદાં પડવાના કારણે બાબતોનું પ્રત્યક્ષ સમાયોજન કરવાની સંભાવના રહે છે. આવા દરેક અંદાજો અને નિર્ણયોની વિગતવાર માહિતીનો સમાવેશ, નાણાકીય પત્રકોમાં અસર પામેલી સંબંધિત બાબત અંગેની ગણતરી વિશેની માહિતી સાથે સંબંધિત નોંધોમાં પરિણામવાનું નોંધપાત્ર જોખમ ધરાવતી ધારણાઓ, અંદાજો અને અનિશ્ચિતતાઓ વિશેની માહિતીઓ નીચેની નોંધોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

- ચાલુ/વિલંબિત કર જવાબદારીઓ

- કર્મચારીઓના નિર્ધારિત લાભોની જવાબદારીની માપણી

- જોગવાઈઓ અને આકસ્મિક જવાબદારીઓ

- રોકાણોની યોગ્ય કિંમત નક્કી કરવી.

યોગ્ય કિંમતોની માપણી અંગેના સિદ્ધાંતો મહત્ત્વની હિસાબી નીતિઓની નોંધ-(ત)માં આપવામાં આવેલ/આવી છે.

ખ.૪ ચાલુ વિરુદ્ધ બિન-ચાલુ વર્ગીકરણ

કંપની ભારતીય હિસાબી ધોરણોનું પાલન કરતી, કંપની અધિનિયમ, ૨૦૧૩ની અનુસૂચિ-૩ની આવશ્યકતાઓ મુજબ, ચાલુ/બિન ચાલુ વર્ગીકરણના આધારે પાકા સરવૈયામાં મિલકતો અને જવાબદારીઓ દર્શાવે છે.

ગ. કરજસંબંધી ખર્ચ

પાત્ર (કવોલીફાઇંગ) મિલકતોના સંપાદન અથવા બાંધકામ દરમિયાન મેળવવાના કરજ અંગેનું ખર્ચ, મિલકતોના ખર્ચના ભાગ તરીકે મૂડીકૃત કરવામાં આવે છે. પાત્ર મિલકત એ એવી મિલકત છે જે તેના ઇચ્છિત ઉપયોગ માટે તૈયાર થવામાં ઘણો સમય લે છે. કરજસંબંધી અન્ય તમામ ખર્ચ મહેસૂલ ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે.

ઘ. સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રીની તમામ બાબતો સંપાદન/ બાંધકામના ઐતિહાસિક ખર્ચ (વસૂલાતપાત્ર કરવેરા પછીના ચોખ્ખા)માંથી સંચિત ઘસારો અને નુકસાનની રકમ બાદ કરીને દર્શાવવામાં આવે છે.

ઐતિહાસિક ખર્ચમાં સંપાદન સાથે પ્રત્યક્ષરીતે જોડાયેલું હોય એવાં ખર્ચનો તેમજ બાંધકામ/ વસ્તુઓના ઇન્સ્ટોલેશન (ગોઠવણી)ના ખર્ચનો સમાવેશ થાય છે. પાછળથી થનાર ખર્ચને મિલકતની ચાલુ રકમમાં ત્યારે જ ઉમેરવામાં અથવા એક અલગ મિલકત તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે તે બાબત જોડાયેલ ભાવિ આર્થિક લાભો કંપનીને મળવાની સંભાવના હોય અને તે બાબતનું ખર્ચ વિશ્વસનીય રીતે માપી શકાય તેમ હોય. અન્ય તમામ મારામત અને નિભાવનું ખર્ચ, તે જે દરમિયાન કરવામાં આવ્યું હોય તે અહેવાલના સમયગાળાના નફા અને નુકસાન ખાતામાં ઉધારવામાં આવે છે. મિલકતોના પ્રારંભિક સંપાદન બાદ પુનર્વસન અને પુનઃસ્થાપન અંગે કરવામાં આવેલું ખર્ચ, સંબંધિત વર્ષના નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

ભારતીય હિસાબી ધોરણોમાં સંક્રાંતિ

ભારતીય હિસાબી ધોરણોમાં સંક્રાંતિ થતાં કંપનીએ, અગાઉના જીએએપી દ્વારા માપવામાં આવેલાં, ૧ એપ્રિલ, ૨૦૧૫ના રોજ ધ્યાનમાં લેવામાં આવેલાં, ચાલુ મૂડીકામો સહિતનાં તમામ સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રીની ચાલુ કિંમત સાથે આગળ વધવાનું અને તે ચાલુ કિંમતને સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રીની માની લીધેલી કિંમત તરીકે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું છે.

કોઈ મિલકતોનો ઉપયોગ કર્યા બાદ ‘ડિકમીશનીંગ’ કરવા માટેના અપેક્ષિત ખર્ચની વર્તમાન કિંમત, જોગવાઈને ધ્યાનમાં લેવાના માપદંડો સંતોષતા હોય તો, સંબંધિત મિલકતના ખર્ચમાં સામેલ કરવામાં આવે છે.

ચાલુ મૂડી કામોમાં, જે હજુ કાર્યરત બનાવવાની છે એવી મિલકતોના સંપાદન/ બાંધકામને લગતા સીધા ખર્ચનો સમાવેશ થાય છે.

મિલકત, પ્લાન્ટ અથવા સાધનસામગ્રીની કોઈ બાબત, સંબંધિત મિલકતનો નિકાલ કરવામાં આવે ત્યારે અથવા તેના ચાલુ ઉપયોગમાંથી કોઈ ભાવિ આર્થિક લાભ મળવાની અપેક્ષા ન રહે ત્યારે ધ્યાને (હિસાબમાં) લેવાનું બંધ કરવામાં આવે છે. મિલકત, પ્લાન્ટ અને સાધન સામગ્રીની કોઈપણ બાબત નફા અને નુકસાનના પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે.

મિલકત, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટનો ઘસારો, કંપનીની બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સંબંધિત પરિપત્રો સાથે કંપની અધિનિયમ, ૨૦૧૩ને વાંચતા, તેની અનુસૂચિ-૨માં નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ પૂરો પાડવામાં આવે છે. ઘસારા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સ્ટ્રેઇટ લાઇન મેથડ (SLM) છે. વર્ષ દરમિયાન સંપાદિત/ નિકાલ કરવામાં આવેલી મિલકતો અંગેનો ઘસારો ભાગે પડતા ધોરણે પૂરો પાડવામાં આવે છે.

મિલકતોની અંદાજિત ઉપયોગી આવરદા નીચે મુજબ છે.

વિગતો	ઉપયોગી આવરદા
૧. મકાન	૩ થી ૬૦ વર્ષ
૨. પ્લાન્ટ અને મશીનરી	૫ થી ૪૦ વર્ષ
૩. વિન્ડમીલ	૨૨ વર્ષ
૪. સોલાર પાર્ક	૨૫ વર્ષ
૫. ફર્નિચર અને જડાણો	૮થી ૧૦ વર્ષ
૬. વાહનો	૮ વર્ષ
૭. કોમ્પ્યુટર	૩ વર્ષ
૮. કચેરી સાધન સામગ્રી	૫ થી ૩૫ વર્ષ

ચ. ઉત્પનન વિકાસ મિલકત

ઉત્પનન વિકાસ મિલકતમાં સામાન્ય રીતે લિગનાઇટની ખાણો માટેના પ્રારંભિક ખર્ચ અને ભવિષ્યમાં તે કામગીરી બંધ કરવા માટેના અંદાજિત ખર્ચનો સમાવેશ થાય છે. ઉત્પનન કામગીરી બંધ કરવામાં સામાન્ય રીતે સ્થળને પૂર્વવત્ બનાવવાનો સમાવેશ થાય છે. ઉત્પનન કામગીરી બંધ કરવા અંગેની જોગવાઈ જ્યારે કંપનીના શીરે ખાણોને પૂર્વવત્ બનાવવાની, સુવિધાઓ ડિસમેન્ટલ અથવા દૂર કરવાની અથવા કોઈ મિલકત અથવા પ્લાન્ટ અને સાધનસામગ્રીની કોઈ ચીજવસ્તુ દૂર કરવાની અને તે જ્યાં આવેલી હોય તે સ્થળને પૂર્વવત્ બનાવવાની કાનૂની અથવા સર્જનાત્મક જવાબદારી હોય ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે. ખાણોને અને સંલગ્ન સુવિધાઓને ડિસમેન્ટલ કરવા અને પૂર્વવત્ બનાવવા અંગેના ખર્ચની સંપૂર્ણ આખરી જવાબદારી સંબંધિત ઉત્પનન વિકાસ મિલકતમાં ધ્યાને લેવામાં આવે છે.

આ તબક્કે, કંપનીએ જેમનો પરામર્શ કર્યો છે તે ઉત્પનન નિષ્ણાતોના મતે ઉત્પનન કામગીરી બંધ કરવાની જવાબદારીનો અંદાજ કાઢવો શક્ય નથી અને તેથી એવું નક્કી કરવામાં આવે છે કે “ઓવર બર્ડન” દૂર કરવાની પ્રક્રિયા, જ્યારે તેનો વાજબી અંદાજ કાઢવાનું શક્ય હશે ત્યારે ઉત્પનન વિકાસ મિલકતનો ભાગ બનશે.

ઉત્પનન વિકાસ મિલકત સામાન્ય રીતે વર્ષ દરમિયાન ખરેખર કાઢવામાં આવેલા લિગનાઇટના જથ્થાના આધારે અથવા વાર્ષિક ધોરણે નક્કી કરેલા જથ્થાના આધારે ઋણમુક્ત કરવામાં આવે છે. આમ છતાં, ઋણમુક્તિની પદ્ધતિ અંગે એકવાર ખરીદનાર અને વેચનાર વચ્ચે એકવાર સંમતિ સંધાય પછી ખાણની આવરદાના સમયગાળાપર્યંત તે નિરંતર ધોરણે લાગુ પાડવામાં આવે છે.

અમૂર્ત મિલકતો

અમૂર્ત મિલકતો (કોઈ કરવસૂલ કરવાનો હોય તો તે વસૂલ કર્યા બાદ ચોખ્ખા) ખર્ચ, પ્રારંભિક ઓળખ થયેથી માપવામાં આવે છે. ત્યારબાદ, અમૂર્ત મિલકતો ખર્ચમાંથી સંચિત ઋણમુક્તિ અને નુકસાની બાદ કરીને હિસાબે લેવામાં આવે છે.

છ. સરકારી અનુદાનો

સરકારના અનુદાનોને, તે મળવાની યોગ્ય ખાતરી હોય અને કંપની તેની સાથે જોડાયેલી તમામ શરતો પૂરી કરશે એવી ખાતરી હોય ત્યારે તેની વાજબી કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે.

આવકને લગતા સરકારી અનુદાનો તરત ધ્યાનમાં લેવામાં આવતાં નથી. પરંતુ તેના થકી જે ખર્ચ કરવાનો ઇરાદો હોય તે ખર્ચ કરવા માટે જરૂરી સમયગાળા દરમિયાન નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે અને અન્ય આવકની અંદર રજૂ કરવામાં આવે છે.

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રી અથવા રોકાણ સંબંધી સંપત્તિની ખરીદી અથવા બાંધકામની બાબતોનાં અનુદાનોને વિલંબિત આવક તરીકે બિન-નાણાકીય જવાબદારીઓ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અને સંબંધિત મિલકતોની અપેક્ષિત આવરદાપર્યંત સુરેખ (સીધી લીટીના) ધોરણો નફા અને નુકસાન ખાતે જમા લેવામાં આવે છે અને અન્ય આવકોની અંદર રજૂ કરવામાં આવે છે.

મહેસૂલ સહાયકીના સ્વરૂપમાં નાણાકીય સહાય સંબંધિત ખર્ચમાંથી બાદ કરવામાં આવે છે. શરતી ધોરણે આપવામાં આવેલાં સરકારી અનુદાનો સંબંધિત ખર્ચ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને હજુ કરવાનાં બાકી હોય એવાં કામો/ કામના ભાગો માટે ઉપયોગમાં લેવા માટે ખાતામાં બાકી રહેલી સિલક અન્ય ચાલુ જવાબદારી તરીકે દર્શાવવામાં આવે છે.

જ. બિન-નાણાકીય મિલકતોની નુકસાની (ઈમ્પેરમેન્ટ)

કોઈપણ મિલકતની ચાલુ કિંમત (કાર્યરત રાખવાની કિંમત) તેની વસૂલાતપાત્ર કિંમત કરતા વધી જાય ત્યારે તેને નુકસાની મિલકત તરીકે ગણવામાં આવે છે. આવી નુકસાની અંગેની ખોટ, તે મિલકતને જે વર્ષે નુકસાની મિલકત તરીકે પારખવામાં આવે તે વર્ષે નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. વસૂલાતપાત્ર રકમના અંદાજમાં ફેરફાર હોય તો, અગાઉના હિસાબી સમયગાળામાં ધ્યાનમાં લેવામાં આવેલી નુકસાની સંબંધી ખોટ ઉલટાવવામાં (‘રિવર્સ’ કરવામાં) આવે છે. અમૂર્ત મિલકતોની નુકસાની સાયમિક ધોરણે ચકાસવામાં આવશે.

ઝ. પટાઓ

કોઈ વ્યવસ્થા, તે પટો છે (અથવા તેમાં પટાનો સમાવેશ થાય છે) કે નહીં તે બાબત, પટાની શરૂઆતના સમયે તે વ્યવસ્થાના તથ્યોના આધારે નક્કી થાય છે. કોઈ ચોક્કસ મિલકત અથવા મિલકતોનો ઉપયોગ કોઈ વ્યવસ્થા પર આધારિત હોય અને તે વ્યવસ્થામાં સ્પષ્ટ રીતે કોઈ અધિકાર નિર્દિષ્ટ કરવામાં ન આવ્યો હોવા છતાં તે વ્યવસ્થા સંતોષવાથી તે મિલકત અથવા મિલકતોનો ઉપયોગ કરવાનો અધિકાર દર્શાવતી (સૂચવતી) હોય તો તે વ્યવસ્થા એ પટો છે (અથવા તેમાં પટાનો સમાવેશ થાય છે).

પટાનો હિસાબ

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે, કંપનીઝ (ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ) એમેન્ડમેન્ટ રૂલ્સ ૨૦૧૯ અને કંપનીઝ (ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ) સેકન્ડ એમેન્ડમેન્ટ રૂલ્સ થકી હાલના ભારતીય હિસાબી ધોરણ ૧૭ “ભાડાપટાઓ” અને તેના અન્ય અર્થઘટનોના સ્થાને ભારતીય હિસાબી ધોરણ

૧૧૬ “ભાડાપટાઓ” નિર્દિષ્ટ કર્યું છે. ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ “પટે આપનાર અને પટે લેનાર બંને માટે ભાડાપટાની સ્વીકૃતિ, માપણી, રજૂઆત અને જાહેરાત અંગેના સિદ્ધાંતો નિર્ધારિત કરે છે. તે ભાડાપટાઓ માટે એકલ, સરવૈયા ઉપરનું હિસાબી મોડલ પ્રસ્તુત કરે છે.

આ નવા ધોરણને અપનાવવાને પરિણામે કંપની, શરૂઆતની અરજીની તારીખથી ૧૨ મહિનાથી ઓછી ભાડાપટાની મુદત બાકી રહી હોય એવા ભાડાપટા સિવાયના તમામ અગાઉથી ચાલતાં ભાડાપટાના સંબંધમાં મિલકતના ઉપયોગના અધિકાર અને ભાડાપટા સંબંધિત અન્ય જવાબદારી ધ્યાનમાં લેતી થઈ છે.

આ કંપનીએ પહેલી એપ્રિલ ૨૦૧૯થી પશ્ચાદ્વર્તી ધોરણે, સુધારેલો અભિગમ અપનાવીને ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ અપનાવ્યું છે અને ૨૦૧૮ના અહેવાલના સમયગાળા માટેની તુલનાત્મક બાબતો પુનઃ દર્શાવી નથી. કંપનીએ શરૂઆતની અરજીની તારીખના રોજ મુજબ, ભારિત સરેરાશ વધતા કરજ દરનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ કરવામાં આવેલી ભાડાપટાની બાકીની ચુકવણીને હાલની કિંમતે ભાડાપટાની જવાબદારીની માપણી કરી છે અને મિલકતની વપરાશના અધિકારની માપણી, ભાડાપટાની જવાબદારી જેટલી રકમના દરે કરવામાં આવી છે, જેનું સમાયોજન, શરૂઆતની અરજીની તારીખની તરત પહેલાના સરવૈયામાં ધ્યાનમાં લેવામાં આવેલા, તે ભાડાપટાના સંબંધમાં અગાઉથી કરવામાં આવેલી અથવા ભાડાપટાની ઉપાર્જિત ચૂકવણીઓની રકમથી કરવામાં આવ્યું છે.

પટે લેનાર તરીકે કંપની

કંપની એ ધ્યાનમાં લે છે કે કોઈ કોન્ટ્રાક્ટ ભાડાપટો છે કે તેમાં ભાડાપટાનો સમાવેશ થાય છે. ભાડાપટાની વ્યાખ્યા "કોઈ અવેજના બદલામાં અમુક સમયગાળા માટે સંબંધિત મિલકતનો ઉપયોગ કરવા માટેનો અધિકાર આપતો કરાર અથવા કરાર નો કોઈ ભાગ" કરવામાં આવે છે. આ વ્યાખ્યા લાગુ પાડવા માટે કંપની એ વાતનું મૂલ્યાંકન કરે છે કે કરાર ત્રણ મુખ્ય બાબતો સંતોષે છે કે કેમ, આ બાબતો છે:

કરારમાં કોઈ નિશ્ચિત મિલકતનો સમાવેશ થાય છે કે કેમ, જે કરારમાં સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી હોય અથવા કંપનીને તે મિલકત ઉપલબ્ધ બનાવવામાં આવે ત્યારે તેનો ઉલ્લેખ કરીને તેને પરોક્ષ રીતે નિર્દિષ્ટ કરવામાં આવી હોય.

કંપની કરારની નિર્ધારિત સંભાવનાની અંદર રહીને તેના અધિકારોને ધ્યાનમાં લેતા, ઉપયોગના સમગ્ર સમયગાળા દરમિયાન, નિર્ધારિત કરવામાં આવેલી મિલકતના ઉપયોગમાંથી તમામ આર્થિક લાભો મહદંશે પ્રાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે કે કેમ.

વપરાશના સમગ્ર સમયગાળા દરમિયાન, નિર્ધારિત કરવામાં આવેલી મિલકતનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવાનો અધિકાર કંપની ધરાવે છે કે કેમ. કંપની એ વાતનું મૂલ્યાંકન કરે છે કે ઉપયોગના સમગ્ર સમયગાળા દરમિયાન તે મિલકત "કેવી રીતે અને કયા હેતુ માટે વાપરવી" તેનો નિર્દેશ કરવાનો અધિકાર કંપની ધરાવે છે કે કેમ.

માપણી અને સ્વીકૃતિ

ભાડાપટાના પ્રારંભની તારીખે, કંપની મિલકતો અને જવાબદારીઓના પત્રકમાં મિલકતનો ઉપયોગ કરવાના અધિકાર અને ભાડાપટાની જવાબદારી ધ્યાનમાં લે છે. મિલકતનો ઉપયોગ કરવાના અધિકારની માપણી પડતર કિંમતે કરવામાં આવે છે જેમાં આ જવાબદારીનું પ્રારંભિક માપ, કંપની દ્વારા કરવામાં આવેલું કોઈ પ્રારંભિક પ્રત્યક્ષ ખર્ચ, ભાડાપટો પૂર્ણ થયેથી મિલકત ઉતારી લેવા અને દૂર કરવા માટે કરવાના કોઈ ખર્ચનો અંદાજ અને ભાડાપટાના પ્રારંભની તારીખ પહેલાં કરવામાં આવેલી ભાડાપટા અંગેની કોઈ ચુકવણી (પ્રાપ્ત થયેલા કોઈપણ પ્રોત્સાહનોને બાદ કરતા ચોખ્ખી)નો સમાવેશ થાય છે.

કંપની ભાડાપટાના પ્રારંભની તારીખથી લઈને મિલકતના ઉપયોગના અધિકારના ઉપયોગની આવરદાના અંત અથવા ભાડાપટાની મુદતના અંત, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી, મિલકતનો ઉપયોગ કરવાના અધિકાર (રાઈટ ઓફ યુસ એસેટ્સ)નો સીધી રેખાના ધોરણે ઘસારો ગણે છે. જ્યારે પણ મિલકતનો ઉપયોગ કરવાના અધિકાર સંબંધે કોઈ નુકસાન થયું હોવાનો સંકેત મળ્યો હોય ત્યારે કંપની તેની આકારણી પણ કરે છે.

પ્રારંભની તારીખે કંપની ભાડાપટાની જવાબદારીની ગણતરી, તે તારીખે વણચૂકવાયેલી ભાડાપટાની ચુકવણીઓની વર્તમાન કિંમતે કરે છે જે, ભાડાપટામાં વ્યાજદર પરોક્ષ રીતે સામેલ હોય અને તે તત્કાલ ઉપલબ્ધ હોય તો, તે દર અથવા કંપનીના કરજ લેવા માટેના રેટનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ કરવામાં આવેલી હોય છે. પ્રારંભિક ગણતરી બાદ જવાબદારી, કરવામાં આવેલી ચૂકવણીના સંદર્ભમાં ઘટતી જશે અને વ્યાજના સંદર્ભમાં વધતી જશે. કોઈપણ પુનઃ મૂલ્યાંકન કે ફેરફાર દર્શાવવા, અથવા વાસ્તવમાં કોઈ નિયત ચૂકવણીમાં ફેરફાર થયો હોય તો તે દર્શાવવા માટે તેની ગણતરી કરવામાં આવે છે.

પટાની જવાબદારીની પુનઃમાપણી કરવામાં આવે ત્યારે, તેને સુસંગત સમાયોજન ઉપયોગ કરવાના અધિકારમાં દર્શાવવામાં આવે છે, અથવા ઉપયોગ કરવાનો અધિકાર ઘટીને શૂન્ય બની ચૂક્યો હોય તો, નફા અને નુકસાનમાં દર્શાવવામાં આવે છે.

વ્યવહારુ રીતે અનુકૂળ બાબતોનો ઉપયોગ કરીને, કંપનીએ ટૂંકાગાળાની અને નીચા મૂલ્યવાળી મિલકતો હિસાબે લેવાનું પસંદ કર્યું છે. મિલકત વાપરવાનો અધિકાર અને પોતાની જવાબદારી ધ્યાને લેવાને બદલે, આ અંગેની ચુકવણી, પટાની મુદત દરમિયાન સીધી રેખાના ધોરણે નફા અથવા નુકસાનમાં ખર્ચ તરીકે ધ્યાને લેવામાં આવી છે.

પટે આપનાર તરીકે કંપની

ભાડાપટાના ઉદભવ વખતે આ જૂથ તેના દરેક પટાને કાર્યરત પટા તરીકે અથવા નાણાકીય પટા તરીકે વર્ગીકૃત કરે છે. કંપની કાર્યરત પટા હેઠળ પ્રાપ્ત થયેલી ચૂકવણીઓને, પટાની મુદત દરમિયાન સીધી રેખાના ધોરણે આવક તરીકે ધ્યાનમાં લે છે. નાણાકીય પટાના કિસ્સામાં, નાણાં વ્યવસ્થાસંબંધી આવક મુદત દરમિયાન, પટે આપનારે પટામાં કરેલા ચોખ્ખા રોકાણ ઉપરના મળતરના અચળ સામયિક દર દર્શાવતી પેટર્નના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે. કંપની જ્યારે પટે આપનાર તરીકે વચોટિયા તરીકે હોય ત્યારે તે મુખ્ય પટામાં અને ગૌણ પટામાં તેના વ્યાજને અલગ-અલગ ધ્યાનમાં લે છે. તે ગૌણ પટાના પટા વર્ગીકરણને મુખ્ય પટામાંથી ઊભા થતા, મિલકતને વાપરવાના સંદર્ભમાં, નહીં કે નિર્ધારિત મિલકતના સંદર્ભમાં, આકારે છે. મુખ્ય પટો ટૂંકી મુદતનો પટો હોય, જેને જૂથ ઉપર જણાવેલ મુક્તિ લાગુ પાડતું હોય તો, આવા ગૌણ પટાને તે કાર્યરત પટા તરીકે વર્ગીકૃત કરે છે.

૨. વેચાણ અને બંધ કરવામાં આવેલી કામગીરીઓ માટે ધારણ કરવામાં આવેલી બિન-ચાલુ મિલકતો

બિન-ચાલુ મિલકતોની ચાલુ રકમ, તેનો ઉપયોગ ચાલુ રાખીને વસૂલ કરવાને બદલે વેચાણ કરીને વસૂલ કરવાની હશે અને વેચાણની સંભાવના વધુ હશે તો તેને વેચાણ માટે ધારણ કરવામાં આવેલી મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. તેની માપણી તેમની ચાલુ કિંમત અને વાજબી કિંમતમાંથી વેચાણ સંબંધી ખર્ચ બાદ કર્યા બાદની કિંમત, એ બે માંથી જે ઓછી હોય તે કિંમતે કરવામાં આવે છે, સિવાય કે આ આવશ્યકતામાંથી જેમને ખાસ મુક્તિ આપવામાં આવી હોય એવી મિલકતો હોય જેમકે વિલંબિત કર સંબંધી મિલકતો, કર્મચારીઓના લાભોમાંથી ઊભી થતી મિલકતો, નાણાકીય મિલકતો અને વીમા કરારો હેઠળના કરારગત અધિકારો.

બિન-ચાલુ મિલકતોને વેચાણ માટે ધારણ કરી રાખવામાં આવી હોય ત્યારે તેમના પર ઘસારો અથવા ઋણમુક્તિ પૂરાં પાડવામાં આવતાં નથી. વેચાણ માટે ધારણ કરી રાખવામાં આવેલી બિન-ચાલુ મિલકતોને પાકા સરવૈયામાં અન્ય મિલકતોથી અલગ રીતે રજૂ કરવામાં આવે છે.

બંધ કરવામાં આવેલી કામગીરી એ કંપનીનો એવો ઘટક છે, જેને નિકાલ કરેલી અથવા વેચાણ માટે ધારણ કરી રાખવામાં આવેલી મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી હોય અને જે અલગ પ્રકારનો મહત્ત્વનો ઘંધો અથવા કામગીરીનો ભૌગોલિક વિસ્તાર દર્શાવતો હોય અને તે ઘટક આવા મુખ્ય ઘંધા અથવા કામગીરીનો નિકાલ કરવા માટેની એકલ સંકલિત યોજનાનો ભાગ છે અથવા પુનઃવેચાણ (રીસેલ) કરવાના લક્ષ સાથે ખાસ રીતે સંપાદિત કરવામાં આવેલ ગૌણ શાખા (સબસીડીયરી) છે. બંધ કરવામાં આવેલી કામગીરીઓનાં પરિણામો નફા અને નુકસાન ખાતમાં અલગ રીતે રજૂ કરવામાં આવે છે.

૬. નાણાકીય ખતો

નાણાકીય ખત એટલે એવો કોઈપણ કરાર જે એક સંસ્થા (એન્ટીટી) માટે નાણાકીય મિલકત ઊભી કરતો હોય અને બીજી સંસ્થા માટે નાણાકીય જવાબદારી અથવા ઇકિવટી ખત ઊભું કરતો હોય.

૬. નાણાકીય મિલકતો

પ્રારંભિક ઓળખ

કંપની નાણાકીય ખતની કરારગત જોગવાઈઓનું પાલન કરવા માટે પક્ષકાર બને ત્યારે પાકા સરવૈયામાં નાણાકીય મિલકત ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્રારંભિક માપણી

પ્રારંભિક ઓળખ વખતે કંપની (વાજબી કિંમતે માપવામાં ન આવેલી) નાણાકીય મિલકતની માપણી તેની વાજબી કિંમતમાં, તે નાણાકીય મિલકત સંપાદિત અથવા ઇસ્યુ કરવા માટે થયેલા પ્રત્યક્ષ લેવડ-દેવડ ખર્ચને ઉમેરી અથવા બાદ કરીને નફા અથવા નુકસાન થકી કરે છે.

પાછળથી કરવામાં આવતી માપણી

પાછળથી કરવામાં આવતી માપણી માટે નાણાકીય મિલકતોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે.

ક. ઋણમુક્તિની કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો;

ખ. નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો (એફવીટીપીએલ); અને

ગ. અન્ય સર્વગ્રાહી આવક થકી વાજબી કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો (એફવીઓસીઆઈ).

કંપની તેની નાણાકીય મિલકતોને નીચેના આધારે ઉપર જણાવેલા વર્ગોમાં વર્ગીકૃત કરે છે :

ક. નાણાકીય મિલકતોનું વ્યવસ્થાપન કરવા માટેનું કંપનીનું બિઝનેસ મોડેલ; અને

ખ. નાણાકીય મિલકતોની કરારગત રોકડ પ્રવાહલક્ષી લાક્ષણિકતાઓ.

નીચેની બંને શરતો સંતોષાતી હોય તો નાણાકીય મિલકતની માપણી ઋણમુક્ત કરવામાં આવેલી કિંમતે કરવામાં આવે છે.

ક. નાણાકીય મિલકત ધંધાના એવા મોડેલની અંદર ધારણ કરવામાં આવી હોય જેનો ઉદ્દેશ્ય, કરારગત રોકડ પ્રવાહ એકત્ર કરીને અને નાણાકીય મિલકતો વેચીને, એમ બંને રીતે હાંસલ કરવામાં આવ્યો હોય; અને

ખ. નાણાકીય મિલકતની કરાર સંબંધી શરતો નિર્દિષ્ટ તારીખોએ એવો રોકડ પ્રવાહ ઊભો કરતા હોય જે બાકી મુદલ રકમ અને તેના પરના વ્યાજની જ ચુકવણીઓ (એસપીપીઆઈ) હોય.

નાણાકીય મિલકત અથવા નાણાકીય જવાબદારીની ઋણમુક્ત કરવામાં આવેલી કિંમત એટલે પ્રારંભિક ઓળખ વખતે નાણાકીય મિલકત અથવા નાણાકીય જવાબદારીની માપણી જે દરે કરવામાં આવે છે તે રકમમાંથી મુખ્ય ચુકવણીઓને બાદ કરીને, પ્રારંભિક રકમ અને પાકતી (મેચ્યોરીટી) રકમ તથા નાણાકીય મિલકતો માટે કોઈ ખોટ સંબંધે કરવામાં આવેલા સમાયોજન વચ્ચેના તફાવતની અસરકારક વ્યાજ-દર પદ્ધતિનો ઉપયોગ કરીને સંચિત ઋણમુક્તિનો ઉમેરો અથવા બાદબાકી કરતાં મળતી રકમ.

પાછળથી નાણાકીય મિલકતોની માપણી, અસરકારક વ્યાજ-દર પદ્ધતિનો ઉપયોગ કરીને, ઋણમુક્ત કરેલી કિંમતે માપવામાં આવે છે. ઋણમુક્ત કરેલી કિંમત, અસરકારક વ્યાજ-દરના અભિન્ન ભાગ રૂપ એવા, સંપાદન અંગેના કોઈપણ વળતર (ડિસ્કાઉન્ટ) અથવા પ્રિમિયમ અને ફી તથા ખર્ચાઓને ધ્યાનમાં લઈને ગણવામાં આવે છે. અસરકારક વ્યાજ-દરની ઋણમુક્તિનો નફા અને નુકસાનમાં નાણાકીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. નુકસાનમાંથી થતી ખોટ નફા અથવા નુકસાનમાં ધ્યાને લેવામાં આવે છે.

નીચેની બંને શરતો સંતોષાતી હોય તો નાણાકીય મિલકતની માપણી અન્ય સર્વગ્રાહી આવક થકી વાજબી કિંમતે ફેરવામાં આવે છે.

ક. નાણાકીય મિલકતો ધંધાના એવા મોડેલની અંદર ધારણ કરવામાં આવી હોય જેનો હેતુ કરારગત રોકડ પ્રવાહ એકત્ર કરીને અને નાણાકીય મિલકતો વેચીને હાંસલ કરવામાં આવતો હોય; અને

ખ. મિલકતનો કરારગત રોકડપ્રવાહ એસપીપીઆઈ દર્શાવતો હોય.

નાણાકીય મિલકત નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવે છે, સિવાય કે તે અન્ય સર્વગ્રાહી આવક થકી, ઋણમુક્ત કરવામાં આવેલી કિંમતે અથવા વાજબી કિંમતે માપવામાં આવતી હોય. વધુમાં, કંપની અન્યથા ઋણમુક્ત કરવામાં આવેલી કિંમત અથવા એફવીઓસીઆઈ ધોરણો સંતોષતી હોય એવી નાણાકીય મિલકતને એફવીટીપીઆઈ તરીકે પદનામિત કરી શકે છે. આમ છતાં, આવું કરવાથી માપણી સંબંધી વિસંગતતાઓ અથવા ઓળખ સંબંધી વિસંગતતાઓ (જેને હિસાબી વિસંગતતા (એકાઉન્ટીંગ મીસમેચ તરીકે ઓળખવામાં આવે છે) ઘટતી અથવા દૂર થતી હોય તો જ આવી પસંદગી કરવાની છૂટ છે.

ધંધા સંબંધી મળવાપાત્ર

ધંધા સંબંધી મળવાપાત્ર રકમો શરૂઆતમાં વાજબી કિંમતે અને ત્યારબાદ ઋણમુક્ત કરવામાં આવેલી કિંમતમાંથી નુકસાનની જોગવાઈ બાદ કરીને ધ્યાને લેવામાં આવે છે.

ઇકિવટી ખતો

ભારતીય હિસાબી ધોરણોના વ્યાપમાં આવતા તમામ ઇકિવટી ખતો વાજબી કિંમતે માપવામાં આવે છે. ટ્રેડીંગ (ધંધા) માટે ધારણ કરવામાં આવેલા ઇકિવટી ખતોને એફ.વી.ટી.પી.એલ. તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. અન્ય તમામ ઇકિવટી ખતો માટે કંપની, વાજબી કિંમતમાં પાછળથી થતા ફેરફારો અન્ય સર્વગ્રાહી આવકમાં દર્શાવવાની કાયમી પસંદગી કરી શકે છે. કંપની આવી પસંદગી પ્રત્યેક ખતના ધોરણે કરે છે. આ વર્ગીકરણ પ્રાથમિક ઓળખ વખતે કરવામાં આવે છે અને તેમાં ફેરફાર કરી શકાતો નથી.

જો કંપની તેના કોઈ ઇકિવટી ખતને એફ.વી.ઓ.સી.આઈ. તરીકે વર્ગીકૃત કરવાનું નક્કી કરે તો ડિવિડંડ સિવાયની તમામ વાજબી કિંમતોના ફેરફારોને અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવે છે. રોકાણોનું વેચાણ કરવામાં આવે ત્યારે એકત્રિત નફો અથવા નુકસાન અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવે છે અને તે રકમને નફા અથવા નુકસાન ખતે પુનઃવર્ગીકૃત કરવામાં આવતી નથી. એફ.વી.ટી.પી.એલ. કક્ષાની મર્યાદામાં સામેલ કરવામાં આવેલા ઇકિવટી ખતોની માપણી, નફા અને નુકસાનમાં ધ્યાને લેવામાં આવેલા તમામ ફેરફારો સાથે વાજબી કિંમતે કરવામાં આવે છે.

કંપનીએ તેના ઇકિવટી ખતો એફ.વી.ઓ.સી.આઈ. થકી માપવાનું પસંદ કર્યું છે.

ડીરેક્ટ્શન (સરવૈયામાંથી દૂર કરવું)

કોઈપણ નાણાકીય મિલકતને (અથવા લાગુ પડતું હોય ત્યાં નાણાકીય મિલકતના ભાગને અથવા નાણાકીય મિલકતોના જૂથ અથવા સમાન પ્રકારની નાણાકીય મિલકતોને) નીચેના સંજોગોમાં “ડીરેક્ટનાઈઝ” (એટલે કે કંપનીના પાકા સરવૈયામાંથી દૂર) કરવામાં આવે છે.

ક. નાણાકીય મિલકતોમાંથી કરારગત રોકડ પ્રવાહ મળવાનું બંધ થયું હોય;

ખ. કંપનીએ તે મિલકતમાંથી રોકડ પ્રવાહ મેળવવાના અધિકારો ત્રીજા પક્ષને તબ્દીલ કર્યા હોય અથવા મેળવેલા રોકડ પ્રવાહને કોઈ પ્રત્યક્ષ વિલંબ વિના, “પાસ-થ્રુ” વ્યવસ્થા હેઠળ સંપૂર્ણરીતે કોઈ ત્રીજા પક્ષને ચૂકવવાની જવાબદારી ધારણ કરી હોય; અને

(૧) કંપનીએ મિલકતનાં તમામ જોખમો અને પુરસ્કારો મહદંશે તબ્દીલ કર્યા હોય; અથવા

(૨) કંપનીએ મિલકતનાં તમામ જોખમો અને પુરસ્કારો તબ્દીલ પણ ન કર્યા હોય અને જાળવી પણ ન રાખ્યા હોય પરંતુ મિલકતનું નિયંત્રણ તબ્દીલ કર્યું હોય.

કંપનીએ જ્યારે મિલકતમાંથી રોકડ પ્રવાહ મેળવવાના તેના અધિકારો તબ્દીલ કર્યા હોય અથવા “પાસ-થ્રુ”ની વ્યવસ્થા કરી હોય ત્યારે તે, માલિકીનાં જોખમો અને પુરસ્કારો જાળવી રાખવા માંગે છે કે કેમ અને જો જાળવી રાખવા માંગતી હોય તો કેટલા પ્રમાણમાં જાળવી રાખવા માંગે છે તે બાબતનું કંપની વિશ્લેષણ કરે છે. કંપનીએ મિલકતના તમામ જોખમો અને પુરસ્કારો તબ્દીલ પણ ન કર્યા હોય અને જાળવી પણ ન રાખ્યા હોય કે મિલકતનું નિયંત્રણ પણ તબ્દીલ ન કર્યું હોય ત્યારે તે મિલકત સાથે કંપની જેટલા પ્રમાણમાં જોડાયેલી રહી હોય તેટલા પ્રમાણમાં તે તબ્દીલ કરેલી મિલકતને ધ્યાનમાં લેવાનું ચાલુ રાખે છે. તેવા કિસ્સામાં કંપની સહયોગી જવાબદારીને પણ ધ્યાને લે છે. તબ્દીલ કરેલી મિલકત અને સહયોગી જવાબદારી, કંપનીએ જાળવી રાખેલા અધિકારો અને જવાબદારીઓ દર્શાવે તેવી રીતે માપવામાં આવે છે.

તબ્દીલ કરવામાં આવેલી મિલકત પર બાંધકામનું સ્વરૂપ ધારણ કરતું કંપનીનું ચાલુ રહેલું જોડાણ, તે મિલકતની મૂળ ચાલુ રકમ અને કંપનીએ પરત ચૂકવવો જરૂરી હોય તેવા અવેજની મહત્તમ રકમમાંથી જે ઓછું હોય તે દરે માપવામાં આવે છે.

નાણાકીય મિલકતોની નુકસાની

કંપની નીચેનાના અપેક્ષિત ધિરાણ-ખોટ મોડેલના આધારે મિલકતોની નુકસાનીની માપણી કરે છે.

ક. ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો.

ખ. અન્ય સર્વગ્રાહી આવક થકી વાજબી કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો

અપેક્ષિત ધિરાણ-ખોટ નીચેના જેટલી રકમના દરે ખોટ-સ્વીકાર થકી માપવામાં આવે છે :

ક. દર મહિનાના અપેક્ષિત ધિરાણ ખોટ (અહેવાલની તારીખ પછીના ૧૨ મહિનાની અંદર સંભવિત હોય તેવા નાણાકીય ખતો પર ડિફોલ્ટની ઘટનાઓના પરિણામે ઊભા થતા અપેક્ષિત ધિરાણ ખોટ); અથવા

ખ. પૂરા સમયના અપેક્ષિત ધિરાણ ખોટ (નાણાકીય ખતની આવરદા પર્યંત સંભવિત તમામ ડિફોલ્ટની ઘટનાઓના પરિણામે ઊભા થતા અપેક્ષિત ધિરાણ ખોટ). ઘંઘા સંબંધી મળવાપાત્ર રકમો પર નુકસાની ખોટ સ્વીકાર ધ્યાનમાં લેવા માટે કંપની “સરળ અભિગમ”ને અનુસરે છે. તે દરેક અહેવાલની તારીખે, નાણાકીય ખતની સમગ્ર આવરદા માટેના અપેક્ષિત ધિરાણ-ખોટના આધારે નુકસાની-ખોટ સ્વીકારને, સરવૈયામાં તેના પ્રારંભથી ધ્યાનમાં લે છે. પ્રત્યેક અહેવાલની તારીખે, ઐતિહાસિક રીતે જોવા મળેલા ડિફોલ્ટ દરો અપડેટ કરવામાં આવે છે અને આગામી અંદાજોમાં થયેલા ફેરફારોનું પૃથક્કરણ કરવામાં આવે છે.

અન્ય નાણાકીય મિલકતો અંગેની નુકસાની ખોટ અને જોખમોની સંભાવના ધ્યાનમાં લેવા માટે કંપની, ધિરાણ સંબંધી જોખમ પ્રથમવાર ધ્યાનમાં લેવામાં આવ્યું ત્યારથી તેમાં નોંધપાત્ર વધારો થયો છે કે કેમ એ નક્કી કરે છે. ધિરાણ સંબંધી જોખમમાં નોંધપાત્ર વધારો થયો ન હોય તો, નુકસાની ખોટ પૂરી પાડવા માટે ૧૨ મહિનાની અપેક્ષિત ધિરાણ-ખોટ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ છતાં ધિરાણ સંબંધી જોખમમાં નોંધપાત્ર વધારો થયો હોય તો આવરદા પર્યંતની ધિરાણ-ખોટનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળના સમયગાળામાં નાણાકીય ખતના સંદર્ભમાં મળવાપાત્ર રકમોની ચૂકવણીઓમાં એટલો સુધારો થાય કે ધિરાણ સંબંધી જોખમને પ્રથમવાર ધ્યાનમાં લેવામાં આવ્યું હોય તે પછી તેમાં કોઈ નોંધપાત્ર વધારો થતો ન હોય તો કંપની નુકસાની ખોટ-સ્વીકાર પુનઃ ૧૨ મહિનાની અપેક્ષિત ધિરાણ-ખોટના આધારે ધ્યાનમાં લેવાનું શરૂ કરે છે.

આ સમયગાળા દરમિયાન ધ્યાનમાં લેવામાં આવેલ અપેક્ષિત ધિરાણ-ખોટ, નુકસાની ખોટ સ્વીકાર (અથવા તેનું ‘રિવર્સલ’) એ નફા અને નુકસાન પત્રકમાં આવક/ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવેલ છે. જુદાં જુદાં નાણાકીય ખતો માટે પાકા સરવૈયામાં કરવામાં આવેલું પ્રસ્તુતીકરણ નીચે વર્ણવવામાં આવ્યું છે.

ક. ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલ નાણાકીય મિલકતો અને મળવાપાત્ર કરારગત આવક-અપેક્ષિત ધિરાણ-ખોટને સ્વીકૃતી તરીકે એટલે કે તે મિલકતોની માપણીના એક અભિન્ન ભાગ તરીકે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવી છે. આ સ્વીકૃતીને કારણે ચોખ્ખી ચાલુ રકમમાં ઘટાડો થાય છે. મિલકત તેને માંડવાળ કરવા માટેનાં ધોરણો ન સંતોષે ત્યાં સુધી કંપની તેની એકંદર ચાલુ રકમમાંથી નુકસાની-સ્વીકારની રકમ ઘટાડતી નથી.

ખ. એફવીઓસીઆઈના દરે માપવામાં આવેલી નાણાકીય મિલકતો – નાણાકીય મિલકતોને વ્યાજબી કિંમતે જ દર્શાવાઈ હોવાથી તેની કિંમતમાંથી નુકસાની સ્વીકારની રકમ વધુ ઘટાડવામાં આવી નથી. અપેક્ષિત ધિરાણ-ખોટની રકમ અન્ય સર્વગ્રાહી આવકમાં સંચિત નુકસાનીની રકમ તરીકે દર્શાવવામાં આવી છે.

ધિરાણ સંબંધી જોખમ અને નુકસાની ખોટમાં થયેલો વધારો આકારવા માટે કંપની, ધિરાણ સંબંધી જોખમમાં થયેલો નોંધપાત્ર વધારો સમયસર જાણી શકાય તે તેવું પૃથક્કરણ કરવાના હેતુથી, નાણાકીય ખતોનું સંયોજન “શેડ કેડિટ-રીસ્ક કેરેક્ટરીસ્ટીક્સ”ના આધારે કરે છે.

નાણાકીય જવાબદારીઓ

પ્રારંભિક ઓળખ અને માપણી

તમામ નાણાકીય જવાબદારીઓ પ્રારંભમાં વાજબી કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે અને લોન, કરજ અને ચુકવવાપાત્ર રકમોના કિસ્સામાં તે પ્રત્યક્ષ લેવડ દેવડ ખર્ચને બાદ કરીને ચોખ્ખી દર્શાવવામાં આવે છે.

પાછળથી તમામ નાણાકીય જવાબદારીઓ નફા અને નુકસાન પત્રક થકી, ઋણમુક્ત કિંમતે અથવા વાજબી કિંમતે માપવામાં આવે છે. કંપનીની નાણાકીય જવાબદારીઓમાં ઘંધા સંબંધી તેમજ અન્ય ચુકવવાપાત્ર રકમો, બેંક ઓવરડ્રાફ્ટ સહિત લોન અને કરજનો સમાવેશ થાય છે.

પાછળથી કરવામાં આવતી માપણી

ક. ઋણમુક્ત કિંમતે માપવામાં આવતી નાણાકીય જવાબદારીઓ.

ખ. પાછળથી નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવતી નાણાકીય જવાબદારીઓ.

નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવતી નાણાકીય જવાબદારીઓમાં, નફા અને નુકસાન થકી વાજબી કિંમતે પ્રારંભિક ઓળખ કરવામાં આવ્યેથી પદનામિત કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ તેમ જ ઘંધા માટે ધારણ કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓનો સમાવેશ થાય છે. નજીકની મુદતમાં જેની પુનઃ ખરીદી કરવાના હેતુથી જે ઊભી કરવામાં આવી હોય તેવી નાણાકીય જવાબદારીઓને ઘંધા માટે ધારણ કરેલી નાણાકીય જવાબદારીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ઘંધા માટે ધારણ કરી રાખવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ અંગેનો નફો અથવા ખોટ નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે.

નફા અને નુકસાન થકી વાજબી કિંમતે પ્રારંભિક ઓળખ કરવામાં આવ્યેથી પદનામિત કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓને પાકા સરવૈયામાં તેને પ્રથમવાર ધ્યાનમાં લેવામાં ત્યારે અને ભારતીય હિસાબી ધોરણ ૧૦૮નાં માપદંડો સંતોષતા હોય ત્યારે જ એ રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. એફવીટીપીએલ તરીકે પદનામિત કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ માટે, પોતાના જ ધિરાણ સંબંધી જોખમમાં ફેરફાર થવાને કારણે વાજબી કિંમતમાં થતા નફા/નુકસાનને અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવે છે. આ નફા/નુકસાનને પાછળથી નફા અને નુકસાન ખાતે તબદીલ કરવામાં આવતાં નથી. આમ છતાં, કંપની સંચિત લાભ અથવા નુકસાનને ઇકિવટીની અંદર જ તબદીલ કરી શકે છે. આવી જવાબદારીની વાજબી કિંમતમાં થતા તમામ ફેરફારો નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. કંપનીએ કોઈ નાણાકીય જવાબદારી નફા અને નુકસાન થકી વાજબી કિંમતે ધ્યાનમાં લીધી નથી.

ઘંધા સંબંધી તેમજ અન્ય ચુકવવાપાત્ર રકમો

આ રકમો, નાણાકીય વર્ષના અંત પહેલાં કંપનીને પૂરાં પાડવામાં આવેલાં માલસામાન અને સેવાઓ અંગેની એ જવાબદારીઓ દર્શાવે છે જેની ચુકવણી કરવામાં આવી ન હોય. અહેવાલના સમયગાળા પછી ૧૨ મહિનાની અંદર ચુકવણી કરવાની થતી ન હોય એ સિવાય ઘંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમોને ચાલુ જવાબદારીઓ તરીકે દર્શાવવામાં આવે છે. તે શરૂઆતમાં વાજબી કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ અસરકારક વ્યાજદર પદ્ધતિનો ઉપયોગ કરીને ઋણમુક્ત કિંમતે માપવામાં આવે છે.

ડીરેક્ટગ્નીશન (સરવૈયામાંથી દૂર કરવું)

કોઈપણ નાણાકીય જવાબદારી હેઠળનું દાયિત્વ પૂરું થાય, રદ થાય અથવા સમાપ્ત થાય ત્યારે તેને સરવૈયામાં દર્શાવવામાં બંધ કરવામાં આવે છે. જ્યારે હાલમાં અસ્તિત્વ ધરાવતી કોઈ નાણાકીય જવાબદારીના સ્થાને તે જ ‘લેન્ડર’ પાસેથી અથવા મહદંશે જુદા જ પ્રકારની શરતો હેઠળ અન્ય જવાબદારી ઊભી કરવામાં આવે અથવા હાલમાં અસ્તિત્વ ધરાવતી જવાબદારીની શરતોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવે ત્યારે આવા વિનિમય અથવા ફેરફારને મૂળ જવાબદારી ધ્યાને લેવાનું બંધ કરીને નવી જવાબદારીને ધ્યાને લેવામાં આવી હોવાનું ગણવામાં આવે છે. સંબંધિત જવાબદારીઓની ચાલુ કિંમત વચ્ચેના તફાવતને નફા અને નુકસાન પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે.

ઢ. નાણાકીય ખતોની નુકસાન ભરપાઈ કરવી (ઓફ સેટીંગ)

નાણાકીય મિલકતો અને નાણાકીય જવાબદારીઓની નુકસાન ભરપાઈ (ઓફ સેટીંગ) કરીને ચોખ્ખી રકમ સરવૈયામાં ત્યારે જ દર્શાવવામાં આવે છે જ્યારે ધ્યાને લેવામાં આવેલી રકમને ‘ઓફ સેટ’ કરવાનો કાયદેસર અમલપાત્ર અધિકાર હોય અને જવાબદારીની પતાવટ કરવાનો અથવા મિલકતો પ્રાપ્ત કરવાની સાથેસાથે જ જવાબદારીઓની પતાવટ કરવાનો ઇરાદો હોય. કાયદેસર અમલપાત્ર અધિકાર ભવિષ્યની ઘટનાઓના સંદર્ભમાં આનુષંગિક ન જ હોવો જોઈએ અને તે ઘંધાના સામાન્ય કામકાજમાં અને કંપની અથવા પ્રતિપક્ષ ડિફોલ્ટ (ચૂક), નાદાર અથવા દેવાળિયો થઈ જાય એવા પ્રસંગે જ લાગુ પાડી શકાય તેવો હોવો જોઈએ.

ત. વાજબી કિંમત

કંપની પ્રત્યેક સરવૈયાની તારીખે કેટલાંક નાણાકીય ખતોની વાજબી કિંમતે માપણી કરે છે. વાજબી કિંમતે માપણી એ ધારણા પર આધારિત છે કે મિલકતના વેચાણ અથવા જવાબદારીને તબ્દીલ કરવા અંગેની લેવડ દેવડ-

ક. મિલકત અથવા જવાબદારીના મુખ્ય બજારમાં થાય છે, અથવા

ખ. મુખ્ય બજાર ન હોય તો, મિલકતો અને જવાબદારીઓ માટેના સૌથી ફાયદાકારક બજારમાં થાય છે.

મુખ્ય અથવા સૌથી ફાયદાકારક બજાર કંપનીને સુલભ હોવું જોઈએ. કોઈ મિલકત અથવા જવાબદારીની વાજબી કિંમતની માપણી ખરીદ-વેચાણમાં ભાગ લેનારી વ્યક્તિઓ તેમના પોતાના શ્રેષ્ઠ આર્થિક હિતમાં વર્તતા હોવાની ધારણા કરીને, તેઓ તે મિલકત અથવા જવાબદારી વિશે જે ધારણા કરે તેને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે.

કંપની જે તે સંજોગોમાં યોગ્ય હોય અને વાજબી કિંમતે માપવા માટે જે અંગે પૂરતો ડેટા ઉપલબ્ધ હોય તેવી મૂલ્ય નિર્ધારણની ટેકનિકનો ઉપયોગ કરે છે અને આમ કરતી વખતે સંબંધિત દેખીતા ભાવનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને દેખીતા ન હોય તેવા ભાવનો સૌથી ઓછો ઉપયોગ કરે છે.

નાણાકીય પત્રકોમાં જેની વાજબી કિંમત માપવામાં અથવા જાહેર કરવામાં આવી હોય તે તમામ મિલકતો અને જવાબદારીઓને, વાજબી કિંમતની માપણી માટે મહત્ત્વના હોય એવા સૌથી ઓછા ભાવના આધારે નીચે મુજબ વાજબી કિંમતના કમમાં મૂકવામાં આવે છે.

ક. લેવલ-૧ : ક્વોટેડ (બિન સમાયોજિત) સમાન પ્રકારની મિલકતો અથવા જવાબદારીઓ માટે સક્રિય બજારમાં બજાર કિંમત.

ખ. લેવલ-૨ : કિંમત નક્કી કરવાની એ તકનિકો જે માટે, સૌથી ઓછા ભાવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોઈ શકાતા હોય.

ગ. લેવલ-૩ : કિંમત નક્કી કરવા માટેની એ ટેકનિકો જે માટે સૌથી ઓછા ભાવો જોવા મળતા ન હોય.

નાણાકીય પત્રકોમાં આવર્તક ધોરણે ધ્યાનમાં લેવામાં આવતી હોય તેવી મિલકતો અને જવાબદારીઓ માટે કંપની, દરેક અહેવાલના સમયગાળાના અંતે, (એકંદર ધોરણે વાજબી કિંમતની માપણી માટે મહત્ત્વના છે એવા સૌથી ઓછા ભાવના આધારે) વાજબી કિંમતના વર્ગીકરણની પુનઃમુલવણી કરીને, વર્ગીકરણના સ્તરો (લેવલ્સ) વચ્ચે તબ્દીલી થઈ છે કે કેમ તે નક્કી કરે છે.

આ નોંધમાં વાજબી કિંમત અંગેની હિસાબી નીતિનો સાર આપવામાં આવ્યો છે. વાજબી કિંમત સંબંધી અન્ય જાહેરાતો સંબંધિત નોંધોમાં આપવામાં આવી છે.

થ. માલસામગ્રી

માલસામગ્રીમાં વિકસિત પ્લોટ્સનો સમાવેશ થાય છે. વિકસિત પ્લોટ્સમાં પડતર જમીન સંપાદનનું ખર્ચ, બાંધકામ અને વિકાસ અંગેનું ખર્ચ, માલ સામાનનું ખર્ચ, સેવા, અને સોલાર પાર્ક-૧ સંબંધી અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. વિકસિત પ્લોટ્સનું મૂલ્ય નિર્ધારણ પડતર કિંમત અથવા ચોખ્ખી મળી શકે તેવી કિંમત, એ બેમાંથી જે ઓછું હોય તે કરવામાં આવે છે.

દ. કર્મચારી સંબંધી લાભો

૧. ટૂંકાગાળાના કર્મચારી સંબંધી લાભો અંગેનું દાવિત્વ

કર્મચારીઓએ સંબંધિત સેવાઓ આપી હોય તે અહેવાલના સમયગાળાના અંત પછી ૧૨ મહિનાની અંદર જેમની પૂરેપૂરી પતાવટ કરવાની અપેક્ષા હોય તેવી, બિન-નાણાકીય લાભો સહિતની, પગાર-વેતન અંગેની જવાબદારીઓ, અહેવાલના સમયગાળાના અંત સુધીની કર્મચારીઓની સેવાઓના સંદર્ભમાં ધ્યાને લેવામાં આવે છે અને એ જવાબદારીઓની પતાવટ કરવાની હોય ત્યારે ચુકવવાની અપેક્ષિત રકમના દરે તેની માપણી કરવામાં આવે છે. સરવૈયામાં આ જવાબદારીઓ કર્મચારી લાભો અંગેના ચાલુ દાવિત્વ તરીકે રજૂ કરવામાં આવે છે.

૨. અન્ય લાંબાગાળાના, કર્મચારી સંબંધી લાભો અંગેનું દાવિત્વ

કર્મચારીઓએ સંબંધિત સેવાઓ જે દરમિયાન પૂરી પાડી હોય તે સમયગાળાના અંત પછીના ૧૨ મહિનામાં પ્રાપ્ત રજાઓ અને માંદગીની રજાઓ અંગેની જવાબદારીઓ પૂરેપૂરી પતાવવાની અપેક્ષા હોતી નથી. તેવી તેમની માપણી, પ્રોજેક્ટેડ યુનિટ કેડિટ મેથડનો ઉપયોગ કરીને, કર્મચારીએ અહેવાલના સમયગાળાના અંત સુધી પૂરી પાડેલી સેવાઓના સંદર્ભમાં કરવાની અપેક્ષિત ભાવિ ચુકવણીની હાલની કિંમતે માપવામાં આવે છે. આ લાભો બજારની ઊપજનો ઉપયોગ કરીને સંબંધિત દાવિત્વની મુદત સુધીની સંબંધિત સમયગાળાની મુદતના અંદાજે લાભોમાં ઘટાડો કરવામાં આવે છે. અનુભવ, સમાયોજન અને જોખમ સંબંધી ધારણાઓમાં ફેરફારોના પરિણામે કરવામાં આવેલી પુનઃમાપણી નફા અને નુકસાન ખાતામાં ધ્યાને લેવામાં આવે છે.

૩. રોજગાર પછીના દાવિત્વો

કંપની રોજગાર પછીની (નિવૃત્તિ પછીની) નીચે મુજબની યોજનાઓ ચલાવે છે.

ક. નિર્ધારિત લાભો અંગેની યોજના જેમકે ગ્રેચ્યુઇટી અને

ખ. નિર્ધારિત લાભો અંગેની યોજના જેમકે રજાનું રોકડમાં રૂપાંતર

ગ. નિર્ધારિત ફાળા અંગેની યોજના જેમકે ભવિષ્યનિધિ

ગ્રેચ્યુઇટી સંબંધી દા્યિત્વ

ગ્રેચ્યુઇટી સંબંધી દા્યિત્વ વાર્ષિક ત્રીજા પક્ષના જોખમ સંબંધી મૂલ્ય નિર્ધારણના આધારે માપવામાં આવે છે અને કર્મચારીએ આપેલી સેવાઓના સમયગાળા દરમિયાન ધ્યાને લેવામાં આવે છે. કંપની તેના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી યોજનાઓના સ્વરૂપે નિર્ધારિત લાભ સંબંધી યોજનાઓ ઓફર કરે છે. કંપની ભારતીય જીવન વીમા નિગમને ભંડોળ આપે છે. દર વર્ષે ચુકવવામાં આવેલી પ્રિમિયમની રકમ નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

રજાનું રોકડમાં રૂપાંતર

રજાના રોકડમાં રૂપાંતર માટેની જોગવાઈ જોખમ સંબંધી મૂલ્ય નિર્ધારણના આધારે નક્કી થાય છે અને ઊપાર્જિત થાય છે.

ભવિષ્ય નિધિ

નિર્ધારિત ફાળા સંબંધી યોજના ભવિષ્ય નિધિમાં ફાળો કાયદાના નિયમો મુજબ આપવામાં આવે છે અને તે, કર્મચારીએ જ્યારે તે ફાળા માટે હકદાર બનવા જેટલી સેવાઓ બજાવી હોય ત્યારે ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

ધ. વિદેશી ચલણમાં લેવડદેવડ

વિદેશી ચલણમાં લેવડ દેવડોને, લેવડ દેવડની તારીખે જે વિનિમય દર ચાલતો હોય તેનો ઉપયોગ કરીને ચાલુ ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. વર્ષના અંતે આવી લેવડ દેવડોની પતાવટમાંથી અને વિદેશી ચલણની સંજ્ઞા (ડીનોમીનેશન) વાળી નાણાકીય મિલકતો અને જવાબદારીઓના રૂપાંતરણમાંથી થયેલા વિદેશી ચલણ સંબંધી લાભ અને નુકસાનને સામાન્ય રીતે નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે.

ન. આવકને ધ્યાનમાં લેવા બાબત

માપણી અંગેની અથવા ઉધારણી અંગેની કોઈ નોંધપાત્ર અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી ન હોય ત્યારે આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રાપ્ત થયેલા અથવા મળવાપાત્ર અવેજની વાજબી કીમતે આવકની માપણી કરવામાં આવે છે. આવકમાંથી રિબેટ અને એ પ્રકારનાં અન્ય ભથ્થાં બાદ કરવામાં આવે છે.

પટે આપવામાં આવેલા પ્લોટમાંથી આવક (એટલે કે ઉધારાવવામાં આવેલ પ્રિમિયમ અને ડેવલપમેન્ટ ચાર્જ), માપણી અંગેની અથવા ઉદ્ધારણી અંગેની કોઈ નોંધપાત્ર અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી ન હોય ત્યારે અને માલિકી અંગેના તમામ નોંધપાત્ર જોખમો અને પુરસ્કારો ખરીદનારને સમજૂતીની શરતો મુજબ આપી દેવામાં આવ્યા હોય ત્યારે ધ્યાને લેવામાં આવે છે. ગ્રાહકો પાસેથી મળેલી રકમો, જો તે “ગ્રાહકો પાસેથી મળેલી પેશગીઓ” સદર હેઠળ અન્ય ચાલુ જવાબદારીઓ તરીકે હિસાબે લેવામાં આવી હોય તો, આવક તરીકે ધ્યાને લેવાને પાત્ર બનતી નથી. આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવેલી રકમો સામે ગ્રાહકો પાસેથી મળવાપાત્ર રકમોને, “ધંધા સંબંધી મળવાપાત્ર રકમો” સદર હેઠળ ચાલુ મિલકત તરીકે હિસાબે લેવામાં આવે છે.

ભારતીય હિસાબી ધોરણ-૧૧૫ મુજબ, જવાબદારી સંતોષકારક રીતે પૂરી કરવામાં આવે ત્યારે આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

સેવાઓમાંથી થયેલી આવકને, કરારની શરતોને ધ્યાનમાં લઈને, સેવાઓ જ્યારે પૂરી પાડવામાં આવે ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે વીજ ઉત્પાદમાંથી થયેલી અવકને, કરારની શરતોને ધ્યાનમાં લઈને ધ્યાને લેવામાં આવે છે.

વ્યાજની આવક, બાકી રકમ અને લાગુ પડવાપાત્ર વ્યાજદરને ગણતરીમાં લઈને, સમયના પ્રમાણના આધારે ધ્યાને લેવામાં આવે છે. ચુકવણી મેવવાનો અધિકાર સ્થાપિત થાય ત્યારે ડિવિડન્ડ હિસાબે લેવામાં આવે છે.

પ. ખર્ચ

સંચાલન ખર્ચ અને બાંધકામ અને વિકાસ ખર્ચ, ચારણકા ખાતે સોલારપાર્કના વિસ્તારમાં પ્લોટની ફાળવણીના પ્રમાણના આધારે નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

૭૦૦ મે.વો.નો મેગા પ્રોજેક્ટ રાધાનેસડા અને ૧૦૦૦ મે.વો.નો સોલાર પ્રોજેક્ટ-ધોલેરા પર કરવામાં આવેલું ખર્ચ, આ પ્રોજેક્ટ હમણાં જ શરૂ થયા હોવાથી, “ચાલુ કામો” ખતે તબ્દીલ કરવામાં આવ્યું છે.

ફ. કરવેરા

આવકવેરો

આવકવેરાનું ખર્ચ અથવા આ સમયગાળા માટેની ક્રેડિટ એ, કામચલાઉ તફાવતો અને કરવેરા સંબંધી ખોટને કારણે ઊભી થતી કરસંબંધી મિલકતો અને જવાબદારીઓમાં ફેરફારો થકી સમાયોજિત, લાગુ પડતા આવકવેરા દરના આધારે, ચાલુ સમયગાળાની કરપાત્ર આવક પર ચુકવવાપાત્ર કર છે.

ચાલુ આવકવેરાનું ખર્ચ, અહેવાલના સમયગાળાના અંતે ઘડવામાં આવેલા અથવા નોંધપાત્ર રીતે ઘડવામાં આવેલા કર સંબંધી કાયદાના આધારે ગણવામાં આવે છે. ચાલુ આવકવેરા સંબંધી મિલકતો અને જવાબદારીઓ, અહેવાલના સમયગાળાના અંતે ઘડવામાં આવેલા અથવા નોંધપાત્ર રીતે ઘડવામાં આવેલા કરસંબંધી કાયદા અને દરોના આધારે, સત્તામંડળો ચુકવેલા પાસેથી વસૂલ કરવાની અથવા તેમને ચુકવવાની અપેક્ષા હોય એ રકમોના દરે માપવામાં આવે છે. ચાલુ કરસંબંધી બાબતો, અન્ય સર્વગ્રાહી આવક અથવા ઇકિવટીમાં પ્રત્યક્ષ રીતે કરવામાં આવેલી સંબંધિત લેવડદેવડોને અનુરૂપ ધ્યાનમાં લેવામાં આવે છે.

વિલંબિત કરવેરા

મિલકતો અને જવાબદારીઓના કર-આધાર અને સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોમાં તેમની ચાલુ રકમો વચ્ચે ઊભા થતા કામચલાઉ તફાવત પર વિલંબિત લેવડદેવડોને અનુરૂપ ધ્યાનમાં લેવામાં આવે છે.

વિલંબિત આવકવેરો, અહેવાલના સમયગાળાના અંત સુધીમાં ઘડવામાં આવેલા અથવા મહદંશે ઘડવામાં આવેલા કરવેરાના દર (અને કાયદા)નો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે અને જ્યારે સંબંધિત વિલંબિત આવકવેરા મિલકત પ્રાપ્ત થાય અથવા વિલંબિત આવકવેરાની જવાબદારીની પતાવટ થાય ત્યારે તે લાગુ પાડવાની અપેક્ષા હોય છે. વિલંબિત કર મિલકતો, તમામ કપાતપાત્ર કામચલાઉ તફાવતો અને ઉપયોગમાં લેવામાં ન આવેલી કરવેરા સંબંધી ખોટ માટે તો જ ધ્યાને લેવામાં આવે છે જો એ સંભવ હોય કે ભાવિ કરપાત્ર રકમો એ કામચલાઉ તફાવતો અને ખોટને ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ હશે.

વિલંબિત કર મિલકતો અને જવાબદારીઓને ઓફસેટ કરવાનો કાયદેસર અમલપાત્ર અધિકાર હોય ત્યારે અને જ્યારે વિલંબિત કર સિલકો એક જ કર-સત્તામંડળને લગતી હોય ત્યારે વિલંબિત કર મિલકતો અને જવાબદારીઓ ઓફ-સેટ કરવામાં આવે છે. ચાલુ કર મિલકતો અને કર જવાબદારીઓ ઓફસેટ કરવાનો કાયદેસર અમલ પાત્ર અધિકાર હોય ત્યારે અને જ્યારે તેની ચોખ્ખી રકમના આધારે પતાવટ કરવાનો અથવા મિલકત પ્રાપ્ત કરવાની સાથે સાથે જ જવાબદારીની પતાવટ કરવાનો ઇરાદો હોય ત્યારે તેને ઓફસેટ કરવામાં આવે છે.

ચાલુ અને વિલંબિત કરને, તે અન્ય સર્વગ્રાહી આવકમાં અથવા સીધો ઇકિવટીમાં ધ્યાનમાં લેવામાં આવેલી બાબતો સાથે સંબંધ ધરાવતો હોય તેટલા પ્રમાણ સિવાય, નફા અને નુકસાન પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે. આ કિસ્સામાં કર અનુક્રમે અન્ય સર્વગ્રાહી આવકમાં અથવા સીધો જ ઇકિવટીમાં પણ ધ્યાને લેવામાં આવે છે. કોઈપણ ઉપલબ્ધ ટેક્સ ક્રેડિટ, ભાવિ કરપાત્ર નફો-જેની સામે ઉપયોગમાં ન લેવાયેલ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ થઈ શકે તેમ હોય- જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેટલા પ્રમાણમાં વિલંબિત કર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

ઉક્ત મિલકત, નફા અને નુકસાન પત્રક ખાતે ક્રેડિટ દ્વારા ઊભી કરવામાં આવે છે અને વિલંબિત કર મિલકતના સદર હેઠળ દર્શાવવામાં આવે છે.

વિલંબિત કર મિલકતોની ચાલુ રકમની સમીક્ષા દરેક અહેવાલની તારીખે કરવામાં આવે છે અને વિલંબિત કર મિલકતની પૂરેપૂરી અથવા આંશિક રકમનો ઉપયોગ થઈ શકે એટલો પ્રચીપ્ત કરપાત્ર નફો ઉપલબ્ધ હોવાની સંભાવના ન રહે એટલા પ્રમાણમાં તે ઘટાડવામાં આવે છે. ધ્યાનમાં લેવામાં ન આવી હોય એવી વિલંબિત કર-મિલકતોની દરેક અહેવાલની તારીખે પુનઃ આકારણી કરવામાં આવે છે અને ભાવિ કરપાત્ર નફા થકી જેટલા પ્રમાણમાં વિલંબિત કર મિલકત વસૂલ થવાની સંભાવના હોય તેટલા પ્રમાણમાં વિલંબિત કર મિલકત વસૂલ થવાની સંભાવના હોય તેટલા પ્રમાણમાં તે ધ્યાને લેવામાં આવે છે.

બ. જોગવાઈઓ, આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક મિલકતો

કોઈ ભૂતકાળની ઘટનાના પરિણામે કંપની માટે વર્તમાન દાયિત્વ ઊભું થયેલું હોય ત્યારે જોગવાઈઓ વર્તમાન કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે. એ સંભવ છે કે આર્થિક લાભો દર્શાવતા સંસાધનો એ દાયિત્વની પતાવટ માટે ખર્ચવા જરૂરી બને અને તે દાયિત્વની રકમનો વિશ્વસનીય અંદાજ કાઢી શકાય. જોગવાઈને લગતો ખર્ચ, પુનઃભરપાઈ કરવાની કોઈ રકમ હોય તો તેને બાદ કરીને નફા અને નુકસાન ખાતે રજૂ કરવામાં આવે છે.

અંદાજ રોકડ પ્રવાહીનો ઉપયોગ કરીને, દાયિત્વની પતાવટ માટે, અપેક્ષિત ખર્ચોની વર્તમાન કિંમતે “ડીકમીશનીંગ કોસ્ટ” પૂરી પાડવામાં આવે છે અને તે પીપીઈની કિંમતના ભાગ તરીકે ધ્યાને લેવામાં આવે છે. રોકડ પ્રવાહો, જે ધ્યાનમાં લેવાનું બંધ કરવામાં આવ્યું હોય તેવી જવાબદારીઓ (ડીકમીશનીંગ લાયેબીલીટી) અંગેના વિશેષ જોખમો દર્શાવતા, કરવેરા પહેલાંના ચાલુ દરોએ રોકડ પ્રવાહો ઘટાડવામાં આવે છે. ઘટાડવામાં આવેલા ડિસ્કાઉન્ટને કરેલ ખર્ચ ગણીને, નાણાકીય ખર્ચ તરીકે નફા અને નુકસાન પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે. “ડીકમીશનીંગ”ની અંદાજ ભાવિ કિંમતોની દર વર્ષે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું યોગ્ય રીતે સમાયોજન કરવામાં આવે છે. અંદાજ ભાવિ કિંમતો અથવા લાગુ પાડવામાં આવેલા ડિસ્કાઉન્ટ રેટમાં થયેલા ફેરફારો મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે અથવા તેમાંથી બાદ કરવામાં આવે છે.

આકસ્મિક જવાબદારીઓ પ્રત્યક્ષ ન હોય તો તેની જોગવાઈ કરવામાં આવતી નથી. તે હિસાબોની નોંધ થકી જાહેર કરવામાં આવે છે. આકસ્મિક

મિલકતો નાણાકીય પત્રકોમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. આમ છતાં, આર્થિક લાભ થવાની સંભાવના હોય ત્યાં તે જાહેર કરવામાં આવે છે.

ભ. રોકડ અને રોકડ સમાન

રોકડ અને રોકડ સમાન રકમોમાં રોકડ તેમજ બેંકમાં મૂકેલી થાપણોનો સમાવેશ થાય છે. ખરીદીની તારીખે જે પાકવાની મુદતમાં ત્રણ મહિના અથવા ઓછો સમય બાકી હોય અને રોકડની જાણીતી રકમોમાં જેને તરત રૂપાંતરિત કરી શકાય તેમ હોય એવાં અતિ પ્રવાહી રોકાણોને કંપની રોકડ-સમાન ગણે છે.

રોકડપ્રવાહોના પત્રકમાં રજૂ કરવાના હેતુ માટે રોકડ અને રોકડ સમાન રકમોમાં હાથ પરની રોકડ, ટૂંકી મુદતના અને જે પાકવાની મુદતમાં ત્રણ મહિના અથવા ઓછો સમય બાકી હોય અને રોકડની જાણીતી રકમોમાં જેને તરત રૂપાંતરિત કરી શકાય તેમ હોય એવાં અતિ પ્રવાહી રોકાણો જેમની કિંમતમાં ફેરફાર થવાનું નજીવું જોખમ હોય તેમનો અને બેંક ઓવર ડ્રાફ્ટ્સનો સમાવેશ થાય છે. બેંક ઓવરડ્રાફ્ટ્સ, પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીઓમાં કરજોની અંદર દર્શાવવામાં આવે છે.

મ. રોકડ પ્રવાહનું પત્રક

રોકડ પ્રવાહો પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને જણાવવામાં આવે છે, જે થકી કરવેરા પહેલાનો નફો બિન-રોકડ પ્રકારની કોઈપણ લેવડ-દેવડોની અસરો, ભૂતકાળની અથવા ભવિષ્યની કાર્યલક્ષી રોકડ પ્રાપ્તિઓ અથવા ચુકવણીઓના વિલંબ અથવા ઊપાર્જન અને નાણાકીય અથવા રોકાણ સંબંધી રોકડ પ્રવાહો સાથે સંકળાયેલી આવક અથવા ખર્ચની બાબત માટે સમાયોજિત કરવામાં આવે છે. સંચાલન, રોકાણ અને નાણાકીય સંબંધી પ્રવૃત્તિઓમાંથી થતા રોકડ પ્રવાહોને અલગ તારવવામાં આવે છે.

ચ. અહેવાલની તારીખ પછી બનતી ઘટનાઓ

સરવૈયાની તારીખ પછી બનતી સમાયોજનની ઘટનાઓ (જે સરવૈયાની તારીખે અસ્તિત્વ ધરાવતી સ્થિતિનો પુરાવો પૂરો પાડે છે) ને નાણાકીય પત્રકોમાં ધ્યાને લેવામાં આવે છે. સરવૈયાની તારીખ બાદ બનતી પ્રત્યક્ષ બિન સમાયોજનની ઘટનાઓ (જેમાં સરવૈયાની તારીખ પછી ઊભી થયેલી સ્થિતિનો સમાવેશ થાય છે) ઘટનાઓ જે નાણાકીય સ્થિતિને અસર કરતા પ્રત્યક્ષ ફેરફારો અને પ્રતિબદ્ધતાઓ દર્શાવે છે, તે નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવે છે.

૨. અપવાદરૂપ બાબતો

કંપનીની સામાન્ય પ્રવૃત્તિઓને લગતાં કેટલાંક પ્રસંગો, કંપનીનું કદ, પ્રકાર અથવા આવક અથવા ખર્ચની બાબતની અસર એવાં હોય છે કે તેની જાહેરાત કરવાથી કંપનીની કામગીરી વધુ સારી રીતે સમજી શકાય છે. આવી આવક અથવા ખર્ચને અપવાદરૂપ બાબત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તદનુસાર તે નાણાકીય પત્રકો સાથેની નોંધોમાં જાહેર કરવામાં આવે છે.

લ. સેગમેન્ટ વિશે જાણ કરવા બાબત (સેગમેન્ટ રિપોર્ટીંગ)

વર્ષ દરમિયાન જીપીસીએલ વીજસંબંધી ઉત્પાદનોના વિકાસ અને વીજ નિર્માણના વ્યાપારમાં રોકાણેલ હતું. તેની પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાંથી થતી આવક માત્ર ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા હિસાબી ધોરણ ૧૦૮ “ઓપરેટીંગ સેગમેન્ટ્સ” મુજબ કંપની માત્ર એક જ જાણ કરવાપાત્ર સેગમેન્ટ ધરાવે છે. જેની વિગતો અન્ય નોંધ-૩૦ (દ) તરીકે રજૂ કરવામાં આવી છે.

વ. સામાન્ય નોંધ

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કંપનીના હિસાબો નોંધવાની અને બંધ કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૨

ના.વ. ૨૦૨૧-૨૨નાં નાણાકીય પત્રકો મંજૂર કર્યાની તારીખ ૧૮/૧૨/૨૦૨૨ છે.

નોંધ-૨ સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી

૨૦૨૧-૨૨ના વર્ષ માટે

વિગતો	એકંદર બ્લોક				
	૧લી એપ્રિલ, ૨૦૨૧ મુજબ	વર્ષ દરમિયાન ઉમેરો	નિકાલ/ સમાયોજન	આઈએનડી એ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૨ મુજબ
જમીન	૬,૭૮૩.૬૭				૬,૭૮૩.૬૭
મકાન	૫,૬૭૦.૩૬				૫,૬૭૦.૩૬
પ્લાન્ટ અને યંત્ર સામગ્રી	૧,૮૩૯.૬૨				૧,૮૩૯.૬૨
કચેરી સાધન સામગ્રી	૪,૩૮૭.૮૧	૨.૪૯			૪,૩૯૦.૩૦
ફર્નિચર અને જડાણો	૧૪૦.૩૪	૦.૪૪			૧૪૦.૭૮
કોમ્પ્યુટર્સ	૧૯૮.૫૨	૨૦.૫૫	૧૧.૬૦		૨૦૭.૪૭
વાહનો	૮૨.૬૦				૮૨.૬૦
વિન્ડ મીલ	૧૨,૨૧૮.૦૪				૧૨,૨૧૮.૦૪
સોલારપાર્ક	૧૨,૩૦૮.૯૭				૧૨,૩૦૮.૯૭
સરવાળો	૪૩,૬૨૯.૯૪	૨૩.૪૮	૧૧.૬૦	૦.૦૦	૪૩,૬૪૧.૮૨

૨૦૨૦-૨૧ના વર્ષ માટે

વિગતો	એકંદર બ્લોક				
	૧લી એપ્રિલ, ૨૦૨૦ મુજબ	વર્ષ દરમિયાન ઉમેરો	નિકાલ/ સમાયોજન	આઈએનડી એ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ
જમીન	૬,૭૮૩.૬૭	૪૬.૪૪	૪૬.૪૪		૬,૭૮૩.૬૭
મકાન	૬,૬૪૩.૫૯		૯૭૩.૨૩		૫,૬૭૦.૩૬
પ્લાન્ટ અને યંત્ર સામગ્રી	૧,૮૭૫.૦૪	૦.૩૫	૩૫.૭૬		૧,૮૩૯.૬૨
કચેરી સાધન સામગ્રી	૪,૩૭૭.૭૬	૧૦.૦૮	૦.૦૩		૪,૩૮૭.૮૧
ફર્નિચર અને જડાણો	૩૧૬.૧૮	૦.૧૫	૧૭૫.૯૯		૧૪૦.૩૪
કોમ્પ્યુટર્સ	૧૯૮.૫૨	૦.૦૦	૦.૦૦		૧૯૮.૫૨
વાહનો	૮૨.૬૦	૦.૦૦	૦.૦૦		૮૨.૬૦
વિન્ડ મીલ	૧૨,૨૧૮.૦૪	૦.૦૦	૦.૦૦		૧૨,૨૧૮.૦૪
સોલારપાર્ક	૧૨,૩૦૮.૯૭	૦.૦૦	૦.૦૦		૧૨,૩૦૮.૯૭
સરવાળો	૪૪,૮૦૪.૩૭	૫૭.૦૩	૧,૨૩૧.૪૫	૦.૦૦	૪૩,૬૨૯.૯૪

(રકમ રૂ. લાખમાં)

ઘસારો અને ઋણમુક્તિ					ચોખ્ખો બ્લોક	
૧લી એપ્રિલ ૨૦૨૧ મુજબ	આ વર્ષ માટે	નિકાલ/ સમાયોજન	આઈએનડીએ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૨ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૨ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ
					૬,૭૮૩.૬૭	૬,૭૮૩.૬૭
૧,૪૦૧.૮૬	૮૬.૦૪			૧,૪૮૮.૦૦	૪,૧૮૨.૩૬	૪,૨૬૮.૪૧
૬૩૨.૪૫	૭૭.૧૧			૭૦૮.૫૬	૧,૧૩૦.૦૬	૧,૨૦૭.૧૭
૧,૪૭૬.૭૬	૧૫૦.૮૦			૧,૬૨૭.૬૫	૨,૭૬૨.૬૫	૨,૮૧૧.૦૬
૧૨૭.૩૨	૪.૬૮			૧૩૨.૦૨	૮.૭૬	૧૩.૦૨
૧૮૮.૫૪	૦.૮૪	૧૧.૦૨		૧૭૮.૪૭	૨૮.૦૧	૮.૮૮
૭૭.૮૬	૦.૫૮			૭૮.૪૪	૪.૧૬	૪.૭૪
૫,૦૧૧.૦૪	૫૧૫.૧૮			૫,૫૨૬.૨૨	૬,૬૮૧.૮૨	૭,૨૦૭.૦૦
૩,૭૦૦.૬૪	૪૫૮.૫૭			૪,૧૬૦.૨૧	૮,૧૪૮.૭૬	૮,૬૦૮.૩૪
૧૨,૬૧૬.૫૬	૧,૨૮૫.૦૩	૧૧.૦૨	૦.૦૦	૧૩,૮૦૦.૫૭	૨૮,૭૪૧.૨૬	૩૧,૦૧૩.૩૮

(રકમ રૂ. લાખમાં)

ઘસારો અને ઋણમુક્તિ					ચોખ્ખો બ્લોક	
૧લી એપ્રિલ ૨૦૨૦ મુજબ	આ વર્ષ માટે	નિકાલ/ સમાયોજન	આઈએનડીએ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ
૦.૦૦					૬,૭૮૩.૬૭	૬,૭૮૩.૬૭
૧,૪૩૩.૮૧	૮૩.૮૮	૧૨૫.૮૪		૧,૪૦૧.૮૬	૪,૨૬૮.૪૧	૫,૨૦૮.૬૮
૫૭૪.૬૬	૭૭.૩૧	૧૮.૫૨		૬૩૨.૪૫	૧,૨૦૭.૧૭	૧,૩૦૦.૩૮
૧,૩૨૬.૭૪	૧૫૦.૦૧			૧,૪૭૬.૭૬	૨,૮૧૧.૦૬	૩,૦૫૧.૦૧
૨૬૮.૨૬	૧૫.૮૪	૧૫૬.૮૭		૧૨૭.૩૨	૧૩.૦૨	૪૭.૮૨
૧૮૭.૪૪	૧.૧૦			૧૮૮.૫૪	૮.૮૮	૧૧.૦૮
૭૪.૭૦	૩.૧૫			૭૭.૮૬	૪.૭૪	૭.૮૦
૪,૪૮૫.૮૬	૫૧૫.૧૮			૫,૦૧૧.૦૪	૭,૨૦૭.૦૦	૭,૭૨૨.૧૮
૩,૨૪૧.૦૬	૪૫૮.૫૭			૩,૭૦૦.૬૪	૮,૬૦૮.૩૪	૮,૦૬૭.૮૧
૧૧,૬૦૨.૬૪	૧,૩૧૬.૧૫	૩૦૨.૨૪	૦.૦૦	૧૨,૬૧૬.૫૬	૩૧,૦૧૩.૩૮	૩૩,૨૦૧.૭૩

નોંધ:

- (૧) કંપની અધિનિયમ, ૨૦૧૩ ઘડાયા પછી કંપનીએ , ઘસારા/ઋણમુક્તિ અંગેની હિસાબી નીતિમાં જાહેર કર્યા મુજબ અનુસૂચિ-૨માં નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ અંદાજિત ઉપયોગી આવરદા લાગુ પાડી છે. તદનુસાર, બિનઋણમુક્ત ચાલુ મૂલ્યનો, સુધારેલી/બાકીની ઉપયોગી આવરદા સુધી ઘસારો ગણવામાં આવે છે.
- (૨) એસઈસીએલ સાથે પાવર પર્યેઝ એગ્રીમેન્ટ અને સીક્યુરીટાઇઝેશન એક્ટ મુજબ, કંપનીની તમામ જવાબદારી અંગે ૧૦ મેવો.ના સોલાર પ્રોજેક્ટને લગતી રૂ. ૬૧,૧૪,૪૬,૫૧૮/-ની અનુમાનિત મિલકત ઉપર પ્રથમ ચાર્જ છે.

નોંધ: ૨

પટાઓ

ક. પટે લેનાર તરીકે પટાની અસર

પટે આપવાની પ્રવૃત્તિઓ, શરતો, પટા તરીકે લેવામાં આવેલ મિલકતનો વર્ગ વગેરે અંગેની પ્રમાણદર્શક મહિતી

૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરાં થયેલા વર્ષ દરમિયાન મિલકતનો ઉપયોગ કરવાના કંપનીના અધિકારોની ચાલુ કિંમત તથા પટાસંબંધી જવાબદારીઓમાં થયેલી ગતિવિધિઓ નીચે મુજબ છે.

ક. જમીનની મિલકત વાપરવાનો અધિકાર

વિગતો	૨૦૨૧-૨૨ના વર્ષ માટે રકમ (લાખ રૂપિયામાં)	૨૦૨૦-૨૧ના વર્ષ માટે રકમ (લાખ રૂપિયામાં)
એકંદર ચાલુ કિંમત		
ઉઘડતી સિલક	૫.૮૪	-
હિસાબી ધોરણ ૧૧૬માં થયેલી તબદીલી (એપ્રિલ-૧, ૨૦૨૦થી)ને કારણે ઉમેરો	-	-
વર્ષ દરમિયાન ઉમેરો	-	૧૧.૦૩
ઘટાડો	-	-
બંધ થતી સિલક (ક)	૫.૮૪	૧૧.૦૩
સંચિત ઋણમુક્તિ		
ઉઘડતી સિલક	-	-
વર્ષ દરમિયાન ચાર્જ	૦.૫૫	૫.૦૮
વર્ષદરમિયાન ઘટાડો/સમાયોજન	-	-
બંધ થતી સિલક (ખ)	૦.૫૫	૫.૦૮
૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ ચોખ્ખી સિલક (ગ=ક - ખ)	૫.૩૮	૫.૯૪

ખ. પટા અંગેની જવાબદારી

વિગતો	૨૦૨૧-૨૨ના વર્ષ માટે રકમ (લાખ રૂપિયામાં)	૨૦૨૦-૨૧ના વર્ષ માટે રકમ (લાખ રૂપિયામાં)
ઉઘડતી સિલક	૪.૮૪	-
હિસાબી ધોરણ ૧૧૬માં થયેલી તબદીલી (એપ્રિલ-૧, ૨૦૧૮ના રોજ)ને કારણે ઉમેરો	-	-
વર્ષ દરમિયાન ઉમેરો	-	૧૧.૦૩
કરવામાં આવેલ નાણાકીય ખર્ચ	(૦.૬૫)	૩.૩૮
પટા અંગેની જવાબદારીનું સમાયોજન		(૮.૫૭)
બંધ થતી સિલક	૪.૧૯	૪.૮૪
ચાલુ ભાગ	૦.૬૦	૦.૬૫
બિન-ચાલુ ભાગ	૩.૬૦	૪.૧૯

ગ. નફા અથવા નુકસાનમાં ધ્યાનમાં લેવામાં આવેલી રકમો

વિગતો	૨૦૨૧-૨૨ના વર્ષ માટે રકમ (લાખ રૂપિયામાં)	૨૦૨૦-૨૧ના વર્ષ માટે રકમ (લાખ રૂપિયામાં)
૨૦૨૧ -૨૨ - હિસાબી ધોરણ ૧૧૬ હેઠળના પટા		
મિલકત વાપરવાના અધિકારના ખર્ચોની ઋણમુક્તિ	૦.૫૫	૫.૦૮
પટા અંગેની જવાબદારી અંગેનું વ્યાજ ખર્ચ	(૦.૬૫)	૩.૩૮
નફા અને નુકસાનમાં ધ્યાનમાં લેવામાં આવેલ કુલ રકમ	(૦.૧૦)	૮.૪૭

ઘ. ટૂંકી મુદતના પટા સિવાયનું નીચાં મૂલ્યની મિલકતો અંગેની જાહેરાત

વિગતો	રકમ (લાખ રૂપિયામાં)
૨૦૨૦-૨૧ - હિસાબી ધોરણ ૧૧૬ હેઠળના પટા	
ટૂંકી મુદતના પટા અંગેનું ખર્ચ	-
નીચાં મૂલ્યની મિલકતોના ટૂંકી મુદતના પટા સિવાયનું નીચાં મૂલ્યની મિલકતોનું ખર્ચ	-

પટા અંગેની જવાબદારી પાકવા અંગેનું વિશ્લેશણ

રકમ (લાખ રૂપિયામાં)

વિગતો	૩૧ માર્ચ ૨૦૨૨		૩૧ માર્ચ ૨૦૨૧	
	પટા અંગેની ન્યૂનતમ ચુકવણી	એમએલપીની વર્તમાન કિંમત	પટા અંગેની ન્યૂનતમ ચુકવણી	એમએલપીની વર્તમાન કિંમત
૧ વર્ષ કરતાં મોડી નહીં	૧.૪૮	૦.૬૦	૧.૪૮	૦.૬૫
૧ વર્ષ પછી પરંતુ ૫ વર્ષ કરતાં મોડી નહીં	૭.૪૧	૧.૮૬	૭.૪૧	૨.૫૫
૫ વર્ષ પછી	૫.૫૭	૧.૬૪	૭.૦૫	૧.૬૪
પટા અંગેની કુલ ન્યૂનતમ ચુકવણી	૧૪.૪૬	૪.૧૦	૧૫.૯૪	૪.૮૪
બાદ- નાણાકીય ચાર્જ્સ દર્શાવતી રકમો	-	-	-	-
પટા અંગેની કુલ ન્યૂનતમ ચુકવણીની વર્તમાન કિંમત	૧૪.૪૬	૪.૧૦	૧૫.૯૪	૪.૮૪

પટા અંગેની ન્યૂનતમ ચુકવણીની કિંમત ગણી કાઢવા માટે કરજે લેવા માટેનો વ્યાજ દર એટલે કે ૮.૪૫ ટકા ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

નોંધ - ૨ ઉત્પનન વિકાસ મિલકત

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૨ના રોજ મુજબ	૩૧-૦૩-૨૦૨૧ના રોજ મુજબ
પ્રારંભિક વિકાસ ખર્ચ		
ઉધડતી સિલક	૩,૮૫૧.૮૨	૪,૦૪૭.૮૮
ઉમેરો:વર્ષ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવેલ		-
બાદ:વર્ષ દરમિયાન ઋણમુક્તિ	(૧૩૮.૮૫)	(૮૬.૧૭)
બંધ થતી સિલક	૩,૮૧૧.૮૬	૩,૯૫૧.૮૨
ઉત્પનન બંધ કરવાની જવાબદારી અંગેની મિલકત*		

* ગુજરાત સરકારે તેના જુદા જુદા હુકમો અન્વયે, સંબંધિત તારીખોથી ૨૫ વર્ષ માટે ૧૩૫૫ હેક્ટર વિસ્તારને આવરી લેતા લિગ્નાઇટના ઉત્પનન પટા મંજૂર કર્યા છે. ઉક્ત પટો, ઉક્ત વિસ્તારમાંથી ઉત્પનન કરવામાં આવેલા સમગ્ર લિગ્નાઇટના જથ્થાનો ઉપયોગ બીએલટીપીએસ પાવર પ્લાન્ટ માટે કરવાની જોગવાઈ કરી છે. એગ્રીમેન્ટ મુજબ એમડીઓ લિગ્નાઇટ ઉત્પનન ફી હેઠળ આવરી લેવામાં આવેલ ૩૩.૫૦ એમએમટી લિગ્નાઇટ ખોદવા માટે બંધાયેલું છે. આ સ્તરે, તકનિકી નિષ્ણાતોના મતે, ધોધા સુરકા લિગ્નાઇટ માઈનીંગ પ્રોજેક્ટ બંધ કરવાનો અંદાજ કાઢવા માટે તેના ડિકમીશનીંગ ખર્ચનો અંદાજ કાઢી શકાય તેમ નથી. તે બાબતને ધ્યાનમાં લેતાં ભારતીય હિસાબી ધોરણ ૩૭ “ખાણોની આર્થિક આવરદાના અંતે, તેમને ભવિષ્યમાં બંધ કરવા માટે, આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક મિલકતો અંગેની જોગવાઈ કરી ન શકાય.

નોંધ -૩

ગૌણ અને સહાયક અને સંયુક્ત કંપનીઓમાં રોકાણ (અનકવોટેડ)

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ મુજબ
બિન ચાલુ		
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસોના અનકવોટેડ ઇકિવટી શેર્સમાં રોકાણ		
બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (બીડબલ્યુસીસીએલ)	૧,૦૦૦.૦૦	૧,૦૦૦.૦૦
(૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૧,૦૦,૦૦૦; ૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ : ૧,૦૦,૦૦૦ ઇકિવટી શેર્સ ઇકિવટી શેર્સ રૂ. ૧૦૦૦નો એક એવા પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર્સ)		
ટોરેન્ટ પીપાવાવ જનરેશન લિમિટેડ (ટીપીજીએલ)*	૨૫૦.૦૦	૨૫૦.૦૦
બાદ: કાયમી ઘટાડો	(૨૫૦.૦૦)	-
(૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૨૫૦,૦૦૦; ૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ ૨૫૦,૦૦૦ ઇકિવટી શેર્સ એક રૂ. ૧૦નો, પૂરેપૂરા ભરપાઈ થયેલ)		૨૫૦.૦૦
જી.એસ.પી.સી. પીપાવાવ પાવર કંપની લિમિટેડ (જીપીપીસીએલ)	૨,૧૮૩.૭૬	૨,૧૮૩.૭૬
(૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૨,૧૮,૩૭૬૨૭; ૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ ૨,૧૮,૩૭૬૨૭ ઇકિવટી શેર્સ એક રૂ. ૧૦નો, પૂરેપૂરા ભરપાઈ થયેલ)		
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસોમાં કુલ રોકાણ	૩,૧૮૩.૭૬	૩,૪૩૩.૭૬

*આ કંપની અને ટોરેન્ટ પાવર લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસથી શરૂ કરવામાં આવેલી કંપની ટોરેન્ટ પીપાવાવ જનરેશન લિમિટેડ (ટીપીજીએલ) દ્વારા, અદાલતના હુકમ મુજબ, અમરેલી, ગુજરાતમાં ૧૦૦૦+ મેગા વોટના કોલસા આધારિત પાવર પ્લાન્ટના વિકાસ માટે ખાનગી જમીન સંપાદિત કરવા માટેના વળતરરૂપે ચુકવણી કરવામાં આવી હતી. બળતણ માટેની સંપર્ક કડી ઉપલબ્ધ ન હોવાને કારણે ગુજરાત સરકારે તેના તારીખ ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૭ના પત્ર અન્વયે એવું જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ શરૂ ન કરવામાં આવે અને તદનુસાર આ સંયુક્ત સાહસ સમેટી લેવાનો આશય છે. વધુમાં, ઉપર જણાવેલા પત્ર

મુજબ, જમીનનું ખર્ચ, જમીનનો નિકાલ કર્યા બાદ પુનઃ ભરપાઈ કરવામાં આવશે. આ સંદર્ભમાં માર્ચ ૨૦૧૯માં જીપીસીએલએ કલેક્ટર અમરેલીને પત્ર લખીને જણાવ્યું હતું કે સંબંધિત જમીન ગુજરાત સરકારને સુપરત કરી દેવામાં આવી છે અને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગને આ બાબતમાં વધુ કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે. એવું જાણવા મળે છે કે ગુજરાત સરકાર ઔદ્યોગિક હેતુ માટે આ જમીનનો ઉપયોગ કરવાની સંભાવના તપાસી રહી છે. વ્યવસ્થાપક મંડળે ગુજરાત સરકાર પાસેથી વસૂલાતપાત્ર રકમનું ઘટાડા મૂલ્યાંકન કર્યું છે અને એવું તારણ કાઢ્યું છે કે આ જમીનની ચાલુ રકમમાં કોઈ ઘટાડો થયો નથી. આ જમીનમાં રોકવામાં આવેલી રકમની વસૂલાતક્ષમતાનો સમય, તે ખરીદનારની ઉપલબ્ધતા ઉપર નિર્ભર રહેશે. ઉપર જણાવેલી હકીકતોને ધ્યાનમાં લેતાં, મિલકતો અને જવાબદારીઓ તેમની ચોખ્ખી ઉપજપાત્ર કિંમત અથવા મૂલ્ય, બેમાંથી જે ઓછી હોય તે રકમે દર્શાવવામાં આવી છે અને માર્ચ ૩૧, ૨૦૨૨ના રોજ પૂરાં થતાં વર્ષ માટે ટીપીજીએલના નાણાકીય પત્રકો બિન-ચાલુ ધંધાના આધારે તૈયાર કરવામાં આવ્યાં છે. તેથી કંપનીએ રોકાણના મૂલ્યમાં કાયમી ઘટાડો ધ્યાને લીધો છે.

**નોંધ-૪
રોકાણો**

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
બિન ચાલુ રોકાણો		
(ક)અન્ય કંપનીઓના ક્વોટેડ ઇક્વિટી શેર્સમાં રોકાણ (ઓસીઆઈ મારફત વાજબી કિંમતે ગણેલું (એફવીટીઓસીઆઈ) ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડ (૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૪૯,૭૭,૪૯૧; ૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૪૯,૭૭,૪૯૧ ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦ પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૩,૬૫૫.૮૭	૩,૭૭૦.૪૫
ગુજરાત ગેસ લિમિટેડ (જીજીએલ) (૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૧૩,૩૨,૨૩૫; ઇક્વિટી શેર્સ એક રૂ. ૨ નો એવા પૂરેપૂરા ભરપાઈ થયેલ ૩૧મી માર્ચ, ૨૦૨૧ ૧૩,૩૨,૨૩૫ ઇક્વિટી શેર્સ એક રૂ. ૨નો પૂરેપૂરા ભરપાઈ થયેલ	૬,૭૦૪.૪૭	૭,૩૧૯.૮૭
(ખ)અન્ય કંપનીઓના અનક્વોટેડ ઇક્વિટી શેર્સમાં રોકાણ (ઓસીઆઈ મારફત વાજબી કિંમતે ગણેલું) (એફવીટીઓસીઆઈ) ગુજરાત રાજ્ય એનર્જી જનરેશન લિ. (જીએસઈજીએલ) (૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૧,૫૮,૧૫,૪૫૪; ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦ પૂરેપૂરા ભરપાઈ થયેલ ૩૧મી માર્ચ, ૨૦૨૧ ૧,૫૮,૧૫,૪૫૪ ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦નો પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૧,૪૨૩.૩૮	૧,૮૦૪.૫૪
કાલુપુર બેંક (૩૧મી માર્ચ, ૨૦૨૨ : ૪૦૦ ઇક્વિટી શેર્સ; ૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ ૪૦૦ ઇક્વિટી શેર્સ રૂ. ૨૫નો એક એવા પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૦.૧૦	૦.૧૦
કુલ બિન ચાલુ રોકાણો	૧૧,૭૮૩.૮૩	૧૨,૮૯૫.૦૬

જુઓ નોંધ-૨૯- વાજબી કિંમતની માપણી

ચાલુ રોકાણો

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
અન્ય ચાલુ રોકાણો	-	-
સરવાળો ચાલુ રોકાણો	-	-

નોંધ-૫

અન્ય નાણાકીય મિલકતો

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
બિન ચાલુ		
જામીનગીરી અને અન્ય થાપણો	૧૮૮.૨૮	૧૮૮.૨૮
કુલ બિન ચાલુ નાણાકીય મિલકતો	૧૮૮.૨૮	૧૮૮.૨૮
ચાલુ		
કોર્પોરેટ સંસ્થાઓ પાસે રહેલી થાપણો	૧,૦૨,૮૮૬.૬૭	૮૪,૬૦૫.૨૪
કુલ ચાલુ થાપણો	૧,૦૨,૮૮૬.૬૭	૮૪,૬૦૫.૨૪

નોંધ - ૬

ચાલુ કરવેરા મિલકતો

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
વર્ષ માટેનો અગ્રીમ આવકવેરો	૧,૭૮૫.૦૦	૮૮૨.૦૦
મળવાપાત્ર ટીડીએસ	૭૫૫.૩૪	૬૭૮.૩૬
મળવાપાત્ર ટીસીએસ	૨૫.૫૮	૧૬.૮૭
વર્ષની આવકવેરા માટેની જોગવાઈ	(૨,૫૪૨.૭૦)	(૧,૦૦૩.૫૫)
કુલ ચાલુ કરવેરા મિલકતો (ચોખ્ખી)	૨૩.૨૩	૫૭૩.૬૮

નોંધ -૭ અન્ય મિલકતો

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
બિન ચાલુ		
કેપીટલ એડવાન્સ	૩૮૩.૫૪	૧૭.૬૩
કામગીરી અને નિભાવની મળવાપાત્ર આવક	૧,૩૩૬.૪૪	૮૨૨.૧૩
મળવાપાત્ર પટાભાડું	૨૨૪.૮૩	-
અગ્રીમ આવકવેરો (કરવેરાની જોગવાઈ બાદ ચોખ્ખો)	૩,૫૫૨.૬૬	૨,૫૬૬.૩૦
મકાન બાંધકામ પેશગી		
અન્ય	૪૮.૪૮	૪૮.૪૮
કુલ અન્ય બિન ચાલુ મિલકતો	૫,૫૫૬.૯૬	૪,૭૫૨.૦૧
ચાલુ		
પરિયોજના વિકાસ ખર્ચ*	૮૫૦.૨૮	૧,૦૦૪.૧૦
રાજ્ય સરકારની તિજોરી, ગાંધીનગરમાંથી માર્ગમાં રહેલી પ્રાપ્તિ નીચેના પર ઉપાર્જિત પરંતુ મળવાપાત્ર ન થયેલું વ્યાજ	-	-
(ક) બેંક થાપણો પર	૮૬.૫૬	૭૧.૬૩
(ખ) બોન્ડ પર	૧.૬૮	૩.૨૮
(ગ) કોર્પોરેટ સંસ્થાઓ પાસેની થાપણો	૨,૫૧૫.૭૩	૨,૩૦૮.૪૨
સંચાલન અને નિભાવની મળવાપાત્ર આવક	૨૩૭.૧૧	૨૩૩.૬૬
સ્થાયી મિલકતો પેટે મળવાપાત્ર હોય તેવી પાકતી રકમો	૭૦.૦૦	૭૦.૦૦
અન્ય		
ઘોઘા સુરખા ખાણ પરિયોજના માટે પેશગી	-	૮૫૩.૧૭
જીડબલ્યુઆઈએલ પાસેથી વસૂલાતપાત્ર રકમ	-	૮૮.૬૪
અગાઉથી ચુકવાયેલ ખર્ચ	૭૫.૫૫	૭૪.૨૫
મળવાપાત્ર સર્વિસ ટેક્સ	૩.૨૮	૩.૨૮
મળવાપાત્ર જીએસટી	૩,૩૫૫.૫૮	૨૮૪.૫૬
અન્ય	૪.૪૪	૪.૮૮
કુલ અન્ય ચાલુ મિલકતો	૭,૨૦૦.૨૩	૫,૦૨૨.૦૦

* પ્રોજેક્ટ વિકાસ ખર્ચમાં ૧૦૦૦ મે.વો. કોલસા આધારિત પીપાવાવ પ્રોજેક્ટ માટે ચુકવવામાં આવેલ પરમર્શ ફીનો સમાવેશ થાય છે.આને ધ્યાનમાં લઈને નોંધ ૩૦ (જ)માં જણાવાયા મુજબ રૂ. ૧.૫૪ કરોડની રકમ શકમંદ દેવાં માટેની જોગવાઈ ખાતે તબદીલ કરવામાં આવી છે.

નોંધ- ૮

માલસામગ્રી

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
સોલર પાર્ક-૧, ચારણકાનું થયેલું/ ચાલુ કામ	૨,૫૪૭.૭૮	૩,૨૩૫.૩૦
૭૦૦ મે.વો. અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ રાધાનેસડા પેટે વિકાસ ખર્ચ	૩,૭૫૩.૮૩	૨,૮૮૦.૩૭
૧૦૦૦ મે.વો. સોલાર પ્રોજેક્ટ ધોલેરા પેટે વિકાસ ખર્ચ	૫૨.૭૮	૧૮.૭૩
કુલ માલસામગ્રી	૬,૩૫૪.૫૦	૬,૧૩૫.૪૦

નોંધ -૯

ધંધાસંબંધી મળવાપાત્ર

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
સારી અને તારણવાળી ગણાતી હોય તેવી મળવાપાત્ર રકમો	૨,૧૩૮.૦૨	૮૮૭.૨૧
સારી અને તારણ વિનાની ગણાતી હોય તેવી મળવાપાત્ર રકમો	૬,૪૩૪.૬૭	૬,૬૦૫.૪૮
જે મળવાનું જોખમ વધુ હોય તેવી મળવાપાત્ર રકમો		-
ધંધા સંબંધી મળવાપાત્ર-મળવાનું જોખમ હોય તેવી	૧૧.૬૭	૧૧.૬૭
	૮,૫૮૪.૩૬	૭,૫૦૪.૩૫
ખરાબ અને શકમંદ દેવાં માટે જોગવાઈ	(૧૧.૬૭)	(૧૧.૬૭)
ધંધા સંબંધી કુલ મળવાપાત્ર	૮,૫૭૨.૬૯	૭,૪૮૨.૬૮

રકમની મુદત દર્શાવતું પત્રક અલગ નોંધ તરીકે આપવામાં આવ્યું છે

નોંધ -૧૦

રોકડ અને રોકડ સમાન

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
રોકડ અને અન્ય બેંક બેલેન્સ		
બેંકમાં બેલેન્સ		
ચાલુ ખાતાઓમાં	૧૪૫.૮૧	૭,૩૩૪.૪૦
હાથ પરની રોકડ	૦.૫૮	૦.૫૧
કુલ રોકડ અને રોકડ સમાન	૧૪૬.૪૮	૭,૩૩૪.૯૧
અન્ય બેંક બેલેન્સ		
સીમાંત નાણાં થાપણો	૭,૭૪૪.૮૩	૭,૧૩૫.૫૦
તરલ થાપણ	-	૫૭૬.૪૨
કુલ અન્ય બેંક બેલેન્સ	૭,૭૪૪.૮૩	૭,૭૧૧.૯૨

ના.વ. ૨૦૨૧-૨૨ ધંધાસંબંધી મળવાપાત્ર એકંદર રકમની મુદત દર્શાવતું પત્રક

(રકમ લાખ રૂ. માં)

વિગત	"ચુકવણીની તારીખથી નીચેના સમયગાળા માટે બાકી					સરવાળો
	૬ માસથી ઓછી	૬ માસ - ૧ વર્ષ	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
(૧) ધંધાસંબંધી મળવાપાત્ર નિર્વિવાદિત રકમો - સંધ્ધર ગણાતી.	૧,૭૫૪.૭૮	૫,૭૬૬.૧૫	૮૬૩.૩૦	૧૨.૧૮	૧૭૬.૨૭	૮,૫૭૨.૬૯
(૧) ધંધાસંબંધી મળવાપાત્ર નિર્વિવાદિત રકમો - જે પાછી મળવા અંગેનાં જોખમમાં ઘણો વધારો થયો છે.						-
(૩) ધંધાસંબંધી મળવાપાત્ર નિર્વિવાદિત રકમો - જે મળવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે.					૧૧.૬૭	૧૧.૬૭
(૪) ધંધાસંબંધી મળવાપાત્ર વિવાદિત રકમો - સંધ્ધર ગણાતી.						-
(૫) ધંધાસંબંધી મળવાપાત્ર વિવાદિત રકમો - જે મળવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે.						-
(૬) ધંધાસંબંધી મળવાપાત્ર વિવાદિત રકમો - જે મળવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે.						-
	૧,૭૫૪.૭૮	૫,૭૬૬.૧૫	૮૬૩.૩૦	૧૨.૧૮	૧૮૭.૯૪	૮,૫૮૪.૩૬

ના.વ. ૨૦૨૦-૨૧ ધંધાસંબંધી મળવાપાત્ર એકંદર રકમની મુદત દર્શાવતું પત્રક

(રકમ લાખ રૂ. માં)

વિગત	યુકવણીની તારીખથી નીચેના સમયગાળા માટે બાકી					સરવાળો
	૬ માસથી ઓછી	૬ માસ - ૧ વર્ષ	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
(૧) ધંધાસંબંધી મળવાપાત્ર નિર્વિવાદિત રકમો - સંધર ગણતી	૬.૭૮	૩૭.૫૫	૭,૨૭૨.૦૭	૧૭૬.૨૭	-	૭,૪૮૨.૬૮
(૧) ધંધાસંબંધી મળવાપાત્ર નિર્વિવાદિત રકમો - જે પાછી મળવા અંગેનાં જોખમમાં ઘણો વધારો થયો છે.						-
(૩) ધંધાસંબંધી મળવાપાત્ર નિર્વિવાદિત રકમો - જે મળવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે.					૧૧.૬૭	૧૧.૬૭
(૪) ધંધાસંબંધી મળવાપાત્ર વિવાદિત રકમો - સંધર ગણતી						-
(૫) ધંધાસંબંધી મળવાપાત્ર વિવાદિત રકમો - જે મળવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે.						-
(૬) ધંધાસંબંધી મળવાપાત્ર વિવાદિત રકમો - જે મળવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે.						-
	૬.૭૮	૩૭.૫૫	૭,૨૭૨.૦૭	૧૭૬.૨૭	૧૧.૬૭	૭,૫૦૪.૩૫

નોંધ- ૧૧
ઇકિવટી શેર મૂડી

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
અધિકૃત શેરમૂડી રૂ. ૧૦૦નો એક એવા ૬,૦૦,૦૦,૦૦૦ ઇકિવટી શેર (૩૧ માર્ચ, ૨૦૨૨ : રૂ. ૧૦૦નો એક એવા ૬,૦૦,૦૦,૦૦૦ ઇકિવટી શેર)	૬૦,૦૦૦.૦૦	૬૦,૦૦૦.૦૦
કુલ	૬૦,૦૦૦.૦૦	૬૦,૦૦૦.૦૦

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
ઇસ્યુ થયેલી સબસ્ક્રાઇબ થયેલી અને ભરપાઈ થયેલી શેર મૂડી રૂ. ૧૦૦નો એક એવા ૫,૧૩,૨૩,૨૬૩ ઇકિવટી શેર (ગત વર્ષે રૂ. ૧૦૦નો એક એવા ૫,૧૩,૨૨,૫૫૩ ઇકિવટી શેર) એક ઇકિવટી શેરનો અડધો ભાગ દર્શાવતા ફેક્શનલ સર્ટીફિકેટ્સ/ વોરન્ટ્સ-૧૫	૫૧,૩૨૩.૨૬ ૦.૦૧	૫૧,૩૨૨.૫૫ ૦.૦૧
કુલ	૫૧,૩૨૩.૨૭	૫૧,૩૨૨.૫૬

અહેવાલના સમયગાળાના આરંભે અને અંતમાં બાકી હોય એવા શેર્સનો હિસાબમેળ

વિગત	શેર્સની સંખ્યા	રકમ લાખ રૂ.માં
૧લી એપ્રિલ, ૨૦૨૧ના રોજ	૫,૧૩,૨૨,૫૬૦.૫૦	૫૧,૩૨૨.૫૬
વર્ષના આરંભે	૫,૧૩,૨૨,૫૬૦.૫૦	૫૧,૩૨૨.૫૬
વત્તા : વર્ષ દરમિયાન ઇસ્યુ થયેલા શેર્સ	૭૧૦.૦૦	૦.૭૧
૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ	૫,૧૩,૨૩,૨૭૦.૫૦	૫૧,૩૨૩.૨૭

૫ ટકાથી વધુ ઇક્વિટી શેર્સ ધરાવતા શેર ધારકોની વિગતો

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
ઇક્વિટી શેર્સની સંખ્યા		
ગુજરાત સરકાર	૪,૯૩,૯૩,૧૭૨	૪,૯૩,૯૨,૪૬૨
ઇક્વિટી શેર્સમાં હોલ્ડિંગની ટકાવારી		
ગુજરાત સરકાર	૦.૮૬	૦.૮૬

- નોંધો
- ઇક્વિટી શેર્સ સાથે જોડાયેલી શરતો/ અધિકારો
- (ક) આ કંપની પ્રત્યેક શેર દીઠ રૂ. ૧૦૦ની કિંમત ધરાવતા એક જ પ્રકારના શેર્સ ધરાવે છે. પ્રત્યેક શેર ધારક કોઈ નિયંત્રણ વિના, શેર દીઠ એક મત આપવાનો અધિકાર ધરાવે છે અને જ્યારે પણ ડિવિડન્ડ જાહેર કરવામાં આવે ત્યારે ડિવિડન્ડ મેળવવા હકદાર છે. નિયામક મંડળ દ્વારા કોઈ ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તો તે, વચગાળાના ડિવિડન્ડ સિવાય, ત્યાર પછીની વાર્ષિક સભામાં શેર ધારકોની મંજૂરીને અધીન છે. કંપની ફંડમાં જાય તેવા કિસ્સામાં તમામ શેરધારકોને સમાન દરજ્જાના ગણવામાં આવે છે અને તમામ પ્રેફરેન્સિવલ રકમોના વિતરણ બાદ કંપનીની બાકીની મિલકતો મેળવવા તેઓ હકદાર બને છે.
- (ખ) સરવૈયાની તારીખના તરત પહેલાંના ૫ વર્ષના સમયગાળા દરમિયાન રોકડમાં ચુકવણી પ્રાપ્ત થયા વિના, કરારને અનુસરીને કંપનીએ કોઈ શેર ફાળવ્યા નથી.
- (ગ) સરવૈયાની તારીખના તરત પહેલાંના ૫ વર્ષના સમયગાળા દરમિયાન, કંપનીને કોઈ શેરની પરત ખરીદી કરી નથી.

પ્રમોટરોના હોલ્ડિંગની વિગતો

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
ઇક્વિટી શેર્સની સંખ્યા		
ગુજરાતના રાજ્યપાલ શ્રી	૪,૯૩,૯૩,૧૭૨.૦૦	૪,૯૩,૯૨,૪૬૨.૦૦
જીયુવીએનએલ	૧૯,૩૦,૦૧૩.૦૦	૧૯,૩૦,૦૧૩.૦૦
ગુજરાત સરકારના નામનિયુક્ત	૩૨.૫૦	૩૨.૫૦
જીયુવીએનએલના નામનિયુક્ત	૩૨.૫૦	૩૨.૫૦
વ્યક્તિગત	૨૦.૫૦	૨૦.૫૦
શેર હોલ્ડિંગની ટકાવારી (%)		
ગુજરાતના રાજ્યપાલશ્રી	૯૬.૨૩૯૩%	૯૬.૨૩૯૩%
જીયુવીએનએલ	૩.૭૬૦૫%	૩.૭૬૦૬%
ગુજરાત સરકારના નામનિયુક્ત	૦.૦૦૦૧%	૦.૦૦૦૧%
જીયુવીએનએલના નામનિયુક્ત	૦.૦૦૦૧%	૦.૦૦૦૧%
વ્યક્તિગત	૦.૦૦૦૦%	૦.૦૦૦૦%

નોંધ-૧૨

અન્ય ઇક્વિટી

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
સામાન્ય અનામત	૩૭.૭૬	૩૭.૭૬
જાળવી રાખેલી આવક	૬૯,૭૦૨.૬૮	૬૦,૫૭૮.૪૫
ફાળવણી બાકી હોય એવા શેર્સના અરજી નાણાં	૦.૨૯	-
અપ્રાપ્ત નફા/ નુકસાન દર્શાવતી અનામત	૮,૭૯૦.૯૯	૮,૯૦૪.૧૦
કુલ અન્ય ઇક્વિટી	૭૮,૫૩૧.૭૨	૭૦,૫૨૦.૩૦

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
સામાન્ય અનામત		
ઉઘડતી સિલક	૩૭.૭૬	૩૭.૭૬
કુલ સામાન્ય અનામત	૩૭.૭૬	૩૭.૭૬

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
જાળવી રાખેલી આવક ઉઘડતી સિલક વત્તા : વર્ષ દરમિયાન નફો	₹૦,૫૭૮.૪૫ ૮,૧૨૪.૨૪	₹૬,૪૫૪.૩૪ ૪,૧૨૪.૧૧
જાળવી રાખેલી કુલ આવક	₹૮,૭૦૨.૬૮	₹૦,૫૭૮.૪૫

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
ફાળવણી બાકી હોય એવા શેર્સના અરજી નાણાં ઉઘડતી સિલક વત્તા : વર્ષ દરમિયાન ઉમેરો બાદ : વર્ષ દરમિયાન ઘટાડો	- ૧.૦૦ (૦.૭૧)	- ₹૨૦.૦૦ (₹૨૦.૦૦)
ફાળવણી બાકી હોય તેવા શેર્સના કુલ શેર અરજી નાણાં	૦.૨૯	-

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
અપ્રાપ્ત નફો/ નુકસાન દર્શાવતી અનામતો એફ.વી.ઓ.સી.આઇ.- ઇકિવટી રોકાણ ઉઘડતી સિલક એફ.વી.ઓ.સી. આઇ. ઇકિવટી ખતોની વાજબી કિંમતમાં વધારો/ (ઘટાડો) નિવૃત્તિ પછીના લાભોની જવાબદારીની પુનઃ ગણતરી આ બાબતોને લગતો આવક વેરો	₹૮,૮૦૪.૧૦ (₹૧,૧૧૧.૧૩) (₹૨.૮૦) ૦.૮૨	₹૪,૨૭૭.૨૨ ₹૫,૬૨૭.૬૬ (₹૧.૧૦) ૦.૩૨
અપ્રાપ્ત નફો/ નુકસાન દર્શાવતી અનામતો	₹૮,૭૯૦.૯૯	₹૮,૮૦૪.૧૦

નોંધ-૧૩ જોગવાઈઓ

₹કમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
બિન ચાલુ ગ્રેચ્યુઇટી માટેની જોગવાઈ રજાના રોકડમાં રૂપાંતર માટેની જોગવાઈ એસેટ રીટાયરમેન્ટ ઓબ્લીગેશન-એઆરઓ	₹૧૮.૦૦ ₹૧૫૧.૭૮ ₹૧,૩૮૮.૩૨	₹૮.૮૨ ₹૧૩૩.૭૪ ₹૧,૨૮૫.૪૮
કુલ બિન ચાલુ જોગવાઈઓ	₹૧,૫૫૮.૧૧	₹૧,૪૨૮.૦૩
ચાલુ ગ્રેચ્યુઇટી માટે જોગવાઈ ખર્ચ માટે જોગવાઈ	₹૪.૨૫ ₹૨૦.૧૩	₹૪.૪૫ ₹૮.૧૮
કુલ ચાલુ જોગવાઈઓ	₹૨૪.૩૮	₹૧૨.૬૪

નોંધ : ૧૪ વિલંબિત કરમિલકતો/ (જવાબદારી)

₹કમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
વિલંબિત કર મિલકતો	₹૫૪૧.૮૫	₹૪૩૧.૫૨
સરવાળો...	₹૫૪૧.૮૫	₹૪૩૧.૫૨
વિલંબિત કર જવાબદારી	₹૪,૮૦૨.૦૦	₹૪,૬૧૦.૧૪
સરવાળો	₹૪,૮૦૨.૦૦	₹૪,૬૧૦.૧૪
ચોખ્ખી વિલંબિત કર (મિલકતો/ જવાબદારી)	₹૪,૨૬૦.૧૫	₹૪,૧૭૮.૬૨

નોંધ- ૧૫ અન્ય જવાબદારીઓ

₹કમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
બિન ચાલુ ધંધા સંબંધી ચુકવવાપાત્ર (ક) સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને નાના ઉદ્યોગ સાહસો સિવાયના લેણદારોનું કુલ બાકી લેણું (ખ) સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને નાના ઉદ્યોગ સાહસોનું કુલ બાકી લેણું અન્ય	₹૩૦૪.૫૫ - ₹૫,૦૩૮.૫૮	₹૨૧૮.૭૪ - ₹૫,૦૫૮.૭૩
કુલ બિન ચાલુ જવાબદારીઓ	₹૫,૩૪૩.૧૪	₹૫,૨૭૮.૪૭

ચાલુ વૈધાનિક જવાબદારી	૩૮૧.૦૨	૩૦૫.૨૪
ચુકવવાપાત્ર કર્મચારી લાભો	૦.૧૮	૧.૮૮
ગ્રાહકો પાસેથી પેશગી	૨૧,૫૬૪.૦૩	૨૦,૮૫૪.૦૩
વપરાશ બાકી હોય એવી ગ્રાન્ટ	૬૯૪.૨૩	૩,૬૦૪.૭૦
ગ્રાન્ટ પર ચુકવવાપાત્ર વ્યાજ	૪૪.૭૧	-
ગ્રાન્ટ પર જંગલ ચુકવવાપાત્ર વ્યાજ	૧,૧૨૨.૮૭	૧,૧૨૨.૮૭
અર્નેસ્ટ મની ડિપોઝીટ	૧૮૨.૧૧	૨૨૬.૦૭
ચુકવવાપાત્ર સીએસઆર	૩૩૫.૮૭	૨૭૨.૧૧
અન્ય	૨૧,૨૩૫.૧૨	૧૨,૫૪૬.૮૫
કુલ ચાલુ જવાબદારીઓ	૪૫,૫૭૦.૨૬	૩૮,૦૩૩.૭૬

નોંધ- ૧૬ ધંધા સંબંધી ચુકવવાપાત્ર

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો સિવાયના લેણદારોનાં બાકી લેણાં	૪૮૩.૨૪	૩,૨૮૫.૮૬
સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનાં કુલ બાકી લેણાં	૧૦૦.૭૦	-
ધંધા સંબંધી ચુકવવાપાત્ર કુલ રકમ	૫૮૩.૯૪	૩,૨૮૫.૮૬

* એજિંગ શીડ્યુલ અલગ નોંધ તેરીકે આપવામાં આવ્યું છે.

* માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ, ૨૦૦૬ હેઠળ ઘણાં સપ્લાયર્સની માહિતી કંપનીને મળી નથી. વધુમાં ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ કંપનીના શીરે કોઇ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનું એવું કોઇ લેણું નથી જે ૪૫ કરતા વધુ દિવસથી બાકી હોય. ઉક્ત અધિનિયમ હેઠળ જાહેર કરવી જરૂરી છે એવી આ માહિતી, કંપની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે પારખવામાં આવેલી આવી પાર્ટીઓ પૂરતી નક્કી કરવામાં આવી છે.

ધંધા સંબંધી ચુકવવાપાત્ર બાબતોનું એજિંગ શીડ્યુલ

ના.વ. ૨૦૨૧-૨૨

વિગતો	ચુકવણીની નિયત તારીખથી નીચેના સમયગાળા માટે બાકી #				સરવાળો
	૧ વર્ષ કરતાં ઓછો	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ કરતા વધુ વર્ષ	
(૧) એમએસએમઈ					-
(૨) અન્ય	૪૮૨.૪૮		૧૮.૩૭	૭૩.૦૮	૫૮૩.૯૪
(૩) વિવાદિત લેણાં - એમએસએમઈ					-
(૪) વિવાદિત લેણાં - અન્ય					-

ધંધા સંબંધી ચુકવવાપાત્ર બાબતોનું એજિંગ શીડ્યુલ

ના.વ. ૨૦૨૦-૨૧

વિગતો	ચુકવણીની નિયત તારીખથી નીચેના સમયગાળા માટે બાકી #				સરવાળો
	૧ વર્ષ કરતાં ઓછો	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ કરતા વધુ વર્ષ	
(૧) એમએસએમઈ					-
(૨) અન્ય	૩,૧૮૪.૩૮	૧૮.૩૭		૭૩.૦૮	૩,૨૮૫.૮૬
(૩) વિવાદિત લેણાં - એમએસએમઈ					-
(૪) વિવાદિત લેણાં - અન્ય					-

નોંધ- ૧૭

કામગીરીઓમાંથી આવક

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
માલસામગ્રીનું વેચાણ :		
લિગ્નાઈટ પ્રોજેક્ટ્સમાંથી આવક*	૩૭,૮૦૦.૭૬	૨૨,૬૮૦.૬૫
સેવાઓનું વેચાણ		
પટે આપવામાં આવેલા પ્લોટમાંથી આવક	૧,૭૧૦.૪૨	-
વીજળીના નિર્માણમાંથી આવક	૨,૮૮૭.૧૪	૨,૪૭૧.૭૮
બાદ : વીજળીના વેચાણ પર રિબેટ	(૪૫.૮૮)	(૧૧૮.૬૪)
બાદ : ડીએસએમ ચાર્જ્સ - વિંડ મીલ પ્રોજેક્ટ્સ	(૬.૪૮)	(૪.૬૦)
બાદ : ડીએસએમ ચાર્જ્સ - સોલાર પાવર પ્રોજેક્ટ્સ	(૨૬૦.૨૮)	(૧૭૫.૨૮)
બાદ : ગ્રીન ઇન્સેન્ટીવ અંગેનું ખર્ચ	-	(૩૨.૬૪)
	૪૨,૨૮૫.૫૫	૨૪,૮૨૧.૨૮
અન્ય કાર્યલક્ષી આવક		
પટા ભાડું	૬૫૬.૮૭	૧૪૬.૩૪
કામગીરી અને નિભાવ પેટે વસૂલ કરવામાં આવેલ	૨,૩૮૨.૧૨	૧,૮૨૪.૨૫
અન્ય કાર્યલક્ષી આવક	-	૦.૮૦
	૩,૦૩૯.૦૮	૨,૦૭૧.૪૦
કામગીરીઓમાંથી કુલ આવક	૪૫,૩૨૪.૬૪	૨૬,૮૯૨.૬૮

* જીપીસીએલ અને જીએસઈસીએલ વચ્ચે ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ (એફએસએ)ની પ્રક્રિયા ચાલુ છે. તેને આખરી રૂપ મળતાં તેનો અમલ કરવામાં આવશે. પરંતુ વચગાળાની વ્યવસ્થારૂપે, જીપીસીએલએ ઉત્ખનન ફી પેટે એમડીઓને ચુકવેલી રકમ છૂટી કરવા માટે જીએસઈસીએલને વિનંતી કરેલ છે.

નોંધ - ૧૮

અન્ય આવક

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
લાંબા ગાળાના રોકાણો અંગે ડિવિડન્ડ	૧૬૧.૦૪	૧૬૧.૦૦
લાંબાગાળાના રોકાણો અંગે ડિવિડન્ડ (બેંક)	-	-
પ્રાપ્ત થયેલ વીમાનો દાવો	૧૪.૩૧	૦.૧૩
ટેન્ડર ફી	૦.૦૮	૨.૨૬
પ્રકીર્ણ આવક	૮૨.૨૦	૨૩૬.૪૪
	૨૫૭.૬૪	૩૯૯.૮૩
કુલ અન્ય આવક	૨૫૭.૬૪	૩૯૯.૮૩

નોંધ- ૧૯

નાણા સહાયમાંથી આવક

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
વ્યાજની આવક		
ઇન્ટર કોર્પોરેટ ડિપોઝીટ અંગેનું વ્યાજ	૫,૪૧૪.૫૮	૪,૫૬૮.૨૭
થાપણો અંગેનું વ્યાજ	૨૮૮.૪૮	૩૬૮.૧૫
અન્ય વ્યાજ	-	૦.૦૨
કુલ નાણાકીય આવક	૫,૭૦૩.૦૮	૪,૯૩૬.૪૪

નોંધ- ૨૦

પ્લોટ્સના બાંધકામ અને વિકાસ અંગેનું ખર્ચ

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
સોલાર પાર્ક - ૧		
પ્લોટ્સના બાંધકામ અને વિકાસ અંગેના ખર્ચની ઉઘડતી સિલક	૩,૨૩૫.૩૦	૩,૨૩૫.૮૦
વત્તા : વર્ષ દરમિયાન થયેલ/ તબ્દીલ થયેલ	૪૬૦.૩૦	-
બાદ : વર્ષ દરમિયાન સમાયોજિત	(૧૫.૦૦)	(૦.૬૦)
બંધ થતી સિલક	(૨,૫૪૭.૭૮)	(૩,૨૩૫.૩૦)
બાંધકામનું ખર્ચ	૧,૧૩૨.૮૩	-
૭૦૦ મે.વો. રાધાનેસડા યુએમએસએસપી		
બાંધકામ અને પ્લોટના વિકાસના ખર્ચની ઉઘડતી સિલક	૨,૮૮૦.૩૭	૩૧૮.૨૪
વત્તા : વર્ષ દરમિયાન થયેલ/ તબ્દીલ થયેલ	૧,૧૧૧.૩૮	૨,૫૭૦.૩૮
બાદ : વર્ષ દરમિયાન સમાયોજિત	(૨૩૭.૮૨)	(૮.૨૬)
બંધ થતી સિલક	(૩,૭૫૩.૮૩)	(૨,૮૮૦.૩૭)
ધોલેરા પ્રોજેક્ટ	-	-
બાંધકામ અને પ્લોટના વિકાસના ખર્ચની ઉઘડતી સિલક	૦.૦૦	૧૭.૮૭
વત્તા : વર્ષ દરમિયાન થયેલ/ તબ્દીલ થયેલ	૩૩.૦૫	૧.૮૭
બાદ : વર્ષ દરમિયાન સમાયોજિત	-	-
બંધ થતી સિલક	(૩૩.૦૫)	(૧૮.૭૩)
બાંધકામનું ખર્ચ	-	-
બાંધકામ ખર્ચ અને પ્લોટના વિકાસ અંગેનું કુલ ખર્ચ	૧,૧૩૨.૮૩	-

નોંધ- ૨૧

ઉત્પાદન વિકાસ ખર્ચ

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
લિગ્નાઈટ ઉત્પાદન વિકાસ ખર્ચ	૩૪,૦૬૫.૧૪	૧૮,૭૫૮.૬૫
લિગ્નાઈટ ઉત્પાદન વિકાસ કુલ ખર્ચ	૩૪,૦૬૫.૧૪	૧૮,૭૫૮.૬૫

નોંધ - ૨૨

કર્મચારીઓના લાભો અંગેનું ખર્ચ

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
પગાર, વેતન અને ભથ્થાં	૨૧૭.૭૪	૨૪૧.૮૧
ભવિષ્ય નિધિ અને અન્ય ભંડોળમાં ફાળો	૧૮.૪૭	૩૦.૨૮
કર્મચારીઓ પૂરા પાડવા અંગેનું ખર્ચ	૪૫.૪૫	૪૮.૫૧
કર્મચારીવર્ગના કલ્યાણ માટે ખર્ચ	૧.૭૩	૦.૮૨
કર્મચારીઓના લાભો અંગેનું કુલ ખર્ચ	૨૮૩.૩૯	૩૨૧.૪૨

નોંધ- ૨૩

નાણા વ્યવસ્થા સંબંધી ખર્ચ

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
બેંક ગેરંટી ચાર્જ	૧૯.૨૮	૧૮.૫૪
અનુદાન પરનું વ્યાજ(*)	-	૧,૨૧૩.૮૧
અનુદાન પરનું વ્યાજ	૪૪.૭૧	
પટે ધારણ કરેલી મિલકતો પરનું વ્યાજ	૦.૮૪	૩.૩૮
એસેટ રીટાયરમેન્ટ ઓબ્લીગેશનની જોગવાઈ અંગે વળતર બાદ કરવું:	૧૦૨.૮૪	૮૫.૨૨
કુલ નાણા વ્યવસ્થાનું કુલ ખર્ચ	૧૬૭.૬૬	૧,૩૩૧.૦૫

(*) જીપીસીએલ સરકાર પાસેથી નાણાકીય સહય મેળવે છે અને તે ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ સર્વિસીસ લિમિટેડ (જીએસએફએલ લિ.)પાસે આઈસીડીમાં પાર્ક કરવામાં આવે છે. તેના પર જે વ્યાજ મળે છે તે જીપીસીએલએ સરકારને આપવાનું હોય છે. તેથી જીપીસીએલએ તેની આવક અને ખર્ચ ભરતીય હિસાબી ધોરણ ૧ મુજબ નોંધ્યું છે. ઉક્ત લેવડદેવડ નાણાકીય પત્રકોને સારી રીતે સમજી શકાય તે માટે નફા અને નુકસાનના પત્રકથી દર્શાવવામાં આવી છે કરણકે ભરતીય હિસાબી ધોરણ ૧ સ્પષ્ટપણે એમ જણાવે છે કે “ભરતીય હિસાબી ધોરણ હેઠળ જરૂરી હોય અથવા પરવાનગી આપવામાં આવી હોય તે સિવાય, કોઈ સંસ્થા મિલકત અને જવાબદારી અથવા આવક અને ખર્ચ સમસામે વાળશે નહીં”.

નોંધ- ૨૪

અન્ય ખર્ચ

રકમ (લાખ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
(ક) મરામત અને નિભાવ		
પ્લાન્ટ અને મશીનરી	૫૭૦.૮૩	૭૩૪.૫૨
વીમો	૭૭.૪૮	૭૫.૭૭
વ્યવસાયિક ફી	૫૨.૮૩	૩૮.૨૨
સમયપત્રક અને હિસાબો તૈયાર કરવાની ફી	૦.૮૨	૦.૮૮
પ્રવાસ ખર્ચ	૬.૮૭	૩.૨૦
વોટર ચાર્જીસ	૨૩.૮૨	૧,૧૬૭.૭૭
અન્ય મરામત અને નિભાવ	૨૧.૮૫	૨૮.૦૬
	૭૫૪.૯૧	૨,૦૪૮.૪૩
(ખ) અન્ય		
પટા ભાડું	૮૧.૬૫	-
ભાડું	૩૬.૦૮	૪૪.૪૬
મિલકતોની તબ્દીલી અંગેની ખોટ	૦.૨૨	૮૮૨.૭૫
દરો અને કરવેરા	૨૪.૩૦	૦.૪૮
જાહેરાત અને વેચાણ ખર્ચ	૧.૬૫	૭૧.૮૩
વીજ ખર્ચ	૬.૫૨	૭.૩૬
કરવેરા પર વ્યાજ	૭.૨૩	૦.૧૭
સી.એસ.આર./ડોનેશન (જુઓ નોંધ ૩૦(પ))	૨૪૨.૨૭	૪૦૫.૬૫
શકમંદ દેવાં	૧૫૩.૮૧	-
અન્ય ખર્ચ	૧૧૮.૫૨	૧૬૮.૫૨
સરવાળો..	૬૭૨.૨૪	૧,૫૮૨.૨૨
	૧.૫૮	૧.૧૫
(ગ) વૈધાનિક ઓડિટરો તરીકે	૧.૫૮	૧.૧૫
સરવાળો- અન્ય ખર્ચ (ક + ખ + ગ)	૧,૪૨૮.૭૫	૩,૬૩૨.૮૧

નોંધ- ૨૫

શેર દીઠ આવક

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૨ના મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૧ના મુજબ
નીચેના માટે ઇક્વિટી ધારકોને આપવાનો નફો		
મૂળભૂત આવક	૯૧,૨૪,૨૩,૮૭૧	૪૧,૨૪,૧૦,૮૩૯
ઘટેલી કિંમતની અસર માટે સમાયોજિત	-	-
નીચેના માટે ઇક્વિટી શેર્સની ભારિત સરેરાશ સંખ્યા		
મૂળભૂત શેરદીઠ આવક	૫,૧૩,૨૨,૭૦૩	૫,૦૬,૦૧,૪૧૭
ઘટેલી કિંમતની અસર માટે સમાયોજિત	૧૫૧	-
શેરદીઠ આવક		
મૂળભૂત	૧૭.૭૮	૮.૧૫
ઘટેલી	૧૭.૭૮	૮.૧૫

૨૨.૧ ભારતીય હિસાબી ધોરણ-૧૯ મુજબ ગ્રેજ્યુઇટી અને રજા પગારની જોગવાઈ અંગે જાહેરાત

કંપનીએ ભારતીય જીવન વીમા નીગમની ગ્રુપ ગ્રેજ્યુઇટી યોજનામાં ભાગ લીધો છે. ગ્રેજ્યુઇટી લાભો અને રજા પગારને લાભદાયી યોજનાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હોવાથી અને તેની ચુકવણી ભવિષ્યમાં કરવાની થતી હોવાથી તે સરવૈયાની તારીખે “એક્યુરીયલ” મૂલ્યે નક્કી કરવામાં આવે છે.

ગ્રેજ્યુઇટી અને રજા પગારનું મૂલ્ય નક્કી કરતી વખતે નીચેની ધારણાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિગત	૨૦૨૧-૨૨		૨૦૨૦-૨૧	
	ગ્રેજ્યુઇટી	રજા પગાર	ગ્રેજ્યુઇટી	રજા પગાર
આવરદા	ભારતીય નિશ્ચિત આવરદા (૨૦૧૨-૧૪) યુએલટી.		ભારતીય નિશ્ચિત આવરદા (૨૦૧૨-૧૪) યુએલટી.	
ઉપાડનો દર	યુવાન વયે ૫ ટકાના દરે જે ઘટીને વૃદ્ધ થયે ૧ ટકાના દરે		યુવાન વયે ૫ ટકાના દરે જે ઘટીને વૃદ્ધ થયે ૧ ટકાના દરે	
નિવૃત્તિ વય	૫૮ અને ૬૦ વર્ષ		૫૮ અને ૬૦ વર્ષ	
વળતરનો દર	૬.૧૦%	૬.૧૦%	૬.૦૫%	૬.૦૫%
આયોજિત મિલકતો અંગેના મળતરનો દર	૬.૪૫%	૬.૪૫%	૬.૪૫%	૬.૪૫%
પગાર વધારો	૭.૦૦%	૭.૦૦%	૭.૦૦%	૭.૦૦%

નીચેના કોષ્ટકમાં, ભારતીય હિસાબી ધોરણ-૧૯ “કર્મચારી લાભ” હેઠળ જરૂરી છે તે મુજબ ગ્રેજ્યુઇટી પ્લાન અને રજા પગારની સ્થિતિ નિયત કરવામાં આવી છે.

વિગત	૨૦૨૧-૨૨		૨૦૨૦-૨૧	
	ગ્રેજ્યુઇટી	રજા પગાર	ગ્રેજ્યુઇટી	રજા પગાર
લાભ સંબંધી જવાબદારીમાં ફેરફાર દર્શાવતો કોઠો				
નિર્ધારિત લાભ સંબંધી જવાબદારીની ઉઘડતી સિલક	૧૬૨.૦૦	૧૩૪.૦૦	૧૬૨.૦૩	૧૨૦.૮૩
વ્યાજ ખર્ચ	૯.૬૯	૮.૦૦	૧૦.૨૯	૭.૭૦
ચાલુ સેવા ખર્ચ	૪.૪૫	૫.૩૪	૫.૬૪	૫.૦૧
ચુકવવામાં આવેલ લાભ	-	-	(૧૭.૧૮)	(૧૧.૨૩)
જવાબદારી અંગેની એક્યુરીયલ ખોટ / (લાભ)	૪.૪૪	૪.૭૨	૧.૬૯	૧૧.૩૩
ભૂતકાળની સેવાનું ખર્ચ				
આ સમયગાળાના અંતે જવાબદારી	૧૮૧.૦૦	૧૫૨.૦૦	૧૬૨.૦૦	૧૩૪.૦૦

આયોજિત મિલકતોની વાજબી કિંમતમાં ફેરફાર દર્શાવતો કોઠો

આરંભમાં આયોજિત મિલકતોની વાજબી કિંમત	૧૪૮.૦૦	-	૧૫૪.૭૮	-
ઉઘડતા ભંડોળ સાથે સમાયોજન	-	-	-	-
આયોજિત મિલકતો અંગે અપેક્ષિત મળતર ફાળો	૧.૬૪	-	૦.૫૯	-
અનુભવસંબંધી સમાયોજનને કારણે એક્યુરિયલ ખોટ / (લાભ)	-	-	-	-
વ્યાજ આવક	૮.૯૬	-	૧૦.૦૧	-
ચુકવવામાં આવેલ લાભ	-	-	(૧૭.૧૮)	-
આયોજિત મિલકતો અંગે એક્યુરિયલ લાભ/(ખોટ)	-	-	-	-
આ સમયગાળાના અંતે આયોજિત મિલકતોની વાજબી કિંમત	૧૫૯.૦૦	-	૧૪૮.૦૦	-

વિગત	૨૦૨૧-૨૨		૨૦૨૦-૨૧	
	ગ્રેચ્યુઇટી	રજા પગાર	ગ્રેચ્યુઇટી	રજા પગાર
ધ્યાનમાં લેવામાં આવેલ ખરેખર લાભ/નુકસાન જવાબદારીઓ અંગે એક્યુરિયલ(લાભ)/ ખોટ	૧૪.૦૦	૪.૭૨	૭.૨૫	૧૧.૩૩
આયોજિત મિલકતો અંગે એક્યુરિયલ (લાભ)/ ખોટ	૧.૬૪	-	૦.૫૯	-
વર્ષ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખો એક્યુરિયલ (લાભ)/ ખોટ	૧૬.૦૦	૫.૦૦	૮.૦૦	૧૧.૦૦
સરવૈયામાં ધ્યાનમાં લેવામાં આવેલ રકમ	૧૮૧.૦૦	૧૫૨.૦૦	૧૬૨.૦૦	૧૩૪.૦૦
આ સમયગાળાના અંતે જવાબદારી	૧૫૯.૦૦	-	૧૪૮.૦૦	-
આ સમયગાળાના અંતે આયોજિત મિલકતની વાજબી કિંમત	૨૨.૦૦	૧૫૨.૦૦	૧૪.૦૦	૧૩૪.૦૦
સરવૈયામાં ધ્યાનમાં લેવામાં આવેલી ચોખ્ખી રકમ	-	-	-	-
નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલ ખર્ચ	૪.૪૫	૫.૩૪	૫.૬૪	૫.૦૧
ચાલુ સેવા ખર્ચ	૦.૭૩	૮.૦૦	૦.૨૮	૭.૭૦
વ્યાજ ખર્ચ	-	-	-	-
આયોજિત મિલકત અંગે અપેક્ષિત મળતર	-	-	-	-
ધ્યાનમાં લેવાની ચોખ્ખી એક્યુરિયલ ખોટ/ (લાભ)	-	૪.૭૨	-	૧૧.૩૩
ઉઘડતા ભંડોળ/ અગાઉના સમયના ચાલુ સાથે સમાયોજન	-	-	-	-
નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખું ખર્ચ	૫.૧૮	૧૮.૦૫	૫.૯૨	૨૪.૦૪
અન્ય સર્વત્રાહી આવકના પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલ ખર્ચ	-	-	-	-
નાણાકીય ધારણામાં ફેરફારને કારણે	(૦.૩૭)	(૦.૩૨)	૩.૧૨	૨.૭૭
વસ્તી સંબંધી ધારણામાં ફેરફારના કારણે	-	-	-	-
અનુભવ સંબંધી સમાયોજનને કારણે	૪.૮૧	૫.૦૪	(૧.૪૩)	૮.૫૬
વ્યાજ સંબંધી આવકમાં સમાવિષ્ટ રકમને બાદ કરીને આયોજિત મિલકતો અંગે મળતર	(૧.૬૪)	-	(૦.૫૯)	-
ઓસીઆઇમાં ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખો ખર્ચ	૨.૮૦	૪.૭૨	૧.૧૦	૧૧.૩૩

સંવેદના વિશ્લેષણ (Sensitivity Analysis)

અહેવાલની તારીખે, અન્ય ધારણાઓને અચળ રાખીને, કોઈ એક સંબંધિત એક્યુરિયલ ધારણામાં આવેલા, નોંધપાત્રીતે સંભવ ફેરફારોએ, નિર્ધારિત લાભસંબંધી જવાબદારીઓ પર નીચે દર્શાવ્યા મુજબ અસર કરી હોત.

ગ્રેચ્યુઇટી	૨૦૨૧-૨૨		૨૦૨૦-૨૧	
	વધારો	ઘટાડો	વધારો	ઘટાડો
વળતરનો દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧૭૭.૪૫	૧૮૪.૭૭	૧૫૮.૫૮	૧૬૬.૫૦
પગાર વૃદ્ધિ દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧૮૧.૮૧	૧૮૦.૨૩	૧૬૩.૬૦	૧૬૧.૭૪

રજા પગાર	૨૦૨૧-૨૨		૨૦૨૦-૨૧	
	વધારો	ઘટાડો	વધારો	ઘટાડો
વળતરનો દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧૪૮.૬૪	૧૫૫.૦૪	૧૩૦.૨૮	૧૩૭.૩૨
વળતરનો દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧૫૫.૦૦	૧૪૮.૬૫	૧૩૭.૨૭	૧૩૦.૩૧

૨૬. અસરકારક કર ગણતરી અને વિલંબિત કર મિલકતો/ (જવાબદારીઓ) (ચોખ્ખી)

રકમ (લાખ રૂપિયામાં)

કરસંબંધી ખર્ચ		
નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલી રકમ		
વિગત	૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરા થતા સમયગાળા માટે	૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે
ચાલુ આવકવેરો	૩,૩૨૨.૭૪	૧,૭૬૮.૧૮
વિલંબિત આવકવેરાની જવાબદારી/(મિલકત) ચોખ્ખી		
કામચલાઉ તફાવતનો ઉદ્ભવ અને તેનું રિવર્સલ	૮૨.૩૫	(૧૦૭.૭૪)
અગાઉ ધ્યાનમાં ન લેવામાં આવેલ કરવેરાના નુકસાન ધ્યાનમાં લીધું		
ધ્યાનમાં લેવામાં આવેલ કપાતપાત્ર કામચલાઉ તફાવતોમાં ફેરફાર		
વિલંબિત કર ખર્ચ	૮૨.૩૫	(૧૦૭.૭૪)
અગાઉના વર્ષની આવકવેરાની અધિક જોગવાઈ	-	(૧૬.૮૪)
વર્ષ માટે કુલ કર ખર્ચ	૩,૪૦૫.૦૯	૧,૬૪૪.૫૦
અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાનમાં લેવામાં આવેલી રકમ		
વિગત	૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરા થતા સમયગાળા માટે	૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે
નફા અથવા નુકસાન તરીકે પુનઃવર્ગીકૃત નહીં કરવામાં આવે તેવી બાબતો (ક)		
એફવીટીઓસીઆઈ ઈકિવટી ખાતોની વાજબી કિંમતમાં ફેરફાર	(૨.૮૦)	(૧.૧૦)
ઈકિવટી ખાતોની વાજબી કિંમતમાં ફેરફાર	(૧,૧૧૧.૧૩)	૫,૬૨૭.૬૬
	(૧,૧૧૩.૯૩)	૫,૬૨૬.૫૫
નફા અથવા નુકસાન તરીકે પુનઃ વર્ગીકૃત કરવામાં નહીં આવે તેવી આવકવેરાસંબંધી બાબતો (ખ)		
એફવીટીઓસીઆઈ ઈકિવટી ખાતોની વાજબી કિંમતમાં ફેરફાર	૦.૮૨	૦.૩૨
	૦.૮૨	૦.૩૨
અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવેલ ચોખ્ખી રકમ (ક+ખ)		
નિર્ધારિત નફા-યોજનાઓની પુનઃ માપણી	(૧.૮૮)	(૦.૭૮)
અન્ય સર્વગ્રાહી આવક થકી ઈકિવટી ખાતો	(૧,૧૧૧.૧૩)	૫,૬૨૭.૬૬
	(૧,૧૧૩.૧૧)	૫,૬૨૬.૮૮
અમલીકૃત આવકવેરાના દરનો હિસાબમેળ		
વિગત	૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરા થતા સમયગાળા માટે	૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે
કરવેરા પહેલાંનો નફો	૧૨,૫૩૩.૦૭	૫,૭૬૮.૬૧
કંપનીના ઘરેલુ કરવેરા દરનો ઉપયોગ કરીને કરવેરા ૨૮.૧૨ ટકાના દરે (અગાઉના વર્ષે ૨૮.૧૨ ટકા)	૩,૬૪૮.૬૩	૧,૬૭૮.૮૨
કરવેરાના દરમાં ઘટાડો		
નીચેનાની કર-અસર		
બિન-કપાતપાત્ર કરખર્ચ		
નફો અને નુકસાન ખાતા મુજબ ઘસારો	૪૧૮.૦૩	૪૧૨.૭૫
સીએસઆર ખર્ચ માટે	૭૦.૫૫	૧૧૮.૧૨
મંજૂર ન રાખવામાં આવેલી અન્ય બાબતો	૭૪.૮૭	૨૫૭.૧૦
ભારતીય હિસાબી ધોરણને કારણે અસર	(૮૧.૪૬)	(૩૫.૦૩)
કલમ-૪૩ ખ હેઠળ મંજૂર ન રાખવામાં આવેલી બાબતો		-
કર્મચારીઓનાં કલ્યાણ- શ્રમ ઉપકર, ગ્રેયુઇટી અને રજાના રોકડમાં રૂપાંતર માટે ભવિષ્યનિધિ ફાળા	૭.૫૮	૫.૭૭
અથવા વ્યવસ્થિત ફંડ અથવા ગ્રેયુઇટી ફંડ અથવા અન્ય કોઈ પણ ફંડમાં કપાત થકી ચૂકવવાપાત્ર રકમ		
કપાત		

આવકવેરા અધિનિયમ મુજબ ઘસારો	(૨૨૧.૮૨)	(૨૫૮.૦૦)
પરવાનગીપાત્ર કપાત-અન્ય		
ડિવિડન્ડની આવક	-	-
ઓસીઆઈમાં નોંધાયેલ એક્યુરિયલ ખોટ	(૦.૮૨)	(૦.૩૨)
ભારતીય હિસાબી ધોરણની ખાતા પર અસર	(૦.૧૯)	
પ્રકરણ-૬-ક હેઠળ કપાત	(૫૮૩.૬૨)	(૪૧૦.૦૪)
વિલંબિત કરની સ્વીકૃતિ	૮૨.૩૫	(૧૦૭.૭૪)
અગાઉના વર્ષો માટે ઓછી (અધિક) જોગવાઈ	-	(૧૬.૮૪)
નફો અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખું કરવેરા ખર્ચ	૩,૪૦૫.૦૮	૧,૬૪૪.૫૦

વિગતો	ચોખ્ખી સિલક ૧લી એપ્રિલ, ૨૦૨૧	૩૧મી માર્ચ, ૨૦૨૨			
		નફા અને નુકસાનમાં ધ્યાનમાં લેવાયેલ	ચોખ્ખી	વિલંબિત કર મિલકતો	વિલંબિત કર જવાબદારી
વિલંબિત કર મિલકત/ (જવાબદારીઓ)					
પીપીઈની ચાલુ કિંમત કર આધાર કરતાં વધુ હોવા અંગે	(૪,૦૮૫.૬૬)	(૭૯.૦૫)	(૪,૧૭૪.૭૧)	-	(૪,૧૭૪.૭૧)
જવાબદારીઓ બંધ કરવી- જોગવાઈ	૩૭૪.૩૩	૨૯.૯૫	૪૦૪.૨૮	૪૦૪.૨૮	-
એસેટ રીયાયરમેન્ટ ઓબ્લીગેશન- વિન્ડમીલ	(૧૧૩.૮૦)	૮.૧૫	(૧૦૫.૭૫)	-	(૧૦૫.૭૫)
નુકસાન આગળ ખેચ્યું	-	-	-	-	-
કામગીરી અને નિભાવની મળવાપાત્ર આવક	(૩૩૬.૫૬)	(૧૨૧.૬૫)	(૪૫૮.૨૨)	-	(૪૫૮.૨૨)
રોકાણની વાજબી કિંમત	(૧૧.૦૯)	૦.૭૩	(૧૦.૩૬)	-	(૧૦.૩૬)
અન્ય બાબતો -	(૫૨.૬૦)	-	(૫૨.૬૦)	-	(૫૨.૬૦)
દરો અને કરવેરા, રજાનું રોકડમાં રૂપાંતર, શ્રમ ઉપકર અને ગ્રેચ્યુઈટી	૫૭.૧૯	૭.૫૮	૬૪.૭૭	૬૪.૭૭	-
ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ને કારણે અસર	(૦.૩૨)	(૦.૦૩)	(૦.૩૫)	-	(૦.૩૫)
રોકાણનાં મૂલ્યમાં ઘટાડા માટે જોગવાઈ	-	૭૨.૮૦	૭૨.૮૦	૭૨.૮૦	-
કરવેરા સંબંધી મિલકતો/ (જવાબદારીઓ)	(૪,૧૭૮.૬૨)	(૮૧.૫૩)	(૪,૨૬૦.૧૫)	૫૪૧.૮૫	(૪,૮૦૨.૦૦)
સેટ-ઓફ કરવામાં આવેલ કર					
ચોખ્ખી કર મિલકતો (જવાબદારીઓ)	(૪,૧૭૮.૬૨)	(૮૧.૫૩)	(૪,૨૬૦.૧૫)	૫૪૧.૮૫	(૪,૮૦૨.૦૦)

૧. કંપની ચાલુ કર મિલકતો અને ચાલુ કર જવાબદારીઓ તથા વિલંબિત કર મિલકતો અને વિલંબિત કર જવાબદારીઓ, જે આવકવેરાઓ સમાન કર સત્તાધિકારી દ્વારા લેવામાં આવતા હોય, (કંપની) તેને સેટ-ઓફ કરવાની બાબત કાયદેસર રીતે લાગુ પાડવાનો અધિકાર ધરાવતી હોય તો અને તો જ કર મિલકતો અને જવાબદારીઓ સેટ-ઓફ કરે છે.

૨. આવકવેરા, વિલંબિત આવકવેરા મિલકતો અને જવાબદારીઓ તથા વિલંબિત આવકવેરા મિલકતોની વસૂલાતપાત્રતા માટેની જોગવાઈ નક્કી કરવા માટે વ્યવસ્થાપક મંડળે મહત્વનો નિર્ણય કરવો જરૂરી છે. વિલંબિત આવકવેરા મિલકતોની વસૂલાતપાત્રતા એ પ્રત્યેક ક્ષેત્રાધિકાર (જયુરીસડિક્શન)ના કરપાત્ર આવકના અંદાજો પર આધારિત છે. જેમાં સંબંધિત સંસ્થા કામ કરતી હોય અને એ સમયગાળા પર આધારિત છે જે દરમિયાન વિલંબિત આવકવેરા મિલકતોની વસૂલાત કરવાની હોય.

નોંધ-૨૭ સંબંધિત પાર્ટીઓ અંગે જાહેરાત

ભારતીય હિસાબી ધોરણ-૨૪ “સંબંધિત પાર્ટીઓ અંગે જાહેરાત” અને કંપની અધિનિયમ, ૨૦૧૩ મુજબ સંબંધિત પાર્ટીઓ સાથેની લેવડદેવડની જાહેરાત નીચે આપવામાં આવી છે.

ક. સંબંધિત પાર્ટીઓ

ક્રમ નં.	વિગતો	સંબંધ
૧.	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ	સહાયક કંપની
૨.	ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ	પ્રમોટર
૩.	સુનયના તોમર, આઈ.એ.એસ.	અધ્યક્ષ (૧૫/૦૬/૨૦૨૧ સુધી)
૪.	મમતા વર્મા, આઈ.એ.એસ.	અધ્યક્ષ (૦૮/૦૭/૨૦૨૧થી)
૫.	શ્રી એસ.બી. ખયલિયા	મેન. ડિરેક્ટર (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ) (૩૦/૦૮/૨૦૨૧ સુધી)
૬.	શ્રી વિકલ્પ ભારદ્વાજ, આઈ.એ.એસ.	મેન. ડિરેક્ટર (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ) (૧૧/૧૧/૨૦૨૧થી)
૭.	શ્રી પ્રફુલ હરદેવરાય રાણા	નિયામક
૮.	સુશ્રી દિપલ હડિયલ (૨૩/૧૨/૨૦૨૦થી)	નામનિયુક્ત નિયામક
૯.	શ્રીમેહુલ જે. ડનાયક	મુખ્ય નાણાકીય અધિકારી (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગ)
૧૦.	સુશ્રી કૃપા જોશી	કંપની સેક્રેટરી (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ)

ખ. સંબંધિત પાર્ટીઓ સાથેની લેવડદેવડો

(રકમ લાખ રૂ.માં)

ક્રમ નં.	વિગતો	૨૦૨૧-૨૨ રૂ.	૨૦૨૦-૨૧ રૂ.
ક.	વર્ષ દરમિયાન લેવડદેવડ		
	ગુ.ઊ.વિ.નિ.લિ.ને વીજળીનું વેચાણ	૧,૮૭૮.૫૯	૧,૩૨૧.૯૪
	નિયામક બેઠક ફી		
	શ્રી પી.એચ.રાણા	૦.૩૦	૦.૨૭
	મમતા વર્મા	૦.૦૯	-
	વિકલ્પ ભારદ્વાજ	૦.૧૮	-
	પી.કે.તનેજા	૦.૧૫	૦.૦૬
	દિપલ હડિયલ	૦.૨૧	૦.૦૩
	અંજુ શર્મા	-	૦.૦૬
	આર.જી દેસાઈ	-	૦.૦૬
	સુનયના તોમર	-	૦.૧૨
	નિયામકોનું ખર્ચ		
	શ્રી પી.એચ.રાણા	૦.૧૮	૦.૦૯
	આર.જી.દેસાઈ	-	૦.૦૧
	પ્રકાશ શાહ	-	-
	મહેશ સિંઘ	-	૦.૦૧
	મમતા વર્મા	૦.૦૬	-
	વિકલ્પ ભારદ્વાજ	૦.૧૨	-
	પી.કે.તનેજા	૦.૧૦	૦.૦૨
	અંજુ શર્મા	-	૦.૦૪
	સુનયના તોમર	-	૦.૦૪
	એસ.બી.ખયલિયા	૦.૦૪	૦.૦૯
	દિપલ હડિયલ	૦.૧૪	૦.૦૧
	પગાર અને ભથ્થાં		
	મેહુલ ડનાયક	૨૦.૩૮	૧૮.૧૧
	એસ.બી.ખયલિયા	૨૨.૧૩	૯૦.૧૪
	સુશ્રી કૃપા જોશી	૧૦.૧૬	૯.૨૬
ક્રમ નં.	વિગતો	૩૧મી માર્ચ, ૨૦૨૨ રૂ.	૩૧મી માર્ચ, ૨૦૨૧ રૂ.
ખ.	બંધ થતી સિલક		
	ગુ.ઊ.વિ.નિ.લિ. પાસેથી વીજળીના વેચાણ પેટે મળવાપાત્ર	૧૦૭.૨૨	૨૦૫.૪૧

નોંધ- ૨૮

ક. કક્ષાવાર અને તેમની વાજબી કિંમત મુજબ નાણાકીય ખતો

(રકમ લાખ રુ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ	ચાલુ રકમ				વાજબી કિંમત			
	એફ.વી.ટી.પી.એલ.	એફ.વી.ટી.ઓ.સી.આઈ.	ઋણ મુક્ત કરેલી રકમ	સરવાળો	સક્રિય બજારમાં લેવલ-૧ ભાવ પત્રકની કિંમત	લેવલ-૨ મહત્ત્વની અવલોકન પાત્ર ઇનપુટ	લેવલ-૩ મહત્ત્વની બિન અવલોકન પાત્ર ઇનપુટ	સરવાળો
નાણાકીય મિલકતો								
રોકાણો								
કવોટેડ		૧૦,૩૬૦.૪૪	-	૧૦,૩૬૦.૪૪	૧૦,૩૬૦.૪૪			૧૦,૩૬૦.૪૪
અનકવોટેડ		૧,૪૨૩.૪૯	-	૧,૪૨૩.૪૯			૧,૪૨૩.૪૯	૧,૪૨૩.૪૯
અન્ય નાણાકીય મિલકતો								
ચાલુ			૧,૦૨,૯૮૬.૬૭	૧,૦૨,૯૮૬.૬૭				
ધંધા સંબંધી મળવાપાત્ર			૮,૫૭૨.૬૯	૮,૫૭૨.૬૯				
રોકડ અને રોકડ સમાન			૧૪૬.૪૮	૧૪૬.૪૮				
અન્ય બેંક સિલક			૭,૭૪૪.૯૩	૭,૭૪૪.૯૩				
અન્ય નાણાકીય મિલકતો								
બિન ચાલુ			૧૮૮.૨૮	૧૮૮.૨૮			૧૮૮.૨૮	૧૮૮.૨૮
કુલ નાણાકીય મિલકતો		૧૧,૭૮૩.૯૩	૧,૧૯,૬૩૯.૦૬	૧,૩૧,૪૨૨.૯૯	૧૦,૩૬૦.૪૪		૧,૬૧૧.૭૭	૧૧,૯૭૨.૨૧
નાણાકીય જવાબદારીઓ								
કરજ								
બિન ચાલુ								
અન્ય નાણાકીય જવાબદારીઓ								
ચાલુ			૦.૬૦	૦.૬૦				
બિન ચાલુ			૫,૩૪૭.૭૪	૫,૩૪૭.૭૪				
ધંધાસંબંધી ચૂકવવાપાત્ર			૫૮૩.૯૪	૫૮૩.૯૪				
સરવાળો નાણાકીય જવાબદારીઓ			૫,૯૩૧.૬૮	૫,૯૩૨.૨૮				

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ	ચાલુ રકમ				વાજબી કિંમત			
	એફ.વી.ટી.પી.એલ.	એફ.વી.ટી.ઓ.સી.આઈ.	ઋણ મુક્ત કરેલી રકમ	સરવાળો	સક્રિય બજારમાં લેવલ-૧ ભાવ પત્રકની કિંમત	લેવલ-૨ મહત્ત્વની અવલોકન પાત્ર ઇનપુટ	લેવલ-૩ મહત્ત્વની બિન અવલોકન પાત્ર ઇનપુટ	સરવાળો
નાણાકીય મિલકતો								
રોકાણો								
કવોટેડ		૧૧,૦૯૦.૪૧	-	૧૧,૦૯૦.૪૧	૧૧,૦૯૦.૪૧			૧૧,૦૯૦.૪૧
અનકવોટેડ		૧,૮૦૪.૬૪	-	૧,૮૦૪.૬૪			૧,૮૦૪.૬૪	૧,૮૦૪.૬૪
અન્ય નાણાકીય મિલકતો								
ચાલુ			૮૪,૬૦૫.૨૪	૮૪,૬૦૫.૨૪				
ધંધા સંબંધી મળવાપાત્ર			૭,૪૯૨.૬૯	૭,૪૯૨.૬૯				
રોકડ અને રોકડ સમાન			૭,૩૩૪.૯૧	૭,૩૩૪.૯૧				
અન્ય બેંક સિલક			૭,૭૧૧.૯૨	૭,૭૧૧.૯૨				
અન્ય								
નાણાકીય મિલકતો			૧૮૮.૨૮	૧૮૮.૨૮			૧૮૮.૨૮	૧૮૮.૨૮
બિન ચાલુ		૧૨,૮૯૫.૦૬	૧,૦૭,૩૩૩.૦૬	૧,૨૦,૨૨૮.૧૦	૧૧,૦૯૦.૪૧		૧,૯૯૨.૯૨	૧૩,૦૮૩.૩૪
કુલ નાણાકીય મિલકતો								
નાણાકીય જવાબદારીઓ								
કરજ								
બિન ચાલુ								
અન્ય નાણાકીય જવાબદારીઓ								
ચાલુ			૦.૬૫	૦.૬૫				
બિન ચાલુ			૫,૨૮૨.૬૭	૫,૨૮૨.૬૭				
ધંધા સંબંધી ચૂકવવાપાત્ર			૩,૨૮૫.૮૬	૩,૨૮૫.૮૬				
સરવાળો નાણાકીય જવાબદારીઓ			૮,૫૬૮.૫૨	૮,૫૬૮.૫૨				

ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલ નાણાકીય મિલકતો અને જવાબદારીઓની વાજબી કિંમત, ઋણમુક્ત કિંમત કરતાં પ્રત્યક્ષ રીતે જુદી નથી. વધુમાં, ચાલુ ખતો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા નાણાકીય ખતો માટે નાણાંની સમયલક્ષી કિંમતની અસર વધુ નથી. તદનુસાર, વાજબી કિંમત અલગ રીતે જાહેર કરવામાં આવી નથી.

ઇનપુટના પ્રકારો નીચે મુજબ છે.

ઇનપુટ લેવલ-૧ (પ્રત્યક્ષ જોઈ શકાય તેવું) જેમાં સમાન પ્રકારની મિલકતો માટે સક્રિય બજારમાં કવોટ કરવામાં આવેલી કિંમતોનો સમાવેશ થાય છે, જેમકે સીક્યુરીટી એક્સ્ચેન્જ અંગેની કોઈ ઇકિવટી સીક્યુરીટી માટે દર્શાવવામાં આવેલી કિંમત.

ઇનપુટ-૨ (પરોક્ષ રીતે જોઈ શકાય તેવું) જેમાં સમાન પ્રકારની મિલકતો માટે સક્રિય બજારમાં ચાલતી કિંમતોનો સમાવેશ થાય છે, જેમ કે સક્રિય બજારમાં સમાન મિલકતો માટેની ‘કવોટેડ’ કિંમતો, સમાન પ્રકારના ધંધામાં થયેલી લેવડ દેવડમાં કિંમતોમાંથી તારવવામાં આવેલ “વેલ્યુએશન મલ્ટિપલ”.

ઇનપુટ લેવલ-૩ (પરોક્ષ રીતે જોઈ ન શકાય તેવું) જેમાં કોઈ વાજબી કિંમતે આવવા માટે વ્યવસ્થાપક મંડળે પોતે કરેલી ધારણાઓનો સમાવેશ થાય છે, જેમ કે કોઈ ધંધાનું મૂલ્ય નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ પ્રક્ષેપિત (પ્રોજેક્ટ) કેશ ફ્લોઝ.

ખ. વાજબી કિંમતની માપણી

મૂલ્ય નિર્ધારણની ટેકનિક અને જોઈ ન શકાય તેવા મહત્ત્વના ઇનપુટ

નીચેના કોઠાઓમાં લેવલ-૨ અને લેવલ-૩ની તેમજ જોઈ ન શકાય તેવા મહત્ત્વના ઇનપુટ માપણીમાં ઉપયોગમાં લેવામાં આવેલી મૂલ્ય નિર્ધારણની ટેકનિકો દર્શાવવામાં આવી છે.

વાજબી કિંમતે માપવામાં આવેલ નાણાકીય ખતો

અનકવોટેડ ઇકિવટી શેર્સમાં એફ.વી. ટી.ઓ.સી.આઈ.	<p>તબ્દીલી (ટ્રાન્ઝીશન)ની તારીખે ગૌણ સંસ્થાઓ અને ઇકિવટી ખાતાં ધરાવતી સંસ્થાઓમાં ઇકિવટી શેર્સમાં રોકાણો : જીએસઈજી- તબ્દીલીની તારીખે જીએસઈજીનું ઇકિવટી મૂલ્ય નિર્ધારણ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો (ડીસીએફ) પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. ઇકિવટીમાં ફી-કેશ ફ્લો (એફ.સી.એફ.ઇ.)માં ઇકિવટીની કિંમતના ૧૪ ટકા ઘટાડો ઇકિવટી મૂલ્ય નિર્ધારણ માટે કરવામાં આવ્યો છે.</p> <p>અન્ય સંસ્થાઓના ઇકિવટી શેર્સમાં રોકાણો :</p> <p>કાલુપુર બેંક : કાલુપુર બેંકમાંથી લોન લેતી વખતે તે બેંકના શેર્સમાં રોકાણ કરવામાં આવ્યું હતું, રૂ. ૨૫ની કિંમતે ૪૦૦ શેર્સ ખરીદવામાં આવ્યા હતા. આછતાં, ઉક્ત લોનની પરત ચુકવણી ૨૦૧૬-૧૭માં કરી દેવામાં આવી હતી અને તેથી ઉક્ત શેર્સ વેચી નાખવાની અપેક્ષા છે. ઉક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને અને તેની નજીવી કિંમતને અનુલક્ષીને ઉક્ત રોકાણ તેની ચાલુ કિંમતે દર્શાવવામાં આવ્યું છે.</p>
--	--

લેવલ-૧ અને લેવલ-૨ વચ્ચે ટ્રાન્સફર

અહેવાલના સમયગાળાઓ દરમિયાન લેવલ-૧ અને લેવલ-૨ વચ્ચે કોઈ ટ્રાન્સફર નથી.

લેવલ-૩ વાજબી કિંમત

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળાઓ માટેના ઉનકવોટેડ ઇકિવટી ખતોના મૂલ્યમાં તફાવત નીચે મુજબ છે.

(રકમ લાખ રૂ.માં)

વિગતો	રકમ
૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ	૧,૮૦૪.૬૪
અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાનમાં લેવામાં આવેલ નફો/ નુકશાન	(૩૮૧.૧૫)
૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૧,૪૨૩.૪૯

લેવલ-૩માંથી ટ્રાન્સફર

૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨નાં વર્ષો દરમિયાન લેવલ-૩માંથી કોઈ ટ્રાન્સફર ન હતી.

ખ. નાણાકીય જોખમ વ્યવસ્થાપન

કંપનીની મુખ્ય નાણાકીય જવાબદારીઓમાં લોન અને કરજો તથા ધંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમોનો સમાવેશ થાય છે. આ નાણાકીય જવાબદારીઓનો મુખ્ય હેતુ કંપનીની કામગીરીઓ માટે નાણા વ્યવસ્થા કરવાનો અને તેની કામગીરીઓની સહાય માટે ગેરંટી પૂરી પાડવાનો છે. કંપનીની મુખ્ય નાણાકીય મિલકતોમાં ધંધાસંબંધી તેમજ અન્ય મળવાપાત્ર રકમો, રોકડ અને રોકડ સમાન રકમો તેમજ કંપનીની કામગીરીઓમાંથી પ્રત્યક્ષ રીતે મેળવવામાં આવેલાં રોકાણોનો સમાવેશ થાય છે. કંપની નાણાકીય ખતોમાંથી ઊભાં થતાં નીચે મુજબના જોખમોની સંભાવના ધરાવે છે

૧. ધિરાણ સંબંધી જોખમ
૨. તરલતા સંબંધી જોખમ
૩. બજાર સંબંધી જોખમ

(૧) ધિરાણ સંબંધી જોખમ

ધિરાણ સંબંધી જોખમ એટલે એવું જોખમ જેમાં ગ્રાહકો અથવા નાણાકીય ખતમાં સામેનો પક્ષ તેની પાસેથી લેણી નીકળતી રકમ ચૂકવી ન શકે અને પરિણામે કંપનીને નાણાકીય ખોટ થાય. ધિરાણ સંબંધી જોખમ ઊભું થાય એવી સંભવિત પ્રવૃત્તિઓમાં રોકડ અને રોકડ સમાન રકમો, નાણાકીય સંસ્થાઓ પાસેના ડેરીવેટીવ ફાઇનાન્સીયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને થાપણો અને મુખ્યત્વે ગ્રાહકો પાસેથી ધિરાણ બાદ લેણી નીકળતી બાકી રકમોનો સમાવેશ થાય છે.

ધંધા સંબંધી મળવાપાત્ર

સંબંધિત અહેવાલની તારીખે ધંધા સંબંધી મળવાપાત્ર રકમોના મહત્ત્વના હિસ્સામાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને નોંધપાત્ર સરકારી પ્રભાવ ધરાવતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. વધુમાં, આ અંગે વ્યવસ્થાપક મંડળને ધિરાણ સંબંધી કોઈ જોખમની અપેક્ષા નથી.

અન્ય નાણાકીય મિલકતો

અન્ય નાણાકીય મિલકતોમાં રોકડ અને રોકડ સમાન રકમો, કર્મચારીઓને આપવામાં આવેલી લોન અને ગૌણ, સહાયક તથા સંયુક્ત સાહસો સિવાયની કંપનીઓના ઇકિવટી શેર્સમાં કરવામાં આવેલા રોકાણોનો સમાવેશ થાય છે.

- રોકડ અને રોકડ સમાન રકમો તથા બેંક થાપણો સારી સાખ તેમજ પર્યાપ્ત કેડિટ રેટીંગ ધરાવતી બેંકોમાં મૂકવામાં આવે છે. કંપની તેમની ધિરાણ-યથાર્થતાનું નિયમિત સમયાંતરે પુનર્વિલોકન કરે છે.

- રોકાણો ધિરાણ-યથાર્થ કંપનીઓમાં કરવામાં આવે છે.

(૨) તરલતા સંબંધી જોખમ

તરલતા સંબંધી જોખમ એટલે એવું જોખમ જેમાં કંપની, રોકડ અથવા અન્ય નાણાકીય મિલકત આપીને જેની પતાવટ કરવાની હોય એવી, તેની નાણાકીય જવાબદારીઓ સાથે જોડાયેલી જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલી અનુભવવાની હોય. કંપનીના નાણાકીય આયોજને શક્ય હોય ત્યાં સુધી એ સુનિશ્ચિત કર્યું છે કે જ્યારે પણ આવી જવાબદારી ઊભી થાય ત્યારે તેને પહોંચી વળવા માટે પૂરતી તરલતા સામાન્ય અને તંગ સ્થિતિઓમાં પણ, કંપની માટે અસ્વીકાર્ય નુકસાન અથવા જોખમ નોતર્યા વિના ઉપલબ્ધ હોય.

તરલતાસંબંધી જોખમની સંભાવના

અહેવાલની તારીખે નાણાકીય જવાબદારીઓના બાકીના પાકતા કરારો નીચે મુજબ છે. આ રકમો એકંદર/ ઘટાડવા વિનાની કિંમતો છે અને તેમાં અંદાજિત વ્યાજની ચુકવણીઓનો સમાવેશ થાય છે, 'નેટીંગ એગ્રીમેન્ટ'ની અસરોનો સમાવેશ થતો નથી.

(રકમ લાખ રૂ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૨	પાકતા કરારો પર આધારિત કેશ-ફ્લો			
	ચાલુ રકમ	સરવાળો	૧૨ મહિનાથી ઓછી	૧૨ મહિનાથી વધુ
નોન-ડેરીવેટીવ નાણાકીય જવાબદારી				
બિન ચાલુ કરજો	-	-	-	-
ચાલુ કરજો	-	-	-	-
બિન ચાલુ નાણાકીય જવાબદારીઓ	૫,૩૪૪.૧૪	૫,૩૪૪.૧૪	-	૫,૩૪૪.૧૪
ચાલુ નાણાકીય જવાબદારીઓ	૪૫,૫૭૦.૨૬	૪૫,૫૭૦.૨૬	૪૫,૫૭૦.૨૬	-
ઘંધાસંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમો	૫૮૩.૮૪	૫૮૩.૮૪	૫૮૩.૮૪	-
સરવાળો.	૫૧,૪૯૮.૩૫	૫૧,૪૯૮.૩૫	૪૬,૧૫૪.૨૦	૫,૩૪૪.૧૪

(રકમ લાખ રૂ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૧	પાકતા કરારો પર આધારિત કેશ-ફ્લો			
	ચાલુ રકમ	સરવાળો	૧૨ મહિનાથી ઓછી	૧૨ મહિનાથી વધુ
નોન-ડેરીવેટીવ નાણાકીય જવાબદારી				
બિન ચાલુ કરજો	-	-	-	-
ચાલુ કરજો	-	-	-	-
બિન ચાલુ નાણાકીય જવાબદારીઓ	૫,૨૭૮.૪૭	૫,૨૭૮.૪૭	-	૫,૨૭૮.૪૭
ચાલુ નાણાકીય જવાબદારીઓ	૩૮,૦૩૩.૭૬	૩૮,૦૩૩.૭૬	૩૮,૦૩૩.૭૬	-
ઘંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમો	૩,૨૮૫.૮૬	૩,૨૮૫.૮૬	૩,૨૮૫.૮૬	-
સરવાળો.	૪૭,૫૯૮.૦૯	૪૭,૫૯૮.૦૯	૪૨,૩૫૨.૬૨	૫,૨૭૮.૪૭

(૩) બજાર સંબંધી જોખમ

બજાર સંબંધી જોખમ એટલે એવું જોખમ જેમાં બજાર કિંમતમાં સંભવિત ફેરફારો અને ઘંધા પર તેની પડનારી વર્તમાન/ ભાવિ અસરોમાંથી જોખમ અથવા અનિશ્ચિતતા ઊભી થતી હોય. બજાર સંબંધી જોખમોમાં કિંમતલક્ષી જોખમ, ચલણલક્ષી જોખમ અને વ્યાજ-દર સંબંધી જોખમનો સમાવેશ થાય છે. કંપની માટે મુખ્ય કિંમતલક્ષી જોખમ વસ્તુઓની કિંમતોને લગતું એટલે કે કંપનીની નાણાકીય મિલકતો, જવાબદારીઓ અથવા અપેક્ષિત ભાવિ રોકડ પ્રવાહના મૂલ્યને વિપરિત અસર કરી શકે એવું કિંમતલક્ષી જોખમ છે.

ઇકિવટીની કિંમત સંબંધી જોખમ

કંપનીની ઇકિવટી સીક્યુરીટી કિંમતસંબંધી જોખમ કંપની દ્વારા ધારણ કરવામાં આવતાં રોકાણોમાંથી ઊભી થાય છે, જે સરવૈયામાં અન્ય સર્વગ્રાહી આવાક થકી વાજબી કિંમત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દર્શાવવામાં આવેલ ઇકિવટી ખતો એનએસસી નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં લિસ્ટેડ હોવાથી જાહેરમાં તેમની લે-વેચ થઈ શકે છે.

સંવેદનશીલતા (સેન્સિટીવીટી)

નીચેના કોષ્ટકમાં, આ સમયગાળા માટેની કંપનીની અન્ય સર્વગ્રાહી આવાકના ઇન્ડેક્સમાં વધારા/ઘટાડાની અસરોનો સારાંશ આપવામાં આવ્યો છે. આ વિશ્લેષણ એ ધારણા પર આધારિત છે કે સંબંધિત સમયગાળાઓ માટે રોકાણો તરીકે ધારણ કરવામાં આવેલા ઇકિવટી શેર્સની કવોટેડ કિંમતની સરેરાશ વધ-ઘટ (મુવમેન્ટ)ના ઇન્ડેક્સમાં વધારો થયો છે. અન્ય તમામ વધ-ઘટ અચળ રહી છે.

વિગતો	અન્ય સર્વગ્રાહી આવક પર અસર	
	૩૧મી માર્ચ, ૨૦૨૨ ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૧ ના રોજ
એનએસઈ નિફ્ટી-૫૦-૩૦ ટકા વધારો (૩૧મી માર્ચ, ૨૦૨૦- ૨૦ ટકા)	૩,૧૦૮.૧૩	૩,૩૨૭.૧૨
એનએસઈ નિફ્ટી-૫૦-૩૦ ટકા ઘટાડો (૩૧મી માર્ચ, ૨૦૨૦- ૨૦ ટકા)	(૩,૧૦૮.૧૩)	(૩,૩૨૭.૧૨)

વ્યાજદર જોખમ

વ્યાજદર જોખમ એ કાંતો વ્યાજબી કિંમત વ્યાજ દર જોખમ હોઈ શકે અથવા કેશ-ફ્લો વ્યાજ દર જોખમ હોઈ શકે. વાજબી કિંમત વ્યાજદર જોખમ એ વ્યાજ-દરોમાં વધ-ઘટ થવાને કારણે નિયત વ્યાજ ધરાવતાં રોકાણોની વાજબી કિંમતોમાં થતા ફેરફારનું જોખમ છે. કેશફ્લો વ્યાજ દર જોખમ એ વ્યાજના દરોમાં વધ-ઘટ થવાને કારણે ફ્લોટિંગ (અનિયત) વ્યાજ ધરાવતાં રોકાણો વાજબી કિંમતોમાં થતા ફેરફારનું જોખમ છે. કંપની વ્યાજના બદલાતા દરોએ કોઈ ન ઉપાડેલું કે બાકી કરજ ધરાવતી નથી અને તેથી તે વ્યાજદર સંબંધી કોઈ જોખમ ધરાવતી નથી.

ઘ. મૂડી વ્યાવસ્થાપન

મૂડીનું વ્યવસ્થાપન કરતી વખતે કંપનીના ઉદ્દેશ્યો નીચે મુજબના રહે છે.

- ચાલુ ધંધા તરીકેની કામગીરી કરવાની ક્ષમતાને સુરક્ષિત કરવી જેથી શેરધારકો માટે મળતર અને અન્ય હિતધારકો માટે લાભો પૂરા પાડી શકાય; અને
- મૂડીનું ખર્ચ ઘટાડવા માટે શ્રેષ્ઠતમ મૂડી-માળખું જાળવી રાખવું. કંપની “સમાયોજિત ચોખ્ખા દેવા”ના પ્રમાણમાં “સમાયોજિત ઇકિવટી”ના ગુણોત્તરનો ઉપયોગ કરીને મૂડી પર દેખરેખ રાખે છે. આ હેતુ માટે સમાયોજિત ચોખ્ખા દેવાને કુલ બિન ચાલુ જવાબદારીઓમાંથી બાદ કરવામાં આવેલી રોકડ અને રોકડ સમાન રકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ સમાયોજિત ચોખ્ખા દેવાની તુલનામાં ઇકિવટીનું પ્રમાણ નીચે મુજબ હતું.

વિગતો	૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ
કુલ બિન ચાલુ જવાબદારીઓ	૧૧,૧૬૬.૦૦	૧૦,૮૮૦.૩૧
બાદ : રોકડ અને બેંક સિલકો	૭,૮૮૧.૪૧	૧૫,૦૪૬.૮૪
સમાયોજિત ચોખ્ખું દેવું	૩,૨૭૪.૫૮	(૪,૧૫૬.૫૩)
કુલ ઇકિવટી	૧,૨૮૦.૦૯	૧,૨૧૮.૮૬
સમાયોજિત ચોખ્ખા દેવાની તુલનામાં સમાયોજિત ઇકિવટીનું પ્રમાણ	૦.૦૨૫:૧ વખત	-૦.૦૩૪:૧ વખત

નોંધ : ૨૮

કંપનીએ સંયુક્ત નિયંત્રણ ધરાવતી સંસ્થાઓમાં કરેલાં રોકાણોની વિગતો

ક્રમ નં.	સંસ્થાનું નામ	સંસ્થા જ્યાં સ્થાપવામાં આવી હોય તે દેશ	માલિકીમાં હિતના હિસ્સાનું પ્રમાણ	માલિકીમાં હિતના હિસ્સાનું પ્રમાણ	અન્ય ભાગીદારોનાં નામ	મૂખ્ય પ્રવૃત્તિઓ
૧.	ટ્રેન્ટ પીપાવાવ જનરેશન લિમિટેડ	ભારત	૫ ટકા	૮૫ ટકા	ટ્રેન્ટ પાવર લિમિટેડ	કોલસા આધારિત વીજ પ્લાન્ટ
૨.	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ	ભારત	૩૩.૩૩ ટકા	૩૩.૩૩ ટકા	કેરાલા સ્ટેટ ઇલેક્ટ્રીસિટી બોર્ડ ઔરિસા હાઇડ્રો પાવર કોર્પો. લિમિટેડ	આ કંપનીની ફળવહી રદ અકરવામાં આવી છે. આ બાબત ઓરિસાની નમદાર હાઇકોર્ટમાં નિર્ણયાધીન છે.
૩.	જીએસપીસી પીપાવાવ પાવર કંપની લિમિટેડ	ભારત	૨.૫૩ ટકા	૮૭.૪૬ ટકા	ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન	વીજળીનું ઉત્પાદન અને વિતરણ

નોંધ- ૩૦

- (ક) જીપીસીએલએ, કલેક્ટર, બનાસકાંઠા, પાલનપુરના તા.૨૦-૧-૨૦૧૬ના પત્ર મુજબ, ૭૦૦ મે.વો.ના અલ્ટ્રામેગા સોલાર પાવર પ્રોજેક્ટ માટે, વાવ તાલુકાના રાધાનાનેસના ગામ ખાતે ૧૪૦૭-૦૬-૮૮ ચો.મી.ની સરકારી જમીનનો અગ્રીમ કબજો મેળવી લીધો છે. આ જમીન જીપીસીએલને નવી સૌર નીતિની શરતોની જોગવાઈઓના આધારે સરકારને ચુકવણી કરવાની શરતને અધીન રહીને આપવામાં આવી છે. તે વર્ષ દરમિયાન હિસાબે લેવામાં આવી છે.
- (ખ) જીપીસીએલએ સોલાર પાર્ક માટે તા. ૩૦-૦૮-૨૦૧૧ના રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના હડસદ ગામ ખાતે ૫૧૦.૩૧.૩૧ હેક્ટરની સરકારી પડતર જમીનનો અગ્રીમ કબજો મેળવી લીધો છે. સરકારે જમીનની કિંમત નક્કી ન કરી હોવાથી તે હિસાબે લેવામાં આવી નથી.

- (ગ) જીપીસીએલએ સોલાર પાર્ક માટે તા. ૩૦-૦૮-૨૦૧૧ના રોજ બનાસકાંઠા જિલ્લાના, સુઈગામ તાલુકાના ઢુંગડા ગામ ખાતે ૮૧.૭૫.૩૮ હેક્ટરની સરકારી પડતર જમીનનો અગ્રીમ કબજો મેળવી લીધો છે. સરકારે જમીનની કિંમત નક્કી ન કરી હોવાથી તે હિસાબે લેવામાં આવી નથી.
- (ઘ) અગાઉના વર્ષના આંકડા, આ વર્ષના વર્ગીકરણ સાથે સુસંગત બનાવવા માટે જ્યાં જરૂરી જણાયું છે ત્યાં પુનઃ ગોઠવવામાં આવ્યા છે.
- (ચ) જીપીસીએલને એસએસએનએનએલ તરફથી ચારણકા સોલાર પાર્ક-૧ પ્રોજેક્ટ માટેના પાણી પુરવઠાના દાવા મુજબ, પાણીના ચાર્જસની રૂ.૨૩૦૮ લાખની કુલ ડિમાન્ડ (રૂ. ૧૧૨૬ લાખના વ્યાજ સહિત) પ્રાપ્ત થઈ છે.

કંપનીએ મુદ્દલ રકમની ચુકવણી ચાલુ નાણાકીય વર્ષમાં કરી દીધી છે અને તા. ૧૮/૦૩/૨૦૨૨ના રોજ મળેલી કંપનીની ૧૫૮મી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ, એસએસએનએનએલ દ્વારા દાવો કરવામાં આવેલી રૂ. ૧૧૨૬ લાખની રકમને આકસ્મિક જવાબદારી તરીકે દર્શાવવામાં આવી છે.

- (છ) ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈંડિયા (એસ.ઈ.સી.આઈ.) સાથે તેના ૧૦ મે.વો. ના સોલાર પાવર પ્રોજેક્ટ માટે રૂ.૧૭૫ લાખની વીજીએફ સહાય મેળવવા માટે ૨૦૧૪માં વાયેબીલીટી ગેપ ફંડીંગ સીક્યુટરાઈઝેશન એગ્રીમેંટ કર્યા છે.

તા.૨૭/૦૩/૨૦૧૪ના વીજીએફ સીક્યુટરાઈઝેશન એગ્રીમેંટના ખંડ ૨.૧(ક) મુજબ, એગ્રીમેંટના આર્ટિકલ ૨.૨માં જણાવવામાં આવેલી શરતોના અનુપાલનને અધીન રહીને, જીપીસીએલ રૂ. ૩.૧૭૫ લાખની વીજીએફ સહાય મેળવવાને પાત્ર છે. ઉપર જણાવેલા એગ્રીમેંટના ખંડ ૨.૧(ખ) મુજબ, રૂ.૧૭૫ લાખનું વીજીએફ છ હપતામાં છૂટું કરવામાં આવશે. ૫૦%નો પ્રથમ હપતો સંપૂર્ણ પરિયોજના ક્ષમતા સફળતાપૂર્વક શરૂ કર્યેથી છૂટો કરવામાં આવશે. બાકીના ૫૦% વીજીએફ ૧૦%ના સમાન પાંચ હપતામાં આગામી પાંચ વર્ષોમાં ક્રમશઃ રીતે, અન્ય શરતો તેમજ વીજનિર્માણની અન્ય જરૂરિયાતો પ્લાંટ દ્વારા સંતોષાય તે મુજબ છૂટું કરવામાં આવશે.

પરિયોજના માર્ચ, ૨૦૧૫માં સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી હતી. તેની વાણિજ્યિક કામગીરીની તરીખે મિલકતની કિંમત નક્કી કરવી અનિવાર્ય છે અને વાણિજ્યિક કામગીરી શરૂ કરવામાં આવે તે વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫માં તેની કિંમતમાંથી, મળવાપાત્ર કુલ વીજીએફ એટલે કે રૂ.૧૭૫ લાખની રકમ બાદ કરવી અનિવાર્ય છે. તદનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં જીપીસીએલએ તેના ઓડિટ થયેલા હિસાબના ચોપડાઓમાં, મળવાપાત્ર વાયેબીલીટી ગેપ ફંડીંગ ખાતાઓમાંથી રૂ.૧૭૫ લાખની રકમ ઊધારી અને તેટલીજ રકમ ૧૦ મે.વો.ના સોલાર પાવર પ્રોજેક્ટના ખાતામાં જમા કરતી એટ્રી કરી હતી કારણ કે આ પ્રોજેક્ટ માર્ચ, ૨૦૧૫માં સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો હોવાથી, ના.વ. ૨૦૧૪-૧૫માં એસઈસીઆઈ સાથેના વીજીએફ કરાર મુજબ જીપીસીએલ રૂ. ૧૭૫ લાખની રકમ મેળવવા હકદાર હતું. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં એસઈસીઆઈએ જીપીસીએલને પ્રથમ હપતા પેટે રૂ. ૮૭,૫૦,૦૦૦/-અને બીજા હપતા પેટે રૂ. ૧૭.૫ લાખની રકમ છૂટી કરી હતી. એસઈસીઆઈ તરફથી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો હપતો છૂટો થવાની પ્રતીક્ષા છે. તેથી, એગ્રીમેંટ મુજબ પ્લાન્ટ દ્વારા વીજનિર્માણની અન્ય જરૂરિયાતો તેમજ અન્ય શરતો સંતોષાવાની બાબતને અધીન રહીને, ૬ઠ્ઠા વર્ષના અંતે (માર્ચ-૨૦૨૦) અને વાર્ષિક રૂ.૧૭.૫૦ લાખના દરે રકમ છૂટી કરવાની થાય છે. એગ્રીમેંટ મુજબ અને વ્યવસ્થાપક મંડળના અભિપ્રાય પ્રમાણે આ રકમો એસઈસીઆઈ તરફથી મળવાપાત્ર છે અને તદનુસાર તે રકમોને એસઈસીઆઈ તરફથી મળવાપાત્ર રકમ તરીકે ૩૧મી માર્ચ, ૨૦૧૫ના રોજ હિસાબે લીધી છે અને મિલકત, પ્લાંટ અને સાધનસામગ્રીમાંથી તે રકમ બાદ કરી છે.

- (જ) જીપીસીએલએ તેના ૧૦૦૦ મે.વો. પીપાવાવ પાવર પ્રોજેક્ટ માટે ખરેખર પરામર્શન ફી પેટે લગભગ રૂ. ૧.૨૭ કરોડ ખર્ચ્યા છે. ગુજરાત સરકારે તેના તા. ૧૫મી ડિસેમ્બર, ૨૦૧૭ના પત્રથી માત્ર જમીન સંપાદન માટે કંપનીએ કરેલ ખર્ચનું વળતર આપવાનું સ્વીકાર્યું છે અને પરામર્શન ફી સહિત પ્રોજેક્ટ અંગે કરેલું અન્ય કોઈપણ ખર્ચ ચૂકવવાનો ઇન્કાર કર્યો છે. આમ છતાં બોર્ડ નિર્દેશ કર્યો છે કે જીપીસીએલએ ખરેખર પરામર્શન ફી પેટે ખર્ચેલા રૂ. ૧.૨૭ કરોડ સહિત કરેલા કુલ ખર્ચનું વળતર ચુકવવા માટે ગુજરાત સરકારને વિનંતી કરવી. પરંતુ આ બાબતમાં ગુજરાત સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. જીપીસીએલએલના તા. ૦૩/૦૨/૨૦૨૧ અને જીઆઈડીસીના તા. ૨૧/૦૮/૨૦૨૧ના પત્રને ધ્યાનમાં લેતાં, આ કંપનીના મતે આ દાવાની રકમ જીઆઈડીસી પાસેથી મેળવવામાં આવશે. વધુમાં, આ સંબંધમાં કંપનીને ગુજરાત સરકારનો તા. ૦૪/૦૩/૨૦૨૨નો પત્ર મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ વિભાગનાં તા. ૦૫/૧૨/૦૨૦૧૭ના પત્રથી જણાવવામાં આવેલા સરકારના નિર્ણયને અનુરૂપ યોગ્ય પગલાં લેવાં જોઈએ. આના પ્રતિભાવ રૂપે જીપીસીએલએ તેના તા. ૨૪/૦૩/૨૦૨૨ના પત્રથી સરકારશ્રીને, ઉપર જણાવેલી જીઆઈડીસીની દરખાસ્તજી સંદર્ભમાં નિર્દેશો આપવાની વિનંતી કરી છે. આ બાબતને ધ્યાનમાં લઈને જીપીસીએલએ, તેના ૧૦૦૦ મે.વો. પીપાવાવ પાવર પ્રોજેક્ટ માટે ખરેખર પરામર્શન ફી પેટે ખર્ચેલી રૂ. ૧.૨૭ કરોડની રકમની ચાલુ વર્ષે મળવાપાત્ર શકમંદ રકમ તરીકે હિસાબે લીધી છે. આ ઉપરાંત, કંપનીએ આ પ્રોજેક્ટ અંગે ફાળવવામાં આવેલ કેટલુંક ખર્ચ ચાર્જ કર્યું છે અને તેથી, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના હિસાબોના ચોપડામાં મળવાપાત્ર શકમંદ રકમ પેટે રૂ. ૧૫૪ લાખની કુલ જોગવાઈ કરી છે.

- (ઝ) કંપની જે અંગે નજીકના ભવિષ્યમાં પ્રત્યક્ષ નુકસાન ઊભું થાય એવા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ સહિત કોઈ લાંબાગાળાના કોન્ટ્રાક્ટ ધરાવતી નથી.
- (ટ) વ્યવસ્થાપક મંડળના મતે સ્થાયી મિલકતો અને બિન-ચાલુ રોકાણો સિવાયની મિલકતોનું મૂલ્ય સામાન્ય કામકાજ દરમિયાન સરવૈયામાં તે દર્શાવવામાં આવ્યું છે તેનાથી ઓછું ઉપજશે નહીં.

(થ) સિલકનું સમર્થન ન થવાને કારણે ૩૧/૦૩/૨૦૨૨ના રોજ પ્રાપ્ત થવા અને ચૂકવવાપાત્ર સિલકો, હિસાબ મેળ/પતાવટને કારણે કોઈ સમાયોજન કરવાનું થાય તો તેને અધીન રહેશે.

(દ) જીપીસીએલએ ટોરેન્ટ પીપાવાવ જનરેશનમાં રોકાણ કર્યું છે (જુઓ નોંધ-૩ “ગૌણ, સહયોગી અને સંયુક્ત સાહસોમાં રોકાણ”). ઘટાડાનું પરીક્ષણ, ઘટાડાની જરૂરિયાત સૂચવતી હોય એવી પરિસ્થિતિઓના અસ્તિત્વના આધારે કરવામાં આવે છે.

વધુમાં, આ સંબંધમાં કંપનીને ગુજરાત સરકારનો તા. ૦૪/૦૩/૨૦૨૨નો પત્ર મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ વિભાગનાં તા. ૦૫/૧૨/૨૦૨૧ના પત્રથી જણાવવામાં આવેલા સરકારના નિર્ણયને અનુરૂપ યોગ્ય પગલાં લેવાં જોઈએ. આના પ્રતિભાવરૂપે જીપીસીએલએ તેના તા. ૨૪/૦૩/૨૦૨૨ના પત્રથી સરકારશ્રીને, ઉપર જણાવેલી જીઆઈડીસીની દરખાસ્તના સંદર્ભમાં નિર્દેશો આપવાની વિનંતી કરી છે. આ બાબતને ધ્યાનમાં લઈને જીપીસીએલએ ઘટાડા પેટે રૂ. ૨૫૦ લાખની જોગવાઈ કરી છે.

(ર) જીપીસીએલએ બૈતરણી વેસ્ટ કોલ કંપનીમાં રોકાણ કર્યું છે (જુઓ નોંધ-૩ “ગૌણ, સહયોગી અને સંયુક્ત સાહસોમાં રોકાણ”). ઘટાડાનું પરીક્ષણ, ઘટાડાની જરૂરિયાત સૂચવતી હોય એવી પરિસ્થિતિઓના અસ્તિત્વના આધારે કરવામાં આવે છે.

જીપીસીએલ બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (બીડબલ્યુસીસીએલ)માં ૩૩.૩૩ ટકાનો પ્રમાણસરનો હિસ્સો ધરાવે છે. બીડબલ્યુસીસીએલને ફાળવવામાં આવેલો કોલ બ્લોક કોલસા મંત્રાલય, ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ બાબત ઓરિસ્સા હાઇકોર્ટમાં પડતર છે.

બીડબલ્યુસીસીએલ એ તેની ૪૬મી બોર્ડ મીટીંગમાં કંપની અધિનિયમ ૨૦૧૩ હેઠળ(બીડબલ્યુસીસીએલ)ને સ્વૈચ્છિક રીતે આટોપી લેવાની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે.

આથી જણાવવાનું કે તારીખ ૩૦/૦૭/૨૦૨૨ના રોજ મળેલી(બીડબલ્યુસીસીએલ)ની અસાધારણ સામાન્ય સભામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે તેની શેર મૂડી રૂપિયા ૩૦ કરોડથી (દરેક પ્રમોટર કંપનીનો રૂપિયા ૧૦ કરોડનો ફાળો)ઘટાડીને રૂપિયા ૬ કરોડ કરી દેવામાં આવે અને એ રીતે બાકીના રૂપિયા ૨૪ કરોડની રકમની શેર મૂડી ઘટાડવા માટે એનસીએલટીની મંજૂરી લીધા બાદ, પ્રમોટર કંપનીઓ એટલે કે ઓરિસ્સા હાઇડ્રો પાવર કોર્પોરેશન લિમિટેડ (ઓરિસ્સા રાજ્ય સરકારનો જાહેર ક્ષેત્રનું ઉપક્રમ), ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (ગુજરાત સરકારનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ) અને કેરાલા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (કેરાલા સરકાર) વચ્ચે સરખા ભાગે ચૂકવી દેવામાં આવે. તેથી આ સંયુક્ત સાહસમાં ઈકિવટીના ઘટાડા સંદર્ભે ચાલુ વર્ષે તેમાં કોઈ અસર આપવામાં આવી નથી.

આ ઉપરાંત કંપનીએ ઉપર જણાવેલી રૂપિયા ૬ કરોડની રકમ (બીડબલ્યુસીસીએલ) દ્વારા, ભવિષ્યમાં ઊભી થનારી સંભવિત આકસ્મિક જવાબદારીને પહોંચી વળવા તેમજ(બીડબલ્યુસીસીએલ)ને પ્રાપ્ત થનાર વ્યાજની રકમમાંથી (બીડબલ્યુસીસીએલ)ના રોજબરોજના ખર્ચને પહોંચી વળવા માટે અલગ રાખવામાં આવી હોવાનું માનવું છે.

(ધ) કંપની દ્વારા ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટના મુસદ્દાને આખરી રૂપ આપવામાં આવ્યું ન હોવાથી વ્યવસ્થાપક મંડળે, તેની મંજૂરી મળ્યા પછી, રૂ. ૩૭૯૦૧ લાખની રકમના લિગ્નાઇટના પુરવઠા માટે કામચલાઉ ધોરણે વચગાળાનું ઇનવોઇસ ઉગવવાનું નક્કી કર્યું હતું. સપ્લાય એગ્રીમેન્ટના મુસદ્દાને આખરી રૂપ આપવામાં થોડો વધુ સમય લાગશે એ હકીકતને ધ્યાનમાં લઈને આ રકમ ચાલુ વર્ષ માટે કામગીરીમાંથી આવક નોંધ-૧૭માં સમાવવામાં આવી છે.

(ન) હિસાબી ધોરણ-૧૧૫ મુજબ કામગીરીસંબંધી જવાબદારીઓ સંતોષકારક રીતે પૂરી થયેથી આવક ધ્યાનમાં લેવામાં આવે છે. ૭૦૦ મે.વો. અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ - રાધાનેસડા અને ૧૦૦૦ મે.વો. સોલાર પ્રોજેક્ટ - ધોલેરા શરૂ કરવામાં આવ્યા હતા અને તેમના અંગેની કામગીરીસંબંધી જવાબદારીઓ (કારારગત ફરજો) સંતોષકારક રીતે પૂરી કરવામાં આવી ન હતી. તેથી, ભારતીય હિસાબી ધોરણ-૧૧૫ હેઠળ નિયત કરવામાં આવેલી શરતો અને જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં, આ પ્રોજેક્ટ પૂરા થશે ત્યારે આવક ધ્યાનમાં લેવામાં આવશે. તેથી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આ બંને પ્રોજેક્ટ અંગેની આવક ધ્યાનમાં લેવામાં આવી નથી. ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલી રકમ નાણાકીય પત્રકોમાં ચાલુ જવાબદારીઓ રૂપે "ગ્રાહકો પાસેથી પેશગી" તરીકે દર્શાવવામાં આવી છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે પ્રોજેક્ટના એક ભાગ તરીકે નિર્ધારિત સમયે વીજ આધારમાળખાકીય સુવિધાઓ ઊભી કરવી ફરજિયાત છે પરંતુ કેટલાંક કારણોસર તેમાં વિલંબ થયો છે. હાલમાં, આ પ્રોજેક્ટ વીજળીની કામચલાઉ વ્યવસ્થાના આધારે શરૂ કરવામાં આવ્યો છે, તેથી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આવાકની ઓળખ કરવામાં આવી નથી.

(પ) ગુજરાત રાજ્ય માટે વીજ ક્ષેત્રમાં ટેકનીકલ માનવ સંસાધન ઊભું કરવાના વિચાર સાથે ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (જીપીઈઆરઆઈ) ઊભી કરવાના માટે જીપીઈઆરએફની રચના જાહેર ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવી હતી. જીપીઈઆરએફના પ્રમોટર ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) છે, જે ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કંપની છે. જીટીયુ દ્વારા ૧૯ મી માર્ચ ૨૦૨૦ના રોજ યોજવામાં આવેલી બેઠકમાં, જીપીઈઆરએફના સ્ટાફ અને જવાબદારીઓ સિવાયની તમામ મિલકતો સાથે ઉક્ત સંસ્થાને ઘટક કોલેજ તરીકે પોતાને હસ્તક લઈ લેવા માટે જીટીયુ તૈયાર થઈ હતી.

જીપીઈઆરઆઈને જુદી જુદી મિલકતો પૂરી પાડવા માટે જીપીસીએલએ લગભગ રૂ. ૧૧૮૫ લાખ ખર્ચ્યાં છે. ઉપરની બાબતને અનુસરીને, જીપીઈઆરઆઈએફ તમામ સ્થાવર અને જંગમ મિલકતો સાથે જીપીઈઆરઆઈ તા. ૧૧/૦૮/૨૦૨૦થી જીટીયુને સોંપી દીધી છે. આ મિલકતો પર

જીપીસીએલ ઘસારો ચાર્જ કરી રહ્યું છે. ઉપર જણાવેલી બાબતમાં લેવામાં આવેલા નિર્ણયને ધ્યાનમાં લઈને, કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં તા. ૧૦/૦૮/૨૦૨૦ સુધી ઘસારો ચાર્જ કર્યો છે અને હિસાબના ચોપડાઓમાં, ૩૧/૦૩/૨૦૨૧ના રોજ મુજબ રૂ. ૮૮૩ લાખની રાઈટ ડાઉન કરવામાં આવેલી કિંમત, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ મિલકતોની તબદીલી અંગેના નુકસાન તરીકે પી અને એલ ખાતામાં ઉધારવામાં આવી છે.

(ક) સેગમેન્ટ રિપોર્ટિંગ નીતિને ધ્યાનમાં લઈને, નાણાકીય પત્રકોમાંથી બાબતવાર જાહેરાત નીચે આપવામાં આવી છે.

વિગતો:	રકમ લાખ રૂપિયામાં
ઉત્પાદનો અને સેવાઓ વિશેની માહિતી:	
બહારના ગ્રાહકો પાસેથી આવક	૪૫,૩૨૪.૬૪
ભૌગોલિક વિસ્તારો વિશે માહિતી:	
બિન ચાલુ મિલકતો: (મૂળ દેશમાં)	
મિલકત, પ્લાન્ટ અને સાધનસામગ્રી	૨૮,૭૪૬.૬૪
ઉત્પાદન વિકાસ મિલકત	૩,૮૧૧.૮૬
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસમાં રોકાણ	૩,૧૮૩.૭૬
અન્ય બિન ચાલુ મિલકતો	૫,૫૫૬.૮૬

મુખ્ય ગ્રાહકો વિશેની માહિતી:

કંપનીના એક ગ્રાહક પાસેથી લિગનાઈટના પુરવઠામાંથી થયેલી આવક લગભગ રૂ. ૩૭૮૦૧ લાખ (કંપનીની કુલ આવકના ૮૩.૬૧%)

(બ) સીએસઆર માટે આ નાણાકીય વર્ષ દરમિયાન નીચે મુજબ ખર્ચ કરવામાં આવ્યું છે.

ક) ચાલુ વર્ષે (ના.વ. ૨૦૨૧-૨૨) કંપનીએ સીએસઆર માટે ખર્ચેલી જરૂરી એકંદર રકમ રૂ. ૧૨૮.૧૩ લાખ છે અને ગત વર્ષ (ના.વ. ૨૦૨૦-૨૧)ની આગાળ ખર્ચવામાં આવેલ વણવપરાયેલ રકમ રૂ. ૧૪૨.૨૧ લાખ છે. અને એ રીતે એકંદર રકમ રૂ. ૨૭૧.૩૪ લાખ છે.

તે પૈકી, ચાલુ વર્ષે (નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨), પાછલા વર્ષોના ફંડમાંથી ખર્ચ કરવામાં આવેલી રકમ રૂ. ૧૩૮.૬૭ લાખ છે અને ચાલુ વર્ષના ફંડમાંથી ખર્ચ કરવામાં આવેલી રકમ રૂ. ૩૮.૭૪ લાખ છે અને તેથી બાકી રહેલી વણવપરાયેલી રૂ. ૮૨.૮૩ લાખ છે. સીએસઆરની વણવપરાયેલી રકમ, અધિનિયમની કલમ ૧૩૫ (૬)ની જોગવાઈ મુજબ એક વિશેષ ખાતામાં તબદીલ કરવામાં આવી છે.

ખ) તા. ૨૪/૧૨/૨૦૧૪ની પર્યાવરણ સંબંધી મંજૂરી (ખંડ ક્રમાંક-૨૬) મુજબ, પ્રોજેક્ટ શરૂ કરનાર મુખ્ય કંપની જીપીસીએલ હોવાથી, ઉત્પાદનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તેણે સ્થાનિક સત્તામંડળો અને ગામો સાથે પરામર્શ કરીને, ખોદવામાં આવેલા લિગનાઈટના પ્રત્યેક ટન દીઠ રૂ.૫ના દરે સીએસઆર પ્રવૃત્તિઓ કરવાની રહેશે, જે વાર્ષિક ફુગાવાને અધીન રહેશે.

નાણાકીય વર્ષ ૧૮-૧૯ માટે જીપીસીએલએ ૫,૦૮,૧૮૪.૮૩ મે.ટ. લિગનાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ. ૨૫.૫ લાખની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે.

વધુમાં, નાણાકીય વર્ષ ૧૯-૨૦ માટે જીપીસીએલએ ૮,૧૭,૦૬૨.૧૯ મે.ટ. લિગનાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ.૪૦.૯ લાખની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે.

વધુમાં, નાણાકીય વર્ષ ૨૦-૨૧ માટે જીપીસીએલએ ૧૨,૭૧,૮૨૦.૫ મે.ટ. લિગનાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ.૬૩.૬ લાખની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે.

વધુમાં, નાણાકીય વર્ષ ૨૧-૨૨ માટે જીપીસીએલએ ૧૮,૫૦,૮૬૬.૧૩ મે.ટ. લિગનાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ.૧૧૩ લાખની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે.

ગ) વર્ષ દરમિયાન નીચે મુજબ રકમ ખર્ચવામાં આવી છે.

(રકમ લાખ રૂ.માં)

ક્રમ નં.	વિગતો	સરવાળો
૧.	કોઈ પણ મિલકતનું બાંધકામ/સંપાદન	-
૨.	ઉપર (૧) સિવાયના અન્ય હેતુ માટે	૧૭૮.૪૧
સરવાળો...		૧૭૮.૪૧

આકસ્મિક જવાબદારીઓ (રૂ. લાખમાં)

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ
બેંક ગેરંટી અને સિમાંત નાણાં	૭,૪૫૪.૧૩	૭,૪૩૧.૮૩
જુદાં જુદાં આકારણી વર્ષો માટે આવક વેરાની વિવાદિત માંગણી	૧૨,૪૪૧.૪૭	૧૧,૬૦૧.૧૬
તા. ૧૨-૧૧-૨૦૧૮ના રોજ મુજબ વિવાદિત સર્વિસ ટેક્સની માંગણી	૨,૮૪૪.૮૮	૨,૮૫૩.૬૫
અસલમાં મૂકવાના અને જેના માટેની જોગવાઈ કરવામાં આવી નથી એવા કરારોની અંદાજિત રકમ	૫,૭૦૮.૬૦	૫,૪૭૧.૦૦
એસએસએનએનએલના અકારવામાં આવ્યા મુજબના પાણી ખર્ચના વિવાદિત હકદાવો	૧,૧૨૬.૧૧	૨૮૫.૩૭
એસઈસીઆઈ સાથેનો વિવાદિત હકદાવો	૨૪૧.૦૮	૨૪૧.૦૮
ઓ.ઈ.ર ૨૬ થવાના કારણે ગ્રાહક સાથે વિવાદિત હકદાવો	૨૮૩.૩૫	૨૮૩.૩૫
સીઈઆરસી ઓ.ઈ.ર મુજબ પીજીસીઆઈએલ પેટેની જવાબદારી	૬,૨૩૫.૬૫	-
સરવાળો	૩૬,૪૪૫.૩૮	૨૮,૨૮૭.૫૩

નોંધ: ૩૧

અન્ય વૈધાનિક જાહેરાત

૧. એવી કોઈ મિલકત નથી જેમાં માલિકીહક અંગેની કોઈ સમસ્યા હોય અને તેથી માલિકીહક અંગેના ખતોસંબંધી જાહેરાત કરવામાં આવી નથી.
૨. કંપની કોઈ રોકાણસંબંધી મિલકત ધરાવતી નથી તેથી પુનઃમૂલ્યનિર્ધારણ અંગે કોઈ ટીકાટિપ્પણ આપવામાં આવ્યાં નથી.
૩. વર્ષ દરમિયાન કંપનીએ તેની કોઈ અમૂર્ત મિલકત અથવા તેની કોઈ સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રીની મિલકતનું પુનઃમૂલ્યનિર્ધારણ કર્યું નથી અને તેથી પુનઃમૂલ્યનિર્ધારણ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
૪. કંપની એવી કોઈ લોન અને પેશગીઓ ધરાવતી નથી, જે માગણી કર્યેથી અથવા પુનઃચુકવણી અંગેની કોઈ નિર્દિષ્ટ શરત વિના પુનઃચૂકવવાપાત્ર બનતી હોય. તેથી, સંબંધિત પક્ષકારોને આપવામાં આવેલ લોન અને પેશગીઓ અંગેની જાહેરાત કરવામાં આવી નથી.
૫. કંપની વિકાસ હેઠળની કોઈ અમૂર્ત મિલકત ધરાવતી નથી, જેથી વિકાસ હેઠળની અમૂર્ત મિલકત અંગેના સમયને લગતી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
૬. કંપનીના કોઈ ચાલુ મૂકી કામો ધરાવતી નથી અને તેથી વિકાસ હેઠળનાં ચાલુ મૂકી કામો અંગેના સમયને લગતી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
૭. કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા અથવા અન્ય નાણાં ધીરનારે કંપનીને ઈરાદાપૂર્વકની બાકીદાર (વીલ્ફુલ ડિફોલ્ટર) જાહેર કરી નથી.
૮. કંપનીઓના રજીસ્ટર દ્વારા જાળવવા આવતા રજીસ્ટરમાંથી જેને કાઢી નાખવામાં આવી હોય એવી કોઈ કંપની સાથે આ કંપની લેવડદેવડ ધરાવતી નથી.
૯. કંપનીઓના રજીસ્ટર પાસે વૈધાનિક સમયગાળા વીતી ગયા પછી પણ નોંધાવવાના બાકી હોય એવા કોઈ “ચાજ” અથવા “સેટીસ્ફેક્શન” કંપની ધરાવતી નથી.
૧૦. કંપની કોઈ ગૌણ કંપની ધરાવતી નથી અને તેથી કંપની (રીસ્ટ્રીક્શન્સ ઓન નંબર ઓફ લેયર્સ) રુલ્સ ૨૦૧૭ સાથે વાંચતા, અધિનિયમની કલમ ૨ ના ખંડ (૮૭) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા “નંબર ઓફ લેયર્સ” સંબંધિત અનુપાલન અંગે કોઈ ટીકા-ટિપ્પણ કરવામાં આવ્યાં નથી.
૧૧. વર્ષ દરમિયાન કંપનીએ કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૨૩૦ થી ૨૩૭માં નિર્દેશ કરવામાં આવ્યા મુજબની કોઈપણ ગોઠવણમાં ભાગ લીધો નથી.
૧૨. કંપનીએ એવી સમજ સાથે, તેનું કોઈ ભંડોળ (વ્યક્તિગત કે એકંદર એવું પ્રત્યક્ષ ભંડોળ), કોઈપણ વિદેશી સંસ્થા (મધ્યસ્થી સંસ્થા) સહિત, અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને, , પેશગી રૂપે અથવા લોન રૂપે આપ્યું નથી અથવા રોકાણ કર્યું નથી કે તે મધ્યસ્થી સંસ્થા -
 - પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, કંપની (આખરી લાભાર્થી) દ્વારા અથવા તેના વતી પારખવામાં આવેલ અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નાણા ધીરે અથવા
 - તેમનામાં નાણાનું રોકાણ કરે અથવા આખરી લાભાર્થીઓ વતી કોઈ બાંધધરી, જામીનગીરી અથવા એવું કોઈ ખત કરી આપે
૧૩. કંપનીએ, લેખિતમાં અથવા અન્યથા નોંધાયેલી કોઈ ત્રાહિત સંસ્થા (ભંડોળ આપનારી સંસ્થા) (આખરી લાભાર્થી) પાસેથી એવી સમજ સાથે કોઈ ભંડોળ (વ્યક્તિગત કે એકંદર એવું પ્રત્યક્ષ ભંડોળ), કોઈપણ ત્રાહિત સંસ્થા સહિત, અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી, પેશગી રૂપે અથવા લોન રૂપે મેળવ્યું નથી અથવા તેનું રોકાણ કર્યું નથી કે કંપની -
 - પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, ભંડોળ આપનારી સંસ્થા દ્વારા અથવા તેના વતી પારખવામાં આવેલ અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નાણા ધીરે અથવા
 - તેમનામાં નાણાનું રોકાણ કરે અથવા આખરી લાભાર્થીઓ વતી કોઈ બાંધધરી, જામીનગીરી અથવા એવું કોઈ ખત કરી આપે
૧૪. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ ક્રિપ્ટો કરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સીમાં કોઈ લેવડદેવડ અથવા રોકાણ કર્યું નથી.
૧૫. કંપની એવી કોઈ બેનામી મિલકત ધરાવતી નથી જે ધારણ કરવા અંગે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય અથવા પડતર હોય.
૧૬. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ, કંપની બેંકો/નાણાકીય સંસ્થાઓ પાસેથી ચાલુ મિલકતોની જામીનગીરીના આધારે કોઈ કરજ લીધું નથી.

૧૭. ના.વ. ૨૧-૨૨ અને ના.વ. ૨૦-૨૧ના રેશિઓ નીચે દર્શાવવામાં આવ્યા છે.

રેશિયો	ન્યુમરેટર	ડી નોમીનેટર	ચાલુ સમયગાળો	અગાઉનો સમયગાળો	% તફાવત	તફાવતનું કારણ
ચાલુ રેશિયો	ચાલુ મિલકતો	ચાલુ જવાબદારીઓ	૨.૮૭	૨.૮૦	૨.૫ %	-
ડેટ ઈકિવટી રેશિયો	કુલ દેવું	શેર ધારકોની ઈકિવટી	૦.૦૦૦૦૩૪૬	૦.૦૦૦૦૪૩૨	-૧૯.૯ %	-
ડેટ સર્વિસ કવરેજ રેશિયો	ડેટ સર્વિસ માટેની કમાણી	ડેટ સર્વિસ (વ્યાજ અને પટાની ચુકવણી+મુદ્દલની પરત ચુકવણી)	૦.૦૧%	૦.૦૨%	-૪૨.૨%	ચાલુ વર્ષે નફામાં ખૂબ જ વધારો થયો છે.
ઈકિવટી ઉપર મળતર રેશિયો	કરવેરા પછીનો ચોખ્ખો નફો- પ્રેફરન્સ ડિવિડન્ડ	શેરધારક ની સરેરાશ ઈકિવટી	૮%	૪%	૧૦૭.૯%	ચાલુ વર્ષે નફામાં ખૂબ જ વધારો થયો છે.
માલસામાનના વકરા સંબંધિત રેશિયો	વેચાયેલા માલ સામાન ની કિંમત	સરેરાશ માલ સામાન	૦.૧૮	૦.૦૦	૧૮.૧%	-
ધંધા સંબંધી મળવાપાત્ર અને વકરો રેશિયો	ચોખ્ખું ધિરાણ વેચાણ (એકંદર ક્રેડિટ સેલ્સ-વેચાણ પરત)	ધંધા સંબંધી મળવા પાત્ર સરેરાશ રકમ	૫.૬૪	૨.૦૮	૧૭૦.૭%	ચાલુ વર્ષે વેચાણમાં ખૂબ જ વધારો થયો છે.
ધંધા સંબંધી ચૂકવવા પાત્ર અને વકરા અંગેનો રેશિયો	ચોખ્ખી ધિરાણ ખરીદી (એકંદર ધિરાણ ખરીદી-ખરીદી પરત)	ધંધા સંબંધી ચૂકવવા પાત્ર સરેરાશ રકમ				
ચોખ્ખી મૂડી વકરાનો રેશિયો	ચોખ્ખું વેચાણ(કુલ વેચાણ- વેચાણ પરત)	કાર્યકારી મૂડી (ચાલુ મિલકતો- ચાલુ જવાબદારીઓ)	૦.૫૨	૦.૩૫	૪૮.૬%	ચાલુ વર્ષે વેચાણમાં ખૂબ જ વધારો થયો છે.
ચોખ્ખા નફાનો રેશિયો	ચોખ્ખો નફો	ચોખ્ખું વેચાણ (કુલ વેચાણ- વેચાણ પરત)	૨૦.૧૩%	૧૫.૩૪%	૩૧.૩%	ચાલુ વર્ષે વેચાણમાં ખૂબ જ વધારો થવાને કારણે ચોખ્ખા નાફામાં વધારો થયો છે.
રોકવામાં આવેલી મૂડી ઉપરનું મળતર	વ્યાજ અને કરવેરા પહેલાની આવક	રોકવામાં આવેલી મૂડી (અમોર્ત ચોખ્ખું મૂલ્ય+ કુલ દેવું+ વિલંબિત કર જવાબદારી)	૬.૬૮%	૪.૭૩%	૪૧.૩%	મૂડી એટલી જ રહી છે પરંતુ નફાકારકતામાં નોંધપાત્ર વધારો થયો છે.
રોકાણ ઉપરનું વળતર	વ્યાજ (નાણાકીય આવક)	રોકાણ	૪૮.૪૯%	૩૮.૩૦%	૨૬.૬%	રોકડ પ્રવાહ અને કાર્યકારી મૂડીમાં વધારો થવાથી રોકાણમાં વધારો થવાને કારણે.

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧w

વતી
જીજ્ઞા એચ. શાહ
ભાગીદાર
સભ્ય નં. ૧૪૧૮૨૫

તારીખ: ૧૯/૧૨/૨૦૨૨
સ્થળ: અમદાવાદ
યુ.ડી.આઈ.એન: ૨૨૧૪૧૮૨૫બીજીબીઈએક્સએલ૭૨૭૭

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : ૫૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧)

વતી
મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
વતી
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫

વતી
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી
વતી
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૯૩૯૬૨૨૨
તારીખ: ૧૯/૧૨/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર

Government Report under section 395 of the Companies Act with regard to the performance of Gujarat Power Corporation Limited (GPCL) for the year ending on 31/03/2022.

The 32nd Annual Report of GPCL has been received by Government on 01/03/2022. The corporation has attained remarkable achievements during the year under report. GPCL was engaged in various activities involving planning of different energy related projects and their stages of implementation during 2021-2022. The corporation has generated income of ₹ ₹ 512.96 crore during the year 2021-2022 compared to ₹ 322.31 crore during the year 2020-2021 and recorded profit of ₹ 125.33 crore compared to the profit of ₹ 57.69 crore in the year 2020-2021.

Considering the requirement of fund for upcoming project, it has been decided to retain the profit in the current year. Therefore, no dividend has been announced during the year under report. As the State Government has an investment of more than 51% in this corporation, GPCL is a government company. As on 31/03/2022, the paid up share capital of the company is ₹ 513.23 crore against the authorized share capital of ₹ 600 crore.

The company has been playing the role of a developmental catalyst in the field of energy in the state. The company identifies energy projects based on different kinds of fuel, identifies private/joint venture partners and implements the projects collectively with the identified partners. Once the projects are identified, the corporation undertakes the task of obtaining various statutory and administrative approvals such as approval with regard to water and air pollution, environmental and forest approval, approval with regard to civil aviation. The company completes the formalities to acquire land under the Land Acquisition Act and integrates energy projects with fuel. In several cases, the company implements the projects under memorandum of understanding executed with public enterprises.

During 2021-2022 following projects were in operation or under implementation.

1) GPCL Power Project (Windmill/Solar):

- (A) 6MW windmill power project at villages Manaba and Pethapur, Taluka Rapar, District Kutch
- (B) 10.5 MW windmill power project at Jamanwada, District Kutch
- (C) 4.2 MW windmill power project under the concept of hybridization at Charanka Solar Park, District Patan
- (D) 5 MW solar power project at Gujarat Solar Park, village Charanka, Taluka Santalpur, District Patan
- (E) 10 MW solar power project at Gujarat Solar Park, village Charanka, Taluka Santalpur, District Patan
- (F) 1 MW Rooftop Solar Project.

2) 6 MW solar power project with battery energy storage system:

Government of Gujarat and the Government of India jointly set up a first-of-its-kind demonstration project - Solarisation of Modhera Sun Temple & Town. The main aim of this project is to provide a round-the-clock solar power supply to Modhera Sun Temple & Town. The government of Gujarat has declared GPCL as an implementing agency for this project. A solar power project with a battery

energy storage system has been set up on 12 hectares of government land at Sujapur village in Mehsana district, 6 km away. The estimated project cost of the project is 80.66 Crore.

3) Various Solar Parks:

1. Gujarat Solar Park, District Patan:

Gujarat Power Corporation Limited is the nodal agency for developing Charanka solar park at village Charanka, Taluka Santalpur, District Patan Till date, 36 developers have installed aggregate 730 MW Solar capacity in this park.

2. 1000 MW (Phase-1) Dholera Ultra Mega Solar Park:

Gujarat government has given "in principle" approval to set up a 1000 MW solar power project at Dholera. The government of India and the Government of Gujarat have declared GPCL as implementing agency. At present, a total of 300 MW of solar power projects have been commissioned.

3. 700+ MW Raghnesda Ultra Mega Solar Park:

The park is located at Village Raghnesada Tal: Vav, District: Banaskantha. The park is operational with 485 MW of solar power generation, and 215 MW of solar projects are in progress. Infrastructural works such as highways, dams, communication, power infrastructure, water supply, electrification, and stormwater drains have been completed in the park. The park is managed by GPCL.

4. 30 GW khavda Renewable Energy Park (30,000 MW) :

Government of Gujarat has allotted 72400 Ha of wasteland for a 30 GW Renewable Energy Park at Khavda, near Vighakot Post, Adjoining International Border, District-Kutch in Gujarat under State Waste Land Policy. In this regard, "In Principle Approval" was given from MNRE and the Ministry of Defense for the setting up of RE Park. GPCL acts as the facilitating agency for the development of 30 GW of Renewable Energy in Gujarat. Till date Government of Gujarat has allotted Land for 25800 MW to various Solar/Wind/Hybrid Park developers viz Adani Green Energy Ltd., Gujarat Industries Power Company Ltd. Sarjan Realities Ltd. NTPC Renewable Energy Ltd. Gujarat State Electricity Corporation Ltd., and Solar Energy Corporation of India Ltd., etc.

4) MINING PROJECTS:

Bhavnagar Lignite Mining Projects.

To cater the fuel requirement of 500 MW Bhavnagar Lignite Thermal Power Station (BLTPS) Power Project at Bhavnagar, GPCL has been sanctioned three (03) Lignite Mining Leases, i.e.

- (1) Ghogha-Surka Mining Project (1355 hectares),
- (2) Khadsaliya-I Mining Project (712 hectares),
- (3) Khadsaliya-II Mining Project (914 hectares).

As of now, Ghogha-Surka Lignite Mining Lease is In-operation and the other two (02) mining leases are non-operating which will be operated in later stage looking to the actual lignite requirement of BLTPS.

The Ghogha Surka Lignite Mining Project is having a mining leases area of 1355 Ha with mineable reserve of 54.68 Million Tones. The rated production capacity of the mine is 2.25 Million Tone/year with average stripping ratio of 1:9.32. The life of the mine is 25 years. GPCL started the mining activities from April, 2018 onwards by appointing a Mine Developer Cum Operator (i.e. M/s P.C. Patel-Mahalaxmi-Simplex Consortium Pvt. Ltd.) and supplying sustained lignite to BLTPS from August, 2018 onwards. GPCL is supplying lignite to BLTPS as per their requirement. As of 31.03.2022; GPCL has supplied about 4.45 Million Tonnes of lignite to BLTPS




Mamta Verma

Principal Secretary




Energy and Petrochemicals Department



Address : Block No. 8, Sixth Floor,
Udhyog Bhavan, Sector 11,
Gandhinagar - 382 011
Phone : 079 - 23251255-60
Fax : 91-79-23251254
www.gpcl.gujarat.gov.in
CIN:U40100GJ1990SGC013961



ANNUAL REPORT 2021-2022



32nd ANNUAL REPORT 2021-22

GUJARAT POWER CORPORATION LIMITED

[CIN: CIN: U40100GJ1990SGC013961;

Registered Office: 6th Floor, Block Nos. 6 & 8 Udhog Bhavan, Sector – 11, Gandhinagar – 382 011

website: www.gpcl.gujarat.gov.in

Tel. No.: 079 – 23251255-60; Fax: 079-23251254]

Board of Directors:

Smt. Sunaina Tomar, IAS	:	Chairman (from 10.01.2020 to 15.06.2021)
Smt. Mamta Verma, IAS	:	Chairman (w.e.f. 09.07.2021)
Shri S. B. Khyalia	:	Managing Director (upto 01.10.2021)
Shri Vikalp Bharadwaj	:	Managing Director (w.e.f. 11.11.2021)
Smt. Anju Sharma, IAS	:	Woman Director (upto 28.07.2021)
Shri Praful H. Rana	:	Director
Ms. Dipal Hadiyal	:	Director (Nominee of FD, GoG)

Independent Directors:

Shri P. K. Taneja, IAS (Retd.)	:	Independent Director (w.e.f. 26.11.2020)
--------------------------------	---	--

Key Managerial Personnel (KMP)

Shri Mehul J. Danayak	:	Chief Financial Officer
Ms. Krupa N. Joshi	:	Company Secretary

Auditors:

Statutory Auditors	:	M/s. Anil N. Shah & Co. Chartered Accountants, Ahmedabad.
Secretarial Auditors	:	M/s. Dhara Patel, Company Secretaries, Practicing Company Secretary, Ahmedabad
Cost Auditors	:	M/s. P. H. Desai & Co., Cost Accountants, Ahmedabad

Bankers:

Axis Bank Ltd.
State Bank of India

INDEX

Sr. No.	Particulars	Page No.
1	Directors' Report	01
2	Comments of the Comptroller and Auditor General of India under Section 143 (6) (b) of the Companies Act, 2013 on the Financial Statements of Gujarat Power Corporation Limited for the year ended 31st March, 2022.	22
3	Auditors' Report	23
4	Balance Sheet	35
5	Statement of Profit & Loss	36
6	Cash Flow Statement	37
7	Statement of Changes in Equity	39
8	Notes to Financial Statements 1 to 31	40

DIRECTORS' REPORT

To,
The Members,
Gujarat Power Corporation Ltd. (GPCL).
Gandhinagar.

Your Directors are pleased to present the 31st Annual Report and Audited Statement of Accounts of the Company for the year ended on 31/03/2022 as below:

1. FINANCIAL RESULTS:

(Rs. In Crores)

Sr. No.	Particulars	2021-22	2020-21
1.	Total Revenue	512.96	322.31
2.	Total Expenditure	385.13	264.62
3.	Exceptional Items	(2.50)	-
4.	Profit before tax	125.33	57.69
5.	Tax including deferred tax	(34.09)	(16.44)
6.	Profit/ (Loss) after tax	91.24	41.25
7.	Other comprehensive income (OCI)	(11.13)	56.26
8.	Total comprehensive income for the period	80.11	97.51

2. DIVIDEND

During the year under review, the Company has earned profits but due to upcoming projects, your Directors do not recommend any dividend for FY 2021-22.

3. TRANSFER TO RESERVES

The Profit is carried to reserves.

4. TRANSFER OF UNCLAIMED DIVIDEND TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF):

The provisions of Section 125(2) of the Companies Act, 2013 do not apply to the Company as there are no unclaimed / unpaid dividends which are to be transferred to IEPF.

5. DEPOSITS

During the year ended March 31, 2022, the Company has not accepted any deposits from the public within the meaning of "Deposits" as defined under The Companies (Acceptance of Deposits) Rules, 2014. As such, Rule 8 (5)(v) & (vi) of the Companies (Accounts) Rules, 2014 read with Rule 3 (ii) of The Companies (Acceptance of Deposits) Rules, 2014, and section 73 of the Companies Act, 2013, are not applicable to the Company.

6. STATUS OF PROJECTS UNDERTAKEN:

A) POWER PROJECTS

1) GPCL OWN POWER PROJECT (WIND / SOLAR):

a.) 6 MW Wind Mill Power Project at Shikarpur:

GPCL has set up a 6 MW Wind Mill Project at villages Manaba & Pethapar, Taluka Rapar, District Kutch during the FY 2010-11. The Project is fully operational. In year 2021-2022, the project has generated 7.69 MUs of electricity and approx earned revenue of Rs. 2.73 Crores.

b.) 10.5 MW Wind Mill Power Project at Jamanwada.

GPCL has set up a 6.3 MW Wind Mill Project at Jamanwada in District Kutch during the FY 2011-12 and 4.2 MW Wind Mill Project at Jamanwada in F.Y. 2012-13. The Project is fully operational. In year 2021-2022, the Project has generated 13.41 MUs of electricity and approx earned revenue of Rs. 5.08 Crores.

c.) 4.2 MW Wind Mill Power Project at Charanka under Hybridization concept:

GPCL has set up a 4.2 MW Wind Mill Project at Charanka to experiment hybridization concept at Charanka during the FY 2012-13. The Project is fully operational. In year 2021-2022, the Project has generated 4.78 MUs of electricity and approx earned revenue of Rs. 1.7 Crores.

d.) 5 MW Solar Project at Charanka:

GPCL has set up a 5 MW Solar Power Project at Charanka during the FY 2011-12. The project is operational. In year 2021-2022, the Project has generated 6.42 MUs of electricity and approx earned revenue of Rs. 9.49 Crores.

e.) Solarisation of Modhera Sun Temple & Town:

Government of India and Government of Gujarat had jointly set up first-of-its-kind demonstration project - Solarisation of Modhera Sun Temple & Town. The main aim of this project is to provide round the clock solar power supply to Modhera Sun Temple & Town. Government of Gujarat has declared GPCL as an implementing agency for this project. The estimated project cost is Rs. 80.66 Crores and is expected to be completed in the mid of FY 2022-23.

2) Gujarat Solar Park.

Gujarat Solar Park is located at Charanka village, Santalpur, Taluka of Patan District. The integrated "Solar Park" has state of art infrastructure with provision to harness rain water besides power evacuation at the door steps. Installed capacity of 730 MW Solar Project has been commissioned by 36 developers.

3) 10MW Solar Power Project under JNNSM Phase II Scheme.

GPCL has commissioned another 10 MW Solar Power Project under JNNSM phase II Batch I scheme with an EPC cost of Rs. 62 Crs. The project was commissioned on 20.03.2015. In year 2021-2022, the project has generated 22.55 MUs and earned revenue of 10.04 Crores.

4) GPCL's Own 1-MW Solar Rooftop Project

GPCL has signed "Power Purchase Agreement (PPA)" with Torrent Power Ltd for its aggregate 1-MW Solar Rooftop Project set up on various Government Buildings located in Gandhinagar and Ahmedabad. GPCL has successfully commissioned 983.99 KW in F.Y. 2013-14. In year 2021-2022, the project has earned revenue of Rs. 61.35 Lakhs.

5) 700 + MW Raghnesda Ultra Mega Solar Park

The park is located at village Raghnesda, Ta.: Vav, Dist.: Banaskantha. The Park is in operation with 485 MW Solar power generation and 215 MW capacity is under execution. The construction of road as well as other basic infrastructure works like bund, water supply, storm water drains at the said park are completed.

6) 1000 MW (Phase-1) Dholera Ultra Mega Solar Park

Government of Gujarat has approved to set up 1000 MW Dholera Ultra Mega Solar Power Park. In this project, Dholera Special Investment Region has in-principally agreed to provide land on long term lease basis. GPCL is Solar Power Park developer in this project. GUVNL had invited tenders for procurement of solar power from this park, of which, 300 MW capacity has been set up by Tata Power Renewable Energy Ltd. in March 2022. Decision for remaining 700MW would be taken by APTEL.

7) 30GW Renewable Energy Park

Government of Gujarat has allotted 72400 Ha of waste land for 30GW Renewable Energy Park at Khavda, near

Vighakot Post, adjoining international border in Kutch district in Gujarat under State Waste Land policy. In this regard, "In principle" approval is given from MNRE and Ministry of Defence for setting up of RE Park. GPCL acts as the facilitating agency for the development of said 30GW Renewable Energy in Gujarat. Since it is declared as a Nodal agency under waste land policy 2019, GPCL is continuously coordinating with Government authorities, Developers and other competent authorities so that this 30GW RE park can be developed within the time frame.

8) Tidal based Power Project.

GPCL has been appointed as nodal agency for implementing the Tidal Power Project.

B) MINING PROJECTS:

1) 500MW Bhavnagar Lignite Based Power Project:

GPCL has identified three lignite blocks/ mining leases in Bhavnagar District for mining of lignite:

- (i.) Ghogha Surka Mining Project (1355 hectares)
- (ii.) Khadsaliya-I Mining Project (712 hectares); (This project is yet to be commissioned)
- (iii.) Khadsaliya-II Mining Project (914 hectares); (This project is yet to be commissioned)

(i) Ghogha Surka Mining Project.

Out of Mining Lease over an area of 1355 hectares having the rated capacity of 2.25 MMT/year, about 1,069 hectares of Private Land has been acquired through the consent award. All the necessary permissions, approvals/ agreements have been obtained / executed, as are necessary for commissioning Mining activities. The mining activity at Ghogha Surka Lignite Mine commenced from 01.04.2018 and supply of lignite to Bhavnagar Thermal Power Station (BLTPS) started from 08.08.2018 onwards. About 44,48,943.65 Tons of lignite have been supplied to BLTPS upto 31.03.2022.

2) Baitarni West Coal

The matter pertaining to de-allocation of coal block to BWCCCL is sub-judice in the Hon'ble High Court of Odisha. Baitarni West Coal block has been allotted to M/s. Odisha Mining Corporation Ltd. (OMCL) by MoC and MoC has paid compensation towards cost of Geological Report and cost of consent to BWCCCL which has been distributed to all three promoter companies equally. The Board of Directors and shareholders of BWCCCL have approved Reduction of Share Capital from existing Rs. 30 Crores to Rs. 6 Crores and filing of application before National Company Law Tribunal (NCLT) for the said Reduction of Share Capital is under process.

7. SUBSIDIARY/ ASSOCIATE/ JOINT VENTURE COMPANIES

The Company has no Subsidiaries as on 31.03.2022.

The Company has one Associate Company viz; Baitarni West Coal Company Limited (BWCCCL) and three other jointly controlled entities with investment of less than 10%. The financial statement pertaining to the associates/ joint ventures of the Company as required under first proviso to section 129 (3) of the Companies Act, 2013 in the prescribed form AOC – 1 contained in Rule 5 of The Companies (Accounts) Rules, 2014 is attached to this Report as – "Annexure – 1". The financial statements of BWCCCL are not consolidated with the Company as the coal block allotted to BWCCCL is de-allocated by the Ministry of Coal, GoI and the matter is sub-judice in the Hon'ble High Court of Orissa. BWCCCL is in process of filing petition with NCLT for reduction of its share capital.

8. DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL (KMP)

a.) Chairman, Managing Director

Smt. Sunaina Tomar, IAS was the Chairman of the Company till 15.06.2021 and Shri S. B. Khyalia, was Managing Director of the Company till 30th September, 2021. Thereafter, Ms. Mamta Verma, IAS was appointed as the Chairman of the Company w.e.f. 09.07.2021 and Shri Vikalp Bharadwaj, IAS was appointed as the Managing Director w.e.f. 11.11.2021.

b.) Independent Directors:

In terms of the definition of 'Independence' of Directors as prescribed under Section 149(6) of the Companies Act, 2013, Shri P. K. Taneja, IAS (Retd.) is the Non –executive Independent Director on the Board of the Company and appointment of another Independent Director is under process. The Independent Director has given necessary declaration as required under section 149 of the Companies Act, 2013. All the Directors have given declaration towards compliance of code of conduct.

c.) Woman Director:

In terms of the provisions of Section 149 of the Companies Act, 2013, Smt. Mamta Verma, IAS and Ms. Dipal Hadiyal are the Women Directors on the Board.

d.) Key Managerial Personnel:

During the FY 2021-22, Ms. Krupa Joshi, is the Company Secretary of the Company and also a KMP u/s 203 of the Companies Act, 2013. Shri Mehul J. Danayak is the Chief Financial Officer of the Company and also a KMP u/s 203 of the Companies Act, 2013.

9. NUMBER OF MEETINGS OF THE BOARD:

During the financial year under review, four Board Meetings were held on 31.07.2021, 29.11.2021, 29.12.2021 and 28.03.2022. The intervening gap between any two Meetings was within the period prescribed under the Companies Act, 2013.

10. COMMITTEES OF THE BOARD

During the year under review, the Company has "Corporate Social Responsibility Committee" in compliance with the requirements of the relevant provisions of the Companies Act, 2013 and Rules thereunder and "Share Offer & Allotment Committee" to look after the matters pertaining to allotment of Equity Shares from time to time.

a.) CSR COMMITTEE:

The Company has constituted the CSR Committee in compliance with the provisions of Section 135 of the Companies Act, 2013. The constitution of CSR Committee as on 31.03.2022 is as follows:

- | | | |
|------------------------------------|---|-----------------------|
| i.) Shri P. K. Taneja, IAS (Retd.) | – | Chairman of Committee |
| ii.) Shri Vikalp Bharadwaj, IAS | – | Member |
| iii.) Shri P. H. Rana | – | Member |
| iv.) Ms. Dipal Hadiyal | – | Member |

The detailed report of the activities is placed at "**Annexure - 2**".

11. VIGIL MECHANISM/ WHISTLE BLOWER POLICY

The Company has implemented a Vigil mechanism pursuant to which Whistle Blowers can raise concerns against unacceptable work behaviour, management/ business practices, physiologically adverse work conditions, actual or suspected fraud or violation of the Codes of conduct or violation of legal or regulatory requirements, incorrect or misrepresentation of any financial statements and reports and such other activities of reasonably negative nature which may be seen to tarnish the image of the Company, employee morale and safety at the workplace etc. Whistle Blower has direct access to the Chairman of Audit Committee in exceptional cases to report genuine concerns or grievances.

12. PARTICULARS OF LOANS, GUARANTEES OR INVESTMENTS MADE UNDER SECTION 186 OF THE COMPANIES ACT, 2013:

The investments made by the Company during the period under review are contained in Note 3 and 4 and loans given are mentioned at Note – 5 to the Financial Statement for FY 2021-22.

13. PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS MADE WITH RELATED PARTIES:

All transactions entered by the Company during the financial year with related parties were in the ordinary course of business and on an arm's length basis and that the provisions of Section 188 of the Companies, Act, 2013 are not attracted. Further there are no material related party transactions during the year under review with the promoters, Directors or Key Managerial Personnel which may have a potential conflict with the interest of the Company. Your Directors draw attention to Note 27 of the financial statement for FY 2021-22 containing related party disclosures. Moreover, in case of holding company/ associated company is a state controlled entity; there is no need to make such disclosure.

14. EXTRACTS OF ANNUAL RETURN

Pursuant to section 134 (3) (a) section 92 (3) of the Companies Act 2013, read with Rule 12 of the Companies (Management and Administration) Rules, 2014 the extracts of the Annual Return as at 31st March, 2022, in the prescribed form MGT - 9 forms part of this report as "Annexure - 3".

15. AUDITORS & AUDIT OBSERVATIONS:

a.) STATUTORY AUDITORS:

As per the provisions of section 139 of the Companies Act, 2013 read with Rules made there under, the office of the Comptroller and Auditor General of India, New Delhi had appointed M/s. Anil N. Shah & Company, Chartered Accountants, Ahmedabad as Statutory Auditors of the Company for the financial year 2021-22 who shall hold the office as such till the date of ensuing Annual General Meeting.

b.) COST AUDITORS:

The Company is required to maintain cost records as specified by the Central Govt. under Section 148 (1) of the Companies Act, 2013. Accordingly, the Company is maintaining requisite Cost records and accounts. As per Companies (cost records and audit) Rules, 2014, M/s. P. H. Desai & Co., Cost Accountants, Ahmedabad were appointed as Cost Auditors of the Company for FY 2021-22 for undertaking the cost audit of the Company.

c.) INTERNAL AUDITORS:

In accordance with the provisions of section 138 of the Companies Act, 2013, read with Rules made there under, the Board appointed M/s. Sandip Desai & Co., Chartered Accountants, Ahmedabad as Internal Auditors of the Company for the FY 2021-22 to carry out the work of Internal Audit. The observations and recommendations of the Internal Auditors are reported to the Audit Committee for appropriate action on the same.

d.) SECRETARIAL AUDITORS:

Pursuant to the provisions of Section 204 read with Rules made there under, the Company appointed M/s. Dhara Patel, Company Secretaries, Practicing Company Secretary, Ahmedabad as the Secretarial Auditor for the Financial Year 2021-22 The Report on Secretarial Audit carried out is annexed herewith as "Annexure - 4".

e.) Explanations or comments by the Board on every qualification/ reservation/ adverse remark or disclaimer made by the Statutory Auditor in his Audit Report and by the Secretarial Auditor in his Secretarial Audit Report

The Statutory Auditors have not given any qualification, reservation or made any adverse remarks or disclaimer in their Audit Report. The observations of Secretarial Auditors are self-explanatory.

16. MATERIAL CHANGES AND COMMITMENT AFFECTING FINANCIAL POSITION OF THE COMPANY:

There are no material changes and commitments, affecting adversely the financial position of the Company which has occurred between the end of the financial year of the Company i.e. 31st March, 2022 and the date of the

Directors' Report other than routine business dealings. There has been no change in the nature of business of the Company. No significant or material Orders have been passed by the regulators or Courts or Tribunals impacting the going concern status of the Company and/ or the Company's operations in future.

17. PARTICULARS OF EMPLOYEES:

As per MCA notification dated 05.06.2015 section-197 is not applicable to the Company as the Company is a government company.

18. SHARE CAPITAL:

The Company has only one class of shares viz; Equity Shares. The Authorised Share Capital of the Company as on 31.03.2022 is Rs. 600 Crores divided into 6 Crore Equity Shares of Rs. 100/- each. The issued, subscribed and paid-up capital of the Company as on 31.03.2022 stood at Rs. 513,23,27,050/-. Other details w.r.t. Capital are:

a.) BUY BACK OF SECURITIES-

The Company has not bought back any of its securities during the year under review.

b.) SWEAT EQUITY-

The Company has not issued any Sweat Equity Shares during the year under review.

c.) BONUS SHARES-

No Bonus Shares were issued during the year under review.

d.) EMPLOYEES STOCK OPTION PLAN-

The Company has not provided any Stock Option Scheme to the employees.

19. CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION, FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO

(a) **Conservation of Energy:** During the period under review, there is no consumption of energy requiring disclosure.

(b) **Technology Absorption:** During the period under review your Company has not imported any technology.

(C) **Foreign Exchange Earnings & Outgo:** Nil

20. RISK MANAGEMENT:

The Company's property and assets have been adequately insured.

21. INTERNAL FINANCIAL CONTROL SYSTEMS:

The Company has put in place proper internal control systems and processes commensurate with its size and scale of operations, ensuring adherence to policies and system facilitating mitigation of the operations risks perceived for each area under audit. Please refer Annexure – III to the Independent Auditors' Report of even date on the Standalone IND AS Financial Statements of the Company.

22. DISCLOSURE UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION & REDRESSAL) ACT, 2013:

During the year under review, the Company had received Nil complaint w.r.t. sexual harassment of women employees. The requisite Internal Complaints Committee under the provisions of the Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition & Redressal) Act, 2013, is yet to be formed.

23. BOARD EVALUATION:

The Company being a Government Company, the provisions of Section 134(3)(p) of the Companies Act, 2013 are not applicable in view of the Notification No. GSR-163(E) dated 05-Jun-2015 issued by the Ministry of Corporate Affairs, Govt. of India.

24. DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

In accordance with the provisions of Section 134(5) of the Companies Act, 2013 the Board hereby submits its responsibility Statement that:—

- a) in the preparation of the annual accounts, the applicable accounting standards had been followed along with proper explanation relating to material departures;
- b) the directors had selected such accounting policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the company at the end of the financial year and of the profit and loss of the company for that period;
- c) the directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the company and for preventing and detecting fraud and other irregularities;
- d) the directors had prepared the annual accounts on a going concern basis; and
- e) (Not Applicable since the company is not a listed Company)
- f) the directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

25. OTHER DISCLOSURES:

- a.) There was no change in the nature of business of the Company during the year.
- b.) There were no instances of frauds identified or reported by the Statutory Auditors during the course of their audit pursuant to Section 143(12) of the Companies Act, 2013.
- c.) No Significant or material orders were passed by the Regulators or Courts or Tribunals which impact the going concern status and the Company's operations in future except as stated elsewhere in this report.
- d.) The Company has complied with the applicable Secretarial Standards.

26. ACKNOWLEDGEMENT

Your Directors take this opportunity to express their gratitude to all employees for the continuous assistance, dedication and loyalty towards the Company. The Directors also place on record their sincere appreciation for co-operation and continued support extended by various departments of Government of Gujarat specifically Energy and Petrochemical Dept., the Clients, Bankers and other Regulatory authorities during the year.

For and on behalf of the Board of Directors

Place: Gandhinagar

Date: 19.12.2022

Sd/-

(Smt. Mamta Verma, IAS)

Chairperson

DIN: 01854315

“Annexure – 1”
Form AOC-1

(Pursuant to first proviso to sub-section (3) of section 129 read with rule 5 of Companies (Accounts) Rules, 2014)

Statement containing salient features of the financial statement of subsidiaries/associate companies/joint ventures

Part “A”: Subsidiaries – N.A. (The Company does not have any subsidiary)

Part “B”: Associates and Joint Venture

Statement pursuant to Section 129 (3) of the Companies Act, 2013 related to Associate Companies:

Name of associates	Baitarni West Coal Company Limited (“BWCCCL”)
1. Latest audited Balance Sheet Date	31.03.2022
2. Shares of Associate held by the company on the year end	
No.	100000 Equity Shares of Rs. 1000/- each
Amount of Investment in Associates/ Joint Venture	Rs. 10,00,00,000/-
Extent of Holding%	33.33%
3. Description of how there is significant influence	It is a Joint Venture Company of Gujarat Government (represented by Gujarat Power Corporation Limited), Orissa Government and Kerala Government wherein each of the Governments have the stake of 33.33%.
4. Reason why the associate/joint venture is not consolidated	The coal block allotted to BWCCCL is de-allocated by the Ministry of Coal, Gol and the matter is sub-judice in the Hon’ble High Court of Orissa, hence the financial statements are not consolidated with the Company.
5. Net worth attributable to shareholding as per latest audited Balance Sheet	*Total Net worth of BWCCCL: Rs. 33,77,39,873/- *Attributable to GPCL (33.33%): Rs. 11,25,68,700/-
6. Profit/Loss for the year	*Net Profit of Rs. 8148264/- *Attributable to GPCL Rs. 27,15,816/-
i. Considered in Consolidation	Nil
i. Not Considered in Consolidation	Rs. 27,15,816/- as N.A.

1. Names of associates or joint ventures which are yet to commence operations.

2. Names of associates or joint ventures which have been liquidated or sold during the year.

Note: This Form is to be certified in the same manner in which the Balance Sheet is to be certified.

For & on behalf of the Board of Directors

Date: 19.12.2022

Place: Gandhinagar

Sd/- Chairperson DIN:01854315	Sd/- Managing Director DIN: 09396222
Sd/- Chief Financial Officer	Sd/- Company Secretary

“Annexure –II”

CSR Report

1. Brief outline on CSR Policy of the Company:

The Company understands that being part of this society it is its moral responsibility to aid and serve the society to the maximum possible extent. The Objective of this CSR Policy through its CSR initiatives is to focus on holistic development of host communities and create social, environmental and economic value to the society

2. Composition of CSR Committee: (As on 31.03.2022)

Sr. No.	Name of Director & Nature of Directorship	Designation	Number of meetings of CSR Committee held during the year	Number of meetings of CSR Committee attended during the year
1.	Shri P. K. Taneja, IAS (Retd.), Independent Director	Chairman	01	01
2.	Shri Vikalp Bharadwaj, IAS, Managing Director	Member	01	01
3.	Ms. Dipal Hadiyal – Director	Member	01	01
4.	Shri P. H. Rana – Director	Member	01	01

(Changes during financial year)

Smt. Anju Sharma, IAS - Chairman of CSR Committee (upto 28.07.2021)

Shri S. B. Khyalia - Member of CSR Committee (upto 01.10.2021)

- Provide the web-link where Composition of CSR committee, CSR Policy and CSR projects approved by the board are disclosed on the website of the company: **www.gpcl.gujarat.gov.in**
- Provide the executive summary along with web-link(s) of Impact assessment of CSR projects carried out in pursuance of sub-rule (3) of rule 8, if applicable.: Not Applicable
- Details of the amount available for set off in pursuance of sub-rule (3) of rule 7 of the Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014 and amount required for set off for the financial year, if any: **NIL**

Sr. No.	Financial Year	Amount available for set-off from preceding financial years (in Rs.)	Amount required to be set-off for the financial year, if any (in Rs.)
NIL			

- Average net profit of the company as per section 135(5). - Rs. 64,56,50,969/-
- (a) Two percent of average net profit of the company as per section 135(5) – **Rs. 1,29,13,019/-**
 (b) Surplus arising out of the CSR projects or programmes or activities of the previous financial years. - Nil
 (c) Amount required to be set off for the financial year, if any - Nil
 (d) Total CSR obligation for the financial year (7a+7b-7c). - **Rs. 1,29,13,019/-**
- (a) CSR amount spent or unspent for the financial year 2021-22:

Total Amount Spent for the Financial Year. (in Rs.)	Amount Unspent (in Rs.)				
	Total Amount transferred to Unspent CSR Account as per section 135(6).		Amount transferred to any fund specified under Schedule VII as per second proviso to section 135(5).		
	Amount.	Date of transfer.	Name of the Fund	Amount.	Date of transfer.
38,73,906	90,39,113	29.04.2022	N.A.	---	---

(b) Details of CSR amount spent against ongoing projects for the financial year 2021-22

Sr. No.	Name of the Project.	Item from the list of activities in Schedule VII to the Act.	Local area (Yes/No).	Location of the project	Project duration	Amount allocated for the project (in Rs.).	Amount spent in the current financial Year (in Rs.).	Amount transferred to Unspent CSR Account for the project as per Section 135(6) (in Rs.).	Mode of Implementation - Direct (Yes/No).	Mode of Implementation - Through Implementing Agency	
				District, State.,						Name	CSR Registration number.
1	Distribution of Happiness Kits	Eradicating hunger, poverty and malnutrition and promoting healthcare	No.	Bhavanagar, Gujarat	Six months	55,00,000	16,50,000	38,50,000	Through Implementing Agency	The Akshay Patra Foundation	CSR0000286
2	Smart Anganwadis, improvement of Percolation Tank, construction of Rooftop rainwater harvesting tanks and provision of safe drinking water	Promoting Education, making available safe drinking water, conservation of natural resources and rural development project.	No.	Patan, Gujarat	Six months	74,13,019	22,23,906	51,89,113	Through Implementing Agency	Gujarat CSR Authority	CSR00002979
Total						1,29,13,019	38,73,906	90,39,113			

(c) Details of CSR amount spent against other than ongoing projects for the financial year 2021-22: NIL

Sl. No.	Name of the Project	Item from the list of activities in schedule VII to the Act.	Local area (Yes/No).	Location of the project.	Amount spent for the project (in Rs.).	Mode of implementation - Direct (Yes/No).	Mode of implementation - Through implementing agency.	
							Name.	CSR registration number.
NIL								

(d) Amount spent in Administrative overheads. - Nil

(e) Amount spent on Impact Assessment, if applicable. - Nil

(f) Total amount spent for the Financial Year (8b+8c+8d+8e). - Rs. 38,73,906/-

(g) CSR amount unspent for the Financial Year: - **Rs. 90,39,113/-**

(f) Excess amount for set-off, if any: **Not Applicable**

Sl. No.	Particular	Amount (in Rs.)
(i)	Two percent of average net profit of the company as per section 135(5)	1,29,13,019/-
(ii)	Total amount spent for the Financial Year	38,73,906/-
(iii)	Excess amount spent for the financial year [(ii)-(i)]	Nil
(iv)	Surplus arising out of the CSR projects or programmes or activities of the previous financial years, if any	Nil
(v)	Amount available for set off in succeeding financial years [(iii)-(iv)]	Nil

9. (a.) Details of Unspent Corporate Social Responsibility amount for the preceding three Financial Years:

Sr. No.	Preceding Financial Year.	Amount transferred to Unspent CSR Account under section 135 (6) (in Rs.)	Amount spent in the reporting Financial Year (in Rs.).	Balance Amount in Unspent CSR Account under sub-section (6) of section 135 (in Rs.)	Amount transferred to any fund specified under Schedule VII as per section 135(6), if any.			Amount remaining to be spent in succeeding financial years. (in Rs.)
					Name of the Fund	Amount (in Rs).	Date of transfer.	
1.	2020-21	35,15,000	32,61,164	2,53,836	PM Cares Fund	107,05,970	02/09/2021	2,53,836
2.	2019-20	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
3.	2018-19	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	Total	35,15,000	32,61,164	2,53,836	-	107,05,970	-	2,53,836

- (b) Details of CSR amount spent in the financial year 2021-22 for ongoing projects of the preceding financial year(s):

Sr No.	Name of the Project	Item from the list of activities in schedule VII.	Local area (Yes/ No).	Location of the project.	Amount allocated for the project (in Rs.).	Amount spent for the project (in Rs.).	Mode of implementation	Name of implementing agency.
1.	Promotion of Educa-tion	promoting education, including special education especially among children.	No	Gogha, Bhav-nagar, Gujarat	8,50,000	5,11,164	Direct	N.A.
2.	Distribution of Happiness Kits	Eradicating hunger, poverty and malnutrition and promoting healthcare	No	Bhav-nagar, Gujarat	27,50,000	27,50,000	Imple-menting Agency	The Akshay Patra Foundation
	Total				35,50,000	32,61,164		

10. Whether any capital assets have been created or acquired through Corporate Social Responsibility amount spent in the Financial Year: No

If Yes, enter the number of Capital assets created/ acquired – Not Applicable

Furnish the details relating to such asset(s) so created or acquired through Corporate Social Responsibility amount spent in the Financial Year:

Sl. No.	Short particulars of the property or asset(s)	Pincode of the property or asset(s)	Date of creation	Amount of CSR amount spent	Details of entity/ Authority/ beneficiary of the registered owner
Not applicable					

(All the fields should be captured as appearing in the revenue record, flat no, house no, Municipal Office/Municipal Corporation/ Gram panchayat are to be specified and also the area of the immovable property as well as boundaries)

11. Specify the reason(s), if the company has failed to spend two per cent of the average net profit as per sub-section (5) of section 135:

Not applicable as the Company has transferred the unspent amount towards the ongoing projects in Unspent Corporate Social Responsibility Account of the Company maintained under section 135(6) of the Companies Act, 2013 read with Rules thereunder.

Sd/-

P. K. Taneja, IAS (Retd.)
Chairman - CSR Committee.
(DIN: 00010589)

Sd/-

Vikalp Bharadwaj, IAS
Managing Director
(DIN: 09396222)

“ANNEXURE – 3”

FORM NO. MGT.9

EXTRACT OF ANNUAL RETURN

as on the financial year ended on 31st March, 2022

[Pursuant to section 92(3) of the Companies Act, 2013 and rule 12(1) of the Companies (Management and Administration) Rules, 2014]

I. REGISTRATION AND OTHER DETAILS:

- i) CIN: U40100GJ1990SGC013961
- ii) Registration Date: 28th June, 1990
- iii) Name of the Company: Gujarat Power Corporation Limited
- iv) Category / Sub-Category of the Company: Company having share capital / State Government Company.
- v) Address of the Registered office and contact details: Block Nos. 6 & 8, 6th Floor, Udhog Bhavan, Sector 11, Gandhinagar – 382010.
Phone No.: 079-2321255-60 Fax. 079-23221254
Email: cosecgpcl@yahoo.co.in – Website: www.gpcl.gujarat.gov.in
- vi) Whether listed company: Yes / No
- vii) Name, Address and Contact details of Registrar and Transfer Agent, if any- NA

II. PRINCIPAL BUSINESS ACTIVITIES OF THE COMPANY

All the business activities contributing 10 % or more of the total turnover of the Company shall be stated:

Sl. No.	Name and Description of main products/ services	NIC Code of the Product/ service	% to total turnover of the company
1.	Generation of solar energy Generation of electricity from other non-conventional sources Site preparation other than in connection with mining (Development of Solar Park)	40106 40108 45102	More than 10%

III. PARTICULARS OF HOLDING, SUBSIDIARY AND ASSOCIATE COMPANIES

Sl. No	Name and address of the Company	CIN/GLN	Holding/ subsidiary/ associate	% of shares held	Applicable Section
1	Baitarni West Coal Company Limited, 3rd Floor, Setu Bhavan, (Orissa Bridge & Construction Corporation Building), Plot No. 3 (D), Nayapally, BBSR -751012	U401020R2008SGC009955	Associate Company	33.33%	2(6)

IV. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity)

i) Category-wise Share Holding

Category of Shareholders	No. of Shares held at the beginning of the year				No. of Shares held at the end of the year				% change during the year
	Demat	Physical	Total	% of Total Shares	Demat	Physical	Total	% of Total Shares	
A. Promoters									
(1.) Indian									
a.) Individual/ HUF	-	85.5	85.5	0.00	-	85.5	85.5	0.00	-
b.) Central Govt.	-	-	-	-	-	-	-	-	-
c.) State Govt.(s)	-	49392462	49392462	96.2392	-	49393172.0	49393172	96.2393	(+)0.0001%
d.) Bodies Corporate		1930013	1930013	03.7606		1930013.0	1930013	03.7606	-
e.) Banks/ FI	-	-	-	-	-	-	-	-	-
f.) Any Other	-	-	-	-	-	-	-	-	-
Sub-Total(A)(1):		51322560.5	51322560.5	100		51323270.5	51323270.5	100	
(2) Foreign									
Sub-total									
(A) (2):-	-	-	-	-	-	-	-	-	-
Total shareholding of Promoter (A)= (A)(1)+(A)(2)	-	51322560.5	51322560.5	100		51323270.5	51323270.5	100	
B. Public Shareholding	-	-	-	-	-	-	-	-	-
Total Public Shareholding (B) = (B)(1) + (B)(2)	-	-	-	-	-	-	-	-	-
C. Shares held by Custodian for GDRs & ADRs	-	-	-	-	-	-	-	-	-
Grand Total (A+B+C)		51322560.5	51322560.5	100		51323270.5	51323270.5	100	

ii) Shareholding of Promoters

Sr.	Shareholder's Name	Shareholding at the beginning of the year			Share- holding at the end of the year			% change in share -holding during the year
		No. of Shares	% of total Shares of the company	%of Shares Pledged/ encumbered to total shares	No. of Shares	% of total Shares of the company	%of Shares Pledged/ encumbered to total shares	
1	Governor of Gujarat	49392462	96.24	-----	49393172.0	96.24	-----	(+)0.0001%
2	Gujarat Urja Vikas Nigam Ltd.	1930013	03.76	-----	1930013	03.76	-----	--
3	*Other	85.5	0.00	-----	85.5	0.00	-----	--
	Total	51322560.5	100	-----	51323270.5	100	-----	

* Other includes Nominees of Government of Gujarat as well as Gujarat Urja Vikas Nigam Ltd.

(iii) Change in Promoters' Shareholding (please specify, if there is no change): **

	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
	No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
At the beginning of the year	49392462	96.2392	49392462	96.2392
Governor of Gujarat				
(a.) 260 Equity Shares of Rs.100 each allotted to Governor of Gujarat on rights basis On 14.07.2021	260	-	49392722	-
(b.) 450 Equity Shares of Rs.100 each allotted to Governor of Gujarat on rights basis On 05.03.2022	450	-	49393172	-
At the End of the year	-	-	49393172	96.2393

**** There is no Change in Gujarat Urja Vikas Nigam Ltd. and Others which fall in the category of Promoters.**

(iv.) Shareholding Pattern of top ten Shareholders (other than Directors, Promoters and Holders of GDRs and ADRs):

Sl. No		Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	For Each of the Top 10 Shareholders				
	At the beginning of the year	NA	NA	NA	NA
	Dt. wise Increase/ Decrease in Share holding during year specifying the reasons for increase/ decrease (e.g. allotment/ transfer/ bonus/ sweat equity etc):	NA	NA	NA	NA
	At the End of the year (or on the date of separation, if separated during the year)	NA	NA	NA	NA
	TOTAL				

(v) Shareholding of Directors and Key Managerial Personnel:

Sl. No.	Name of Director/ Key Managerial Personnel	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares	No. of shares	% of total shares
	At the beginning of the year	NA	NA	NA	NA
	Date wise Increase / Decrease in Share holding during the year	NA	NA	NA	NA
	At the End of the year	NA	NA	NA	NA

Note: None of the Directors/ KMP holds any shares in the Company.

V. INDEBTEDNESS

Indebtedness of the Company including interest outstanding/accrued but not due for payment (Rs. In Lacs)

	Secured Loans Excluding deposits	Unsecured Loans	Deposits	Total Indebtedness
Indebtedness at the beginning of the FY year				
i) Principal Amount	Nil	Nil	Nil	Nil
ii) Interest due but not paid	Nil	Nil	Nil	Nil
iii) Interest accrued but not due (1st April)	Nil	Nil	Nil	Nil
Total (i+ii+iii)	Nil	Nil	Nil	Nil
Change in Indebtedness during the FY				
• Addition	Nil	Nil	Nil	Nil
• Reduction				
Net Change	Nil	Nil	Nil	Nil
Indebtedness at the end of the financial year				
i) Principal Amount	Nil	Nil	Nil	Nil
ii) Interest due but not paid	Nil	Nil	Nil	Nil
iii) Interest accrued but not due (1st April)	Nil	Nil	Nil	Nil
Total (i+ii+iii)	Nil	Nil	Nil	Nil

VI. REMUNERATION OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL

A. REMUNERATION TO MANAGING DIRECTOR, WHOLE-TIME DIRECTORS AND/OR MANAGER:

Sl. no.	Particulars of Remuneration	Name of MD		Total Amount
		Shri S. B. Khyalia (from 01.04.2021 to 30.09.2021)	Shri Vikalp Bharadwaj, IAS (from 11.11.2021 to 31.03.2022)	
1.	Gross salary (a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961 (b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961 (c) Profits in lieu of salary under section 17(3) Income-tax Act, 1961	20,13,062/- 2,00,405/-	- -	20,13,062/- 2,00,405/-
2.	Stock Option	----		----
3.	Sweat Equity	----		----
4.	Commission - as % of profit - others, specify.	----		----
5.	Others, please specify*	4,000/-	12,000/-	16,000/-
	Total	22,17,467/-	12,000/-	22,29,467/-
	Ceiling as per the Act	Not Applicable	Not Applicable	Not Applicable

*Shri Vikalp Bharadwaj, IAS, has not been paid any remuneration for holding the charge of MD, GPCL being serving IAS officer. His sitting fee is directly deposited in government treasury. A token amount of Rs.2000/- per meeting was paid as incidental expenses to Shri S. B. Khyalia and Shri Vikalp Bharadwaj, IAS for attending the Board and Committee Meeting(s).

B. REMUNERATION TO OTHER DIRECTORS.

Category	Particulars of remuneration			Total
	Sitting fees for Board & Committee meetings	Comm- ission	Other (Incidental Charges for attending Board/ Committee Meetings)	
Chairman – Smt. Sunaina Tomar, IAS	***	---	---	---
Chairman – Ms. Mamta Verma, IAS	***	---	6,000/-	6,000/-
Total A	---	---	6,000/-	6,000/-
Independent Directors				
Shri P. K. Taneja, IAS (Retd.)	13,500/-	---	10,000/-	23,500/-
Other Non- Executive Directors				
Smt. Anju Sharma, IAS	***	---	---	---
Shri P. H. Rana	27,000/-	---	18,000/-	45,000/-
Ms. Dipal Hadiyal, (Nominee of FD, GoG)	***	---	14,000/-	14,000/-
Total B	40,500/-	---	42,000/-	82,500/-
Total Managerial Remuneration (A+B)	40,500/-	---	48,000/-	88,500/-
Overall Ceiling as per the Act	-----	-----	-----	-----

***Sitting fee @ Rs.3000/-(less 10% TDS) per meeting in respect of serving IAS Officers and GoG Nominees has been directly deposited in government treasury while incidental expense @Rs.2000/- per meeting was directly paid to the concerned directors.

C. REMUNERATION TO KEY MANAGERIAL PERSONNEL OTHER THAN MD/ MANAGER/ WTD:

Sr.	Particulars of Remuneration	Key Managerial Personnel		
		CEO	CS	CFO
1.	Gross salary			
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961	-----		
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961		10,15,563/-	20,38,097/-
	(c) Profits in lieu of salary under section 17(3) Income-tax Act, 1956			
2.	Stock Option	-----	-----	-----
3.	Sweat Equity	-----	-----	-----
4.	Commission			
	- as % of profit	-----	-----	-----
	- others, specify			
5.	Others, please specify	-----	-----	-----
	Total	-----	10,15,563/-	20,38,097/-

VII. PENALTIES/PUNISHMENT/COMPOUNDING OF OFFENCES:

Type	Brief Description	Details of			Authority [RD/ NCLT/ COURT]	Appeal made, if any (give Details)
		Penalty	Punishment	Compounding fee imposed		
A. COMPANY			NA.		NA.	NA.
B. DIRECTORS			NA		NA	NA
C. OTHER OFFICERS IN DEFAULT			NA		NA	NA

For & on behalf of the Board of Directors

Sd/-	Sd/-
Chairperson	Managing Director
DIN: 01854315	DIN: 09396222

“ANNEXURE – 4”

SECRETARIAL AUDIT REPORT

FOR THE FINANCIAL YEAR ENDED ON 31st March, 2022

[Pursuant to section 204(1) of the Companies Act, 2013 and rule No.9 of the Companies (Appointment and Remuneration Personnel) Rules, 2014]

To,
The Members,
Gujarat Power Corporation Limited
6th Floor, Block No. 6&8
Udyog Bhavan, Sector-11, Gandhinagar-382011

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by **Gujarat Power Corporation Limited**. The secretarial audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/statutory compliances and expressing my opinion thereon. Based on our verification of the Company's books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit, we hereby report that in our opinion, the Company has, during the audit period covering the financial year ended on 31st March, 2022 complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March, 2022 according to the provisions of:

- (i) The Companies Act, 2013 (the Act) and the rules made there-under;
- (ii) The Securities Contracts (Regulation) Act, 1956 ('SCRA') and the rules made there-under to the extent applicable;
- (iii) The Depositories Act, 1996 and the Regulations and Bye-laws framed there-under are not applicable to the Company as the government companies are exempted from the compulsory dematerialization of shares vide MCA Notification No. 43(E) dated 22nd January, 2019.
- (iv) Foreign Exchange Management Act, 1999 and the rules and regulations made thereunder to the extent of Foreign Direct Investment, Overseas Direct Investment and External Commercial Borrowings are not applicable to the Company during the period under review.
- (v) The following Regulations and Guidelines prescribed under the Securities and Exchange Board of India Act, 1992 ('SEBI Act') are not applicable to the Company as the Company is an unlisted Company during the period under review.
 - (a) The Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011;
 - (b) The Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 1992;
 - (c) The Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2009;
 - (d) The Securities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme) Guidelines, 1999;
 - (e) The Securities and Exchange Board of India (Issue and Listing of Debt Securities) Regulations, 2008;
 - (f) The Securities and Exchange Board of India (Registrars to an Issue and Share Transfer Agents) Regulations, 1993 regarding the Companies Act and dealing with client;
 - (g) The Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009; and
 - (h) The Securities and Exchange Board of India (Buyback of Securities) Regulations, 1998;

I further report that, having regard to the compliance system prevailing in the Company and on examination of the relevant documents and records in pursuance thereof, on test-check basis, the Company has complied with the following laws applicable specifically to the Company:

- (i) The Electricity Act, 2003
- (ii) Mines Act, 1952
- (iii) The Environment (Protection) Act, 1986.

I have also examined compliance with the applicable clauses of the following:

- (i) Secretarial Standards issued by The Institute of Company Secretaries of India.
- (ii) The Company being unlisted is not required to comply with the Listing Agreements of Stock Exchange(s).

During the period under review, the Company has generally complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above subject to our following observations:

1. Due to expiration of term of appointment of two Independent Directors i.e. Shri Prakash Shah, IAS (Retd.) and Shri Bharatkumar Modi as on 31.03.2020, the Company filled the position of one Independent Director on 26.11.2020 and the appointment of one more Independent Director is yet to be made and accordingly constitution of committees as per the requirement under section 149, 177 & 178 of Companies Act, 2013 is yet to be made.
2. The Annual General Meeting of the Company was held on 29.12.2021. However, the AGM was adjourned and the Audited Accounts are adopted at the adjourned Annual General Meeting (AGM) of the Company held on 8th March, 2022 i.e. after the due date for convening the AGM (including the extended time of AGM granted upto 31.12.2021).

We further report that

The Board of Directors of the Company is duly constituted with proper balance of Executive Directors and Non-Executive Directors as on 31.03.2022 subject to our observation given hereinabove. The changes in the composition of the Board of Directors that took place during the period under review were carried out in compliance with the provisions of the Act.

Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance & in case of shorter notice required compliance as per Companies Act, 2013 has been ensured and a system exists for seeking and obtaining further information and clarifications on the agenda items before the meeting and for meaningful participation at the meeting.

Generally, all decisions at the Board and Committee meetings are carried out unanimously as recorded in the minutes of the meeting of the Board of Directors and Committee of the Board as the case may be.

We further report that

There are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

We further report that

1. During the audit period the Company has allotted:-

- (i) 260 Equity Shares of Rs.100 each on 14.07.2021 aggregating to Rs. 26,000/-on right basis to the Governor of Gujarat.
- (ii) 450 Equity Shares of Rs.100 each on 05.03.2022 aggregating to Rs. 45,000/-on right basis to the Governor of Gujarat

For, CS Dhara Patel

Sd/-

Proprietor

(CS Dhara Patel)

ACS No. 28198, CP No. 10979

UDIN: A029198D002741655

Date: 19.12.2022

Place: Gandhinagar

(This report is to be read with our letter of even date which is annexed as Annexure A and forms an integral part of this report.)

To,
The Members,
Gujarat Power Corporation Limited
6thFloor, Block No. 6&8
UdyogBhavan, Sector 11, Gandhinagar- 382011

Our report of even date is to be read along with this letter.

1. Maintenance of secretarial record is the responsibility of the management of the Company. Our responsibility is to express an opinion on these secretarial records based on our audit.
2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the processes and practices, we followed provide a reasonable basis for our opinion.
3. We have not verified the correctness and appropriateness of financial Statements, financial records and Books of Accounts of the company.
4. The compliance of the provisions of Corporate and other applicable laws, rules, regulations, standards is the responsibility of management. Our examination was limited to the verification of procedures on test basis.
5. The Secretarial Audit report is neither an assurance as to the future viability of the company nor of the efficacy or effectiveness with which the management has conducted the affairs of the company.

For, CS Dhara Patel

Sd/-

Proprietor

(CS Dhara Patel)

ACS No. 28198, CP No. 10979

UDIN: A029198D002741655

Date: 19.12.2022

Place: Gandhinagar

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF GUJARAT POWER CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2022

The preparation of financial statements of Gujarat Power Corporation Limited for the year ended 31 March 2022 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139 (5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the standards on auditing prescribed under Section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 19 December 2022.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Gujarat Power Corporation Limited for the year ended 31 March 2022 under Section 143 (6)(a) of the Act. This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my supplementary audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditors' report under Section 143 (6)(b) of the Act.

For and on behalf of the
Comptroller and Auditor General of India

Sd/-
(Vijay N Kothari)
Accountant General (Audit-II), Gujarat

Place: Ahmedabad

Date: 10/02/2023

INDEPENDENT AUDITOR'S REPORT

To the Members of Gujarat Power Corporation Ltd.

Report on the Ind AS Financial Statements

Opinion

We have audited the accompanying Ind AS financial statements of **Gujarat Power Corporation Ltd.** ("the Company"), which comprises the Balance Sheet as at March 31, 2022, the Statement of Profit and Loss (including other Comprehensive income), the statement of Cash Flow and the statement of changes in equity for the year then ended, and a summary of significant accounting policies and other explanatory information. (herewith after referred to as "Ind AS financial statements")

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Companies Act, 2013 ("the Act") in the manner so required and give a true and fair view in conformity with the Indian Accounting Standards prescribed under section 133 of the Act read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended, ("Ind AS") and other accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at March 31, 2022, the profit and total comprehensive income, changes in equity and its cash flows for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit of the financial statements in accordance with the Standards on Auditing specified under section 143(10) of the Act (SAs). Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India (ICAI) together with the independence requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Act and the Rules made thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the ICAI's Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the financial statements.

Emphasis of Matters

We draw attention to Note 17 to the financial statements, regarding Fuel Supply Agreement (FSA) between the Company and Gujarat State Electricity Corporation Limited (GSECL) is under process. Pending execution of FSA, the company has accounted revenue from Lignite Project of Rs. 37900.76 Lacs based on interim arrangement with GSECL.

Our opinion on the financial statements and our report on Other Legal and Regulatory Requirements below is not modified in respect of this matter.

Information Other than the Financial Statements and Auditor's Report Thereon

The Company's Board of Directors is responsible for the other information. The other information comprises the Directors' Report including Annexures to the Directors' Report but does not include the financial statements and our auditor's report thereon. The other information is expected to be made available to us after the date of this auditor's report.

Our opinion on the financial statements does not cover the other information and we will not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information identified above when it becomes available and, in doing so, consider whether the other information is materially inconsistent with the financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated.

When we read the other Information, if we conclude that there is a material misstatement therein, we are required to communicate the matter to those charged with governance as required under SA 720 'The Auditor's responsibilities Relating to Other Information'.

Management's Responsibility for the Ind AS Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in section 134(5) of the Act with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance, total comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the Ind AS and other accounting principles generally accepted in India. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors are also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal financial controls relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Act, we are also responsible for expressing our opinion on whether the Company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2020 ("the Order") issued by the Central Government of India in terms of sub-section (11) of section 143 of the Act, we give in the "Annexure-I" a statement on the matters specified in the paragraph 3 and 4 of the Order, to the extent applicable.
2. We are enclosing our report in terms of Section 143 (5) of the Act, on the basis of such checks of the books and records of the Company as we considered appropriate and according to the information and explanations given to us, in the "Annexure II" on the directions and sub-directions issued by Comptroller and Auditor General of India.
3. As required by section 143(3) of the act we report that:
 - a. We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief necessary for the purpose of our audit.
 - b. In our opinion proper books of account as required by law have been kept by the company so far as it appears from our examination of those books.
 - c. The Balance Sheet, Statement of Profit and Loss, the statement of Cash Flow and the statement of changes in equity dealt with by this Report are in agreement with the books of account.
 - d. In our opinion, the aforesaid Ind AS financial statements comply with the Indian Accounting Standards specified under Section 133 of the Act, read with the Companies (Indian Accounting Standards) Rules, 2015;
 - e. On the basis of the written representations received from the directors as on 31 March, 2022 taken on record by the Board of Directors, none of the directors is disqualified as on 31 March, 2022 from being appointed as a director in terms of Section 164 (2) of the Act; and
 - f. With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure III". Our report expresses an unmodified opinion on the adequacy and operating effectiveness of the Company's internal financial controls over financial reporting.
 - g. With respect to the other matters to be included in the Auditor's Report in accordance with the requirements of section 197(16) of the Act, as amended:

In our opinion and to the best of our information and according to the explanations given to us, the Managerial remuneration has been paid or provided in accordance with the provisions of section 197 of the Companies Act, 2013.
 - h. with respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, in our opinion and to the best of our information and according to the explanations given to us:
 - i. The Company has disclosed the impact of pending litigations on its financial position in its financial statements (Refer Note No.: 30(Q)).

- ii. The Company did not have any long-term contracts including derivative contracts as at March 31, 2022 for which there were any material foreseeable losses and
- iii. There were no amounts which were required to be transferred to the Investors Education and Protection fund by the company.
- iv. The management has represented that, to the best of its knowledge and belief as disclosed in Note 31 to the Financial Statements, no funds have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the Company to or in any other persons or entities, including foreign entities ("Intermediaries"), with the understanding, whether recorded in writing or otherwise, that the Intermediary shall:
- directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever ("Ultimate Beneficiaries") by or on behalf of the Company or
 - provide any guarantee, security or the like to or on behalf of the Ultimate Beneficiaries.
- The management has represented, that, to the best of its knowledge and belief, no funds have been received by the Company from any persons or entities, including foreign entities ("Funding Parties"), with the understanding, whether recorded in writing or otherwise, that the Company shall:
- directly or indirectly, lend or invest in other persons or entities identified in any manner whatsoever ("Ultimate Beneficiaries") by or on behalf of the Funding Party or
 - provide any guarantee, security or the like from or on behalf of the Ultimate Beneficiaries; and
- v. The company has not declared or paid any dividend during the year in contravention of the provisions of section 123 of the Companies Act, 2013.

For, Anil N. Shah & Co.
Chartered Accountants
FRN. 114131W

Sd/-
Jigna H. Shah
Partner
Membership No. 141825

Place: Ahmedabad
Date: 19/12/2022
UDIN: 22141825BGBEXL7277

“ANNEXURE I” TO INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in paragraph 1 under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report of even date)

The “Annexure-I” referred to in our Independent Auditor’s Report to the members of the Company on the Ind AS financial statements for the year ended 31 March 2022, we report that:

- 1) In respect of Company’s Property, Plant & Equipment
 - a) The company has maintained proper records showing full particulars including quantitative details and situation of fixed assets.
 - b) The Property, Plant & Equipment of the Company are physically verified by the management according to a phased programme, which in our opinion, is reasonable having regard to the size of the Company and the nature of its assets. Pursuant to the programme, a portion of the fixed assets (Property, Plant & Equipment) has been physically verified by the management during the year and no material discrepancies have been noticed on such verification.
 - c) As per the information and explanations given to us, during the course of audit, the company has all title deeds of immovable properties on its name as at balance sheet date. In respect of immovable properties of Land and building that have been taken on lease and disclosed as fixed assets in the financial statements, the lease agreements are in the name of company.
 - d) As per the information and explanations given to us, the company has not revalued its Property, Plant and Equipment or Intangible Assets or both during the year.
 - e) According to the information and explanations given to us, the records examined by us no proceedings have been initiated or are pending against the company for holding any Benami property under the Benami Transactions (Prohibition) Act, 1988 (45 of 1988) and rules made thereunder
- 2) In our opinion, the inventories have been physically verified by the management at reasonable interval during the year. In our opinion and according to the information and explanations given to us, no material discrepancies were noticed on such verification between the physical stocks and the book records that were 10% or more in the aggregate for each class of inventory.

According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the Company has been not sanctioned working capital limits in excess of five crore rupees, in aggregate, from banks or financial institutions on the basis of security of current assets. The Company has not required to file quarterly/Monthly returns or statements with such bank or financial Institutions.
- 3) According to the information and explanations given to us, the Company has not granted any loans, secured or unsecured, to Companies, Firms, Limited Liability Partnerships or other parties covered in the register maintained under Section 189 of the Companies Act, 2013. Consequently, reporting requirements under clause 3 (iii) (a), (b) & (c) of CARO are not applicable to the Company.
- 4) The Company has not given any loan or guarantee or security under section 185 of the Act. In our opinion and according to the information and explanation given to us, the Company has complied with the provisions of section 186 of the Act in respect of the Investments made.
- 5) According to the information and explanations given to us, the Company has not accepted any deposits during the year from the public within the meaning of provisions of section 73 to 76 of the Act and the rules framed thereunder or under the directives issued by the Reserve Bank of India and therefore, reporting under clause 3(v) of the Order is not applicable to the Company.
- 6) We have broadly reviewed the books of accounts, records maintained by the Company as prescribed by the Central Government under sub-section (1) of section 148 of the Companies Act, 2013 and are of the opinion that prima-facie, the prescribed accounts, and cost records have been maintained. We have however, not made a detailed examination of the cost records with a view to determine whether they are accurate or complete.

7) (a) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, in our opinion, the Company is generally regular in depositing the undisputed statutory dues including Provident Fund, Employees' State Insurance, Income Tax, Goods and Service Tax, Custom Duty, Value Added Tax, goods and service tax, Cess and other material statutory dues as applicable with the appropriate authorities. According to the information and explanations given to us there were no undisputed amounts payable in respect of same were in arrears as at March 31, 2022 for a period of more than six months from the date they became payable.

(b) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, there are no disputed dues in respect of value added tax, goods and service tax, excise duty and duty of customs which have not been deposited. However as explained to us the following are the particulars of income tax and service tax as at March 31, 2022 which have not been deposited on account of dispute:

Name of statute	Nature of Dues	Outstanding Disputed (Rs. In lacs)	Financial year to which the amount relates	Forums where the dispute is pending
Income Tax Act, 1961	Income Tax	15.06	1991-92	High court has passed order on 26-06-12
Income Tax Act, 1961	Income Tax	51.9	1992-93	High court has passed order on 17-10-14
Income Tax Act, 1961	Income Tax	9577.03	2001-02	High court has passed order on 30-07-12 in favour of GPCL. Appeal before Supreme court is pending.
Income Tax Act, 1961	Income Tax	410.65	2002-03	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	8.05	2003-04	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	460.79	2004-05	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	30.72	2006-07	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	55.16	2007-08	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	55.81	2008-09	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	59.6	2002-03	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	81.13	2003-04	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	137.52	2004-05	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	109.79	2005-06	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	23.05	2009-10	CIT(A) has passed order on 22-08-13

Income Tax Act, 1961	Income Tax	436.46	2010-11	ITAT has passed order dated 10-07-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	28.53	2011-12	ITAT has passed order dated 10-07-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	11.28	2012-13	ITAT has passed order dated 19-09-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	48.63	2013-14	ITAT has passed order dated 20-09-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	807.90	2015-16	A.O. has passed order u/s. 147 dated 28-03-22 and appeal before CIT(A) is pending.
Income Tax Act, 1961	Income Tax	5.70	2016-17	A.O. had passed order u/s. 143(3) dated 26-12-19 order u/s. 147 dated 28-03-22. Appeal before CIT(A) is pending.
Income Tax Act, 1961	Income Tax	26.72	2017-18	A.O. has passed order u/s. 143(3) dated 24-09-21 appeal before CIT(A) is pending.
Service Tax Act	Service Tax	2945	April 2009 to December 2012	Matter is pending with CESTAT.

- 8) According to the information and explanations given to us and according to the records of the Company examined by us, there are no transactions which are not recorded in the books of account have been surrendered or disclosed as income during the year in the tax assessments under the Income Tax Act, 1961 (43 of 1961),
- 9) In our opinion and according to the information and explanations given to us, the company. has not taken any loans during the year. Accordingly, paragraph 3(ix) (a to f) of the order is not applicable.
- 10) In our opinion and according to the information and explanations given to us, the company. has not raised any money by way of initial public offer or further public offer (including debt instruments) during the year. Accordingly, paragraph 3(x)(a) of the order is not applicable.
- During the year, the Company has not made any preferential allotment or private placement of shares or fully or partly paid convertible debentures and hence reporting under clause 3 (x) (b) of the Order is not applicable to the Company.
- 11) (a) Based on examination of the books and records of the Company and according to the information and explanations given to us, considering the principles of materiality outlined in Standards on Auditing, we report that no fraud by the Company or on the Company has been noticed by us or reported to us during the course of the audit.
- (b) No report under sub-section (12) of Section 143 of the Companies Act, 2013 is required to be filed by cost auditor/secretarial auditor or by us, as statutory auditors of the Company in Form ADT-4 as prescribed under Rule 13 of Companies (Audit and Auditors) Rules, 2014 with the Central Government.
- (c) According to the information and explanations given to us by the Company, we report that no whistle blower complaints have been received by the Company during the course of the audit.
- 12) The Company is not a Nidhi Company. Hence, reporting requirements as mentioned under clause 3(xii) are not applicable to the Company.
- 13) In our opinion and according to the information and explanations given to us by the management; all transactions with the related parties are in compliance with sections 177 and 188 of Companies Act, 2013 where applicable and the details have been disclosed in the Ind AS Financial Statements, as required by the Indian accounting standards 24 "Related Party Disclosures".

- 14) In our opinion and according to the information and explanation given to us, the Company has an internal audit system commensurate with the size and nature of its business.

The reports of the Internal Auditor for the period under audit have been considered by us.

- 15) In our examination of records and books and as per the information and explanation provided to us, the Company has not entered into any non-cash transactions with directors or persons connected with them. Hence, the clause 3(xv) is not applicable to the company.
- 16) (a) According to the information and explanations given to us, the Company is not required to be registered under section 45-IA of the Reserve bank of India Act, 1934.
- (b) The Company has not conducted non-banking financial / housing finance activities during the year. Accordingly, the reporting under Clause 3(xvi)(b) of the Order is not applicable to the Company.
- (C) The Company is not a Core Investment Company (CIC) as defined in the regulations made by the Reserve Bank of India. Accordingly, the reporting under Clause 3(xvi)(c) of the Order is not applicable to the Company.
- (d) Based on the information and explanations provided by the management of the Company, the Group does not have any CIC. Accordingly, the requirements of clause 3(xvi)(d) are not applicable.
- 18) The company has not incurred cash losses in the financial year and in the immediately preceding financial year.
- 19) There has not been any resignation of the statutory auditor during the year. Accordingly Clause 3(xviii) of the Order is not applicable to the Company.
- 20) In our opinion and on the basis of the financial ratios, ageing and expected dates of realization of financial assets and payment of financial liabilities, other information accompanying the financial statements, our knowledge of the Board of Directors and management plans and based on our examination of the evidence supporting the assumptions, nothing has come to our attention, which causes us to believe that any material uncertainty exists as on the date of the audit report that the Company is not capable of meeting its liabilities existing at the date of balance sheet as and when they fall due within a period of one year from the balance sheet date. We, however, state that this is not an assurance as to the future viability of the Company. We further state that our reporting is based on the facts up to the date of the audit report and we give neither any guarantee nor any assurance that all liabilities falling due within a period of one year from the balance sheet date, will be discharged by the Company as and when they fall due.
- 21) Based on the information and explanations provided, in respect of ongoing projects, the Company has transferred unspent Corporate Social Responsibility (CSR) amount of Rs.92.49 as at the end of 31/03/2022, to a Special account in compliance with the provision of section 135(6) of the Act. (Refer Note No. 30(P))
- 22) The reporting under Clause 3(xxi) of the Order is not applicable in respect of audit of standalone financial statements. Accordingly, no comment in respect of the said clause has been included in this report.

For, Anil N. Shah & Co.
Chartered Accountants
FRN. 114131W

Sd./-

Jigna H. Shah
Partner

Membership No. 141825

Place: Ahmedabad

Date: 19/12/2022

UDIN: 22141825BGBEXL7277

“ANNEXURE II” TO INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in paragraph 2 under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report of even date)

Gujarat Power Corporation Ltd.

Report under Section 143 (5) of the Companies Act, 2013

For The Financial Year 2021-22

1. Main Direction

Sr. No.	Questionnaires	Response / Remedial Measure
1	Whether the Company has system in place to process all the accounting transactions through IT System ?If yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes, the Company has system in place to process all the accounting transactions through IT System only. Since , no transaction is processed outside the IT system, there will be no implication of the same on the integrity of the accounts and there will be no financial implication of the same.
2	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/ internet etc. made by a lender to the Company due to the Company’s inability to repay the loan ? If yes, the financial impact may be stated.	Not Applicable
3	Whether funds received / receivable for specific schemes from central/state agencies were properly accounted for /utilized as per its terms and conditions ? List the cases of deviation.	Not Applicable

2 Sub-Directions under section 143(5) of the companies Act, 2013 applicable for the year 2021-22 (Infrastructure Sector)

Sr.No.	Particulars	Remark
1.	Whether the Company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached under litigation, not put to use or declared surplus? Details may be provided	Yes No
2	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/policies of the Government? Comment on deviation if any.	Not Applicable
3	Whether system for monitoring the execution of works vis-a-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenue/losses from contracts, etc. have been properly accounted for in the books.	Yes
4	Whether funds received/receivable for specific schemes from central/state agencies were properly accounted for/utilized? List the cases of deviations.	Yes
5	Whether bank guarantees have been revalidated in time?	Yes
6	Comment on the confirmation of balances of a) trade receivables, trade payables, b) term deposits, bank accounts & cash obtained.	No Yes

7	The cost incurred on abandoned projects may be Quantified and the amount actually written-off shall be mentioned.	Not Applicable
---	---	----------------

3 Power Sector

Sr. No	Particulars	Remarks
1.	Adequacy of steps to prevent encroachment of idle land owned by Company may be examined In case of the Company is encroached , under litigation, not put to use or declared surplus, details may be provided.	Yes Not Applicable
2	Where land acquisition is involved in setting up new projects, report whether settlement of due done expeditiously and in a transparent manner in all cases. The case of deviation may please be detailed.	Yes
3	Whether the Company has an effective system of recovery of revenue as per contractual terms and the revenue is properly accounted for in the books of accounts in compliance with the applicable Accounting Standards.	Yes
4	How much cost has been incurred on abandoned projects and out of this how much cost has been written off?	Not Applicable

4 Generation

S r . No	Particulars	Remarks
1.	In case of Thermal Power Projects, compliance of the various Pollution Control Acts and the impact thereof including utilisation and disposal of ash and the policy of the company in this regard, may be checked and commented upon.	Not Applicable
2	Has the company entered into revenue sharing agreements with private parties for extraction of coal at pitheads and adequately protects the financial interest of the company?	Not Applicable
3	Does the company have a proper system for reconciliation of quality/quantity of coal ordered and received and whether grade of coal moisture and demurrage etc are properly recorded in the books of accounts?	Not Applicable
4	How much share of free power was due to the State Government and whether the same was calculated as per the agreed terms and depicted in the accounts as per accepted accounting norms?	Not Applicable
5	In the case of Hydroelectric Projects the water discharge is as per policy/guidelines issued by the State Government to maintain biodiversity. For not maintaining it penalty paid/ payable may be reported.	Not Applicable

For, Anil N. Shah & Co.
Chartered Accountants
FRN. 114131W

Jigna H. Shah

Partner

Membership No. 141825

Place: Ahmedabad

Date: 19/12/2022

UDIN: 22141825BGBEXL7277

ANNEXURE III” TO INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in clause (f) paragraph 3 under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 (“the Act”)

The “Annexure III” referred to in our Independent Auditor’s Report to the members of the Company on the Ind AS financial statements for the year ended 31 March 2022, we report that we have audited the internal financial controls over financial reporting of Gujarat Power Corporation Ltd. (“the Company”) as of March 31, 2022 in conjunction with our audit of the financial statements of the Company for the year ended on that date.

Management’s Responsibility for Internal Financial Controls

The Company’s management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company’s policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditors’ Responsibility

Our responsibility is to express an opinion on the Company’s internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the “Guidance Note”) and the Standards on Auditing, issued by ICAI and deemed to be prescribed under section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both applicable to an audit of Internal Financial Controls and, both issued by the Institute of Chartered Accountants of India. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor’s judgement, including the assessment of the risks of material misstatement of the Ind AS financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company’s internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls Over Financial Reporting

A company’s internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of the Ind AS financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company’s internal financial control over financial reporting includes those policies and procedures that

(1) pertains to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;

(2) provides reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of the Ind AS financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorisations of management and directors of the company; and

(3) provides reasonable assurance regarding prevention or timely detection of unauthorised acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the Ind AS financial statements.

Inherent Limitations of Internal Financial Controls Over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Company has maintained, in all material respects, an adequate internal financial controls over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at March 31, 2022, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components

of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

For, Anil N. Shah & Co.
Chartered Accountants
FRN. 114131W

Sd./-

Jigna H. Shah

Partner

Membership No. 141825

Place: Ahmedabad

Date: 19/12/2022

UDIN: 22141825BGBEXL7277

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Balance Sheet as at 31st March, 2022

(Amount in Lakhs)

Particulars	Notes	As at 31st March, 2022	As at 31st March, 2021
ASSETS			
Non-current assets			
Property, plant and equipment	2	29,746.64	31,019.32
Mining Development Asset	2	3,811.86	3,951.82
Investment in subsidiary, associate and joint venture	3	3,183.76	3,433.76
Financial assets			
Investments	4	11,783.93	12,895.06
Other financial assets	5	188.28	188.28
Other non-current assets	7	5,556.96	4,752.01
Total non-current assets		54,271.44	56,240.25
Current assets			
Inventories	8	6,354.50	6,135.40
Financial assets			
Trade receivables	9	8,572.69	7,492.68
Cash and cash equivalents	10	146.48	7,334.91
Other bank balances	10	7,744.93	7,711.92
Other financial assets	5	1,02,986.67	84,605.24
Current tax assets	6	23.23	573.68
Other current assets	7	7,200.23	5,022.00
Total current assets		1,33,028.73	1,18,875.83
TOTAL ASSETS		1,87,300.17	1,75,116.08
EQUITY AND LIABILITIES			
Equity			
Equity share capital	11	51,323.27	51,322.56
Other equity	12	78,531.72	70,520.30
Total Equity		1,29,854.99	1,21,842.86
Liabilities			
Non-current liabilities			
Financial liabilities			
Lease liabilities	2	3.60	4.19
Provisions	13	1,558.11	1,429.03
Deferred tax liabilities (Net)	14	4,260.15	4,178.62
Other non-current liabilities	15	5,344.14	5,278.47
Total non-current liabilities		11,166.00	10,890.31
Current Liabilities			
Financial liabilities			
Lease liabilities	2	0.60	0.65
Trade payables	16	583.94	3,285.86
Provisions	13	124.38	62.64
Other current liabilities	15	45,570.26	39,033.76
Total current liabilities		46,279.18	42,382.91
Total Liabilities		57,445.18	53,273.21
TOTAL EQUITY AND LIABILITIES		1,87,300.17	1,75,116.08

Significant Accounting Policies

The accompanying notes are integral part of the financial statements.

1

As per our report of even date attached

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Date : 19/12/2022
Place : Ahmedabad
UDIN:22141825BGBEXL7277

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

Sd/- Sd/-
Mehul J. Danayak **Mamta Verma**
Chief Financial Officer Chairman
DIN: 01854315

Sd/- Sd/-
Krupa N. Joshi **Vikalp Bharadwaj**
Company Secretary Managing Director
DIN: 09396222

Date : 19/12/2022
Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Statement of profit and loss for the year ended 31st March, 2022

(Amount in Lakhs)

Particulars	Notes	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
INCOME			
Revenue from operations	17	45,324.64	26,892.68
Other income	18	257.64	399.83
Finance income	19	5,714.08	4,938.44
TOTAL INCOME (A)		51,296.37	32,230.95
EXPENSES			
Cost of construction and development of plots	20	1,132.83	-
Mining Development Expense	21	34,065.14	19,759.65
Employee benefits expenses	22	283.39	321.42
Finance costs	23	167.66	1,331.05
Depreciation expenses	2	1,295.03	1,316.15
Amortisation expenses	2	140.51	101.26
Other expenses	24	1,428.75	3,632.81
TOTAL EXPENSES (B)		38,513.30	26,462.35
Profit/ (loss) before exceptional items and tax (A-B)		12,783.07	5,768.61
Exceptional Items	3 & 30(K)	(250.00)	-
Profit/ (loss) before tax		12,533.07	5,768.61
Tax expense			
Current Tax		(3,322.74)	(1,769.18)
Short / Excess Provision for Tax		(3.74)	16.94
Deferred Tax	26	(82.35)	107.74
MAT credit entitlement			-
Profit/ (loss) after tax for the period (C)		9,124.24	4,124.11
Other comprehensive income			
Items that will not be reclassified to profit or loss			
Changes in fair value of FVTOCI equity instruments		(1,111.13)	5,627.66
Remeasurement of post-employment benefit obligations		(2.80)	(1.10)
Income tax relating to these items		0.82	0.32
Other comprehensive income for the period, net of tax (D)		(1,113.11)	5,626.88
Total Comprehensive Income for the Period (C+D)		8,011.13	9,750.98
Earning per equity share (EPS) for profit for the period (face value of Rs.100/-)	25		
Basic (Rs.)		17.78	8.15
Diluted (Rs.)		17.78	8.15

 Significant Accounting Policies
 The accompanying notes are integral part of the financial statements.

1

As per our report of even date attached
For Anil N Shah & Co.
 Chartered Accountants
 FRN No.: 114131W

 Sd/-
Jigna H. Shah
 Partner
 M.No. 141825

 Date : 19/12/2022
 Place : Ahmedabad
 UDIN:22141825BGBEXL7277

For and on behalf of the Board of Directors
 (CIN : U40100GJ1990SGC013961)

 Sd/- Sd/-
Mehul J. Danayak **Mamta Verma**
 Chief Financial Officer Chairman
 DIN: 01854315

 Sd/- Sd/-
Krupa N.Joshi **Vikalp Bharadwaj**
 Company Secretary Managing Director
 DIN: 09396222

 Date : 19/12/2022
 Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Cash flow statement for the year ended 31st March, 2022

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
CASH FLOW FROM OPERATING ACTIVITIES		
Net Profit before tax as per statement of profit and loss	12,533.07	5,768.61
Adjustments for:		
Exceptional Items	250.00	-
Depreciation, Amortisation, Depletion & Impairment	1,435.53	1,417.42
Remeasurement of employee benefits	(2.80)	(1.10)
Finance cost	167.66	1,331.05
Loss on sale of asset	0.22	882.75
Dividend income	(161.04)	(161.00)
Interest from inter corporate deposit	(5,714.08)	(4,938.44)
Short / Excess Provision for Tax	(3.74)	16.94
Operating Profit before working capital changes	8,504.82	4,316.22
Adjustments for changes in Working Capital		
Inventories	(219.10)	(2,563.39)
Trade Receivables	(1,080.01)	10,771.46
Other Financial assets	(18,381.43)	(24,370.61)
Other Current Assets	(1,384.92)	701.88
Provisions	(589.24)	167.95
Other Current Liabilities	6,536.50	10,292.03
Trade payables	(2,701.91)	2,387.60
Other Bank Balances	(609.43)	5.02
Cash Generated from Operations	(9,924.72)	1,708.15
Taxes (paid)/ refund	(2,565.92)	(1,577.23)
Net Cash Flow from Operating Activities (A)	(12,490.65)	130.92
CASH FLOW FROM INVESTING ACTIVITIES		
Purchase of Fixed Assets	(23.48)	(21.61)
Dividend on Long-Term Investments	161.04	161.00
Interest from inter corporate deposit	5,494.45	4,818.23
Other Non-Current Assets	(804.95)	54.68
Sale of Fixed Assets	0.36	0.02
Sale of Investment	-	-
Net Cash Flow from Investing Activities (B)	4,827.42	5,012.32
CASH FLOW FROM FINANCING ACTIVITIES		
Proceed from Equity Share issue	0.71	820.00

Share Application Money pending allotment	0.29	-
Finance cost	(167.66)	(117.14)
Interest on grant	-	(1,213.91)
Availment/(Repayment) of Non-current liability	65.02	3,214.92
Net Cash Flow from Financing Activities (C)	(101.64)	2,703.86
Net Increase/(Decrease) in Cash and Cash equivalents (D) (A+B+C)	(7,764.86)	7,847.10
Cash and Cash equivalents at the Beginning of the Year		
Cash on hand	0.51	0.36
Bank Balances	7,334.40	63.88
Liquid deposit	576.42	-
	7,911.34	64.24
Cash and Cash equivalents at the End of the Year		
Cash on hand	0.58	0.51
Bank Balances	145.91	7,334.40
Liquid deposit	-	576.42
	146.48	7,911.34

As per our report of even date attached

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Date : 19/12/2022
Place : Ahmedabad
UDIN:22141825BGBEXL7277

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

Sd/- Sd/-
Mehul J. Danayak **Mamta Verma**
Chief Financial Officer Chairman
DIN: 01854315

Sd/- Sd/-
Krupa N.Joshi **Vikalp Bharadwaj**
Company Secretary Managing Director
DIN: 09396222

Date : 19/12/2022
Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Statement of changes in equity (SOCIE) for the period ended on 31st March 2022**A. Equity Share Capital**

Particulars	No. of Shares	Amount (In lakhs)
Issued, subscribed and paid up share capital		
Equity Shares of Rs. 100/- each fully paid up		
As at 31st March 2020	5,05,02,568	50,502.56
Changes in equity share capital	8,20,000	820.00
As at 31st March 2021	5,13,22,568	51,322.56
Changes in Equity Share Capital due to prior period errors	-	-
Restated balance at the beginning of the current reporting period	-	-
Changes in equity share capital	710	0.71
As at 31st March 2022	5,13,23,278	51,323.27

B. Other equity

(Amount in Lakhs)

Particulars	Reserves & Surplus			Share Pending money Allotment	Equity Instruments through Other Comprehensive Income	Total Equity
	Capital reserve	General reserve	Retained earnings			
Balance as at March 31, 2020	-	37.76	56,454.34	-	4,277.22	60,769.32
Restated balance at the beginning of the reporting period	-	37.76	56,454.34	-	4,277.22	60,769.32
Profit for the year	-	-	4,124.11	-	-	4,124.11
Other comprehensive income for the year	-	-	-	-	5,626.88	5,626.88
Total comprehensive income for the year	-	37.76	60,578.45	-	9,904.10	70,520.30
Add: Contribution towards share capital				820.00		820.00
Issue of Equity Shares	-	-	-	(820.00)	-	(820.00)
Utilisation during the year			-	-		-
Balance as at March 31, 2021	-	37.76	60,578.45	-	9,904.10	70,520.30
Restated balance at the beginning of the reporting period	-	37.76	60,578.45	-	9,904.10	70,520.30
Profit for the year	-	-	9,124.24	-	-	9,124.24
Other comprehensive income for the year	-	-	-	-	(1,113.11)	(1,113.11)
Total comprehensive income for the year	-	37.76	69,702.68	-	8,790.99	78,531.43
Add: Contribution towards share capital				1.00		1.00
Issue of Equity Shares	-	-	-	(0.71)	-	(0.71)
Utilisation during the year			-	-		-
Balance as at March 31, 2022	-	37.76	69,702.68	0.29	8,790.99	78,531.72

As per our report of even date attached

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Date : 19/12/2022
Place : Ahmedabad
UDIN:22141825GBEXL7277

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

Sd/- Sd/-
Mehul J. Danayak **Mamta Verma**
Chief Financial Officer Chairman
DIN: 01854315

Sd/- Sd/-
Krupa N.Joshi **Vikalp Bharadwaj**
Company Secretary Managing Director
DIN: 09396222

Date : 19/12/2022
Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED
Notes to Financial statements for the year ended 31st March 2022

Note 1 Statement of significant Accounting policies and practices

A. General Information

The financial statements comprise financial statements of Gujarat Power Corporation Limited (“the Company”), which is a state government company incorporated under The Companies Act, 2013.

The registered office of the Company is located at 6th Floor, Block No. 6 & 8, Udyog Bhavan, Sector - 11, Gandhinagar - 11.

The Company is engaged in business of generation of power and also been designated as nodal agency by the Government of Gujarat (GoG) for development of solar park.

B. Significant Accounting policies

B.1. Statement of compliance with Ind AS

The standalone financial statements are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) notified under Section 133 of the Companies Act, 2013 including the rules notified under the relevant provisions of the Companies Act, 2013.

B.2. Historical cost convention

The financial statements are prepared on accrual basis of accounting under historical cost convention in accordance with generally accepted accounting principles in India and the relevant provisions of the Companies Act, 2013 including Indian Accounting Standards notified thereunder, except for the following where the fair valuation have been carried out in accordance with the requirements of respective Ind AS:

- Certain financial assets and liabilities measured at fair value
- Defined benefit plans - plan assets measured at fair value

Prior Period/Pre-paid items:

Prior Period items as determined by the management are accounted retrospectively by restating the relevant accounting periods.

B.3. Use of estimates and judgements

The preparation and presentation of the financial statements are in conformity with the Ind AS which requires the management to make estimates, judgments and assumptions that affect the reported amounts of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities. Such estimates and assumptions are based on management’s evaluation of relevant facts and circumstances as on the date of financial statements. The actual outcome may differ from these estimates.

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to the accounting estimates are accounted prospectively.

This policy provides an overview of the areas that involved judgement and items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements. Information about assumptions, estimation and uncertainties that have a significant risk of resulting in a material adjustment within the next financial year are included in the following notes:

- Current / Deferred tax liabilities
- Measurement of employee defined benefit liabilities
- Provisions and contingent liabilities
- Fair valuation of investment

Principles of fair value measurement have been provided in note - L of the significant accounting policies.

B.4. Current versus non-current classification

The Company presents assets and liabilities in the Balance Sheet based on current/non-current classification as per the requirements of Ind AS compliant Schedule III to the Companies Act, 2013.

C. Borrowing costs

Borrowing costs attributable during the acquisition or construction of qualifying assets are capitalized as part of the cost of the assets. A qualifying asset is one that necessarily takes substantial period of time to get ready for intended use. All other borrowing costs are charged to revenue.

D. Property, Plant and Equipment (PPE)

All items of property, plant and equipment are stated at historical cost of acquisition/construction (net of recoverable taxes) less accumulated depreciation and impairment losses, if any.

Historical cost includes expenditure that is directly attributable to the acquisition as well as construction/installation of the items. Subsequent costs are included in the asset's carrying amount or recognized as a separate asset, as appropriate, only when it is probable that future economic benefits associated with the item will flow to the Company and the cost of the item can be measured reliably. All other repairs and maintenance are charged to statement of profit and loss during the reporting period in which they are incurred. Rehabilitation and resettlement expenses incurred after initial acquisition of the assets are expensed to profit or loss in the year in which they are incurred.

Transition to Ind AS:

On transition to Ind AS, the Company has elected to continue with the carrying value of all of its property, plant and equipment including capital work-in-progress recognised as at 1 April 2015 measured as per the previous GAAP and use that carrying value as the deemed cost of the property, plant and equipment.

The present value of the expected cost for the decommissioning of an asset after its use is included in the cost of the respective asset if the recognition criteria for a provision are met.

Capital Work-in-progress includes expenditure that is directly attributable to the acquisition/construction of assets, which are yet to be commissioned.

An item of property, plant or equipment is derecognized upon disposal or when no future economic benefits are expected to arise from the continued use of the asset. Any gain or loss arising on the disposal or retirement of an item of property, plant and equipment is recognized in the statement of profit and loss.

Depreciation on Property, Plant & Equity (PPE) is provided in the manner prescribed in Schedule II to the Companies Act, 2013 read with relevant circulars issued by the Department of Company Affairs. Method of depreciation adopted is Straight Line Method (SLM). Depreciation on assets acquired/disposed off during the year is provided on pro-rata basis.

The estimated useful lives of assets as per SLM are as follows:

Particulars	Useful life
1. Building	3 to 60 Years
2. Plant & machinery	5 to 40 Years
3. Windmill	22 Years
4. Solar park	25 Years
5. Furniture & Fixtures	8 to 10 Years
6. Vehicles	8 Years
7. Computer	3 Years
8. Office Equipment	5 to 35 Years

Mine Development Asset

Mine Development asset generally comprises of initial expenditure for lignite mines and estimated future decommissioning costs.

Decommissioning cost generally includes cost of restoration. Provisions for decommissioning costs are recognized when the Company has a legal or constructive obligation to restore mines, dismantle and remove a facility or an item of property, plant & equipment and to restore the site on which it is located. The full eventual estimated liability towards costs relating to dismantling and restoring mines and allied facilities are recognized in respective mine development asset.

At this stage, estimation of Decommissioning liability is not possible as per the opinion of Mining Expert consulted by the company and so it is concluded that removal of overburden will be part of Mining development asset as and when its reasonable estimation is possible.

Mine development asset is generally amortized either on the basis of quantity of Lignite actually extracted during the year or period based fixed amortization on a yearly basis. However, the Amortization method, once agreed between buyer and seller, is consistently applied over the life of mine.

E. Intangible assets

Intangible assets are measured on initial recognition at cost (net of recoverable taxes, if any). Subsequently, intangible assets are carried at cost less any accumulated amortization and accumulated impairment losses, if any.

F. Government Grants

Grants from the Government are recognized at their fair value where there is a reasonable assurance that the grant will be received and the Company will comply with all attached conditions.

Government grants relating to income are deferred and recognized in the Statement of Profit and Loss over the period necessary to match them with the costs that they are intended to compensate and presented within the other income.

Government grants relating to the purchase or construction of items of property, plant and equipment or investment properties are included in non-financial liabilities as deferred income and credited to Statement of Profit and Loss on a straight line basis over the expected lives of the related assets and presented within the other income.

Financial assistance in the form of revenue subsidy is netted off from related expense. Government grant with condition attached to it are utilized for incurring related expenses and balance in account pending for utilization due to work\part of work being still to be carried out is shown as other current liability.

G. Impairment of non-financial assets

An asset is treated as impaired when carrying cost of asset exceeds its recoverable value. An impairment loss is charged to Statement of Profit and Loss in the year in which an asset is identified as impaired. The impairment loss recognized in prior accounting period is reversed, if there has been a change in estimate of recoverable amount. In case of intangible assets, the same will be tested on periodical basis for impairment.

H. Leases

The determination of whether an arrangement is (or contains) a lease is based on the substance of the arrangement at the inception of the lease. The arrangement is, or contains, a lease if fulfilment of the arrangement is dependent on the use of a specific asset or assets and the arrangement conveys a right to use the asset or assets, even if that right is not explicitly specified in an arrangement.

Lease accounting

Ministry of Corporate Affairs ("MCA") through Companies (Indian Accounting Standards) Amendment Rules, 2019 and Companies (Indian Accounting Standards) Second Amendment Rules, has notified Ind AS 116 Leases which replaces the existing lease standard, Ind AS 17 leases, and other interpretations. Ind AS 116 sets out the principles for the recognition, measurement, presentation and disclosure of leases for both lessees and lessors. It introduces a single, on-balance sheet lease accounting model for lessees.

The adoption of this new Standard has resulted in the Company recognising a right-of-use asset and related lease liability in connection with all former operating leases except for leases having a remaining lease term of less than 12 months from the date of initial application.

The Company has adopted Ind AS 116 using modified retrospective approach from 1 April 2019 and has not restated comparatives for the 2018 reporting period. The Company has measured the lease liability at present value of remaining lease payments discounted by using the weighted average incremental borrowing rate as at the date of initial application and Right of Use asset is measured at an amount equal to lease liability, adjusted by the amount of any prepaid or accrued lease payments relating to that lease recognized in the balance sheet immediately before the date of initial application.

The Company as a lessee

The Company considers whether a contract is, or contains a lease. A lease is defined as 'a contract, or part of a contract, that conveys the right to use an asset (the underlying asset) for a period in exchange for consideration'. To apply this definition, the Company assesses whether the contract meets three key evaluations which are whether:

- the contract contains an identified asset, which is either explicitly identified in the contract or implicitly specified by being identified at the time the asset is made available to the Company
- the Company has the right to obtain substantially all of the economic benefits from use of the identified asset throughout the period of use, considering its rights within the defined scope of the contract
- the Company has the right to direct the use of the identified asset throughout the period of use. The Company assess whether it has the right to direct 'how and for what purpose' the asset is used throughout the period of use.

Measurement and recognition

At lease commencement date, the Company recognises a right-of-use asset and a lease liability in the statement of assets and liabilities. The right-of-use asset is measured at cost, which includes the initial measurement of the lease liability, any initial direct costs incurred by the Company, an estimate of any costs to dismantle and remove the asset at the end of the lease, and any lease payments made in advance of the lease commencement date (net of any incentives received).

The Company depreciates the right-of-use assets on a straight-line basis from the lease commencement date to the earlier of the end of the useful life of the right-of-use asset or the end of the lease term. The Company also assesses the right-of-use asset for impairment when such indicators exist.

At the commencement date, the Company measures the lease liability at the present value of the lease payments unpaid at that date, discounted using the interest rate implicit in the lease if that rate is readily available or the Company's incremental borrowing rate.

Subsequent to initial measurement, the liability will be reduced for payments made and increased for interest. It is remeasured to reflect any reassessment or modification, or if there are changes in in-substance fixed payments.

When the lease liability is re-measured, the corresponding adjustment is reflected in the right-of-use asset, or profit and loss if the right-of-use asset is already reduced to zero.

The Company has elected to account for short-term leases and leases of low-value assets using the practical expedients.

Instead of recognising a right-of-use asset and lease liability, the payments in relation to these are recognised as an expense in profit or loss on a straight-line basis over the lease term.

The Company as a lessor

At the inception of the lease the Group classifies each of its leases as either an operating lease or a finance lease. The Company recognises lease payments received under operating leases as income on a straight-line basis over the lease term. In case of a finance lease, finance income is recognised over the lease term based on a pattern reflecting a constant periodic rate of return on the lessor's net investment in the lease. When the Company is an intermediate lessor it accounts for its interests in the head lease and the sub-lease separately. It assesses the lease classification

of a sub-lease with reference to the right-of-use asset arising from the head lease, not with reference to the underlying asset. If a head lease is a short-term lease to which the Group applies the exemption described above, then it classifies the sub-lease as an operating lease.

I. Non-current assets held for sale and discontinued operations

Non-current assets are classified as held for sale if their carrying amount will be recovered principally through a sale transaction rather than through continuing use and a sale is considered highly probable. They are measured at the lower of their carrying amount and fair value less costs to sell, except for assets such as deferred tax assets, assets arising from employee benefits, financial assets and contractual rights under insurance contracts, which are specifically exempt from this requirement.

Non-current assets are not depreciated or amortized while they are classified as held for sale. Non-current assets classified as held for sale are presented separately from the other assets in the balance sheet.

A discontinued operation is a component of the Company that has been disposed of or is classified as held for sale and that represents a separate major line of business or geographical area of operations, is part of a single coordinated plan to dispose of such a line of business or area of operations, or is a subsidiary acquired exclusively with a view to resale. The results of discontinued operations are presented separately in the statement of profit and loss.

J. Financial instruments

A financial instrument is any contract that gives rise to a financial asset of one entity and a financial liability or equity instrument of another entity.

Financial assets

Initial recognition

A financial asset is recognized in the balance sheet when the Company becomes party to the contractual provisions of the instrument.

Initial measurement

At initial recognition, the Company measures a financial asset (which are not measured at fair value) through profit or loss at its fair value plus or minus transaction costs that are directly attributable to the acquisition or issue of the financial asset.

Subsequent measurement

For purpose of subsequent measurement, financial assets are classified into:

- A. Financial assets measured at amortized cost;
- B. Financial assets measured at Fair Value Through Profit or Loss (FVTPL); and
- C. Financial assets measured at Fair Value Through Other Comprehensive Income (FVOCI).

The Company classifies its financial assets in the above mentioned categories based on:

- A. The Company's business model for managing the financial assets, and
- B. The contractual cash flows characteristics of the financial asset.

A financial asset is measured at amortized cost if both of the following conditions are met:

- A. The financial asset is held within a business model whose objective is to hold financial assets in order to collect contractual cash flows and
- B. The contractual terms of the financial assets give rise on specified dates to cash flows that are solely payments of principal and interest (SPPI) on the principal amount outstanding.

Amortized cost of a financial asset or financial liability means the amount at which the financial asset or financial liability is measured at initial recognition minus the principal repayments, plus or minus the cumulative amortization

using the effective interest rate method of any difference between that initial amount and the maturity amount and, for financial assets, adjusted for any loss allowance.

Financial assets are subsequently measured at amortised cost using the effective interest rate (EIR) method. Amortised cost is calculated by taking into account any discount or premium on acquisition and fees or costs that are an integral part of the EIR. The EIR amortisation is included in finance income in the profit or loss. The losses arising from impairment are recognised in the profit or loss.

A financial asset is measured at fair value through other comprehensive income if both of the following conditions are met:

- A. The financial asset is held within a business model whose objective is achieved by both collecting the contractual cash flows and selling financial assets and
- B. The asset's contractual cash flows represents SPPI.

A financial asset is measured at fair value through profit or loss unless it is measured at amortised cost or at fair value through other comprehensive income. In addition, the Company may elect to designate a financial asset, which otherwise meets amortized cost or FVOCI criteria, as at FVTPL. However, such election is allowed only if doing so reduces or eliminates a measurement or recognition inconsistency (referred to as 'accounting mismatch').

Trade receivables

Trade receivables are recognised initially at fair value and subsequently measured at amortised cost, less provision for impairment.

Equity instruments

All equity investments in scope of Ind AS 109 are measured at fair value. Equity instruments which are held for trading are classified as at FVTPL. For all other equity instruments, the Company may make an irrevocable election to present in other comprehensive income subsequent changes in the fair value. The Company makes such election on an instrument by-instrument basis. The classification is made on initial recognition and is irrevocable.

If the Company decides to classify an equity instrument as at FVOCI, then all fair value changes on the instrument, excluding dividends, are recognized in the Other Comprehensive Income (OCI). On sale of investments, cumulative gain or loss is recognised in OCI and the amount is not reclassified to profit or loss. Equity instruments included within the FVTPL category are measured at fair value with all changes recognised in the Profit and Loss.

The company has elected to measure its equity instrument through FVOCI.

Derecognition

- A financial asset (or, where applicable, a part of a financial asset or part of a group of similar financial assets) is primarily derecognised (i.e. removed from the Company's balance sheet) when:
 - A. The contractual rights to the cash flows from the financial asset have expired, or
 - B. The Company has transferred its rights to receive cash flows from the asset or has assumed an obligation to pay the received cash flows in full without material delay to a third party under a 'pass-through' arrangement; and either
 - i) The Company has transferred substantially all the risks and rewards of the asset, or
 - ii) The Company has neither transferred nor retained substantially all the risks and rewards of the asset, but has transferred control of the asset.

When the Company has transferred its rights to receive cash flows from an asset or has entered into a pass-through arrangement, it evaluates if and to what extent it has retained the risks and rewards of ownership. When it has neither transferred nor retained substantially all of the risks and rewards of the asset, nor transferred control of the asset, the Company continues to recognise the transferred asset to the extent of the Company's continuing involvement. In that case, the Company also recognises an associated liability. The transferred asset and the associated liability are measured on a basis that reflects the rights and obligations that the Company has retained.

Continuing involvement that takes the form of a guarantee over the transferred asset is measured at the lower of the original carrying amount of the asset and the maximum amount of consideration that the Company could be required to repay.

Impairment of financial assets

The Company assesses impairment based on expected credit loss (ECL) model to the following:

- A. Financial assets measured at amortised cost
- B. Financial assets measured at fair value through other comprehensive income

Expected credit losses are measured through a loss allowance at an amount equal to:

- A. The 12-months expected credit losses (expected credit losses that result from those default events on the financial instrument that are possible within 12 months after the reporting date); or
- B. Full time expected credit losses (expected credit losses that result from all possible default events over the life of the financial instrument).

The Company follows 'simplified approach' for recognition of impairment loss allowance on trade receivables. It recognises impairment loss allowance based on lifetime ECLs at each reporting date, right from its initial recognition. At every reporting date, the historical observed default rates are updated and changes in the forwardlooking estimates are analysed.

For recognition of impairment loss on other financial assets and risk exposure, the Company determines that whether there has been a significant increase in the credit risk since initial recognition. If credit risk has not increased significantly, 12-months ECL is used to provide for impairment loss. However, if credit risk has increased significantly, lifetime ECL is used. If, in a subsequent period, credit quality of the instrument improves such that there is no longer a significant increase in credit risk since initial recognition, then the Company reverts to recognising impairment loss allowance based on 12-months ECL.

ECL impairment loss allowance (or reversal) recognized during the period is recognized as income/ expense in the statement of profit and loss. The balance sheet presentation for various financial instruments is described below:

A. Financial assets measured as at amortised cost and contractual revenue receivables - ECL is presented as an allowance, i.e., as an integral part of the measurement of those assets in the balance sheet. The allowance reduces the net carrying amount. Until the asset meets write-off criteria, the company does not reduce impairment allowance from the gross carrying amount.

B. Financial assets measured at FVOCI - Since financial assets are already reflected at fair value, impairment allowance is not further reduced from its value. Rather, ECL amount is presented as accumulated impairment amount in the OCI.

For assessing increase in credit risk and impairment loss, the Company combines financial instruments on the basis of shared credit risk characteristics with the objective of facilitating an analysis that is designed to enable significant increases in credit risk to be identified on a timely basis.

Financial Liabilities

Initial recognition and measurement

All financial liabilities are recognised initially at fair value and, in case of loans and borrowings and payables, net of directly attributable transaction costs.

Subsequently, all financial liabilities are measured at amortised cost or at fair value through profit or loss. The Company's financial liabilities include trade and other payables, loan and borrowings including bank overdrafts.

Subsequent measurement

- A. Financial liabilities measured at amortised cost
- B. Financial liabilities subsequently measured at fair value through profit or loss

Financial liabilities at fair value through profit or loss include financial liabilities held for trading and financial liabilities designated upon initial recognition as at fair value through profit or loss. Financial liabilities are classified as held for trading if they are incurred for the purpose of repurchasing in the near term. Gains or losses on liabilities held for trading are recognised in the profit or loss.

Financial liabilities designated upon initial recognition at fair value through profit or loss are designated as such at the initial date of recognition, and only if the criteria in Ind AS 109 are satisfied. For liabilities designated as FVTPL, fair value gains/ losses attributable to changes in own credit risk are recognized in OCI. These gains/ loss are not subsequently transferred to profit or loss. However, the Company may transfer the cumulative gain or loss within equity. All other changes in fair value of such liability are recognised in the statement of profit or loss. The Company has not designated any financial liability as at fair value through profit or loss.

Trade and other payables

These amounts represent liability for goods and services provided to the Company prior to the end of financial year which are unpaid. Trade and other payables are presented as current liabilities unless payment is not due within 12 months after the reporting period. They are recognised initially at fair value and subsequently measured at amortised cost using the effective interest rate method.

Derecognition

A financial liability is derecognised when the obligation under the liability is discharged or cancelled or expires. When an existing financial liability is replaced by another from the same lender on substantially different terms, or the terms of an existing liability are substantially modified, such an exchange or modification is treated as the derecognition of the original liability and the recognition of a new liability. The difference in the respective carrying amounts is recognised in the statement of profit or loss.

K. Offsetting financial instruments

Financial assets and financial liabilities are offset and the net amount is reported in the balance sheet when, and only when, there is a legally enforceable right to offset the recognised amount and there is intention either to settle on net basis or to realise the assets and to settle the liabilities simultaneously. The legally enforceable right must not be contingent on future events and must be enforceable in the normal course of business and in the event of default, insolvency or bankruptcy of the Company or counterparty.

L. Fair value

The Company measures certain financial instruments at fair value at each balance sheet date. The fair value measurement is based on the presumption that the transaction to sell the asset or transfer the liability takes place either:

- A. In the principal market for the asset or liability, or
- B. In the absence of a principal market, in the most advantageous market for the asset or liability.

The principal or the most advantageous market must be accessible by the Company. The fair value of an asset or a liability is measured using the assumptions that market participants would use when pricing the asset or liability, assuming that market participants act in their best economic interest.

The Company uses valuation techniques that are appropriate in the circumstances and for which sufficient data are available to measure fair value, maximizing the use of relevant observable inputs and minimising the use of unobservable inputs.

All assets and liabilities for which fair value is measured or disclosed in the financial statements are categorised within the fair value hierarchy, described as under, based on the lowest level input that is significant to the fair value measurement as a whole:

- A. Level 1 - Quoted (unadjusted) market prices in active markets for identical assets or liabilities.
- B. Level 2 - Valuation techniques for which the lowest level input that is significant to the fair value measurement is directly or indirectly observable.

- C. Level 3 - Valuation techniques for which the lowest level input that is significant to the fair value measurement is unobservable.

For assets and liabilities that are recognised in the financial statements on a recurring basis, the Company determines whether transfers have occurred between levels in the hierarchy by re-assessing categorisation (based on the lowest level input that is significant to the fair value measurement as a whole) at the end of each reporting period.

This note summarises the accounting policy for fair value. Other fair value related disclosures are given in the relevant notes.

M. Inventories

Inventories comprises of Developed Plots. Developed Plots comprises of cost of land acquisition, construction & development cost, cost of materials, service and other expenditure related to the solar park - 1 project, valued at cost. Developed Plots are valued at lower of cost or net realisable value.

N. Employee benefits

i. Short term employee benefit obligations

Liabilities for wages, salaries, including non-monetary benefits that are expected to be settled wholly within 12 months after the end of the period in which the employees render the related services are recognised in respect of employees' services up to the end of the reporting period and are measured at the amounts expected to be paid when the liabilities are to be settled. The liabilities are presented as current employee benefit obligations in the balance sheet.

ii. Other long term employee benefit obligations

The liabilities for earned leave and sick leave are not expected to be settled wholly within 12 months after the end of the period in which employees render the related service. They are therefore measured as the present value of expected future payments to be made in respect of services provided by employees up to the end of reporting period using the projected unit credit method. The benefits are discounted using the market yield at the end of reporting period that have terms approximating to the terms of related obligation. Remeasurement as a result of experience, adjustments and changes in actuarial assumptions are recognised in the statement of profit and loss.

iii. Post-employment obligations

The Company operates the following post-employment schemes:

- A. Defined benefit plan such as gratuity; and
- B. Defined benefit plan such as Leave encashment
- C. Defined contribution plan such as provident fund

Gratuity obligations

Gratuity obligation is measured on the basis of annual third party actuarial valuation and recognized during the period when employees rendered the services. Company offers its employees, defined benefit plans in the form of gratuity schemes. The company contributes funds to Life Insurance Corporation of India. The premium amount paid every year is charged to profit and loss account.

Leave encashment

Provision for leave encashment is determined and accrued on the basis of actuarial valuation.

Provident fund

Contribution to provident fund, a defined contribution plan, are made in accordance with the rules of the statute and are recognized as expense when employees have rendered service entitling them to the contributions.

O. Foreign currency transactions

Foreign currency transactions are translated into the functional currency using the exchange rates at the date of the transactions. Foreign exchange gains and losses resulting from the settlement of such transactions and from the

translation of monetary assets and liabilities denominated in foreign currencies at the year-end exchange rates are generally recognised in profit or loss.

P. Revenue recognition

Revenue is recognized when no significant uncertainty as to the measurability or collectability exists. Revenue is measured at the fair value of the consideration received or receivable. Revenue is reduced for rebates and other similar allowances.

Revenue (i.e. premium and development charged collected) from plot given on lease is recognized when no significant uncertainty as to measurability or collectability exist and when all the significant risk & rewards of ownership have been passed to the buyer as per agreed terms. The amount received from customers which does not qualify for revenue recognition is accounted for as other current liabilities under the head advance from customer. The amount receivable from customers against the revenue recognized is accounted for as current asset under the head trade receivables.

As per Ind AS-115, revenue is recognised upon satisfaction of performance obligation.

Revenue from services is recognized as and when services are rendered taking into account contractual terms.

Revenue from power generation is recognized taking into account contractual terms.

Interest income is recognized on time proportion basis taking into account the amount outstanding and the rate applicable

Dividend is accounted when the right to receive payment is established.

Q. Expenses

Operating expenses and cost of construction and development charges are charged to profit and loss account on the basis of proportion of allocation of plots in its solar park area at Charankha.

Expenses incurred on the projects 700MW Ultra Mega Project- Raghnesda and 1000 MW Solar Project- Dholera are transferred to work-in-progress inventory as the projects have just commenced.

R. Taxation

Income tax

The income tax expense or credit for the period is the tax payable on the current period's taxable income based on the applicable income tax rate adjusted by changes in deferred tax assets and liabilities attributable to temporary differences and to unused tax losses.

The current income tax charge is calculated on the basis of the tax laws enacted or substantively enacted at the end of the reporting period. Current income tax assets and liabilities are measured at the amount expected to be recovered from or paid to the taxation authorities, based on the rates and tax laws enacted or substantively enacted, at the reporting date. Current tax items are recognised in correlation to the underlying transaction either in OCI or directly in equity.

Deferred taxes

Deferred tax is provided in full on temporary difference arising between the tax bases of the assets and liabilities and their carrying amounts in standalone financial statements.

Deferred income tax is determined using tax rates (and laws) that have been enacted or substantially enacted by the end of the reporting period and are expected to apply when the related deferred income tax asset is realized or the deferred income tax liability is settled. Deferred tax assets are recognised for all deductible temporary differences and unused tax losses only if it is probable that future taxable amounts will be available to utilize those temporary differences and losses.

Deferred tax assets and liabilities are offset when there is a legally enforceable right to offset current tax assets and liabilities and when the deferred tax balances relate to the same taxation authority. Current tax assets and tax liabilities

are offset where the Company has a legally enforceable right to offset and intends either to settle on a net basis, or to realize the asset and settle the liability simultaneously.

Current tax and deferred tax are recognised in the Statement of Profit and Loss, except to the extent that it relates to items recognised in other comprehensive income or directly in equity. In this case, the tax is also recognised in other comprehensive income or directly in equity, respectively. Any tax credit available is recognised as deferred tax to the extent that it is probable that future taxable profit will be available against which the unused tax credits can be utilised.

The said asset is created by way of credit to the statement of profit and loss and shown under the head deferred tax asset.

The carrying amount of deferred tax assets is reviewed at each reporting date and reduced to the extent that it is no longer probable that sufficient taxable profit will be available to allow all or part of the deferred tax asset to be utilised. Unrecognised deferred tax assets are re-assessed at each reporting date and are recognised to the extent that it has become probable that future taxable profits will allow the deferred tax asset to be recovered.

S. Provisions, contingent liabilities and contingent assets

Provisions are recognised at present value when the Company has a present obligation (legal or constructive) as a result of a past event, it is probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation and a reliable estimate can be made of the amount of the obligation. The expense relating to a provision is presented in the statement of profit and loss net of any reimbursement.

Decommissioning costs are provided at the present value of expected costs to settle the obligation using estimated cash flows and are recognised as part of the cost of PPE. The cash flows are discounted at a current pre-tax rate that reflects the risk specific to the decommissioning liability. The unwinding of discount is expensed as incurred and recognised in the statement of profit and loss as a finance cost. The estimated future costs of decommissioning are reviewed annually and adjusted as appropriate. Changes in the estimated future costs or in the discount rate applied are added to or deducted from the cost of the asset.

Contingent liabilities are not provided for, if material, are disclosed by way of notes to accounts. Contingent assets are not recognised in financial statements. However, the same is disclosed, where an inflow of economic benefit is probable.

T. Cash and Cash Equivalents

Cash and cash equivalents comprise cash and deposits with banks. The Company considers all highly liquid investments with a remaining maturity at the date of purchase of twelve months or less and that are readily convertible to known amounts of cash to be cash equivalents.

For the purpose of presentation in the statement of cash flows, cash and cash equivalents includes cash on hand, other short term, highly liquid investments with original maturities of three months or less that are readily convertible to known amounts of cash and which are subject to an insignificant risk of changes in value, and bank overdrafts. Bank overdrafts are shown within borrowings in current liabilities in the balance sheet.

U. Statement of Cash Flows

Cash flows are reported using the indirect method, whereby profit before tax is adjusted for the effects of transactions of a non-cash nature, any deferrals or accruals of past or future operating cash receipts or payments and item of income or expenses associated with investing or financing cash flows. The cash flows from operating, investing and financing activities of the Company are segregated.

V. Events occurring after the Reporting Date

Adjusting events (that provides evidence of condition that existed at the balance sheet date) occurring after the balance sheet date are recognized in the financial statements. Material non adjusting events (that are inductive of conditions that arose subsequent to the balance sheet date) occurring after the balance sheet date that represents material change and commitments affecting the financial position are disclosed in the financial statements .

W. Exceptional items

Certain occasions, the size, type or incidence of an item of income or expense, pertaining to the ordinary activities of the Company is such that its disclosure improves the understanding of the performance of the Company, such income or expense is classified as an exceptional item and accordingly, disclosed in the notes accompanying to the financial statements.

X. Segment reporting

GPCL during the year was engaged in the business of development of projects related to power and generation of power. Its activities and revenue from activities are associated with Energy sector only and hence, as per Ind AS-108 "Operating Segments" issued by the Institute of Chartered Accountants of India, the company has single reportable segment. Details of which are presented as other note 30(O)

Y. General Note

A cut off date for recording and closing of accounts of F.Y. 2021-22 is 31/05/2022.

Date of approval of financial statements of F.Y.2021-22 is 19/12/2022.

Notes to Financial statements for the year ended 31st March 2022

Note : 2 Property, Plant & Equipment

For the year 2021-22

Particulars	Gross Block				
	As at 1st April 2021	Addition during the year	Disposal/ Adjustment	IND AS Measurement	As at 31st March 2022
LAND	6,783.67				6,783.67
BUILDING	5,670.36				5,670.36
PLANT & MACHINERY	1,839.62				1,839.62
OFFICE EQUIPMENT	4,387.81	2.49			4,390.30
FURNITURE & FIXTURE	140.34	0.44			140.78
COMPUTERS	198.52	20.55	11.60		207.47
VEHICLE	82.60				82.60
WIND MILL	12,218.04				12,218.04
SOLAR PARK	12,308.97				12,308.97
TOTAL	43,629.94	23.48	11.60	0.00	43,641.82

For the year 2020-21

Particulars	Gross Block				
	As at 1st April 2020	Addition during the year	Disposal/ Adjustment	IND AS Measurement	As at 31st March 2021
LAND	6,783.67	46.44	46.44		6,783.67
BUILDING	6,643.59		973.23		5,670.36
PLANT & MACHINERY	1,875.04	0.35	35.76		1,839.62
OFFICE EQUIPMENT	4,377.76	10.08	0.03		4,387.81
FURNITURE & FIXTURE	316.18	0.15	175.99		140.34
COMPUTERS	198.52	0.00	0.00		198.52
VEHICLE	82.60	0.00	0.00		82.60
WIND MILL	12,218.04	0.00	0.00		12,218.04
SOLAR PARK	12,308.97	0.00	0.00		12,308.97
TOTAL	44,804.37	57.03	1,231.45	0.00	43,629.94

(Amount in Lakhs)

Depreciation and Amortization					Net Block	
As at 1st April 2021	For the year	Disposal/ Adjustment	IND AS Measurement	As at 31st March 2022	As at 31st March 2022	As at 31st March 2021
					6,783.67	6,783.67
1,401.96	86.04			1,488.00	4,182.36	4,268.41
632.45	77.11			709.56	1,130.06	1,207.17
1,476.76	150.90			1,627.65	2,762.65	2,911.06
127.32	4.69			132.02	8.76	13.02
188.54	0.94	11.02		178.47	29.01	9.98
77.86	0.59			78.44	4.16	4.74
5,011.04	515.18			5,526.22	6,691.82	7,207.00
3,700.64	459.57			4,160.21	8,148.76	8,608.34
12,616.56	1,295.03	11.02	0.00	13,900.57	29,741.26	31,013.38

(Amount in Lakhs)

Depreciation and Amortization					Net Block	
As at 1st April 2020	For the year	Disposal/ Adjustment	IND AS Measurement	As at 31st March 2021	As at 31st March 2021	As at 31st March 2020
0.00					6,783.67	6,783.67
1,433.91	93.89	125.84		1,401.96	4,268.41	5,209.68
574.66	77.31	19.52		632.45	1,207.17	1,300.38
1,326.74	150.01			1,476.76	2,911.06	3,051.01
268.26	15.94	156.87		127.32	13.02	47.92
187.44	1.10			188.54	9.98	11.08
74.70	3.15			77.86	4.74	7.90
4,495.86	515.18			5,011.04	7,207.00	7,722.18
3,241.06	459.57			3,700.64	8,608.34	9,067.91
11,602.64	1,316.15	302.24	0.00	12,616.56	31,013.38	33,201.73

Note:

- 1) Pursuant to the enactment of Companies Act 2013, the company has applied the estimated useful lives as specified in Schedule II as disclosed in Accounting Policy on Depreciation/Amortisation. Accordingly the unamortised carrying value is being depreciated / amortised over the revised/remaining useful lives.
- 2) There is a first charge over the hypothecated Assets of Rs. 61,14,46,519/- pertaining to 10 MW Solar Project for all the obligation of the Company as per power purchase agreement and VGF Securitisation Act with SECI.

Note 2
LEASES
A. Effect of Leases as lessee

Qualitative information on nature of leasing activities, terms, conditions, asset class taken on lease etc.

The following is the carrying amounts of Company's Right of use assets and the movement in lease liabilities during the year ended March 31, 2022:

a. Right of Use Asset on Land

Particulars	For the year 2021-22 (Amount in Lakhs)	For the year 2020-21 (Amount in Lakhs)
Gross Carrying Value		
Opening Balance	5.94	-
Additions on account of transition to Ind AS 116 (at April 01, 2020)	-	-
Additions during the year	-	11.03
Deductions	-	-
Closing Balance (A)	5.94	11.03
Accumulated amortisation		
Opening Balance	-	-
Charge for the year	0.55	5.09
Deduction/Adjustment during the year	-	-
Closing Balance (B)	0.55	5.09
Net balance as at 31st March, 2022 (C=A-B)	5.38	5.94

b. Lease Liability

Particulars	For the year 2021-22 (Amount in Lakhs)	For the year 2020-21 (Amount in Lakhs)
Opening Balance	4.84	-
Additions on account of transition to Ind AS 116 (on April 01, 2019)	-	-
Additions during the year	-	11.03
Finance costs incurred	(0.65)	3.38
Adjustment of Lease Liabilities	-	(9.57)
Closing balance	4.19	4.84
Current Portion	0.60	0.65
Non-Current Portion	3.60	4.19

c. Amounts recognised in profit or loss

Particulars	For the year 2021-22 (Amount in Lakhs)	For the year 2020-21 (Amount in Lakhs)
2021-22 - Leases under Ind AS 116		
Amortization Expenses of Right to Use Asset	0.55	5.09
Interest Expenses on Lease Liability	(0.65)	3.38
Total Amounts recognised in profit or loss	(0.10)	8.47

d. Disclosure of Short Term Lease and low-value asset

Particulars	(Amount in Lakhs)
2020-21 - Leases under Ind AS 116	
Expenses relating to short-term leases (&)	-
Expenses relating to leases of low-value assets, excluding short-term leases of low-value assets	-

Maturity Analysis of lease liability :

(Amount in Lakhs)

Particulars	31st March 2022		31st March 2021	
	Minimum Lease Payments	Present Value of MLP	Minimum Lease Payments	Present Value of MLP
Not Later than 1 year	1.48	0.60	1.48	0.65
Later Than 1 year and not later than 5 years	7.41	1.96	7.41	2.55
Later Than 5 years	5.57	1.64	7.05	1.64
Total Minimum Lease Payments	14.46	4.19	15.94	4.84
Less:- Amounts representing finance charges	-	-	-	-
Present Value of Minimum lease payments	14.46	4.19	15.94	4.84

The interest rate of borrowing i.e., 8.45% is used as the discount rate in calculating the present value of the minimum lease payments

Note 2 Mining Development Assets

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Initial Development Expenditure		
Opening Balance	3,951.82	4,047.99
Add: Recognition during the year	-	-
Less: Amortised during the year	(139.95)	(96.17)
Closing Balance	3,811.86	3,951.82

Asset For Decommissioning Liability *

*The Government of Gujarat vide its various orders have granted mining lease for lignite for 25 years from respective dates covering the area of 1355 hectares. The said lease provides to use all lignite excavated from the above area for use in BLTPS power plants. As per the agreement MDO is bound to excavate about 33.50MMT of lignite, which is covered under the lignite mining fee, as per the terms and conditions of agreement. At this stage, estimation of decommissioning cost cannot be ascertained to estimate the unwinding cost of Ghogha Surka Lignite Mining Project as per the opinion of Technical Mining Expert. In view thereof, as per the principle of IND AS 37 "provisions, contingent liabilities and contingent assets for the future decommissioning of mines at the end of their economic lives can not be made."

Note 3**Investments in Subsidiary, Associate and Joint venture (Unquoted)**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Non-Current		
A. Investments in unquoted equity shares of Subsidiary, Associate and Joint Ventures		
Baitarni West Coal Company Limited (BWCCCL) (As at 31st March 2022 : 1,00,000; As at 31st March 2021 : 1,00,000 Equity shares of Rs. 1000 each fully paid up)	1,000.00	1,000.00
Torrent Pipavav Generation Limited (TPGL)* Less: Permanent diminution	250.00 (250.00)	250.00 -
(As at 31st March 2022: 25,00,000; As at 31st March 2021 : 25,00,000 Equity shares of Rs. 10 each fully paid up)	-	250.00
GSPC Pipavav Power Company Limited (GPPCL) As at 31st March 2022 : 2,18,37,627; As at 31st March 2021 : 2,18,37,627 Equity shares of Rs. 10 each fully paid up)	2,183.76	2,183.76
Total investments in Subsidiary, Associate and Joint venture	3,183.76	3,433.76

*Torrent Pipavav Generation Limited ("TPGL"), a joint venture between the Company and Torrent Power Limited, had made payments in nature of compensation for acquisition of private land as per the court orders in Amreli, Gujarat for the purpose of developing a coal-based power plant of 1,000+ MW. Due to non-availability of fuel linkage, Government

of Gujarat ("GoG") vide its letter dated December 06, 2017, communicated that the said project may not be developed and accordingly, the joint venture is intended to be dissolved. Further, as per the said letter, the cost of land would be reimbursed after the disposal of land. With reference to this, in the month of March 2019, GPCL has written a letter to Collector, Amreli stating that the land is surrendered to the Government of Gujarat and requested Energy and Petroleum Department, GoG to take further action in the matter. It is learnt that the Government of Gujarat is exploring the possibility of usage of Land for industrial purpose. The management has made an impairment assessment of the amount recoverable from Government of Gujarat and concluded that there is no impairment in the carrying amount of the land. The timing of the recoverability of the amounts invested in land would depend upon the availability of the buyer. Considering the above facts, assets and liabilities are reflected at their net realisable values or cost whichever is lower and the financial statements of TPGL for the year ended March 31, 2022 have been prepared on a non - going concern basis. Therefore the company has considered permanent diminution in value of investment.

Refer note no. 29 & 30(K)

Note 4

Investments

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Non-current investments		
A. Investment in quoted equity shares of other companies (measured at Fair Value Through OCI) (FVTOCI)		
Gujarat Industrial Power Company Limited (GIPCL) (As at 31st March 2022 : 49,77,491; As at 31st March 2021 : 49,77,491 Equity shares of Rs. 10 each fully paid up)	3,655.97	3,770.45
Gujarat Gas Limited (GGL) (As at 31st March 2022 : 1332235 Equity shares of Rs.2 each fully paid up; As at 31st March 2021 : 1332235 Equity shares of Rs.2 each fully paid up)	6,704.47	7,319.97
B. Investment in unquoted equity shares of other companies (measured at Fair Value Through OCI)(FVTOCI)		
Gujarat State Energy Generation Limited (GSEGL) (As at 31st March,2022: 1,58,15,454 Equity Shares of Rs.10 each fully paid up,As at 31st March,2021: 1,58,15,454 Equity Shares of Rs.10 each fully paid up)	1,423.39	1,804.54
Kalupur Bank (As at 31st March 2022 : 400 Equity shares of Rs. 25 each fully paid up, As at 31st March 2021 : 400 Equity shares of Rs. 25 each fully paid up)	0.10	0.10
Total non-current investments	11,783.93	12,895.06

Refer Note-29-Fair Value Measurement

Current investments

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Other Current Investments	-	-
Total Current investments	-	-

Note 5

Other financial assets

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Non-Current		
Security & Other deposit	188.28	188.28
Total non-current financial assets	188.28	188.28
Current		
Deposits with Corporate Bodies	1,02,986.67	84,605.24
Total current deposits	1,02,986.67	84,605.24

Note 6**Current tax asset**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Advance Income Tax for the year	1,785.00	882.00
TDS Receivable	755.34	678.36
TCS Receivable	25.58	16.87
Provision for Income tax of the year	(2,542.70)	(1,003.55)
Current Tax asset (net)	23.23	573.68

Note 7**Other assets**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Non-Current		
Capital Advance	393.54	17.63
O&M Income receivable	1,336.44	922.13
Lease rent receivable	224.83	-
Advance Income Tax (Net of Provision of Tax)	3,552.66	2,566.30
House Building Advance		
Others	49.49	49.49
Total other non-current assets	5,556.96	4,752.01
Current		
Project Development Cost*	850.29	1,004.10
Receipt in transit from State Government Treasury Gandhinagar	-	-
Interest accrued but not due on:		
(a) Deposits with banks	86.56	71.63
(b) Bond	1.68	3.29
(c) Deposits with corporate bodies	2,515.73	2,309.42
O&M Income receivable	237.11	233.66
Current maturity of receivable towards fixed asset	70.00	70.00
Other		
Advances for Gogha surkha Mine Project	-	853.17
Amount Recoverable from GWIL	-	99.64
Prepaid expenses	75.55	74.25
Service Tax Receivable	3.29	3.29
GST Receivable	3,355.58	294.56
Other	4.44	4.98
Total other current assets	7,200.23	5,022.00

*Project development cost includes consultancy fees paid for 1000 MW coal based Pipavav Project. In view of the same an amount of Rs. 1.54 crores has been transferred to provision for doubtful debts as mentioned in note No. 30(G)

Note 8**Inventories**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2020
Developed Plots/Work in progress of Solar Park - 1 Charankha	2,547.78	3,235.30
Development cost towards 700MW Ultra Mega Project- Raghnesda	3,753.93	2,880.37
Development cost towards 1000 MW Solar Project- Dholera	52.78	19.73
Total inventories	6,354.50	6,135.40

Note 9
Trade receivables

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Trade receivables considered good-secured	2,138.02	887.21
Trade receivables considered good-unsecured	6,434.67	6,605.48
Trade receivables which have significant increase in credit risk		-
Trade receivables - credit impaired	11.67	11.67
	8,584.36	7,504.35
Allowance for bad and doubtful debts	(11.67)	(11.67)
Total trade receivables	8,572.69	7,492.68

Ageing schedule is given as a separate note

Note 10
Cash and cash equivalents

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Cash and bank balances		
Balances with banks		
In current accounts	145.91	7,334.40
Cash on hand	0.58	0.51
Total cash and cash equivalents	146.48	7,334.91
Other bank balances		
Margin money deposits	7,744.93	7,135.50
Liquid deposit	-	576.42
Total other bank balances	7,744.93	7,711.92

FY 2021-22
Gross Trade Receivables ageing schedule

(Amount in Lakhs)

Particulars	"Outstanding for following periods from due date of payment"					Total
	"Less than 6 months"	"6 months - 1 year"	"1-2 years"	"2-3 years"	"More than 3 years"	
(i) Undisputed Trade receivables – considered good	1,754.79	5,766.15	863.30	12.18	176.27	8,572.69
(ii) Undisputed Trade Receivables – which have significant increase in credit risk						-
(iii) Undisputed Trade Receivables – credit impaired					11.67	11.67
(iv) Disputed Trade Receivables – considered good						-
(v) Disputed Trade Receivables – which have significant increase in credit risk						-
(vi) Disputed Trade Receivables – credit impaired						-
	1,754.79	5,766.15	863.30	12.18	187.94	8,584.36

FY 2020-21

Gross Trade Receivables ageing schedule

(Amount in Lakhs)

Particulars	"Outstanding for following periods from due date of payment"					Total
	"Less than 6 months"	"6 months - 1 year"	"1-2 years"	"2-3 years"	"More than 3 years"	
(i) Undisputed Trade receivables – considered good	6.79	37.55	7,272.07	176.27	-	7,492.68
(ii) Undisputed Trade Receivables – which have significant increase in credit risk						-
(iii) Undisputed Trade Receivables – credit impaired					11.67	11.67
(iv) Disputed Trade Receivables – considered good						-
(v) Disputed Trade Receivables – which have significant increase in credit risk						-
(vi) Disputed Trade Receivables – credit impaired						-
	6.79	37.55	7,272.07	176.27	11.67	7,504.35

Note 11
Equity share capital

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Authorised share capital		
6,00,00,000 equity shares of Rs. 100 each (31st March, 2022 : 6,00,00,000 equity shares of Rs. 100 each)	60,000.00	60,000.00
Total	60,000.00	60,000.00

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Issued, subscribed and paid up capital		
5,13,23,263 equity shares of Rs. 100 each (P.Y. 5,13,22,553 equity shares of Rs. 100 each)	51,323.26	51,322.55
Fractional certificates/warrants- 15 shares representing one half of equity share	0.01	0.01
Total	51,323.27	51,322.56

Reconciliation of the shares outstanding at the beginning and at the end of the reporting period

Particulars	No of shares	Amount in Lakhs
As at 31st March 2021	5,13,22,560.50	51,322.56
At the beginning of the year	5,13,22,560.50	51,322.56
Add : Shares issued during the year	710.00	0.71
As at 31st March 2022	5,13,23,270.50	51,323.27

Details of shareholder(s) holding more than 5% Equity Shares

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Number of Equity Shares		
Government of Gujarat	4,93,93,172	4,93,92,462
% Holding in equity shares		
Government of Gujarat	0.96	0.96

Notes
Terms /Rights attached to equity shares

a) The Company has only one class of equity shares having a par value of Rs. 100 per share. Each Shareholder is eligible for one vote per share, without restrictions and are entitled to dividend, as and when declared. The dividend proposed by Board of Directors, if any, is subject to the approval of shareholders in the ensuing Annual General Meeting, except in case of interim dividend. In the event of liquidation, all the equity shareholders rank equally and are eligible to receive the remaining assets of the Company, after distribution of all preferential amounts.

b) The Company has not allotted any share pursuant to Contract(s) without payment being received in cash during the period of 5 years immediately preceding the Balance Sheet date.

c) The company has not bought back its shares during the period of 5 years immediately preceding the Balance Sheet date.

Details of Promoter(s) holding:

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Number of Equity Shares		
Governor of Gujarat	4,93,93,172.00	4,93,92,462.00
GUVNL	19,30,013.00	19,30,013.00
Nominee of GoG	32.50	32.50
Nominee of GUVNL	32.50	32.50
Individual	20.50	20.50
Share Holding Percentage (%)		
Governor of Gujarat	96.2393%	96.2393%
GUVNL	3.7605%	3.7606%
Nominee of GoG	0.0001%	0.0001%
Nominee of GUVNL	0.0001%	0.0001%
Individual	0.0000%	0.0000%

Note 12
Other equity

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
General Reserve	37.76	37.76
Retained Earnings	69,702.68	60,578.45
Share application money pending allotment	0.29	-
Reserves representing unrealized gains/losses	8,790.99	9,904.10
Total other equity	78,531.72	70,520.30
Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
General reserve		
Opening Balance	37.76	37.76
Total general reserve	37.76	37.76

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Retained earnings		
Opening Balance	60,578.45	56,454.34
Add:		
Profit during the year	9,124.24	4,124.11
Total retained earnings	69,702.68	60,578.45

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Share application money pending allotment		
Opening Balance	-	-
Add: During the year	1.00	820.00
(Less): During the year	(0.71)	(820.00)
Total Share application money pending allotment	0.29	-

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Reserves representing unrealized gains/losses		
FVOCI - equity investments		
Opening Balance	9,904.10	4,277.22
Increase/(Decrease) fair value of FVOCI equity instruments	(1,111.13)	5,627.66
Remeasurement of post-employment benefit obligations	(2.80)	(1.10)
Income tax relating to these items	0.82	0.32
Total reserves representing unrealized gains/losses	8,790.99	9,904.10

Note 13**Provisions**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Non-Current		
Provision for gratuity	18.00	9.82
Provision for leave encashment	151.79	133.74
Asset Retirement Obligation - ARO	1,388.32	1,285.48
Total non-current provisions	1,558.11	1,429.03
Current		
Provision for Gratuity	4.25	4.45
Provision for expenses	120.13	58.19
Total current provisions	124.38	62.64

Note 14**Deferred tax Asset/(Liability)**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Deferred tax Asset	541.85	431.52
Total	541.85	431.52
Deferred tax Liability	4,802.00	4,610.14
Total	4,802.00	4,610.14
Net Deferred Tax (Asset)/Liability	4,260.15	4,178.62

Note 15**Other liabilities**

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Non-current		
Trade payables		
(a) Total outstanding dues of creditors other than micro enterprises and small enterprises	304.55	218.74
(b) Total outstanding dues of micro enterprises and small enterprises	-	-
Others	5,039.59	5,059.73
Total non-current liabilities	5,344.14	5,278.47

Current		
Stutory dues	381.02	305.24
Employee benefit payable	0.19	1.88
Advance from customers	21,564.03	20,954.03
Grant pending utilisation	694.23	3,604.70
Interest payable on Grant	44.71	-
Interest Payable to GEDA on Grant	1,122.87	1,122.87
Earnest Money Deposit	192.11	226.07
CSR Payable	335.97	272.11
Others	21,235.12	12,546.85
Total current liabilities	45,570.26	39,033.76

Note 16
Trade payables

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Total outstanding dues of creditors other than micro enterprises and small enterprises	483.24	3,285.86
Total outstanding dues of micro enterprises and small enterprises	100.70	-
Total trade payables	583.94	3,285.86

* Ageing schedule is given as a separate note

*The company has not received intimation from many suppliers regarding their status under Micro, Small and Medium Enterprise Development Act, 2006. Further, there are no Micro and Small enterprise to whom company owes dues, which are outstanding for more than 45 days as on 31st March, 2022. This information is required to be disclosed under the said Act, has been determined to the extent such parties have been identified on the basis of information available with the company.

Trade Payables ageing schedule
FY 2021-22

Particulars	Outstanding for following periods from due date of payment#				Total
	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
(i) MSME					-
(ii) Others	492.48		18.37	73.09	583.94
(iii) Disputed dues- MSME					-
(iv) Disputed dues- Others					-

Trade Payables ageing schedule
FY 2020-21

Particulars	Outstanding for following periods from due date of payment#				Total
	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
(i) MSME					-
(ii) Others	3,194.39	18.37		73.09	3,285.86
(iii) Disputed dues- MSME					-
(iv) Disputed dues- Others					-

Note 17**Revenue from operations**

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
Sale of Goods		
Revenue from Lignite Projects *	37,900.76	22,680.65
Sale of services		
Revenue from plot given on lease	1,710.42	-
Revenue from generation of Electricity	2,987.14	2,471.79
Less: Rebate on Sale of Electricity	(45.99)	(118.64)
Less: DSM charges- Windmill projects	(6.49)	(4.60)
Less: DSM charges- Solar power projects	(260.28)	(175.28)
Less: Green Incentive Expense	-	(32.64)
	42,285.55	24,821.28
Other operating revenues		
Lease Rent	656.97	146.34
Recovered Towards O&M	2,382.12	1,924.25
Other Operating Income	-	0.80
	3,039.09	2,071.40
Total revenue from operations	45,324.64	26,892.68

* Fuel Supply Agreement (FSA) between GPCL and GSECL is under process and will be executed once finalized. As an adhoc interim arrangement, GPCL has requested GSECL to release amount paid by GPCL to the MDO towards mining fees.

Note 18**Other income**

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
Dividend on Long-Term Investments	161.04	161.00
Dividend on Long-Term Investments (Bank)	-	-
Insurance claim received	14.31	0.13
Tender Fees	0.09	2.26
Miscellaneous income	82.20	236.44
	257.64	399.83
Total other income	257.64	399.83

Note 19**Finance income**

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
Interest income		
Interest on Inter Corporate Deposit	5,414.59	4,569.27
Interest on Deposits	299.49	369.15
Other Interest	-	0.02
Total finance income	5,714.08	4,938.44

Note 20

Cost of construction and development of plots

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
Solar Park-1		
Opening Balance of cost of construction and development of plots	3,235.30	3,235.90
Add: Incurred/Transferred during the year	460.30	-
Less: Adjusted during the year	(15.00)	(0.60)
Less: Closing Balance	(2,547.78)	(3,235.30)
Cost of construction	1,132.83	-
700MW Raghnesda UMSSP		
Opening Balance of cost of construction and development of plots	2,880.37	318.24
Add: Incurred/Transferred during the year	1,111.39	2,570.38
Less: Adjusted during the year	(237.82)	(8.26)
Less: Closing balance	(3,753.93)	(2,880.37)
Cost of construction	-	-
Dhorela Project		
Opening Balance of cost of construction and development of plots	0.00	17.87
Add: Incurred/Transferred during the year	33.05	1.87
Less: Adjusted during the year	-	-
Less: Closing balance	(33.05)	(19.73)
Cost of construction	-	-
Total Cost of construction and development of plots	1,132.83	-

Note 21

Mining Development Expense

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
Lignite Mining Development Expense	34,065.14	19,759.65
Total Mining Development Expense	34,065.14	19,759.65

Note 22

Employee benefit expenses

(Amount in Lakhs)

Particulars	For the year ended 31st March, 2022	For the year ended 31st March, 2021
Salary, wages and allowances	217.74	241.81
Contribution to provident fund and other funds	18.47	30.28
Manpower supply Expense	45.45	48.51
Staff welfare expenses	1.73	0.82
Total employee benefit expenses	283.39	321.42

Note 23**Finance costs**

(Amount in Lakhs)

Particulars	For the year ended	For the year ended
	31st March, 2022	31st March, 2021
Bank guarantee charges	19.28	18.54
Interest on Grant (*)	-	1,213.91
Interest on Grant	44.71	
Interest on leasehold asset	0.84	3.38
Unwinding of discount on provision of Asset Retirement Obligation	102.84	95.22
Total finance costs	167.66	1,331.05

(*) GPCL receives financial assistance from Government and the same is parked in ICD with Gujarat State Financial Services Limited (GSFS Ltd.) by GPCL on which interest is received and such interest received by GPCL is to be given to Government. Hence GPCL recorded income and expense thereof and as per IND AS -1 said transaction has been routed through statement of Profit & Loss for better understanding of financial statements and clarity. Since IND AS -1 categorically states that "An entity shall not offset assets and liabilities or income and expenses unless required or permitted by IND AS"

Note 24**Other expenses**

(Amount in Lakhs)

Particulars	For the year ended	For the year ended
	31st March, 2022	31st March, 2021
(A) Repair & Maintenance		
Plant & Machinery	570.83	734.52
Insurance	77.49	75.77
Professional fee	52.93	38.22
Scheduling & Accounting fee	0.92	0.89
Travelling expense	6.97	3.20
Water charges	23.92	1,167.77
Other repair & maintenance	21.85	29.06
	754.91	2,049.43
(B) Other		
Lease Rent	81.65	-
Rent	36.09	44.46
Loss on transfer of asset	0.22	882.75
Rates & Taxes	24.30	0.49
Advertisement and Selling Expenses	1.65	71.83
Electricity Expense	6.52	7.36
Interest on Tax	7.23	0.17
CSR / Donation [(Refer note no. 30(P))]	242.27	405.65
Doubtful Debts [(Refer note no. 30(G))]	153.81	-
Other expense	118.52	169.52
	672.24	1,582.22
(C) As Statutory Auditors		
	1.59	1.15
	1.59	1.15
Total other expenses (A+B+C)	1,428.75	3,632.81

Note 25
Earning per share

Particulars	For the year ended	For the year ended
	31st March, 2022	31st March, 2021
Profit attributable to equity holders for :		
Basic earnings	91,24,23,871	41,24,10,939
Adjusted for the effect of dilution	-	-
Weighted average number of equity Shares for:		
Basic EPS	5,13,22,703	5,06,01,417
Adjusted for the effect of dilution	151	-
Earnings Per Share (Rs.):		
Basic	17.78	8.15
Diluted	17.78	8.15

22.1 DISCLOSURES FOR GRATUITY & LEAVE SALARY PROVISIONS AS PER INDIAN ACCOUNTING STANDARD - 19

Company has participated in Group Gratuity scheme of Life Insurance Corporation of India. The liability in respect of gratuity benefits & leave salary being defined benefit schemes, payable in future, are determined by actuarial valuation as on balance sheet date.

In arriving at the valuation for gratuity & leave salaries following assumptions were used:

Particulars	2021-22		2020-21	
	Gratuity	Leave Salary	Gratuity	Leave Salary
Mortality	Indian Assured Lives Mortality (2012-14) Ult.		Indian Assured Lives Mortality (2012-14) Ult.	
Withdrawal rate	5% at younger age reducing to 1% at old age		5% at younger age reducing to 1% at old age	
Retirement Age	58 & 60 years		58 & 60 years	
Discount Rate	6.10%	6.10%	6.05%	6.05%
Rate of Return on Plan Assets	6.45%	6.45%	6.45%	6.45%
Salary escalation	7.00%	7.00%	7.00%	7.00%

The following table sets out status of gratuity plan and leave salary as required under Indian Accounting Standard 19 on "Employee Benefit".

Particulars	2021-22		2020-21	
	Gratuity	Leave Salary	Gratuity	Leave Salary
Table showing change in benefit obligation				
Opening defined benefit obligation	162.00	134.00	162.03	120.93
Interest Cost	9.69	8.00	10.29	7.70
Current Service Cost	4.45	5.34	5.64	5.01
Benefit Paid	-	-	(17.18)	(11.23)
Actuarial Loss / (gain) on Obligations	4.44	4.72	1.69	11.33
Past service cost				
Liability at the end of the period	181.00	152.00	162.00	134.00

Table showing change in Fair Value of Plan Assets

Fair Value of Plan Assets at the beginning	148.00	-	154.78	-
Adjustment to Opening fund	-	-	-	-
Expected Return on Plan Assets	1.64	-	0.59	-
Contributions	-	-	-	-
Actuarial loss/ (gain) due to experience adjustments	-	-	-	-
Interest Income	8.96	-	10.01	-
Benefit paid	-	-	(17.18)	-
Actuarial gain /(loss) on Plan Assets	-	-	-	-
Fair Value of Plan Assets at the end of the period	159.00	-	148.00	-

Particulars	2021-22		2020-21	
	Gratuity	Leave Salary	Gratuity	Leave Salary
Actual Gain / loss recognized				
Actuarial (gain) / loss on obligations	14.00	4.72	7.25	11.33
Actuarial (gain) / loss on Plan Assets	1.64	-	0.59	-
Net Actuarial (gain) / loss recognized during year	16.00	5.00	8.00	11.00
Amount recognized in Balance Sheet				
Liability at the end of the period	181.00	152.00	162.00	134.00
Fair Value of Plan Asset at the end of the period	159.00	-	148.00	-
Net Amount recognized in Balance Sheet	22.00	152.00	14.00	134.00
Expense recognized in the Statement of Profit and Loss				
Current Service cost	4.45	5.34	5.64	5.01
Interest cost	0.73	8.00	0.28	7.70
Expected return on Plan Asset	-	-	-	-
Net Actuarial Loss / (gain) to be recognized	-	4.72	-	11.33
Adjustment to Opening fund/Prior year Charges	-	-	-	-
Net Expense recognized in P&L	5.18	18.05	5.92	24.04
Expense recognized in the Statement of Other Comprehensive Income				
Due to change in financial assumption	(0.37)	(0.32)	3.12	2.77
Due to change in demographic assumption	-	-	-	-
Due to experience adjustment	4.81	5.04	(1.43)	8.56
Return on plan assets excluding amounts included in interest income	(1.64)	-	(0.59)	-
Net Expense recognized in OCI	2.80	4.72	1.10	11.33

Sensitivity Analysis

Reasonably possible changes at the reporting date to one of the relevant actuarial assumptions, holding other assumptions constant, would have affected the defined benefit obligation by the amounts shown below:

Gratuity	2021-22		2020-21	
	Increase	Decrease	Increase	Decrease
Discount rate - 0.5% (PY: 0.5%)	177.45	184.77	158.58	166.50
Salary growth rate - 0.5% (PY: 0.5%)	181.81	180.23	163.60	161.74

Leave salary	2021-22		2020-21	
	Increase	Decrease	Increase	Decrease
Discount rate - 0.5% (PY: 0.5%)	148.64	155.04	130.29	137.32
Salary growth rate - 0.5% (PY: 0.5%)	155.00	148.65	137.27	130.31

26. Effective tax calculation & Deferred tax asset/ (liabilities) [Net]

A) Tax expense		
Amount recognised in statement of profit and loss		
Particulars	For the period ended 31st March, 2022	For the period ended 31st March, 2021
Current income tax	3,322.74	1,769.18
Deferred income tax liability / (asset), net		
Origination and reversal of temporary differences	82.35	(107.74)
Recognition of previously unrecognised tax losses		
Change in recognised deductible temporary differences		
Deferred tax expense	82.35	(107.74)
Excess provision of income tax in respect of previous years	-	(16.94)
Total tax expense for the year	3,405.09	1,644.50
Amount recognised in other comprehensive income		
Particulars	For the period ended 31st March, 2022	For the period ended 31st March, 2021
Items that will not be reclassified to profit or loss (A)		
Changes in fair value of FVTOCI equity instruments	(2.80)	(1.10)
Changes in fair value of equity instruments	(1,111.13)	5,627.66
	(1,113.93)	5,626.55
Income tax relating to items that will not be reclassified to profit or loss (B)		
Changes in fair value of FVTOCI equity instruments	0.82	0.32
	0.82	0.32
Net amount recognised in other comprehensive income (A+B)		
Remeasurements of the defined benefit plans	(1.99)	(0.78)
Equity instruments through other comprehensive income	(1,111.13)	5,627.66
	(1,113.11)	5,626.88
Reconciliation of effective income tax rate		
Particulars	For the period ended 31st March, 2022	For the period ended 31st March, 2021
Profit before tax	12,533.07	5,768.61
Tax using the Company's domestic tax rate @ 29.12% (Previous Year @ 29.12%)	3,649.63	1,679.82
Reduction in tax rate		
Tax effect of:		
Non-deductible tax expenses		
Depreciation as per Profit and Loss Account	418.03	412.75
CSR Expenses	70.55	118.12
Other Disallowances	74.97	257.10
Impact on account of Ind AS	(91.46)	(35.03)
Disallowance U/s 43B		-
Any sum payable by way of contribution to any provident fund or superannuation fund or gratuity fund or any other fund for the welfare of employees-Labour Cess, Gratuity & Leave Encashment	7.58	5.77
Deductions		

Depreciation as per Income tax act	(221.92)	(259.00)
Deduction allowable - Others		
Dividend Income	-	-
Actuarial Loss recorded in OCI	(0.82)	(0.32)
Impact on account of Ind AS	(0.19)	
Deduction under Chapter VI-A	(583.62)	(410.04)
Recognition of deferred tax	82.35	(107.74)
Short/(Excess) Provision of tax for earlier years	-	(16.94)
Tax expense recognised in statement of profit and loss	3,405.09	1,644.50

B) Movement in deferred tax balances

Particulars	"Net balance April 1, 2021"	31st March, 2022			
		Recognised in profit or loss	Net	Deferred tax asset	Deferred tax liability
Deferred tax asset/ (liabilities)					
On excess of carrying value of PPE over Tax base	(4,095.66)	(79.05)	(4,174.71)	-	(4,174.71)
Decommissioning obligations - Provision	374.33	29.95	404.28	404.28	-
Asset Retirement Obligation - Windmill	(113.90)	8.15	(105.75)	-	(105.75)
Carried forward of loss	-	-	-	-	-
O&M Income Receivable	(336.56)	(121.65)	(458.22)	-	(458.22)
Fair Value of Investment	(11.09)	0.73	(10.36)	-	(10.36)
Other items	(52.60)	-	(52.60)	-	(52.60)
Rates & Taxes, Leave encashment, labour cess & Gratuity	57.19	7.58	64.77	64.77	-
Effect Due to IND AS 116	(0.32)	(0.03)	(0.35)	-	(0.35)
Provision for Diminution in value of Investment	-	72.80	72.80	72.80	-
Tax assets/ (liabilities)	(4,178.62)	(81.53)	(4,260.15)	541.85	(4,802.00)
Set off tax					
Net tax assets/ (liabilities)	(4,178.62)	(81.53)	(4,260.15)	541.85	(4,802.00)

Notes

1. The company offsets tax assets and liabilities if and only if it has a legally enforceable right to set off current tax assets and current tax liabilities and the deferred tax assets and deferred tax liabilities relate to income taxes levied by the same tax authority.
2. Significant management judgement is required in determining provision for income tax, deferred income tax assets and liabilities and recoverability of deferred income tax assets. The recoverability of deferred income tax assets is based on estimates of taxable income by each jurisdiction in which the relevant entity operates and the period over which deferred income tax assets will be recovered.

Note 27 Related Party disclosures

As per IND AS 24 'Related Party Disclosure', and Companies Act, 2013, the disclosure of transactions with the related parties are given below:

A. Related Parties

S.No	Particulars	Relationship
1	Baitarni West Coal Company Limited	Associate Company
2	Gujarat Urja Vikas Nigam Limited	Promoter
3	Sunaina Tomar, IAS	" Chairman (Upto 15/06/2021) "
4	Mamta Verma, IAS	" Chairman (From 09/07/2021) "
5	S.B Khayalia	" Managing Director (Key Managerial Personnel) (Upto 30/09/2021) "
6	Vikalp Bharadwaj, IAS	" Managing Director (Key Managerial Personnel) (From 11/11/2021) "
7	Shri Praful Hardevrai Rana	Director
8	"Ms.Dipal Hadiyal (w.e.f 23/12/2020)"	Nominee Director
9	Shri. Mehul J. Danayak	" Chief Financial Officer (Key Managerial Personnel) "
10	Ms. Krupa Joshi	" Company Secretary (Key Managerial Personnel) "

B. Related Party Transaction

(Amount in ₹)

Sr. No.	Particulars	2021-22 Rs.	2020-21 Rs.
A	Transactions During The Year		
	Sale of Electricity to GUVNL	1,878.59	1,321.94
	Director sitting fees		
	P. H. Rana	0.30	0.27
	Mamta Verma	0.09	-
	Vikalp Bharadwaj	0.18	-
	P.K. Taneja	0.15	0.06
	Dipal Hadiyal	0.21	0.03
	Anju Sharma	-	0.06
	R. G. Desai	-	0.06
	Sunaina Tomar	-	0.12
	Director expenses		
	P. H. Rana	0.18	0.09
	R.G.Desai	-	0.01
	Prakash S. Shah	-	-
	Mahesh Singh	-	0.01
	Mamta Verma	0.06	-
	Vikalp Bharadwaj	0.12	-
	P.K. Taneja	0.10	0.02
	Anju Sharma	-	0.04
	Sunaina Tomar	-	0.04
	S. B. Khayalia	0.04	0.09
	Dipal Hadiyal	0.14	0.01
	Salary and Allowances		
	Mehul Danayak	20.38	18.11
	S.B. Khayalia	22.13	90.14
	Ms. Krupa Joshi	10.16	9.26
Sr. No	Particulars	31st March 2022	31st March 2021
		Rs.	Rs.
B	Closing balance		
	Receivable towards sale of electricity from GUVNL	107.22	205.41

Note 28**A. Financial instruments by category and their fair value**

(Amount in Lakh)

As at 31st March 2022	Carrying amount				Fair value			
	FVTPL	FVTOCI	Amotised Cost	Total	Level 1 - Quoted price in active markets	Level 2 - Significant observable inputs	Level 3 - Significant unobservable inputs	Total
Financial assets								
Investments								
Quoted		10,360.44	-	10,360.44	10,360.44			10,360.44
Unquoted		1,423.49	-	1,423.49			1,423.49	1,423.49
Other financial assets								
Current			1,02,986.67	1,02,986.67				
Trade Receivables			8,572.69	8,572.69				
Cash and Cash Equivalents			146.48	146.48				
Other Bank Balances			7,744.93	7,744.93				
Other financial assets			-	-				
Non-current			188.28	188.28			188.28	188.28
Total financial assets		11,783.93	1,19,639.06	1,31,422.99	10,360.44		1,611.77	11,972.21
Financial liabilities								
Borrowings								
Non-current								
Other financial liabilities								
current			0.60	0.60				
Non-current			5,347.74	5,347.74				
Trade Payables			583.94	583.94				
Total financial liabilities			5,931.68	5,932.28				

As at 31st March 2021	Carrying amount				Fair value			
	FVTPL	FVTOCI	Amotised Cost	Total	Level 1 - Quoted price in active markets	Level 2 - Significant observable inputs	Level 3 - Significant unobservable inputs	Total
Financial assets								
Investments								
Quoted		11,090.41	-	11,090.41	11,090.41			11,090.41
Unquoted		1,804.64	-	1,804.64			1,804.64	1,804.64
Other financial assets								
Current			84,605.24	84,605.24				
Trade Receivables			7,492.68	7,492.68				
Cash and Cash Equivalents			7,334.91	7,334.91				
Other Bank Balances			7,711.92	7,711.92				
Other financial assets			-	-				
Non-current			188.28	188.28			188.28	188.28
Total financial assets		12,895.06	1,07,333.04	1,20,228.10	11,090.41		1,992.92	13,083.34
Financial liabilities								
Borrowings								
Non-current								
Other financial liabilities								
current			0.65					
Non-current			5,282.67	5,282.67				
Trade Payables			3,285.86	3,285.86				
Total financial liabilities			8,568.52	8,568.52				

Fair value of financial assets and liabilities measured at amortised cost is not materially different from the amortised cost. Further, impact of time value of money is not significant for the financial instruments classified as current. Accordingly, the fair value has not been disclosed separately.

Types of inputs are as under:

Input Level I (Directly Observable) which includes quoted prices in active markets for identical assets such as quoted price for an equity security on Security Exchanges.

Input Level II (Indirectly Observable) which includes prices in active markets for similar assets such as quoted price for similar assets in active markets, valuation multiple derived from prices in observed transactions involving similar businesses etc.

Input Level III (Unobservable) which includes management's own assumptions for arriving at a fair value such as projected cash flows used to value a business etc.

B. Measurement of fair values
Valuation techniques and significant unobservable inputs

The following tables show the valuation techniques used in measuring Level 2 and Level 3 fair values, as well as the significant unobservable inputs used.

Financial instruments measured at fair value

FVTOCI in unquoted equity shares	<p><u>“Investments in Equity Shares of Subsidiaries & Equity Accounted Entities as on the transition date:</u> GSEG - Equity valuation of GSEG at the transition date has been carried out using discounted cash flow (DCF) method. Free cash flows to equity (“FCFE”) have been discounted at 14% cost of equity to arrive at equity valuation.</p> <p><u>Investments in Equity Shares of Other Entities :</u> Kalupur Bank - Investment in the shares of Kalupur Bank was made at the time of taking loan from it, 400 shares at a price of Rs. 25/- were purchased. However the said loan has got repaid in the F.Y. 2016-17 and hence the said shares are expected to be sold off. In view of the aforesaid scenario, and materiality concept due to its meagre value, the said investment has been presented at its carrying cost.”</p>
---	--

Transfers between Levels 1 and 2

There have been no transfers between Level 1 and Level 2 during the reporting periods.

Level 3 fair values

Movements in the values of unquoted equity instruments for the period ended 31st March, 2022 is as below:

((Amount in Lakh)

Particulars	Amount
As at 1 April 2021	1,804.64
Gains/ (losses) recognised in other comprehensive income	(381.15)
As at 31 March 2022	1,423.49

Transfer out of Level 3

There were no transfers out of level 3 during the year 2020-21 and 2021-22.

C. Financial risk management

The Company’s principal financial liabilities comprises of loans & borrowings and trade & other payables. The main purpose of these financial liabilities is to finance the Company operations and to provide guarantees to support its operations. The Company’s principal financial assets include trade & other receivables, cash & cash equivalents and investments that are derived directly from its operations. The Company has exposure to the following risks arising from financial instruments:

- i. Credit risk
- ii. Liquidity risk
- iii. Market risk

(i) Credit risk

Credit risk is the risk that a customer or counterparty to a financial instrument will fail to perform or fail to pay amounts due causing financial loss to the company. The potential activities where credit risks may arise include from cash and cash equivalents, derivative financial instruments and deposits with financial institutions and principally from credit exposures to customers relating to outstanding receivables.

Trade receivables

Significant portion of trade receivables at the respective reporting date comprise of PSUs and entities with significant government influence. Further, Management does not expect any credit risk on the same.

Other financial assets

“Other financial assets comprise of cash and cash equivalents, loans provided to employees and investments in equity shares of companies other than subsidiaries, associates and joint ventures.

- Cash and cash equivalents and Bank deposits are placed with banks having good reputation and past track record

with adequate credit rating. The Company reviews their credit-worthiness at regular intervals.

- Investments are made in credit worthy companies.”

(ii) Liquidity risk

Liquidity risk is the risk that the Company will encounter difficulty in meeting the obligations associated with its financial liabilities that are proposed to be settled by delivering cash or other financial asset. The Company's financial planning has ensured, as far as possible, that there is sufficient liquidity to meet the liabilities whenever due, under both normal and stressed conditions, without incurring unacceptable losses or risking damage to the Company's reputation.

Exposure to liquidity risk

The following are the remaining contractual maturities of financial liabilities at the reporting date. The amounts are gross / undiscounted values and include estimated interest payments and exclude the impact of netting agreements.

(Amount in Lakh)

31st March, 2022	Contractual cash flows based on maturity			
	Carrying amount	Total	Less than 12 months	More than 12 months
Non-derivative financial liabilities				
Non current borrowings	-	-	-	-
Current borrowings	-	-	-	-
Non current financial liabilities	5,344.14	5,344.14	-	5,344.14
Current financial liabilities	45,570.26	45,570.26	45,570.26	-
Trade and other payables	583.94	583.94	583.94	-
Total	51,498.35	51,498.35	46,154.20	5,344.14

(Amount in Lakh)

31st March, 2021	Contractual cash flows based on maturity			
	Carrying amount	Total	Less than 12 months	More than 12 months
Non-derivative financial liabilities				
Non current borrowings	-	-	-	-
Current borrowings	-	-	-	-
Non current financial liabilities	5,278.47	5,278.47	-	5,278.47
Current financial liabilities	39,033.76	39,033.76	39,033.76	-
Trade and other payables	3,285.86	3,285.86	3,285.86	-
Total	47,598.09	47,598.09	42,319.62	5,278.47

(iii) Market risk

Market risk is the risk or uncertainty arising from possible market price movements and their impact on the present/ future performance of a business. The market risks include price risk, currency risk and interest rate risk. The primary price risk for the company is commodity price risk i.e. price risk of that could adversely affect the value of the Company's financial assets, liabilities or expected future cash flows.

Equity price risk

The Company's exposure to equity securities price risk arises from investments held by the Company which are classified in the balance sheet as fair value through other comprehensive income (FVOCI). The captioned equity investments are publicly traded as they are listed on the NSE Nifty 50 Index.

Sensitivity

The table below summarises the impact of increases/decreases of the index on the Company's other comprehensive income for the period. The analysis is based on the assumption that the index had increased average of the movements in quoted prices of equity shares held as investments for the respective periods. All other variables held constant.

Particulars	Impact on Other Comprehensive Income	
	As at 31st March, 2022	As at 31st March, 2021
NSE NIFTY 50 - increase 30% (31 March 2020 - 20%)	3,108.13	3,327.12
NSE NIFTY 50 - decrease 30% (31 March 2020 - 20%)	(3,108.13)	(3,327.12)

Interest rate risk

Interest rate risk can be either fair value interest rate risk or cash flow interest rate risk. Fair value interest rate risk is the risk of changes in fair values of fixed interest bearing investments because of fluctuations in the interest rates. Cash flow interest rate risk is the risk that the future cash flows of floating interest bearing investments will fluctuate because of fluctuations in the interest rates. The Company does not have any undrawn or outstanding borrowings at fluctuating rate of interest and hence does not possess any interest rate risk.

D. Capital management

“The Company’s objectives when managing capital are to:

- safeguard their ability to continue as a going concern, so that they can continue to provide returns for shareholders and benefits for other stakeholders, and
- maintain an optimal capital structure to reduce the cost of capital.

The Company monitors capital using a ratio of ‘adjusted net debt’ to ‘adjusted equity’. For this purpose, adjusted net debt is defined as total non-current liabilities, less cash and cash equivalents. Adjusted equity comprises all components of equity.”

The Company’s adjusted net debt to equity ratio on 31st March, 2022 was as follows.

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
Total non-current liabilities	11,166.00	10,890.31
Less : Cash and bank balances	7,891.41	15,046.84
Adjusted net debt	3,274.59	(4,156.53)
Total equity	1,29,854.99	1,21,842.86
Adjusted net debt to adjusted equity ratio	0.025:1 times	-0.034:1 times

Note 29

Details of investments in jointly controlled entities made by the company

Sr. No.	Name of the entity	Country of incorporation	Proportion of ownership interest	Proportion of ownership interest	Name of other partners	Principal Activities
1	Torrent Pipavav Generation Limited	India	5%	95%	Torrent Power Ltd.	Coal Based power plant
2	Bairrani West Coal Company Limited	India	33.33%	33.33%	Kerala State Electricity Board Orissa Hydro Power Corp. Ltd.	The coal block allocated to company has been deallocated. The matter is sub-judice in the Hon'ble High Court of Orissa
3	GSPC Pipavav Power Company Limited	India	2.53%	97.46%	Gujarat State Petroleum Corporation	Generation and Distribution of Power

Note 30

- A) GPCL has taken advance possession of 1407-06-98 Sqr. mtrs of Government land at village Raghananesna, Taluka Vav on 20/1/2016 for 700 MW Ultra Mega Solar Power Project as per letter dated 20/1/2016 of Collector , Banaskatha, Palanpur. This land is given to GPCL subject to making payment to Government based on provisions and conditions of New Solar Policies. The same has been accounted for during the year.
- B) GPCL has taken advance possession of 510.31.31 Ha. of Government waste land at village Hadsad, Taluka Suigam, District Banaskatha on 30.09.2011 for Solar Park. The same has not been accounted for as Government has not fixed the price of land.

- C) GPCL has taken advance possession of 81.75.38 Ha. of Government waste land at village Dungda, Taluka Suigam, District Banaskatha on 30.09.2011 for Solar Park. The same has not been accounted for as Government has not fixed the price of land.
- D) Previous year's figures have been regrouped/reclassified/recasted, wherever necessary, to conform to this year's classification.
- "E) GPCL had received a total demand of Water charges of Rs.2308 Lakh (Inclusive of interest amount Rs.1126 Lakh) from SSNNL as per their claim for water supply for Charanka Solar Park -1 Project.

The company has paid the principal amount in the current financial year and interest amount of Rs.1126 Lakh as claimed by SSNNL is shown as contingent liability in view of decision taken by GPCL Board in its 158th Meeting held on 18-03-2022."

- "F) Gujarat Power Corporation Limited (GPCL) has entered into viability Gap Funding Securitization Agreement with Solar Energy Corporation of India (SECI) for getting VGF support of Rs.1.75 Crores for its 10 MW Solar Power Project in the year 2014.

As per clause no.2.1 (a) of the VGF securitization agreement dated 27-03-2014, GPCL is eligible to receive VGF support of Rs.175 Lakh subject to the compliance of terms and conditions as detailed in Article 2.2 of the agreement. As per clause 2.1 (b) of the above-mentioned agreement, VGF of Rs.175 Lakh will be released in 6 tranches. The first tranche of 50% of VGF shall be released on successful commissioning of the full project capacity. Balance 50% of the VGF shall be released progressively over next 5 years in five equal installments of 10% each subject to plant meeting generation requirement and other terms & conditions.

This Project was successfully commissioned (COD) in March-2015. Cost of the Asset has to be firmed up on Commercial Operation Date (COD) and total VGF receivable i.e.Rs.175 Lakh has to be reduced from the cost of the Asset in the Financial year in which COD is achieved i.e F.Y. 2014-15. Accordingly, in the financial year 2014-15, GPCL passed an entry in its Audited books of account by debiting Viability Gap Funding Receivable a/c by Rs.175 Lakh and crediting 10 MW Solar Power Project a/c by Rs.175 Lakh, as GPCL was eligible to receive Rs.175 Lakh as per the VGF agreement with SECI in F.Y.2014-15 as the Project was successfully commissioned (COD) in March-2015. In the F.Y. 2016-17, SECI released Rs.87.50 Lakh to GPCL towards First tranche and Rs. 17.5 lakh towards second tranche. Release of third, fourth, fifth & sixth trench from SECI are awaited. Hence as per the agreement, the amount to be released at the end of the 6th year (March-2020) @ Rs.17.50 lakh per annum is subject to plant meeting generation requirement and other terms and conditions. As per the agreement and in the opinion of the management these amounts are receivable from SECI and accordingly Company has accounted the same as receivable from SECI as on 31st March 2015 and reduced the amount from Property, Plant and Equipments."

- G) GPCL has incurred about Rs.127 Lakh towards actual consultancy fees for its 1000 MW Pipavav Power Project. GOG has accepted to compensate only cost incurred by the Company for acquisition of land and denied to pay any other expenses incurred on the project including consultancy fees vide its letter dated 5th December, 2017. However it was directed by Board that GPCL may request GOG to compensate total expenses incurred including actual consultancy fees of Rs.127 Lakh to GPCL, but there was no response from GOG in the matter. In view of GPCL's letter dated 03-02-2021 and GIDC's letter dated 21/08/2021, the company is of the opinion that this claim will be received from GIDC. Further, in this connection the company has received the letter date of 04-03-2022 from GOG stating that company should take appropriate action in line with Government's decision conveyed vide Department's letter dated 05-12-2017. In response to this letter, GPCL has vide its letter dated 24-03-2022 requested GoG to give directions w.r.t. GIDC's proposal as referred above. In view of the same, the amount of Rs.127 Lakh incurred by GPCL towards actual consultancy fees for its 1000 MW Pipavav Power Project, has been booked as provision for doubtful receivables in current year. Further, as the company has charged some allocated expenses on this project and hence have made total provision towards doubtful receivable amount of Rs. 154 Lakh in its books of accounts in FY 2021-22.
- H) The company did not have any long term contract including derivative contract for which there were any material foreseeable losses.

- I) In the opinion of management, the value of realisation of assets other than fixed assets and non current investment in the ordinary course of business will not be less than the value at which they are stated in the balancesheet.
- J) In the absence of balance confirmation the balances of receivable and payable as on 31/03/2022 are subject to adjustment if any on reconciliation/settlement.
- “K) (I) GPCL has investment in Torrent Pipavav Generation Limited (Refer note-3 Investments in Subsidiary, Associate and Joint venture). Test of impairment is done on the basis of existence of such conditions which indicate the requirement of impairment.

Further, in this connection the company has received the letter date of 04-03-2022 from GOG stating that company should take appropriate action in line with Government’s decision conveyed vide Department’s letter dated 05-12-2017. In response to this letter, GPCL has vide its letter dated 24-03-2022 requested GoG to give directions w.r.t. GIDC’s proposal in the matter. In view of the same, GPCL has made provision of Rs.250 Lakh as provision for impairment.

- (II) GPCL has investment in Baitarni West Coal Company Limited (Refer note-3 Investments in Subsidiary, Associate and Joint venture). Test of impairment is done on the basis of existence of such conditions which indicate the requirement of impairment.

GPCL has proportionate interest of 33.33% in Baitrani West Coal Company Limited (BWCCCL). The Coal block allotted to BWCCCL is de-allocated by the Ministry of Coal, Government of India. The matter is sub-judice in the Hon’ble High Court of Orissa.

BWCCCL in its 46th Board Meeting has decided to initiate voluntary winding up of BWCCCL under the Companies Act, 2013.

It is to state that, in the Extraordinary General Meeting of BWCCCL held on 30-07-2022 it has been decided to reduce its Equity Share capital from Rs. 30 crore (contributed by promoter companies @ Rs. 10 crore each) to Rs. 6 crore and thereby to pay the balance Rs. 24 crores equally to the Promoter-Companies viz; Orissa Hydro Power Corporation Limited (Govt. of Odisha State PSU), Gujarat Power Corporation Limited (Govt. of Gujarat state PSU) and Kerala state Electricity Board (Govt. of Kerala), after approval of NCLT for Reduction of Share Capital therefore no effect is given in current year for the same w.r.t. impairment of equity in this Joint Venture.

Further, company is given to understand that above referred Rs.6 crores has been set aside by BWCCCL to meet their contingent liability that may or may not crystalize in future and also to meet day to day expense of BWCCCL through interest earned by BWCCCL. “

- L) As draft fuel supply agreement has not been finalised by company, it was decided by the management to raise interim invoice for supply of lignite on ad-hoc basis amounting to Rs.37901 Lakh subsequent to the approval of the management. Such amount is included in revenue from operation (note-17) for the current year, keeping in view the fact that finalisation of draft supply agreement may take some more time.
- “M) As per Ind AS-115, revenue is recognised upon satisfaction of performance obligation. 700MW Ultra Mega Project- Raghnesda and 1000 MW Solar Project- Dholera had commenced and no performance obligations (contractual duties) are satisfied in respect of them. Therefore considering the definitions and requirements laid down under IND AS-115, revenue will be recognised at a point of time once the projects are completed. Therefore, no revenue is recognised in respect of these two projects in FY 2021-22. The amount received from customers have been shown as ‘Advance from Customers’ as Current Liabilities in the financial statement.

It is pertinent to note that the scheduled power infrastructure facility is mandatory as a part of project but the setup of the same is getting delayed due to certain reasons. Currently, the project has been commissioned on the basis of some temporary arrangement of power, in view of which revenue recognition is not done in the F.Y. 2021-22.”

- “N) GPERF was formulated under Public Private Partnership (PPP) mode to set up an institute viz Gujarat power engineering research institute- GPERI - with an idea of creating a technical human resource in power sector for the State of Gujarat. The promoter of GPERF is Gujarat Power Corporation Limited (GPCL) which is a State Govt. Company promoted by the Government Of Gujarat (GoG). In the meeting conducted by GTU on 19th March 2020, it was agreed by GTU to take over the said organisation as constituent college with all assets except staff of GPERI and liabilities.

GPCL has spent about Rs.1185 Lakh for providing various assets to GPERI. In pursuance to above , GPERF formally handed over GPERI to GTU with effect from 11.09.2020 with all movable and immovable assets.GPCL has been charging depreciation on these assets.In view of the decision taken in the matter as referred above , Company has charged depreciation on these assets for F.Y. 2020-21 till 10.09.2020 and the written down value amount of Rs. 883 Lakh as on 31.03.2021 in books has been charged to P&L account as loss on transfer of assets in the F.Y.2020-21.”

- O) In view of the Segment reporting policy, entity-wide disclosures are given from the financial statements are as below:

Particulars	Amount (In Lakhs)
Information about products and services:	
Revenue from External Customers	45,324.64
Information about geographical areas:	
Non-Current assets: (In domicile country)	
Property Plant & Equipment	29,746.64
Mining Development Asset	3,811.86
Investment in subsidiary, associate and joint venture	3,183.76
Other non-current assets	5,556.96

Information about major customers:

Revenues from supply of lignite from one customer of company represents approx. Rs. 37901 Lakh (83.61% of the company's total revenue.)

- P) Expense incurred for CSR during the financial year are as follows:

“a) Gross amount required to be spent for CSR by the company during the current year (F.Y. 2021-22) is Rs. 129.13 Lakh and unspent amount of Rs. 142.21 Lakh brought forward from previous years thereby aggregating to Rs. 271.34 Lakh.

Out of which total amount spent in the current year(F.Y.2021-22),amount spent from past years fund is Rs. 139.67 Lakh and from current year fund is Rs. 38.74 Lakh and hence total unspent amount is Rs. 92.93 Lakh . Unspent CSR amount is transferred to a special account in compliance with the provision of Section 135(6) of the Act.”

“b) As per the environmental clearance dated 24/12/2014, (clause no. xxvi) ,GPCL being the project proponent will have to carry CSR activities in the mining affected areas in consultation with local authorities and villages @5 Rs. per tonne of lignite mined, subject to annual inflation.

For FY 18-19, GPCL produced 5,09,194.83 MT of lignite and is liable to carry out CSR amounting to about Rs. 25.5 Lakh in the year 2019-20.

Further for FY 19-20,GPCL produced 8,17,062.19 MT of lignite and is liable to carry out CSR amounting to about Rs.40.9 Lakh in the year 2020-21.

Further for FY 20-21,GPCL produced 12,71,820.5 MT of lignite and is liable to carry out CSR amounting to about Rs.63.6 Lakh in the year 2021-22

Futher for FY 21-22,GPCL produced 18,50,866.13 MT of lignite and is liable to carry out CSR amounting to about Rs.113 Lakh in the year 2022-23”

- c) Amount spent during the year on:

(Amount in Lakhs)

Sr. No	Particulars	Total
1	Construction/acquisition of any asset	-
2	On purposes other than (i) above	178.41
Total		178.41

Q) Contingent Liabilities

(Amount in Lakhs)

Particulars	As at	As at
	31st March, 2022	31st March, 2021
Bank Guarantee and Margin money	7,454.13	7,431.93
Disputed income-tax demand in respect of various Assessment years	12,441.47	11,601.16
Disputed Service tax demand as on 12/11/18	2,944.99	2,953.65
Estimated amount of contracts to be executed & not provided for	5,708.60	5,471.00
SSNNL's Disputed claim towards water charges as assessed	1,126.11	295.37
Disputed Claim with SECI	241.08	241.08
Disputed Claim with Customer for cancellation of order	293.35	293.35
Liability towards PGCIL as per CERC Order	6,235.65	-
Total	36,445.38	28,287.53

Note 31

Other Statutory Disclosure

- 1 There is no such property wherein there is an issue with the title, hence the title deeds related disclosures are not given
- 2 The company does not have any investment property hence, comment related to revaluation is not made
- 3 During the year, the company has not revalued its intangible assets or any asset of Property, Plant & Equipment, hence, disclosure related to revaluation is not made
- 4 The company has no loans and advances which are either repayable on demand or are without specifying any terms or period of repayment. Hence, the disclosures related to loans and advances given to related party are not given
- 5 The company does not have any intangible asset under development, hence, disclosure related to ageing schedule for intangible assets under development is not made.
- 6 The company does not have any Capital Work in Progress, hence, disclosure related to ageing schedule for Capital Work in Progress under development is not made.
- 7 The company is not declared a wilful defaulter by any bank or financial institution or other lender.
- 8 The company does not have any transactions with Companies struck off.
- 9 The company does not have any charges or satisfaction which is yet to be registered with ROC beyond the statutory period.
- 10 Company has no subsidiary company hence, comment related to compliance with the number of layers prescribed under clause (87) of section 2 of the Act read with the Companies (Restriction on number of Layers) Rules, 2017 is not made
- 11 During the year, company has not entered in any scheme of arrangements as specified in Section 230 to Section 237 of the Companies Act, 2013
- 12 "The company has not advanced or loaned or invested funds to any other person(s) or entity(ies), including foreign entities (Intermediaries) with the understanding that the Intermediary shall:
 - (i) directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the company (Ultimate Beneficiaries) or
 - (ii) provide any guarantee, security or the like to or on behalf of the Ultimate Beneficiaries,"
- 13 "The company has not received any fund from any person(s) or entity(ies), including foreign entities (Funding Party) with the understanding (whether recorded in writing or otherwise) that the company shall :
 - (i) directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party (Ultimate Beneficiaries) or
 - (ii) provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries."
- 14 The company have not traded or invested in Crypto currency or Virtual Currency during the financial year.
- 15 The company does not have any Benami property, where any proceeding has been initiated or pending against the company for holding any Benami property.
- 16 The Company does not have borrowings from banks/financial institutions on the basis of security of current assets during the current financial year.

17 Ratios for FY 21-22 and FY 20-21 are presented as under:

Ratio	Numerator	Denominator	Current period	Previous period	% variance	Reason for variance
Current Ratio	Current Assets	Current Liabilities	2.87	2.80	2.5%	-
Debt-Equity Ratio	Total Debt	Shareholder's Equity	0.0000346	0.0000432	-19.9%	-
Debt Service Coverage Ratio	Earnings for debt service	Debt service (Interest & Lease Payments + Principal Repayments)	0.01%	0.02%	-42.2%	Huge increase in profit for current year
Return on Equity Ratio	Net profit after tax - Preference Dividend	Average shareholder's equity	8%	4%	107.9%	Huge increase in profit for current year
Inventory turnover ratio	Cost of goods sold	Average Inventory	0.18	0.00	18.1%	-
Trade Receivables turnover ratio	Net Credit sales (Gross credit sales - sales return)	Average Trade Receivables	5.64	2.08	170.7%	Huge increase in sales in current year
Trade payables turnover ratio	Net credit purchase (Gross credit purchases - purchase return)	Average Trade payables				
Net capital turnover ratio	Net sales (Total sales - sales Return)	Working capital (Current assets - Current liabilities)	0.52	0.35	48.6%	Huge increase in sales in current year
Net profit ratio	Net profit	Net sales (Total sales - Sales Return)	20.13%	15.34%	31.3%	Huge increase in sales in current year resulting in increase in net profit
Ratio	Numerator	Denominator	Current period	Previous period	% variance	Reason for variance
Return on Capital employed	Earnings before interest and tax	Capital Employed (Tangible Net worth + Total Debt + Deferred Tax Liability)	6.68%	4.73%	41.3%	Capital has remained same but the profitability has increased significantly
Return on investment	Interest (Financial Income)	Investment	48.49%	38.30%	26.6%	Due to increase in investments as cashflows and working capital has improved

As per our report of even date attached

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Date : 19/12/2022
Place : Ahmedabad
UDIN:22141825BGBEXL7277

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

Sd/-
Mehul J. Danayak
Chief Financial Officer
DIN: 01854315

Sd/-
Mamta Verma
Chairman

Sd/-
Krupa N.Joshi
Company Secretary

Sd/-
Vikalp Bharadwaj
Managing Director
DIN: 09396222

Date : 19/12/2022
Place : Gandhinagar